

વार्षिक लवाजम ३०. १५०/-

वर्ष : ૪૮મુ
ડિસેમ્બર - ૨૦૨૧
અંક - ૫૨૩

મંગલ મંદિર • ડિસેમ્બર-૨૦૨૧ • ૧
(કુલ પાના : ૮૦)




મંગલ મંદિર

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનું માસિક મુખ્યપત્ર

માસ્ક પહેરો • હાથને વારંવાર સાફ્ કરો • પરચપરનું અંતર જાળવો • કોરોના વેક્સિન અભિયાનને સફળ બનાવો



International
Day of
Persons with
Disabilities



વિશ્વ વિકલાંગ દિન

અને
મંદબુદ્ધિના બાળકો માટેનો દિન

તેઓને સામાન્યજન સમજુને
આપણા અંતરનો પ્રેમ પ્રદાન કરીએ....

મુખ્ય કાર્યાલય :

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

માતુશ્રી સાકરબહેન રવજી મોરારજી લાલન (કોડાય-સુપીમવાલા)

શ્રી કચ્છી જૈન ભવન

૪૩-૪૪, બાલાણ મિશનેડલ સોસાયટી, પાલડી, એલિસબીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬

ફોન : (૦૭૯) 4890 6001, 4890 6002, 4890 6003, 4890 6004

Email : kjssmangalmandir@gmail.com • Web site : www.kutchijainahd.org

તંગી મંડળ :

પ્રતાપ નારાણાજી દંડ - મુખ્ય તંગી
દિનેશ આર. મહેતા - સહતંગી

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત નવનીત ડાયાલિસિસ સેન્ટર - બોપલનો ઉદ્ઘાટન કાર્યક્રમ

રવિવાર, તા. ૧૪-૧૧-૨૦૨૧ • સવારે ૧૦.૦૦ વાગે



નવનીત ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા
મુરલ્લી શ્રી શાંતિભાઈ ગાલા અને વિમળાબેન ગાલા



નવનીત ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા
શ્રી રાજુભાઈ ગાલા, શ્રીમતી સંગીતાબેન ગાલા અને શ્રીમતી કવિતા ગાલા



સમાર્થભનું સંચાલન કરતા
શ્રીમતી ફાલગુણી હીરેન



નવનીત ગૃહના શ્રી રાજુભાઈ ગાલાનું ભહુમાન કરતા
શ્રી હેમંતભાઈ શાહ (પ્રમુખશ્રી - ગુજરાત ચેમ્બર્સ)



નવનીત ગૃહના શ્રી સંદીપભાઈ ગાલાનું ભહુમાન કરતા
શ્રી ચેતનભાઈ શાહ (ચેરમેન - જીતો અમદાવાદ ચેટર)



નવનીત ગૃહના શ્રી કલેશભાઈ ગાલાનું ભહુમાન કરતા
શ્રી જુગીધભાઈ દોશી (યેરમેન - વિશાખા ગુપ્ત)



શ્રી હેમંતભાઈ શાહ (જમણી તરફ)નું ભહુમાન કરતા
સમાજના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દંડ



શ્રી જુગીધભાઈ દોશી (ડાની તરફ)નું ભહુમાન કરતા
સમાજના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ગાટેયા
(કાર્યક્રમની વધુ તસવીરો : જુઓ પાના નં.-૭૮ ઉપર)

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંયાલિત

નવનીત ડાયાલિસિસ સેન્ટર - બોપલના ઉદ્ઘાટન કાર્યક્રમનો અહેવાલ

રવિવાર, તા. ૧૪-૧૧-૨૦૨૧ • સવારે ૧૦.૦૦ વાગે

★ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ તથા ગાલા પરિવારને ખૂબ ખૂબ અનુમોદના. કચ્છી જૈનો દરેક ક્ષેત્રમાં આગળ છે અને તેઓ સમગ્ર ફુનિયામાં પથરાયેલા છે. 'જીતો' સંસ્થાની પ્રેરણા, શ્રી કચ્છી જૈન સેવા સમાજ જેવી સંસ્થાઓમાંથી મળેલ છે. હું એક જમાનામાં મારા પિતાશ્રીને ડાયાલિસિસ કરાવવા નહિયાં લઈ જતો કે જેથી મને જાગ્ર છે કે ડાયાલિસિસના પેશાને કેટલી બધી તકલીફો પડે છે. આ એક રાજરોગ જ છે કે જેમાં અઠવાડિયે બે થી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવા જરૂર જ પડે છે. સરકારે હવે આ બધી પ્રોસીજરના ખર્ચ તો ઘટાડેલ છે તેમ છતાં પેશાન્ત અને તેના પરિવારને આ રોગ થકી સમય અને રૂપિયાનો સારો એવો ભોગ આપવો પડે છે. શ્રી કચ્છી જૈન સેવા સમાજ આ પ્રકારની સેવા પ્રક્રિયામાંથી ખૂબ જ સારું કામ કરી રહેલ છે.

શ્રી હેમંતભાઈ એન. શાહ, પ્રેસિડેન્ટ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇનડસ્ટ્રીઝ - અમદાવાદ

★ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - માત્ર ૧૦૦૦થી ૧૨૦૦ પરિવાર ધરાવતો સમાજ, જો આ શહેરમાં ૨ મેટિકલ સેન્ટર, ઉ ડાયાલિસિસ સેન્ટર અને એ પ્રકારના એક કાર્યક્રમના ઉદ્ઘાટનમાં બીજા નવા પ્રોજેક્ટની આહેરાત કરી શકે તેવા ૪-૫ બીજા સમાજ જો અમદાવાદ અને ગુજરાતમાં હોય તો સરકારનો સારો એવો ભાર હળવો કરી શકાય. આ ઉમદા પ્રવૃત્તિના ડોનર પરિવારને ઘણી ઘણી અનુમોદના.

શ્રી ચેતનભાઈ ડી. શાહ, ચેરમેન, જીતો અમદાવાદ ચેપ્ટર - અમદાવાદ

★ કોઈપણ સમાજ માટે શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ એક આદર્શ ઉદાહરણરૂપ છે. આવા સમાજે થકી જ રાજ્ય બીજાનું છે અને રાજ્યો થકી દેશ પ્રગતિ કરે છે. તમારા સમાજમાં ગાલા ચુપ જેવા દાનવીરો અને ભામાશાઓ છે. અગાઉના જમાનામાં હાર્ડવર્ક વખણાતું હતું. આજે હવે સ્માર્ટ વર્ક અને વિઝનરી વર્કને મહત્વતા મળે છે. કચ્છીઓ હંમેશાં આ પ્રમાણે જ વર્તન કરતા આવે છે. અતે ઉપસ્થિત શ્રી હસમુખભાઈ ગઢેચા તેનું ઉદાહરણ છે. નવનીત પરિવાર સાથે પણ મારો ઘણા વર્ષોનો સંબંધ છે. તમારા હવે પછીના કોઈપણ નવા પ્રોજેક્ટમાં અમે પથાશક્તિ જરૂરથી મદદ કરીશું.

શ્રી જગીરાભાઈ એન. દોશી, ચેરમેન, વિશાળા ચુપ - અમદાવાદ અને પ્રેસિડેન્ટ - પ્લાન્ટ ઇન્ડિયા

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના નવનીત ડાયાલિસિસ સેન્ટર - બોપલ, અમદાવાદના રવિવાર, તા. ૧૪-૧૧-૨૦૨૧ના ઉદ્ઘાટન સમારોહમાં વક્તવ્ય આપતા ઉચ્ચારાયેલા વાક્યો હતા. અતિથિ વિશેષશ્રીઓ શ્રી હેમંતભાઈ એન. શાહ, શ્રી ચેતનભાઈ ડી. શાહ તથા શ્રી જગીરાભાઈ એન. દોશી - અમદાવાદ શહેરની વિશાળ અને પ્રતિભાશાળી વ્યક્તિઓએ જ્યારે શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની પ્રવૃત્તિઓને એકધારી બિરદાવી ત્યારે ઉપસ્થિત જનમેદનીમાં આનંદની લહેરખી પ્રસરી જવા પામેલ હતી.

આ અગાઉ જ્યારે ઉપસ્થિત દાતાશ્રીઓનું બહુમાન કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત દાતાશ્રીઓ અને નવનીત પરિવાર વતી શ્રી રાજુભાઈ ગાલાએ પણ સમાજની પ્રવૃત્તિઓની ખૂબ ખૂબ અનુમોદના કરેલ હતી અને જણાવ્યું હતું કે નવનીત પરિવારે એજ્યુકેશન, મેટિકલ તથા પાંજરાપોળ (જીવદ્યા) કોને પોતાથી શક્ય અનુદાન આપવાનું નક્કી કરેલ છે અને તેથી આ બાબતે

જ્યારે શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ અમારી પાસે કોઈપણ નવા પ્રોજેક્ટની રહેલ લઈને આવશે ત્યારે અમે તેમની સાથે રહીને દાનની સરવાણી વહાવવામાં પાછું વળીને નહીં જોઈએ. અમે તેમની સાથે રહીને ખબે-ખબા મિલાવીને જરૂરથી આગળ વધીશું. આ પ્રસંગે તેઓશ્રીએ વિવિધ ડાયાલિસિસ મશીનના ડોનેશન આપનાર દાતાશ્રીઓની, આર.ઓ. ખાન્ટના દાતાશ્રી તથા વિવિધ બેડના ડોનેશન આપનાર દાતાશ્રીઓની પણ ખૂબ ખૂબ અનુમોદના કરી તેઓ સહુનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે સ્ટેજ પર એચ.એન. સફલ ગૃહના શ્રી ધીરેન વોરા, તથા શ્રી ઉદ્યન વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓએ આ સંસ્થાને નવનીત મેડિકલ સેન્ટરના ઉદ્ઘાટન સમયે ઝા. ૫૧/- લાખનું ડોનેશન આપેલ હતું. તેઓશ્રીના કહેવા થકી શ્રી રાજુભાઈએ તેમના વતી જણાવેલ હતું કે આ સફલ ગૃહ શ્રી કચ્છી જૈન સેવા સમાજ અને નવનીત ફાઉન્ડેશનની કાર્યપદ્ધતિ પ્રત્યે સંતોષની લાગણી વક્ત કરે છે અને ભવિષ્યમાં તેઓ પણ સમાજના ભાવિ પ્રોજેક્ટના સમયે સમાજ સાથે તથા નવનીત ફાઉન્ડેશન સાથે સંપૂર્ણપણે સહકાર આપી પોતાનો સાથ આપશે.

સમારોહના અંતે પ્રવચન આપતા સમારોહના તથા શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દંડે જણાવેલ હતું કે શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના કાર્યકરો એક ટીમ સ્વરૂપે કાર્ય કરી રહેલ છે. હું છેલ્લા ૧૦-૧૨ દિવસથી મારા અંગત કારણોસર બહારગામ હતો. નવનીત ડાયાલિસિસ સેન્ટર - બોપલના ઉદ્ઘાટન કાર્યક્રમ તથા ઉદ્ઘાટન સમારોહના આયોજનમાં મારી બિલકુલ ગેરહાજરી હતી છતાં સમાજની ટીમે પૂરી ચીવટ રાખી સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડેલ છે. આ હકીકત જ સમાજના કાર્યકરો એકરૂપ થઈ જે ભાવના દાખવે છે તેણે સમાજને પ્રગતિની ટોચ પર લાવી દીધેલ છે. તેઓશ્રીએ સમાજના કાર્યકરોની આ ટીમને બિરદાવેલ હતી.

ઉદ્ઘાટન સમારોહની શરૂઆતમાં શ્રી હસમુખભાઈ ગઢેચાએ અતિથિ વિશેષશ્રીઓ, ડાયાલિસિસ સેન્ટરના વિવિધ વિભાગોમાં ડોનેશન આપનાર દાનવીરો, સમાજના ઉપસ્થિત સભ્યો તથા શ્રી કચ્છી સમાજ - અમદાવાદના ઉપસ્થિત મહાનુભાવો તથા અન્ય મહાનુભાવોને આવકાર આપતા જણાવેલ હતું કે વર્ષ ૧૯૮૮માં શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદે મૃથમ ગીતા મંદિર પર અતિથિ ભવન સમાજને અર્પણ કર્યું. ત્યારબાદ વર્ષ ૧૯૯૭માં શ્રી કચ્છી જૈન ભવન - પાલડીનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો કે જ્યાં હાલે મેડિકલ સેન્ટર જેવી પ્રવૃત્તિઓ ખૂબ જ વિકસિત પ્રમાણમાં ચાલી રહેલ છે. ત્યારબાદ વર્ષ ૨૦૦૨માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે શાહીબાગ ખાતે શ્રી કચ્છી વિશ્રામગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું. અહીં ડાયાલિસિસ સેન્ટર અને કચ્છ સંસ્કૃતિ મ્યુઝિયમ પણ કાર્યરત રહેલ છે. વર્ષ ૨૦૧૮માં બોપલ ખાતે નવનીત મેડિકલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. એ દરમિયાન વર્ષ ૨૦૧૦માં બહેરામપુરા ખાતે ૪૦ પરિવારો માટેની આવાસ યોજનાનો પ્રોજેક્ટ પણ આ સમાજ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યો. વર્ષ ૨૦૧૨માં આ સમાજે તેના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જ્યંતી વર્ષ (ગોલ્ડન જ્યુબિલી) પણ જીવેલ હતી. આ સમયે તેમણે સ્વ. માવજી ધારશી કુરિયા, સ્વ. હીરજી પાસુભાઈ શાહ, સ્વ. પોપટલાલ નેણશી ધરોડ, સ્વ. સૂરજલાલ મોતીલાલ મહેતા, સ્વ. કિશોર મૂળજી લાલકા, સ્વ. વીરેન્દ્ર રાધવજી લોડાયા, ડૉ. ચંદ્રકાંત કાનજી દેઢિયા તથા શ્રી અશોક સાકરચંદ મહેતાએ આ સમાજને આપેલ સેવાની નોંધ લઈ, તેઓને બિરદાવેલ હતા. તેમણે વિશેષમાં જણાવેલ હતું કે સમાજનો હવે પછીનો પ્રોજેક્ટ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક નવું મેડિકલ સેન્ટર શરૂ કરવાનો છે કે જેના માટે નવનીત ગૃહ તથા અન્ય દાતાશ્રીઓને અમને પૂર્ણ સહયોગ સાંપડી રહેશે તેનો અમને પૂરેપૂરો વિશ્રામ હતું.

શ્રી હસમુખભાઈ ગઢેચાએ વિશેષમાં જણાવેલ હતું કે સમાજના વિવિધ દિશાના ૪ સંકુલોમાં આજે દરરોજની ઓછામાં ઓછી ૧૦૦૦ વ્યક્તિઓ પોતાના વિવિધ કારણોસર મુલાકાત લે છે અને આ સમાજની વિવિધ યોજનાઓનો લાભ મેળવે છે. આજે આ સમાજ થકી ૧૦૦ પરિવારો પોતાનો જીવન નિર્વહ ચલાવે છે. હવે પછી તે ૨૦૦એ અને ત્યાર પછી તેનો લાભ ૧૦૦૦ પરિવાર લે તેવી ભાવનાથી આ સમાજ આગળ વધી રહેલ છે.

ત્યારબાદ નવનીત મેડિકલ સેન્ટર - બોપલ અને નવનીત ડાયાલિસિસ સેન્ટર - બોપલની સમિતિના કન્વીનર ડૉ. ડિતેન્દ્ર શાહે નવનીત મેડિકલ સેન્ટર તથા નવનીત ડાયાલિસિસ સેન્ટરની દરેક વિગતોથી આ સભાને જ્ઞાત કરેલ હતા અને તેમણે જણાવેલ હતું કે અત્યારે નવનીત મેડિકલ સેન્ટર - બોપલમાં આ સમાજ તરફથી મેડિકલ વિભાગની વિવિધ ભાંચો એટલે

કે મેડિસીન, જનરલ સર્જન, ઓર્થોપેડિક, આઈ, સ્કીન, પિડિયાટ્રિક્સ, ગાયનેક, ટેન્ટલ, સાઇકિઆટિક, પલ્બોનોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, યુરોલોજી, નેફોલોજી જેવી બ્રાંચો કાર્યરત છે. સાથે સાથે એક્સ-રે, સોનોગ્રાફી, પેથોલોજી લેબોરેટરી અને ફીજિયોથેરાપી વિભાગો પણ કાર્યરત છે અને આ વિભાગના અનેક દર્દીઓ આ સવલતોનો લાભ ખૂબ જ ડિફ્ફાયતી દરે મેળવી રહ્યા છે.

ઉપરોક્ત દરેક પ્રવચન સમયે ઉપસ્થિત જનસંખ્યાએ તેઓને હર્ષનાદથી વધાવી લીધેલ હતા. સમારંભના એન્કર શ્રીમતી ફાલ્ગુની હીરેન એ સમાજના ટ્રસ્ટી અને પૂર્વપ્રમુખ શ્રી અશોકભાઈ મહેતાની સેવાને બિરદાવેલ હતી અને ઉપસ્થિત સમુદાયે શ્રી અશોકભાઈ મહેતાને સ્ટેન્ડિંગ ઓવેશન આપી, તેમની સેવાની કદર કરેલ હતી.

ત્યારબાદ શ્રી રજનીકાંત પારેઝે ઉપસ્થિત અતિથિ વિશેષશ્રીઓ, દાતા પરિવાર નવનીત ફાઉન્ડેશન, પાંચ ડાયાલિસિસ મશીનનું ડોનેશન આપનાર જીવન જ્યોત ઝુગ બેંક - મુંબઈના શ્રીમતી મંજુલાબેન વોરા, અન્ય એક-એક મશીનનું ડોનેશન આપનાર કોન્કર્ડ બાયોટેક લિમિટેડ, નવમકાશ ચેરિટીઝ (શ્રી ડેમંતભાઈ એન. શાહ), શ્રીમતી કોકીલાબેન ભોગીલાલ શાહ (કોરિડિયા) પરિવાર, શ્રીમતી કાંતાબેન ગોવિંદલાલ શાહ પરિવાર ટ્રસ્ટ, આર.ઓ. પ્લાન્ટના દાતાશ્રી માતુશ્રી વિજયાબેન શાંતિલાલ મૈશેરી પરિવાર - મુંબઈના શ્રી નિલેશ શાંતિલાલ મૈશેરી તથા ૮ બેડના દાતાશ્રી સ્વ. ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ પરિવારના શ્રી આશિષભાઈ ડી. શાહ, ઉપસ્થિત જન સમુદાય, શ્રી કચ્છી સમાજ - અમદાવાદના ઉપસ્થિત મહાનુભાવો, અન્ય મહાનુભાવો તથા આ કાર્યક્રમને યશસ્વી રીતે પાર પાડનાર ટીમ ડૉ. ડિતેન્દ્ર શાહ, શ્રી વિશાલ શાહ, શ્રી સંદીપ મહેતા, શ્રી મનિષ ગોસર, શ્રી વિમેશ શાહ, અન્ય વોલન્ટિયર્સ તથા આજના સમારંભનું ખૂબ જ સારી રીતે સંચાલન કરનાર શ્રીમતી ફાલ્ગુની હીરેનનો આભાર માનેલ હતો. તેઓશ્રીએ નવનીત મેડિકલ સેન્ટર - બોપલના દરેક સ્ટાફ મેખર્સનો પણ ખૂબ જ આભાર માનેલ હતો. આજના મંડપના તથા જમણાવારના કોન્ટ્રાક્ટર શાંગાર ડેકોરેટર્સના શ્રી સમીરભાઈ તથા તેમની ટીમનો પણ આભાર માનેલ હતો.

બોપલ ખાતેના ઉપરોક્ત ઉદ્ઘાટન સમારોહ અગાઉ ગાલા એનેક્ષમાં બીજે અને ત્રીજે માળે મેડિકલ સેન્ટર ચાલે છે. એ જ મફાનમાં પ્રથમ માળે નવનીત ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન, દાતાશ્રી શાંતિભાઈ ગાલા તથા શ્રીમતી વિમળાબેન ગાલાના વરદ્દ હસ્તે કરવામાં આવેલ હતું. જે રીતે મેડિકલ સેન્ટરની ૬૨૦૦ ચો. ફૂટ જેટલા કાર્પેટ એરિયાના વિસ્તારની જગ્યા અગાઉ નવનીત ફાઉન્ડેશન દ્વારા શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદને મેડિકલ સેન્ટર ચલાવવા ફાળવવામાં આવેલ હતી, એ જ રીતે ગાલા એનેક્ષની પ્રથમ માળની ૧૨૦૦ ચો. ફૂટ જેટલા કાર્પેટ એરિયાની જગ્યા આ સમાજને નવનીત ફાઉન્ડેશન દ્વારા ફાળવવામાં આવેલ છે. ઉદ્ઘાટન બાદ સહૃદે ડાયાલિસિસ સેન્ટરની મુલાકાત લીધેલ કે જગ્યાં ડૉ. ડિતેન્દ્ર શાહ, કે જેઓ મેડિકલ સમિતિ - બોપલના કન્વીનર છે, તેઓ પોતાની ટીમ સાથે ત્યાં ઉપસ્થિત રહેલ હતા અને સહૃ આમંત્રિતોને તેઓએ આ ડાયાલિસિસ સેન્ટરની રજેરજની માહિતી વિસ્તૃતપણે સમજાવેલ હતી. અતિથિ વિશેષશ્રીઓ તથા સહૃ આમંત્રિત મહેમાનોએ ત્યારબાદ આ ડાયાલિસિસ સેન્ટર અને એ જ મફાનના બીજે-ત્રીજે માળે આવેલ મેડિકલ સેન્ટરની મુલાકાત લીધેલ હતી કે જગ્યાં મેડિકલ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. રિદ્ધિબેન શાહ તથા દરેક સ્ટાફ મેખર ઉપસ્થિત રહી, ત્યાંના મુલાકાતીઓને મેડિકલ સેન્ટરની પણ વિગતોની જાણકારી આપેલ હતી. આ મેડિકલ સેન્ટરમાં વિવિધ ૧૨થી ૧૫ વિભાગની ઓ.પી.ડી. ઉપરાંત એક્સ-રે, સોનોગ્રાફી, પેથોલોજી લેબોરેટરી, ફીજિયોથેરાપી સેન્ટર વગેરેની સેવા કાર્યરત રહેવા પામેલ છે. આ સેન્ટરની અતિથિ વિશેષશ્રીઓએ પણ શ્રી હસમુખભાઈ ગઢેચાની સાથે રહી મુલાકાત લીધેલ હતી અને તેઓશ્રીઓએ આ સેન્ટર પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરેલ હતી.

ગાલા એનેક્ષમાં આવેલ ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન બાદ સહૃ આમંત્રિતો ગાલા જમખાનામાં યોજવામાં આવેલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને દરેક મુલાકાતીઓએ આ કાર્યક્રમને આનંદપૂર્વક માણેલ હતો.

ઉદ્ઘાટન સમારોહ બાદ સહૃ સમૂહ ભોજનમાં જોડાયા હતા અને ત્યારબાદ સહૃ મેડિકલ સેન્ટર તથા ડાયાલિસિસ સેન્ટરના ગુણગાન ગાતા વિભરાયા હતા.

શહેરના કેટલાક વિસ્તારોમાંથી શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા અહીં આવવા-જવા માટે બસના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી કે જેનો જૈન સમાજના અનેક સત્યોએ લાભ લીધેલ હતો.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત

નવનીત ડાયાલિસિસ સેન્ટર - બોપલ, અમદાવાદ

જે મહાતુભાવો થકી આ ડાયાલિસિસ સેન્ટર ચરિતાર્થ થઈ શક્યું એ દાનવીરોની ગાઈ

★ ત્રણ ઓફિસ કે જેના અંદાજિત ૧૦૦૦ ચો.કૂટ કાર્પેટ એરિયા થાય - એ જગ્યાનું સમર્પણ કરનાર	નવનીત ફાઉન્ડેશન મુંબઈ / અમદાવાદ
★ ૫ ડાયાલિસિસ મશીનનું ડોનેશન આપનાર દાતાશ્રી	જીવન જ્યોત ટ્રગ બેંક - મુંબઈ દા. મંજુલાબેન વોરા
★ ૧ ડાયાલિસિસ મશીનનું ડોનેશન આપનાર દાતાશ્રી	કોન્કર્ડ બાયોટેક લિમિટેડ - અમદાવાદ
★ ૧ ડાયાલિસિસ મશીનનું ડોનેશન આપનાર દાતાશ્રી	નવપ્રકાશ ચેરિટીઝ - અમદાવાદ
★ ૧ ડાયાલિસિસ મશીનનું ડોનેશન આપનાર દાતાશ્રી	કોકિલાબેન ભોગીલાલ કોરડિયા પરિવાર અમદાવાદ
★ ૧ ડાયાલિસિસ મશીનનું ડોનેશન આપનાર દાતાશ્રી	કાંતાબેન ગોવિંદલાલ શાહ પરિવાર દા. ગૂજર પ્રકાશન - અમદાવાદ
★ ૧ ડાયાલિસિસ મશીનનું ડોનેશન આપનાર દાતાશ્રી	માતુશ્રી વિમળાબેન શાંતિલાલ મેશોરી પરિવાર દા. તિલેશ શાંતિલાલ મેશોરી - મુંબઈ
★ ૮ બેડના દાતાશ્રી	સ્વ. ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ પરિવાર દા. આશિષભાઈ ડી. શાહ - અમદાવાદ

ઉપરોક્ત દાતાશ્રીઓનો શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ ખૂબ ખૂબ આભાર માને છે અને તેઓને આ પ્રજાલક્ષી સેવાકીય કાર્યમાં સાથ-સહકાર આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવે છે.

આ ડાયાલિસિસ સેન્ટરમાં કાયમી તિથિ પણ લખવામાં આવે છે. આપશ્રીના પરિવારને ત્યાં બનેલ સારા-નરસા કાર્યો સામે, તે દિવસની યાદગીરી સ્વરૂપે આપશ્રી એક કાયમી તિથિ લખાવી શકો છો. એક દિવસની કાયમી તિથિનો નકરો રૂ. ૧,૧૧,૧૧૧/- રાખવામાં આવેલ છે. કાયમી તિથિ નિમિત્તે દર વર્ષે જે-તે દિવસે દર્દીનું ડાયાલિસિસ આપશ્રીના નોંધાવેલ નામે કરવામાં આવશે. અમને જણાવતા આનંદ થાય છે કે શ્રી અનિલભાઈ રામજીભાઈ હરિયા તરફથી એક દિવસની તિથિ લખાવવામાં આવેલ છે. તિથિનું નામ લખાવવા, આપશ્રી શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનો સંપર્ક સાધી શકશો.

રજનીકાંત પારેખ
માનદ મંત્રી, શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

લક્ષ્મીનો સ્વભાવ ઘણો ચંચળ છે પણ એથી વધુ ચંચળ તો કીર્તિ છે. કપૂરની જેમ જીડી જતાં એને વાર લાગતી નથી. લક્ષ્મી તો ગયા પછી ભાગ્ય અને પુરુષાર્થના બળે ઘણીવાર પાછી આવે છે પણ આબરૂ ગયા પછી પાછી ફરતી નથી.

શ્રી કર્ચી કૈન સેવા સમાજ - અમદાવાદ

બાળ કલ્યાણ સમિતિ

**બાળ સમૃદ્ધિ યોજના હેઠળ સંબંધિત બાળકોને
મળવાપાત્ર રકમ અંગે જાણકારી...**

- વાલીઓ માટે ખાસ

સમિતિ દ્વારા બાળ સમૃદ્ધિ યોજના હેઠળ આજથી ૧૮ વર્ષ
પહેલાં જન્મેલા બાળકોના નામે સમાજ તરફથી ચોક્કસ રકમનું
રોકાણ UTI અને HDFC ભ્યુ.ફડમાં કરવામાં આવ્યું હતું.

જેમના રોકાણોને ૧૮ વર્ષ પૂરા થયા છે તેઓના નામ
નીચે મુજબ છે. તેઓએ પોતાના સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ
(ભ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલા) સાથે સમાજનો તરત સંપર્ક
કરવો ખૂબ જરૂરી છે. જેથી પાકતી રકમ તેઓને મળી શકે. પુખ્ત
વયના થયેલા જે બાળકનું ખાતું બેંકમાં ન હોય તો તેમના નામનું
બેંક ખાતું તેમના વાલીઓએ તરત જ ખોલાવી લેવું. રકમ પુખ્ત
વયના થયેલા બાળકના નામે જ મળશે.

અગર કોઈએ પાકતી રકમ લઈ લીધી હોય અથવા
બાળકનું સ્ટેટ્સ ભ્યુ.ફડમાં ફેરફાર કરાવી લીધું હોય તો સમાજના
કાર્યાલયમાં આ સમિતિને જાણ કરશો. જેથી તેની અમો અમારા
રેકૉર્ડમાં યોગ્ય નોંધ કરી શકીએ.

UTIમાં મળવાપાત્ર રકમના સંબંધિત બાળકોની યાદી

રૂ. 3,000/- વારાં

- સૌરીન હસમુખલાલ અમૃતલાલ કોરારિયા ૦૭/૧૯૯૮-૯૯
- પિન્ડુ સેવંતીકુમાર રવજી વોરા ૧૩/૧૯૯૮-૯૯
- ઋતુલ ધીરજકુમાર મણિલાલ શાહ ૧૮/૧૯૯૮-૯૯

રૂ. 4,000/- વારાં

- જ્યાણ હરેશ હીરાલાલ કુબડિયા ૦૬/૨૦૦૦-૦૧
- નિશાંત વિનયકુમાર સ્વરૂપચંદ શાહ ૧૧/૨૦૦૦-૦૧
- મિન્ક (સુતિ) જ્યાસુખ જ્યાંતીલાલ વોરા ૧૨/૨૦૦૦-૦૧
- રાજવી ચંદ્રકાંત વિશનજી રાંભિયા ૧૬/૨૦૦૦-૦૧
- હેત કમલેશ નવિનભાઈ સાવલા ૧૭/૨૦૦૦-૦૧
- તીર્થ મૈત્રી અનિશ કોઠારી ૨/૨૦૦૧-૦૨
- દેવમ રસિકલાલ રવજી વોરા ૩/૨૦૦૧-૦૨
- કૃષાલ નૈમેશ નરેન્દ્ર રત્નલાલ શાહ ૪/૨૦૦૧-૦૨
- રૂતાંશુ હિતેશ ધીરજલાલ સંધવી ૬/૨૦૦૧-૦૨
- ચૈત્ય અંકુર કાંતિલાલ ભણસાલી ૮/૨૦૦૧-૦૨

HDFC Children's Gift Fund

રૂ. ૫,૦૦૦/- વારાં

- વંશ વિરેન વાડીલાલ મહેતા ૧૦/૨૦૦૧-૦૨
- જ્ય મનીષ વિજયભાઈ છાડવા ૧૨/૨૦૦૧-૦૨
- જીલ રાયશી હીરજ દેઢિયા ૧૪/૨૦૦૧-૦૨
- જૈનિલ કમલ પ્રફુલ સંધવી ૧૫/૨૦૦૧-૦૨
- રૂત્વિ દીપકુમાર પ્રવીષ લોડાયા ૦૧/૨૦૦૨-૦૩
- ક્યવન સુનિલ દેવજ ગોગરી ૨/૨૦૦૨-૦૩
- સેજલ હિતેશ મણિલાલ દેઢિયા ૦૩/૨૦૦૨-૦૩
- માનવ ચંદ્રકાંત કેશવજ ગડા ૦૪/૨૦૦૨-૦૩
- સાક્ષી સંદીપ ખીમજી ગાલા ૦૫/૨૦૦૨-૦૩
- હર્ષ ઉલ્લાસ મનુભાઈ શાહ ૦૭/૨૦૦૨-૦૩
- તેજ અમર દાંકોરભાઈ શાહ ૦૮/૨૦૦૨-૦૩
- દશયા દિલીપ શામજી ગાલા ૧૧/૨૦૦૨-૦૩
- કવિયા પ્રદીપ કાંતિલાલ સંધવી ૧૫/૨૦૦૨-૦૩
- યશ નકુલ માણેકજ દંડ ૧૭/૨૦૦૨-૦૩
- ખુશી જિતકુમાર રમણિકલાલ શાહ (ગાલા) ૨૦/૨૦૦૨-૦૩
- મોક્ષા તિલક જીવેરયંદ લોડાયા ૨૪/૨૦૦૨-૦૩
- ભૂમિકા રાજેશ ગોસર ૨૦૦૨-૦૩
- શ્રેયાંસ રાજેશ રામજીભાઈ ગોગરી ૨૫/૨૦૦૨-૦૩
- ઘની હેમાંગ નવીનભાઈ હરિયા ૨૭/૨૦૦૨-૦૩
- ધૈર્ય જીજેશ અમૃતલાલ શાહ ૩૦/૨૦૦૨-૦૩
- વૈભવી યોગેશ દેઢિયા ૩૧/૨૦૦૨-૦૩
- યશ બૈરવ ગિરીશ સંધવી ૩૨/૨૦૦૨-૦૩
- ધ્રુવી જ્યેશ અજિત મહેતા ૩૩/૨૦૦૨-૦૩
- રાજ અશોક દામજ મોમાયા ૩૪/૨૦૦૨-૦૩
- કિશ પ્રકાશ કિરણ મહેતા ૩૬/૨૦૦૨-૦૩
- હિતાર્થ શર્વિલ સાયેન્દ્ર શાહ ૩૭/૨૦૦૨-૦૩
- ભૂમિ દીપક માણેકજ દંડ ૦૧/૨૦૦૩-૦૪
- સિમત પૂનમભાઈ જ્યાંતિલાલ મહેતા ૦૨/૨૦૦૩-૦૪
- ખુશ્બુ પરેશભાઈ કાંતિલાલ શાહ ૦૩/૨૦૦૩-૦૪
- બિનોય જ્ય બિપેન્ઝ ગોગરી ૦૪/૨૦૦૩-૦૪
- ચાર્મિ ધનરાજ રામજી દેઢિયા ૦૫/૨૦૦૩-૦૪
- શ્રુત ભાવેશ નયન મોતા ૦૬/૨૦૦૩-૦૪
- પલાશ રોહિત ખીમજી દેઢિયા ૦૭/૨૦૦૩-૦૪
- તુલીપ દીપક કલ્યાણજ છેડા ૦૮/૨૦૦૩-૦૪

● મોહિત દર્શન રસિકભાઈ વોરા	૦૬/૨૦૦૩-૦૪
● મહેષ પંકજકુમાર કીર્તિલાલ સંધવી	૧૦/૨૦૦૩-૦૪
● લોકેશ બ્રિજશ સુરેન્દ્રકુમાર શાહ	૧૧/૨૦૦૩-૦૪
● કેયુરી મૂકેશ જવેરીલાલ શેઠ	૧૨/૨૦૦૩-૦૪
● મીત વિપુલ રમણિકલાલ ગોસર	૧૩/૨૦૦૩-૦૪
● તપસ્વી સંજીવ સૂર્યકાંત શાહ	૧૪/૨૦૦૩-૦૪
● આસ્થા કેતન ચંદ્રકાંત શાહ	૧૫/૨૦૦૩-૦૪
● દિતીશા સ્વરૂપચંદ વિજયકુમાર શાહ	૧/૨૦૦૪-૦૫
● પાર્થ અમર ઠાકોરભાઈ શાહ	૨/૨૦૦૪-૦૫
● ફિનિલ વીરેન દામજ નીસર	૩/૨૦૦૪-૦૫

કન્વીનર, બાલ કલ્યાણ સમિતિ
શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

સમાજ ઉપાય

સરનામા ફેરફાર

- રોહિત વનેચંડ મહેતા
એ-૧૧, હીરા આનંદ ટાવર, ગોરધન ટેકરા, મહિનગર,
અમદાવાદ-૩૮૦ ૦૦૮. મો. ૮૮૨૪૧ ૮૨૫૬૫
- ભરત ખેતશી નેમિદાસ ગાંધી
એ-૧૦૪, ગ્રાન્ડ રિવેરા, રાજનગર સોસાયટી પાસે,
રિવર ફન્ટ સ્પોર્ટ્સ પાર્ક સામે, વિશ્વકુંજ ચાર રસ્તા, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭.
મો. ૮૮૮૮૮ ૩૦૪૬૩, ૭૦૧૬૩ ૩૮૨૧૮
- પ્રવીષ જેતશી દંડ
એ-૨૭, યુગાન્ડા પાર્ક સોસાયટી,
સરદાર પટેલ સ્કૂલની પાછળ, બૈરવનાથ રોડ, મહિનગર,
અમદાવાદ-૩૮૦ ૦૦૮. ● મો. ૮૩૪૭૮ ૬૬૭૩૩

અવસાન નોંધ - પુષ્પાંજલિ

- મંગળવાર, તા. ૨૬-૧૦-૨૦૨૧
જ્યાબેન જુમખલાલ શાહ (ઉ.વ. ૭૮) (માંડવી - અમદાવાદ)
- શાનિવાર, તા. ૦૬-૧૧-૨૦૨૧
કલ્પનાબેન કિરણભાઈ ભોગીલાલ (ઉ.વ. ૬૨)
(મુંડ્રા - અમદાવાદ)
- શુક્રવાર, તા. ૧૨-૧૧-૨૦૨૧
કલ્યાણજી રવજ રાંભિયા (ઉ.વ. ૬૮) (રામાણિયા - અમદાવાદ)
- શુક્રવાર, તા. ૧૮-૧૧-૨૦૨૧
અરુણભાઈ રસિકલાલ દામજભાઈ શાહ (ઉ.વ. ૮૨)
(માંડવી - અમદાવાદ)

સંદર્ભાત્મક આત્માના શ્રેયાથે પ્રાર્થના...

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

સંચાલિત

માતુશ્રી મેધાબાઈ પાસુભાઈ શાહ - આયુર્વેદ વિભાગ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ, વર્ષ ૧૯૮૭થી તેના પાલકી ખાતેના શ્રી કચ્છી જૈન ભવન પર મેડિકલ સેન્ટર ચલાવી રહેલ છે. જેમાં કન્સલિંગ તથા ડાયગ્નોસ્ટિકની લગભગ ૨૫ બ્રાંચ અને અંદાજિત ૮૦ જેટલા એમ.ડી. કક્ષાના અથવા તો તેનાથી ઉપરની કક્ષાના ડોક્ટરશ્રીઓ ત્યાં પોતાની સેવા આપી રહ્યા છે.

આ સેન્ટરમાં આયુર્વેદ બ્રાંચ તથા હોમિયોપેથી બ્રાંચની કન્સલિંગ તથા ડિસ્પેન્સિંગ સેવાઓ નિયમિતપણે ચાલુ રહેવા પામેલ છે. પરંતુ અનેક પેશન્ટોની પંચકર્મ, શિરોધારા જેવી સવલતોની ડિમાન્ડના કારણે આયુર્વેદ ક્ષેત્રને વધુ વિસ્તૃત બનાવવાનું નક્કી કરેલ છે.

હાલે ડૉ. સોનલબેન શાહ અઠવાડિયામાં બે દિવસ આયુર્વેદ ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે. પરંતુ હવે તા. ૧ ડિસેમ્બર, ૨૦૨૧થી આ સેન્ટરમાં ડૉ. ગાર્ગિબેન વસાવડા (સંગોઈ)ની પણ સેવા લેવાનું નક્કી કરેલ હોતાં તા. ૧ ડિસેમ્બર, ૨૦૨૧થી આયુર્વેદના કન્સલિંગ વિભાગ તથા ડિસ્પેન્સિંગ વિભાગ નીચે મુજબ કાર્યરત રહેશે.

★ ડૉ. ગાર્ગિબેન વસાવડા (સંગોઈ)

સોમવાર - બુધવાર - શુક્રવાર
સવારે ૬.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી

★ ડૉ. સોનલબેન શાહ

મંગળવાર - ગુરુવાર - શાનિવાર
સવારે ૬.૦૦થી ૧૧.૦૦ વાગ્યા સુધી

આયુર્વેદ વિભાગના ચાર્જિસ ખૂબ જ કિફાયતી ધોરણે નક્કી કરેલ હોવાથી આ સેન્ટરનો લાભ વધુને વધુ લોકો લઈ શકે તેવું આયોજન કરી રહ્યા છીએ.

આયુર્વેદ વિભાગ તેના કન્સલિંગ ક્ષેત્રે યોગ્ય રીતે ચાલુ થઈ ગયા બાદ તુરંતમાં જ અહીં પંચકર્મ, શિરોધારા વગેરે પ્રકારની સેવાઓ પણ શરૂ કરવાનું આયોજન વિચારેલ છે.

આયુર્વેદ વિભાગના બંને ડોક્ટરો પોતાનાં ક્ષેત્રમાં ખૂબ જ એક્સપર્ટ હોવાથી આ વિભાગનો લાભ વધુને વધુ લોકો નિયમિતપણે લઈ શકે તે માટે ઉચ્ચ પ્રકારની સવલતો આ વિભાગમાં જાહેર જનતાને આપવામાં આવશે.

જાહેર જનતા આ સવલતનો યોગ્ય રીતે ઉપયોગ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

અધ્યાત્મિક સાવલા, કન્વીનર, મેડિકલ સમિતિ - પાલડી

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

છેલ્લા ૪૫ વર્ષથી દર મહિનાની પણ તારીખે
નિયમિતપણે પોટ કરવામાં આવતું
“શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ”નું
મુખ્યપત્ર

“મંગલ મંદિર”

મુખ્ય કાર્યાલય

શ્રી કચ્છી જૈન ભવન,
૪૩-૪૪, શ્રી બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી,
પાલડી, એલિસબિલ,
અમદાવાદ-૩૮૦ ૦૦૬.
ફોન : (૦૭૯) ૪૮૮૦ ૬૦૦૧ થી ૬૦૦૪
ઈ-મેલ : kjssmangalmmandir@gmail.com
વેબ-સાઇટ : www.kutchijainahd.org

તંત્રી

પ્રતાપ નારાણાજી દંડ

સંહ તંત્રી

દિનેશ આર. મહેતા

મો. ૯૯૨૪૩ ૪૨૬૨૮

અંકમાં પ્રસિધ્ય થયેલ લેખો તથા અન્ય વિભાગની
માહિતીઓ સાથે તંત્રીમંડળ સહમત છે તેમ માની વેચું
જરૂરી નથી. રજૂ થયેલ વિચારો જે તે વ્યક્તિના હોય
છે, જેની નોંધ લેવા વિનંતી.

લેખકોને નામ વિનંતી

‘મંગલ મંદિર’માં પ્રગટ કરવા
માટે વિપુલ પ્રમાણમાં લેખ સામગ્રી
અમને મળતી રહે છે અને એટલે
સ્વીકૃત કૃતિઓને પ્રગટ કરવાનું પણ
સ્વાભાવિક રીતે વિલંબાય. મંગલ
મંદિરના ધોરણને ધ્યાનમાં લઈ,
પોતાની રચના મોકલતી વખતે લેખક
સ્વાવિષેક દાખલે તેવી વિનંતી છે.
એક સાથે એકથી વધુ કૃતિઓ
ન મોકલવા વિનંતી.

ભાષાદોષ અને લાંબા લેખો
અસ્વીકાર્ય બનશે તેની નોંધ લેવા
વિનંતી. લેખમાં એકની એક વાતકું
પુનરાવર્તન (રેપિટેશન) ટાઇપું
જરૂરી છે. કૃતિની હસ્તપ્રત સ્વચ્છ
અને સુવાચ્ય હોવી જોઈએ. આશા
છે કે, આ બાબતમાં લેખક મિત્રોનો
સહકાર અમને મળી રહેશે.

- મુખ્યતંત્રી

આનુક્રમણિકા

- શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત
નવનીત ડાયાલિસિસ સેન્ટર - બોપલના ઉદ્ઘાટન કાર્યક્રમનો અહેવાલ. ૩
- તંત્રી લેખ :**
- વિકમ સંવત - ૨૦૭૮ દિનેશ આર. મહેતા..... ૧૧
- આગામી કાર્યક્રમોની એક જલક... ૧૨
- દીપશીખા**
- આશા ટકાવી રાખો ● મુશ્કેલીઓથી ડરો નહીં, આગળ વધો
- અંતરિક શક્તિ ઉપર વિશ્વાસ મૂકો ડૉ. પૂજા કોટક..... ૧૩
- શિક્ષાસા**
- શિક્ષણના અભાવથી જન્મતા પ્રશ્નો...!! કપીલ સતાણી..... ૧૪
- અધિકાર**
- માનવ જીવનને અર્થપૂર્ણ, સંઓષ્ણાનક અને ગૌરવવાન બનાવે તેવા - મુખ્ય અધિકારો અને
તેવા પ્રકારનાં સ્વાતંત્ર્યને માનવ અધિકાર કરી શકાય ડૉ. મિહિર અમ. વોરા..... ૧૫
- વિચાર મંચ**
- સાહિત્ય સાથે જીવનનો સંબંધ પ્રો. જે.પી. પટેલ..... ૧૭
- ગુલશાન (ચાલુ શ્રેણી) (મણકો-૧૩)**
- હવાના દ્વાર ખખડાવતો કવિ - શ્યામ ઠાકોર ચંદ્રકાંત પટેલ ‘સરલ’, સાહિત્યકાર..... ૧૮
- નારી ગૌરવગાચા (મણકો-૬)**
- આરતીબેન ધોરિયા : “આધુનિક યુગની અશપૂર્ણી” ડૉ. શીલા વ્યાસ..... ૨૨
- સુભિરે... બલબીરા, સ્મૃતિપટ પર સંભારણાં (સંકલન : બલવીરસિંહ જાડેજા)**
- “થોડા આંસુ થોડો ખ્યાર” (સત્ય ઘટના પર આધ્યારિત) ડૉ. શરદ ઠાકર..... ૨૩
- “આવા પણ ઠોક્કર હોય છે” (સત્ય ઘટના પર આધ્યારિત) ૨૫
- જ્યોત**
- આશાદીપ ડૉ. રૂપલ ભંડ..... ૨૬
- પિગાળો રે તમે આતમનો અંધકાર! ભારતીબેન ગોહિલ..... ૨૭
- શક્તિ**
- હજુ નારીને સતીની વ્યાખ્યામાં બાંધી છે અંકિતા ભરવાડિયા..... ૨૮
- ‘મા’ - માનવજીતનું આધ તીર્થ અમૃતલાલ હિંગરાજિયા..... ૩૧
- ચિંતન**
- સુખી થવું આપણા હાથમાં છે હરજીવન રંગપરિયા..... ૩૩
- સમજની સુસંગતતા અને વ્યક્તિગત વિચારોની અંગતતા અશોક સરિયા..... ૩૫
- જીવનની પાસબુક ભરત અંજારિયા..... ૩૬
- સંસાર**
- માનવ, I am Sorry એમ. ડી. સોલંકી..... ૩૭
- ગંખના**
- સાચી સુખાનુભૂતિ ડૉ. ભાવેશ જેતપરિયા..... ૪૦
- વ્યક્તિ / સંસ્થા વિશેષ**
- માઝાસે જોખમ ઉઠાવતાં ન ડરવું જોઈએ...
લોકપ્રિય લેખક એચ.અન. ગોલીભાર (ભાલાભાઈ ગોલીભાર)ની રોમાંચક જીવન સફર આશુ પટેલ..... ૪૧
- સંચામ**
- વૃદ્ધત્વ એટલે સંયમની મૌસમ વિપિન પંડ્યા..... ૪૩

<p>શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના “પદાધિકારીશ્રીઓ”</p> <p>મેળેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપ નારાણજી એંડ ઘર : ૦૭૯ - ૨૬૪૦૫૦૪૭ મો. ૯૮૨૬૭ ૨૫૬૧૮</p> <p>ઉપમુખ-૧ શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહ ઘર : ૨૬૪૪ ૬૪૧૩, આ. ૨૬૪૦ ૧૧૫૦ મો. ૯૮૨૫૦ ૩૧૫૨૮</p> <p>ઉપમુખ-૨ શ્રી શાંતિલાલ મુજજી સાવલા ઘર : (૦૨૭૭) ૨૩૪૪૫૫ મો. ૯૮૨૫૦ ૪૮૬૪૫</p> <p>માનદ મંત્રી શ્રી પ્રદીપ સૂર્યભાઈ મહેતા ઘર : ૨૬૬૧૨૦૮૮ મો. ૯૮૨૫૦ ૬૧૧૬૦</p> <p>સહમંત્રી શ્રી રોહિત સંઘવી</p> <p>ખજાનચી શ્રી ચંદ્રકાંત દામજી શાહ ઘર : ૨૬૬૦૫૨૨૫</p> <p>સંખ ખજાનચી શ્રી રજનીકાંત ધરમશી પારેખ મો. ૯૮૮૮૦ ૫૩૫૨૯</p> <p>શ્રી કચ્છી વિશ્વામ ગૃહનું સરનામું : શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત શ્રી કચ્છી વિશ્વામ ગૃહ અર્થિંતનગર દેરાસરની સામે, ગાંધી વિદ્યાલયની ગીવીમાં, રચના સ્કૂલની પાછળ, રાજ્યસ્થાન હોસ્પિટલ પાસે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : ૦૭૯-૨૨૮૮૪૪૭</p> <p>સેવા ભવનનું સરનામું : શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત માતુશ્રી કંદુલેન કાન્યુભાઈ રવજી (નાની ખાખરવાળા) સેવા ભવન, એસ. ટી સ્ટેન્ડ પાસે, સર્કાર ગેટ હાઉસની સામે, રૂગાનાથપુરા, અમદાવાદ-૩૮૦ ૦૨૨. ફોન : ૦૭૯-૨૫૪૭૧૨૭૦</p> <p>‘મંગલ મંદિર’ના અંકો સમાજની વેબસાઈટ www.kutchijainahd.org ઉપર... બ્લોગ... www.hellokutchis.com ઉપર વાંચી શકાય છે.</p>	<p>આચ્યોજન</p> <ul style="list-style-type: none"> આદર્શ વિશ્વ વ્યવસ્થા યોગેશ નટવરલાલ ભંડુ..... ૪૪ <p>સ્વાસ્થ્ય</p> <ul style="list-style-type: none"> મને વારંવાર માથાનો દુઃખાવો (માર્ટ્ઝેન) થાય છે—(૪) ડૉ. મહિલાલ ગડા, સિનિયર મનોધિકિલ્સક ૪૫ માનસિક સ્ટ્રેસ અને માર્ટ્ઝેન ડૉ. દિપી શાહ (ગડા), મનોધિકિલ્સક તથા ભાળ મનોધિકિલ્સક <p>વાતા</p> <ul style="list-style-type: none"> મન ! તોહે કાહે વિધ સમજાઉ ! હરેશ ધોળકિયા..... ૪૭ <p>નોલેજ બેંક</p> <ul style="list-style-type: none"> ગુજરાતી સાહિત્ય નોલેજ બેંક – (૭) : વિવિધ સ્વર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ... રમેશ પટેલ..... ૫૧ <p>કારક્રિયા</p> <ul style="list-style-type: none"> સિવિલ સર્વિસ ડેડર પોલિસિ હીરેન દવે..... ૫૨ <p>ગમ્ભી / કાવ્ય સૂચિ</p> <ul style="list-style-type: none"> શાસમાં ભનવા મળે : હીરીશ પંડ્યા ● હું ક્યાંક આસપાસ છું : મિતેશ રાઠોડ ૫૩ મારા શહેરની સાંજ : દીક્ષિતા નીપણ વોરા ● પિત્તરી ગયો : ભૂપેન્ડ શેઠ ‘નીલમ’ ૫૩ વડલાને વૃદ્ધાવસ્થા આવી : જયસુખ કુછિડિયા ‘ગ્રિયેદી’ ● સંબંધો : જાગૃતિ તક્ષા ‘અનકી’ ૫૪ સૌ સંપીને તહેવારો ઊજીવીએ : કુસુમ કુંડારિયા ● પણ : અલ્ય ગ્રિયેદી ● હાઈકુ : રમેશ પટેલ ૫૪ <p>YOUTH CLUB</p> <ul style="list-style-type: none"> Some Golden Thoughts Presentation : Dinesh R. Mehta ૫૫ <p>વૈવિદ્ય</p> <ul style="list-style-type: none"> અંણે કાગર ૫૬ પુસ્તક પરિચય : “રણ, જણ જણનું” અવલોકન : હંસરાજ કંસારા..... ૬૩ <p>કચ્છ દર્શન</p> <ul style="list-style-type: none"> કચ્છ દર્શન ૬૫ <p>બાળ વિભાગ</p> <ul style="list-style-type: none"> ઇત્ત્રીની નાવડી – વાર્તા ધૂવી અમૃતિથા..... ૬૬ <p>ગોમસ ગોલેરી</p> <ul style="list-style-type: none"> રાજકી આયેગી ભારત – ગેમ ભાવના એ. ગ્રવેરી..... ૬૭ <p>માહિતી</p> <ul style="list-style-type: none"> કુવારાનું વિજ્ઞાન ● પૂર્ખી પરના મહાસાગરો ૬૮ ● વિશ્વની પ્રથમ યુનિવર્સિટીના લાંદા ● ઘોડા વિશે.... ૬૮ <p>નિયમિત વિભાગો</p> <ul style="list-style-type: none"> Nano Nine શેખ્ડ ૨મ્ટ-૧૭૭ ● Nano Nine Sudoku (કોડ-૧૧૩૫) સંકલન : રજનીકાંત પારેખ..... ૬૯ ● જિલજી મ, ભલા....!!! સંકલન : ગુલાબચંદ ધારશી રંભિયા..... ૭૨ <p>શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ</p> <p>સંસ્કૃત સમાચાર</p> <ul style="list-style-type: none"> સમાજ દર્પણ ૮ ભાળ કલ્યાણ સમિતિ : ભાલ સમૃદ્ધ યોજના ડેટા સંબંધિત ભાળકોને મળવાપાત્ર રકમ અંગે જાણકારી ૮ માતુશ્રી મેધબાઈ પાસુભાઈ શાહ આયુર્વેદ વિભાગ ૮ યુવા વિકાસ સમિતિ : ગુરુભાય ૨૦૨૧, વેલક્રમ ૨૦૨૨ કાર્યક્રમ ૭૩ યુવા વિકાસ સમિતિ : Get Together with Fun Games ૭૪ સમાજનું સભ્યપદ મેળવવા માટે તેમજ તેમાંથી મળતા લાભોની વિગત ૭૫
--	---

Printed & Published by : Mr. Pratap Dand, For Shri Kutchhi Jain Seva Samaj - Ahmedabad.

Printed at : Gajanand Offset, Amraiwadi, Ahmedabad.

Published at : Shri Kutchhi Jain Seva Samaj – Ahmedabad, 43/44, Brahman Mitra Mandal Soc., Opp. Navchetan High School, Paldi, Ellisbridge, Ahmedabad-380 006. ● Editor : Mr. Pratap Dand ● Yearly Subscription : Rs.150/-



તંત્રી લેખ

વિક્રમ સંવત - ૨૦૭૮



દિનેશ આર. મહેતા

કારતક સુદ્ધ પાંચમ એટલે કે લાભ પાંચમ. તેની સાથે જ દીપોત્સવના તહેવારોની શુભલાની સમાપ્તિ થઈ. પૂરા થયેલા વર્ષ રમ્ભિયાનનું વેપારી આલમ આવક-જીવકનું સરવૈયું તૈયાર કરે છે અને નાણાંકીય સ્થિતિના ઉપસેલા ચિત્ર અનુસાર નવા વર્ષે આગળ વધે છે. ગુજરાતીઓની કેટલીક વિશિષ્ટ બાબતો છે. તે પેકી એક - એટલે હિસાબ-કિતાબ. વેપાર-દંધો ગુજરાતીઓની ખાસિયત રહી છે. જે મારવાડી સિવાય અન્ય બીજી જ્ઞાતિમાં કવચિત જ જોવા મળે. દેવ-દેવીઓની પૂજા સાથે હિસાબી ચોપડાઓનું પણ પૂજન કરવું એ આપણા આગવા સંસ્કાર રહ્યા છે. એક જમાનામાં વિશ્વના બંદરો પર ગુજરાતી વેપારીઓના વાવટા ફરકતા હતા. હાલારના બંદરોથી છેક આંકિકાના ડિનારાઓ સુધી સામુદ્રિક વ્યાપારની બોલબાલા હતી. તે સમયની હિસાબી પ્રણાલિકા વેપારી આલમના એક વર્ગમાં આજે પણ જોવા મળે છે. વેપારની જેમ હુકીકતમાં દરેક વ્યક્તિએ પણ પોતાના જીવન દરમિયાનના વર્ષનું સરથેયું કાટીને આત્મશુદ્ધિ કરવી જોઈએ. તેને અનુરૂપ જીવન શૈલીમાં પરિવર્તન આણીને બદલાતા માહોલમાં સ્થિર રહીને પોતાની, પોતાના પરિવારની તેમજ જ્ઞાતિ - સમાજની વિક્રમ સંવત ૨૦૭૮માં સર્વાંગી પ્રગતિ થાય તેવા વિચારો સાથે પોતાની જીવનનાવને હંકારવા સતત પ્રયાસ કરવા જોઈએ. પરંપરાગત નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારી આલમ દ્વારા લાભ પાંચમના શુભ હિને મુહૂર્ત કરવામાં આવે છે. આ રીતે એક 'મિની વેકેશન' બાદ માર્કેટ તેમજ દુકાનો પૂર્વવત્ત ધમધમવાનો શુભ આરંભ થાય છે.

દિવાળી બાદ, લાભ પાંચમના દિવસે અગર કોઈ નવા વેપાર કે ધંધાનું મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની એક વિશિષ્ટ પરંપરા - માન્યતા છે. લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ-દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. આ પ્રકારના પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા પર 'શુભ', 'લાભ' લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. આ રીતની ગતિવિધિઓ અગર માનવ જીવનમાં તેના અંતરમાં પ્રતિ વર્ષ થતી હોય તો તે ખૂબ આવકારદાયક છે. આ સમયે આપણામાં પેદા થયેલા રાગ-દ્રેષ્ણને વેરાનેના જળાને દૂર કરીને મન - વિચારને સાફ કરીએ એ વધારે જરૂરી છે. આ પ્રકારની પ્રક્રિયા થાય તો જ આપણે વિક્રમ સંવત ૨૦૭૮ના નૂતન વર્ષનું ભાવનાપૂર્વક અને ખરા અર્થમાં સ્વાગત કર્યું કહેવાય.

આપણે સૌઅં અનુભવ્યું છે તેમ, વિક્રમ સંવત ૨૦૭૭નું વર્ષ ખૂબ જ કપડું હતું. કોરોના વાયરસને સંક્રમણ ખૂબ ભયંકર રીતે સમગ્ર વિશ્વમાં ગ્રસરતાં માનવ-જીવન, કામ-ધંધા, રાષ્ટ્રીય અર્થકારણ વગેરે ક્ષેત્રો પાયમાલ થઈ ગયા. કેટલાક પરિવારોની આર્થિક આવક, રોજી-રોટી છીનવાઈ ગઈ. હજુ પણ તેનું સંક્રમણ ચાલુ જ રહ્યું છે એટલે લોકોએ સાવચેત રહેવાની અતિ આવશ્યકતા છે. પ્રવર્તમાન માહોલની વચ્ચે પણ નવા વર્ષે સૌના જીવનમાં નવી આશા અને ઉમંગ પ્રગટે તથા નૂતન સંકલ્પો પરિપૂર્ણ થાય તેવી અપેક્ષા સેવીએ. ગત વર્ષ દરમિયાન માત્ર શેર બજારમાં ઓલરાઉન્ડ તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના પગલે તમામ વર્ગના રોકાણકારોને મભલક વળતર મળ્યું હતું. હવે નવા વર્ષ એક અદ્ભુત પ્રકારની ઉજનો સંચાર થાય અને તેનાં પગલે સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય તેવી ભાવના ભાવીએ. આપણે સૌ પોતાના આંતરિક જીવનમાં સર્વાંગી પરિવર્તન લાવીએ. ગત વર્ષની પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થવા માનસિક રીતે મજબૂત થઈને નવી શક્તિનું સર્જન કરીએ. વિતેલા વર્ષના દુઃખને વિસરી જઈને નૂતન વર્ષ વિ.સં. ૨૦૭૮માં સૌના સપના સાકાર થાય તેવી પ્રાર્થના કરીએ. તે સાથે મહામારીના સમયે સરકારી માર્ગદર્શિકા અનુસાર નીતિ-નિયમોનું સાખ રીતે પાલન કરવાનું પણ ધ્યાનમાં રાખીએ. જનારોગ્ય, પદેશી દેશો સાથે સરહદી સમર્યાઓ, વ્યાપાર-વાણિજ્ય વગેરે ક્ષેત્રના સંદર્ભમાં વિ.સં. ૨૦૭૮નું વર્ષ અગત્યનું બની રહેશે. તેમ છાતાં વિક્રમ સંવતના નવા વર્ષે અંતરાત્માના અંધકારને પ્રકાશનું સર્જન કરીને દૂર ભગાડીએ. નવા વર્ષને ઉમંગ-ઉલ્લાસના રંગોથી સજાવીએ. દુઃખ-દર્દને ઘડીભર ભૂલી જઈને સ્નેહ-દૂઝના પ્રકાશથી પરસ્પર માનવ જીવનને મધમધતું બનાવીએ તેવા સંકલ્પ, વિશ્વાસ અને આનંદથી વિ.સં. ૨૦૭૮ના વર્ષને દીપાવીએ.

આગામી કાર્યક્રમની એક ગલક....

તારીખ - સમય	સ્થળ	કાર્યક્રમ - આયોજનકર્તા	કાર્યક્રમની વિગત
● બુધવાર, તા. ૨૨-૧૨-૨૦૨૧ ગુરુવાર, તા. ૨૩-૧૨-૨૦૨૧ બપોરના ૨.૩૦ થી ૫.૩૦	શ્રી કચ્છી જૈન ભવન - પાલડી	શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સામાજિક સુરક્ષા સમિતિ	આદર્શ અમદાવાદના સહયોગથી રેઝિનો કાર્યક્રમ. સાર્વજનિક ધોરણે કોઈપણ સભ્ય લાભ લઈ શકે છે. (સમાજ કાર્યાલયમાં આપણું નામ નોંધવશો.)
● શુક્રવાર, તા. ૩૧-૧૨-૨૦૨૧ સાંજના ૭.૦૦ વાગ્યાથી	શ્રી કચ્છી જૈન ભવન - પાલડી	શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ યુવા વિકાસ સમિતિ	ગુરુભાય ૨૦૨૧ - વેલક્રમ ૨૦૨૨ નિમિત્ત કાર્યક્રમ તથા ભોજન
● બુધવાર, તા. ૨૬-૦૧-૨૦૨૨ સવારના ૮.૦૦ કલાકથી	શ્રી કચ્છી જૈન ભવન - પાલડી	શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ	પ્રજ્ઞાસત્તાક દિન નિમિત્ત ધજવંદન કાર્યક્રમ
● બુધવાર, તા. ૨૬-૦૧-૨૦૨૨ સવારના ૧૦.૦૦ કલાકું	સેવા ભવન - ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસે, ગીતા મંદિર	શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ	ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન
● બુધવાર, તા. ૨૬-૦૧-૨૦૨૨ સવારના ૧૧.૦૦ કલાકથી	ટાગોર હોલ, પાલડી	શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ	ગીતા મંદિર ખાતેના સેવા ભવનના ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન સમારંભ તથા ભોજન

(વધુ વિગત માટે સંસ્થા સમાચાર વિભાગમાં જોશો.)

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

માસિક મુખ્યપત્ર 'મંગલ મંદિર'માં પ્રકાશિત કરવા વિજ્ઞાપન માટે દરોની વિગત...

ક્રમ	ટાઈટલ	કલર	આખુ પાનું	અડ્યું પાનું	પા પાનું	અન્ય
૧.	કવર પેઇઝ નં.-૪	મલ્ટિ કલર	૭,૦૦૦	૪,૫૦૦	૩,૦૦૦	—
૨.	કવર પેઇઝ નં. ૨ તથા ૩	મલ્ટિ કલર	૬,૦૦૦	૩,૫૦૦	૨,૫૦૦	—
૩.	કવર પેઇઝ ૨ તથા ઉની સામેનું પાનું	મલ્ટિ કલર	૫,૪૦૦	૩,૨૫૦	૨,૨૫૦	—
૪.	અંદરનું પાનું	મલ્ટિ કલર	૪,૦૦૦	૩,૦૦૦	૨,૦૦૦	—
૫.	અંદરનું પાનું	સિંગલ કલર	૪,૦૦૦	૨,૫૦૦	૧,૪૦૦	—
૬.	અંદરનું સાહુ પાનું	બ્લેક એન્ડ વ્હાઈટ	૨,૦૦૦	૧,૫૦૦	૧,૦૦૦	—
૭.	ટચુકી જાહેર ખબર ૧ કોલમ X ૫ સે.મી.	બ્લેક એન્ડ વ્હાઈટ	—	—	—	૫૦૦
૮.	સાદા પાનાની નીચે ૧ ઈચ્ચની પદ્ધી	બ્લેક એન્ડ વ્હાઈટ	—	—	—	૩૫૦

નોંધ : ૧. એક સાથે ૧૨ મહિનાની જાહેરાત આપનારને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

૨. એક સાથે ૬ મહિનાની જાહેરાત આપનારને ૭.૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

૩. એક સાથે ૩ મહિનાની જાહેરાત આપનારને ૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

જરૂરી રકમ "શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ"ના નામે મોકલાવવા વિનંતી.

(ઓનલાઈન / ડિજિટલ પેમેન્ટ માટેની જરૂરી વિગત અન્યત્ર આપી છે.)

નોંધ : જાહેરાતની સાઈઝ

(૧) કુલ પેજ : ૧૮.૦ X ૨૩.૬ સે.મી. (૨) હાફ પેજ : ૧૮.૦ X ૧૧.૬ સે.મી.

(૩) ૧/૪ પેજ : ૬.૦ X ૧૧.૬ સે.મી. (૪) બોટમ પદ્ધી : ૧૮.૦ X ૨.૫૪ સે.મી.

આશા ટકાવી રાખો

જીવનની ગતિ અકળ છે. તે એક ગતિમાં કદાપી ચાલતું નથી. જીવનનો રાહ સુંવાળો પણ નથી. આ માગભાઈ ક્યારેક વસંતથી પુલકિત થયેલા બાગ હોય છે, તો ક્યારેક કાંટા પણ હોય છે. ગિરિકંદરથી કપરા ચઢાડા હોય છે. આ પ્રકારે જિંગદારીની તાસીરમાં પરિવર્તન આવતું હોય છે. સંસ્કૃતમાં એક શ્લોક છે : “છશ્મોડપિ રોહનિ તરુ ક્ષણોડપિ હૃથપચીયતે પુનશ્ચનન્દ ધતિ વિમૃશન્તઃ સંનતઃ સંતાચન્તઃ ન તે વિપદા ॥”

અર્થાત્ : “વૃક્ષોને કાપવા છતાં તે ફરી ઉગે છે. ચંદ્ર ઘટવા છતાં ફરીથી તે વધે છે. એવો વિચાર કરીને સજજનો આફિતથી વધિત થઈ જતાં નથી.”

જીવનના ચટાવ-ઉતારને સજજનો પચાવી જાય છે. એવા આશાવાદથી કે કપરો સમય પણ વીતી જશે. સારા સમય સાથે અહ્મુને ટકરાવવા દેતા નથી. તડકો-છાંયો, ચઢાવ-ઉતાર, અંધારું-અજવાણું, દિવસ-રાત જેવા દુંદ્રને સિક્કાની બે બાજુ ગળીને આવા લોકો સ્થિતપ્રણ રહે છે. આદર્શ મનુષ્ય તે છે કે જે ગમે તેવા કપરા સંજોગોમાં કર્મની ગતિને રોકતા નથી અને અવિરત કર્મ કરે છે. દરેક સંજોગોમાં તેની પ્રવૃત્તિનો પાયો આશાવાદ છે. વિદ્યાર્થીઓ પણ જો તેમના અધ્યયનમાં આવા આશાવાદને ટકાવી રાખે તો નિષ્ફળતા દૂર ભાગે છે.

મુશ્કેલીઓથી ડરો નહીં, આગળ વધો

જીવન મુશ્કેલીઓનું ચક છે. તેમાં ડગલે નાની મોટી તકલીફો આવે છે. આ મુશ્કેલીઓથી ડરવાણું ન હોય, તેનો સામનો કરવાનો હોય. તો જ લક્ષ્ય સિદ્ધ થાય, આગળ વધી શકાય.

ઈન્દોનેશ્યાની એક મોટા માણસની નાની ઘટના છે. શાળા શરૂ થઈ. થોડા દિવસો બાદ એક વિદ્યાર્થી ઉદાસ ચહેરે ઘરે આવે છે. તેના માતા-પિતા વહાલથી આ ઉદાસી માટે પૂછે છે. તે વિદ્યાર્થી જવાબ આપે છે કે હવે હું શાળામાં જઈશ નહીં. કારણ પૂછતા જ્ઞાનવા મણ્યું કે ‘શાળામાં બધા બાળકો મારી મજાક ઉડાવે છે.’ પિતાએ કહ્યું કે આ નવી બાબત નથી અને શાળામાં શરૂઆતમાં ઘણા માટે આવું બને છે. થોડા સમયમાં તારા ઘણા બધા મિત્રો થઈ જશે. વિદ્યાર્થી પુસ્તકો પછાડી કહે છે કે, ગમે તે થાય, પોતે સ્કૂલમાં નહીં જાય!

આથી આ વિદ્યાર્થીના પિતાએ પોતાના એક શાશ્વત મિત્રની સલાહ લીધી. તે મિત્ર એક દિવસ વિદ્યાર્થીને એક તળાવ પાસે લઈ ગયા અને વિદ્યાર્થી પાસે પાણીમાં એક મોટો પથ્થર ફેંકાવ્યો. થોડી કાણો પાણી ઉડ્યું, અટકી ગયું અને ફરી વહેવા લાગ્યું. પથ્થર પાણીમાં દૂબી ગયો. તેમણે વિદ્યાર્થીને પૂછ્યું કે, ‘આમાં

શું થયું?’ વિદ્યાર્થી અનુત્તર રહ્યો. તેથી તેના પિતાના મિત્રએ સમજ આપી કે પાણીના વહેણને પથ્થર થોડી અડયણ આપી ગયા પણ તેનો પ્રવાહ ફરીથી ચાલુ રહેવા માંડ્યો. જ્યારે પથ્થર દૂબી ગયો. આપણે મનુષ્યે આ પાણીના પ્રવાહની જેમ આગળ વધવાળું હોય, અડયણથી ડરવાળું ન હોય! મુશ્કેલીઓથી ગભરાઈને કોઈ પ્રયત્નો છોડી ન શકાય, પરંતુ ધીરજપૂર્વક તેનો સામનો કરવો જોઈએ તે આ વાતનો સાર છે.

આ વાત ઈન્ડોનેશ્યાના સ્વાતંત્ર્ય સંગ્રહના મહારથી એવા અને પછીથી ત્યાંના પ્રમુખ બનેલા સુકર્ષણાના જીવનની છે.

આંતરિક શક્તિ ઉપર વિશ્વાસ મૂકો

ઉર્જા બે પ્રકારની હોય છે : એક તનાવની અને બીજી શાંતિની! આ પૈકી કોઈપણ શક્તિ કે સ્થિતિથી કાર્ય થઈ શકે છે. પણ શાંત મનથી થયેલું કાર્ય વ્યવસ્થિત થાય છે. આ વ્યવસ્થિત કે પરિણામદારી કાર્ય એ આંતરિક શક્તિની દેન છે. આપણે માત્ર આપણી શક્તિનો ૧૦% ભાગ જ ઉપયોગમાં લઈએ છીએ. પણ બાકીની ૮૦% શક્તિથી અજાણ હોઈએ છીએ. આ છુપાયેલી આંતરિક શક્તિનો જો સ્વસ્થતાથી કે યોગ્ય રીતે ઉપયોગ થાય તો દ્યેય પ્રાપ્તિ સરળ બને છે. તેથી વ્યક્તિએ આ નેવું ટકા (આંતરિક) શક્તિને જગાડવી પડે છે. નેવું ટકા પૈકી વ્યક્તિગત સમર્થતા મુજબ જે ઉપયોગ શક્તિનો થાય તે નફામાં જ ગણાયા! આ માટે ચીલાચાલુ નહીં પણ આગવી ઢબે કાર્ય કરવું પડે છે. ગમતા ક્ષેત્રમાં આંતરિક શક્તિના ઉપયોગથી શ્રેષ્ઠતા મળે છે. યાદ રહે કે મગજ અને દિલનાં સ્વખ્નો અલગ હોય છે. તેથી જે કાર્ય થાય તે દિલથી થાય તો દીપી ઉઠે છે. સહકાર અને વિશ્વાસ પ્રગતિ માટે કેળવવા પડે છે.

આંતરિક શક્તિ ઉપર વિશ્વાસ રાખવાથી માનસિક રાહિત થાય છે. તે કાર્યને સફળ બનાવે છે. આપણી નકારાતક્તા દૂર થાય છે. સફળતા માટેના વિચારો જાગૃત થાય છે. પરીક્ષામાં મહેનત તો યથાશક્તિ દરેક પરીક્ષાર્થી કરે છે, પણ જે સ્માર્ટ મહેનત કરે છે તે જ ટોપર્સ બને છે. કંઈક એવી મહેનત થાય છે જે ‘દિલસે’ કહી શકાય! દિલ અને દિશા બદલે છે. મનુષ્યમાં કેટલીક સુષ્પુમ શક્તિઓ રહેલી છે, જે મોકાએ કે ખરે ટાણે ઉપયોગમાં આવે તે આ ઉર્જા છે. આ પ્રકારની શક્તિનો આપણામાં બંદાર છે, જરૂરત છે ફક્ત તેને કેળવવાની!

- ડૉ. પૂજા કોટક

માણસ કેવી કિંમતી ચીજવસ્તુઓ વાપરે છે એના ઉપરથી એની કિંમત અંકાતી નથી પણ તે પોતાના સમયની અને બીજાના સમયની કેવી કિંમત કરે છે એના ઉપરથી એની કિંમત થઈ શકે છે.



શિક્ષણ

શિક્ષણાં અભાવથી જગતા પ્રશ્નો...!!



કપિલ સતાણી

ભજાવ્યે કોનું સારું થવાનું છે? કોને નોકરો મળવાનો છે? ખોટા ખર્ચ શા માટે કરવા જોઈએ? છોકરીઓને તો પરણીને સાસરે જવાનું હોય! આપણા છોકરા ન ભણે વગેરે જેવા વિવિધ પ્રશ્નો કરી આપણે શિક્ષણનું અપમાન કરીએ છીએ અને આપણા સંતાનોને શિક્ષણથી વંચિત રાખીએ છીએ. શું માત્ર નોકરી મેળવવા માટે જ સંતાનોને ભણાવવાના? સુવ્યવસ્થિત જીવન જીવવા માટે શું શિક્ષણની જરૂર નથી? આપણે આપણા સંતાનોને શિક્ષણથી વંચિત રાખી શું સાબિત કરવા માંગીએ છીએ? આવા પ્રશ્નો આપણને થાય છે ખરા? આપણને તો એમ જ કે શિક્ષણનું ધ્યેય એટલે નોકરી આપવી. પરંતુ આ આપણી ગેરસમજ અને આણસમજ છે. શિક્ષણનું મુખ્ય ધ્યેય વ્યક્તિએ શું વિચારવું, કેવી રીતે વિચારવું તેમજ સમાજમાં કેવી રીતે ડગલા માંડવા તે છે. શૈક્ષણિક પ્રક્રિયાનો મુખ્ય હેતુ માનવજીતનો વિકાસ છે.

શિક્ષણ એટલે માત્ર નવા કપડાં, બુટ પહેરીને શાળાએ જવું તેટલું જ નહીં, પરંતુ જીવનમાં વિવિધ મૂલ્યોનું સંકાન્તિકરણ. આ સંકાન્તિકરણ શિક્ષણનાં માધ્યમથી જ થાય છે. શિક્ષણનો અભાવ એટલે અવ્યવસ્થિત જીવન, પ્રશ્નોની હાડમાણ અને સમસ્યાઓનું સામ્રાજ્ય. સુધૂમ શક્તિનો સંચાર શિક્ષણ દ્વારા જ શક્ય છે. જે સંતાનોએ શિક્ષણ નહીં મેળવું હોય તો કદાચ... તેમનામાં રહેલી સુધૂમ શક્તિ બહાર નહીં આવે!! શાળા અને શિક્ષણ સુધૂમ શક્તિ બહાર લાવવાનું મોટું પ્લેટફોર્મ ચોક્કસપણે ગણી શકાય. સંતાનો જ્યારે મોટા થાય છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે ‘છોકરા કંઈ નવું નથી કરતા!’ પણ ક્યાંથી કરે? તેની સુધૂમ શક્તિનાં વિકાસ માટે આપણે વિચાર કર્યો છે ખરા? આપણે સંતાનોની સુધૂમ શક્તિનાં વિકાસ વખતે તેને ધૂધે જોતરી દઈ તેની મૌલિકતા અને સર્જનાત્મકતા પર રોક લગાવીએ છીએ. આમાં જવાબદાર આપણે પોતે જ છીએ. માતા-પિતા શિક્ષણનાં અભાવથી અનેક હાડમારી ભોગવે છે. શિક્ષણના અભાવમાં બહારગામ જતી વખતે બસનું બોર્ડ વાંચવામાં મુશ્કેલી પડે, તો બીજી તરફ મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, બેંક, પોસ્ટ ઓફિસ, વિવિધ સરકારી કચેરીઓનાં વહીવટ બાબતે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અશીક્ષિત માતા-પિતાએ પોતાની જિંદગી બરબાદ કરી નાખી

હોય છે. સાથે સાથે પોતાના સંતાનોની જિંદગી કેમ બરબાદ કરે છે? તે પણ એક યક્ષ પ્રશ્ન છે. જે માતા-પિતા પોતાના સંતાનોને ભજાવતા નથી તેઓ પોતાના સંતાનોના દુશ્મન નહીં તો બીજું શું? જે દરેક માતા-પિતા પોતાના વહાલસોયા સંતાનોનું સાચા અર્થમાં સુખ દ્યાયતા હોય તો તેમને જરૂર ભણાવે. શિક્ષણનાં અભાવથી માતા-પિતાએ જે મુશ્કેલી વેઠવી પડી હતી તે સંતાનોને ન વેઠવી પડે તે માટે શિક્ષણ ગંગાજળ સમાન સાબિત થશે.

શિક્ષણનો અભાવ એટલે બાળ મજૂરીનું વધતું જતું પ્રમાણ. બાળ મજૂરી કૂદરે ને ભૂસકે વધતી જાય છે. સરકાર કન્યા કેળવણીને ઉત્તેજન આપી રહી છે પરંતુ હજુ ગુજરાતના હજરો ગામડાંઓ એવા છે જ્યાં કન્યા કેળવણીને પૂરતો પ્રતિસાદ મળ્યો નથી. હજુ ઘણા ગામો એવા છે જ્યાં દીકરીઓનાં શિક્ષણ પ્રત્યે રૂઢીચુસ્ત માન્યતાઓ પ્રવર્તે છે. દીકરીને પણ સુનિતા વિલિયન્સની જેમ આકાશમાં ઉડવાનો મનસૂબો હોય છે. દીકરીઓનાં શિક્ષણ પ્રત્યે પણ ઠોસ વિચારણા થવી જ જોઈએ. સમાજમાં પ્રવર્તતી તમામ સમસ્યાઓનું સમાધાન એટલે શિક્ષણ.

કમ્પ્યુટર અને ઇન્ટરનેટનાં બદલાતા જતા નૂતન પ્રવાહ સાથે તાલ મિલાવવા શિક્ષણ અનિવાર્ય અંગ છે. શિક્ષણ, એ માનવ જીવનને બહેતર અને ઉત્તેજન બનાવવા માટેની માનવ શક્તિની વિકાસાત્મક પ્રક્રિયા છે. ઉત્કૃતિવાદના નિયમનાં સૂત્રરૂપે એમ કહેવામાં આવ્યું છે કે, ‘Learn Today to Live Tomorrow.’ (કાલે જીવવા માટે આજે શીખો). શિક્ષણ, એ તો માણસને માનવ તરીકે જીવતા શીખવે છે. માનવનાં જીવનપથમાં અજવાસ ફેલાવે છે. આવો, સૌ સાથે મળીને શિક્ષણ જ્યોત જગાવીએ અને અંધકારને દૂર કરી રાખ્યને પ્રકાશમય બનાવીએ!!

● ખાટું-મીઠું :

રાખ્યીય એકતાનું ચણાતર કોઈ ઈંટ-ચૂના વડે કરી શકાય નહીં. એ તો માણસોનાં દિલ અને દિમાગમાં શાંતિપૂર્વક પાંગરવી જોઈએ, ને એ માટેની પ્રક્રિયા કેળવણીની પ્રક્રિયા જ હોઈ શકે.

— ડૉ. સર્વપલી રાધાકૃષ્ણન


યોગેશ્વર નગર, બાવનગર રોડ,

ગુજરાત - ૩૬૪ ૭૧૦ (ગુજરાત). • મો. ૮૪૨૮૧ ૧૨૦૮



અધિકાર

**માનવ જીવનને અર્થપૂર્ણ, સંતોષજનક અને
ગૌરવવાન બનાવે તેવા મુખ્ય અધિકારો અને
તેવા પ્રકારનાં સ્વાતંત્ર્યને માનવ અધિકાર કહી શકાય**



ડૉ. ભિહિર એમ. વોરા

મિત્રો, આ લેખ વિવિધ માહિતી અને મુદ્દાઓ આધારિત તમારી સામે રજૂ કર્યો છે. એટલે આ લેખ માત્ર માહિતી અને જ્ઞાન આધારિત છે, જેની નોંધ લેજો.

મનુષ્યનો જન્મ થતાં તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે છે. આવા અધિકારો કોઈ આપતું નથી અને કોઈ છીનવી પણ શકતું નથી. આમ, માનવ જીવનને અર્થપૂર્ણ, સંતોષજનક અને ગૌરવવાન બનાવે તેવા મુખ્ય અધિકારો અને તેવા પ્રકારનાં સ્વાતંત્ર્યને માનવ અધિકાર કહી શકાય. માનવ જે તક મેળવવા માટે સક્ષમ છે, તે તક તેને મળે, ભયથી મુક્તિ મળે, તેના અધિકારો ઝુંટવાય નહીં એટલે ૧૦ ડિસેમ્બરને ‘માનવ અધિકાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. બે ભયાનક વિશ્વયુદ્ધ પછી ભયાનક અંધકારમાંથી પ્રકાશનો ઉદ્ય થયો અને અંતે યુનાઇટેડ નેશન્સે ૧૦ ડિસેમ્બર, ૧૯૮૮માં યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સની જીહેરાત કરી અને તેથી વિશ્વમાં ૧૦ ડિસેમ્બરને ‘માનવ અધિકાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને ત્યાર પછી આવા અધિકારોની જોગવાઈ કરતા જુદા જુદા ૨૦ દસ્તાવેજોને અને સમજુતીઓની જોગવાઈ થઈ હતી. દુનિયાનાં ૧૨૦ દેશોએ દસ્તાવેજોને અનુમતિ આપી છે. જ્યારે ભારતમાં માનવ અધિકાર પંચની પ્રથમ વખત રચના ૧૯૮૮માં થઈ અને ઓક્ટોબર ૨૦૦૪સુધીમાં ૧૪ જેટલા રાજ્યોમાં પણ રાજ્ય માનવ અધિકાર પંચની સ્થાપના કરવામાં આવી. ૧૦ ડિસેમ્બર એટલે કે “માનવ અધિકાર દિવસ.” આ દિવસ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ દેશના દરેક નાગરિકને પોતાનો અધિકાર મળી રહે તેના માટે આ દિવસ ઉજવવામાં આવે છે. જે અધિકારો કોઈ આપી કે છીનવી શકતું નથી. આવા અધિકારો માનવ અધિકારો તરીકે ઓળખાય છે. આ મારો અધિકાર છે, તેને હું મેળવીને જ રહીશ. આજે ૭૨ વર્ષ પૂરા થયા છે આ દિવસને. ૭૦ વર્ષ પહેલા માનવ અધિકાર દિવસના ઘોષણા પત્ર જાહેર કરાયો હતો. નાગરિકની શાંતિ, પ્રતિષ્ઠા અને પોતાના અસ્તિત્વ માટેનો આ ઉદ્દેશ આજે પણ આપણને મળી રહ્યો છે. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૮ના રોજ હ્યુમન રાઇટ્સ એક્ટ સમગ્ર વિશ્વમાં અલગથી અમલમાં આવ્યું. આના પર ૧૨ ઓક્ટોબર, ૧૯૮૮ના રોજ સરકારે રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનની

રચના કરી હતી. આ કમિશન રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ કાર્ય કરે છે. જેમ કે વેતન, એચ.આઈ.ડી. એઈડીસ, આરોગ્ય, બાળ લગ્ન, મહિલા અધિકાર વગેરે.

માનવ અધિકાર, એ માનવી સાથે થઈ રહેલ જુલમો રોકવા અને તેના સંઘર્ષને એક નવી ઉડાન આપે છે. માનવ અધિકાર એટલે કોઈ પણ માનવીની જિંદગી, આજાદી, બરાબરી અને તેના સમ્માનનો અધિકાર તે જ માનવ અધિકાર.

જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ, રાજકીય અથવા અન્ય અભિપ્રાય, રાષ્ટ્રીય અથવા સામાજિક મૂળ, સંપત્તિ, જન્મ અથવા અન્ય સ્થિતિ જેવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, માનવી પોતાનું જીવન જીવી શકે તેના માટે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.

દરેક માનવી પોતે મુળભૂત રીતે જન્મની સાથે જે અધિકારો સાથે જન્મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઈપણ જાતની અહ્યાશ વગર મુક્ત રીતે ભોગવી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી જન્મે છે, જીવે છે પરંતુ પોતાનું જીવન જીજીવિષા સાથે જીવનપાર્શ્વ જીવી શકે તે માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્ય પણ. સમગ્ર વૈશ્વિક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની અવિરત પ્રક્રિયાની જેમ માનવ અધિકારોના હનનના બનાવો બન્યા જ કરે છે. જેનું મુખ્ય કારણ પોતાના જ અધિકારોની જાણકારીનો અભાવ છે અને અન્યના અધિકારોની અવગાણના પણ.

સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના જ્યાલનો વિકાસ અને ઉદ્ભબ ૧૩મી સદીમાં હુંલેન્ડમાં બનાવાયેલ લેભિત દસ્તાવેજ “મેનાકાર્ટ”ને ગણી શકાય. આ દસ્તાવેજમાં માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રામ થાય છે, તેવા તમામ અધિકારો પ્રામ થવા જોઈએ તેવા તમામ કુદરતી અધિકારો “મેનાકાર્ટ” દસ્તાવેજથી હુંલેન્ડની પ્રજાને આપવામાં આવેલ હતા. ઈ.સ. ૧૯૧૪થી ૧૯૧૮ના પ્રથમ વિશ્વયુદ્ધ સમયે માનવ અધિકારોની વૈશ્વિક કાયદો બનાવવા વિશે વૈશ્વિક સત્તે ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન માનવ અધિકારો વિશેનો કાયદો

બનાવવામાં સફળતા પ્રાપ્ત ન થવાથી તે ઘ્યાલ વિશેનો સર્વસંમતિથી કાયદો બનાવી શકાયેલ ન હતો. જેના ફલશુતીરૂપે સમગ્ર વિશ્વના તમામ દેશોને વિશ્વયુદ્ધના માઠા પરિણામો ભોગવવા પડેલ. ઈ.સ. ૧૯૪૮માં સમગ્ર વૈશ્વિક સ્તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત “માનવ અધિકાર” શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો.

‘માનવ અધિકાર’ શબ્દનો અર્થ સમજતા પહેલાં ‘અધિકાર’ શબ્દને સમજવો ખૂબ જ જરૂરી છે. ‘અધિકાર’ એટલે માનવીનું હિત છે કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષિત રાખવામાં આવેલું છે.

સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે યુનોએ સૌપ્રથમ વખત યુનિવર્સલ ડેક્લારેશન ઓફ હ્યુમન રાઇટ્સ (UDHR) નામનો દસ્તાવેજ બનાવ્યો હતો. આ ઘોષણાપત્રમાં જ્ઞાયું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્મથી સમાન છે અને તમામને કોઈપણ જાત (રંગ), વર્ષ, જાતિ, ભાષા, ધર્મ, રાજકીય કે અન્ય વિચારો, રાષ્ટ્રીય કે સામાજિક મૂળ લક્ત, જન્મ કે અન્ય કોઈ હોદાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્વતંત્રતાઓ પ્રાપ્ત થાય છે.

ભારતીય બંધારણમાં અપાયેલા માનવી અધિકારો દરેક વ્યક્તિને માત્ર સરકાર વિરુદ્ધ જ પ્રાપ્ત થતાં હોવાથી માનવ અધિકારોના ભંગ બદલ રાજ્યસેવક વિરુદ્ધ જ ફરિયાદ કરી શકાય છે. માનવ અધિકાર ભંગની ફરિયાદ વ્યક્તિ-વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના ડિસ્સાઓમાં કોઈમાં જ ફરિયાદ કરી શકાય છે, પરંતુ તેના સિવાય પણ; જેમ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તેમજ રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખિત ફરિયાદ કરીને આગળની જરૂરી કાર્યવાહી કરી શકાય છે. આ ઉપરાંત મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગને પોતાની ફરિયાદો કરી શકે છે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના લોકો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ ફરિયાદ કરી તેના માનવ અધિકારોના ભંગ બદલ વળતર પ્રાપ્ત કરી શકે છે. **ભારતીય બંધારણમાં દરેક માનવીને તમામ માનવ અધિકારો અપાયા હોવા છતાં માનવ વિકાસમાં પણત છે તેમ સ્વીકારવું પડતું છે.** સરકારી બધા તંત્રોમાં પણ માણસો જ કામ કરે છે અને આ માણસો કાયદાના રખેવાળ બનવાની બદલે કાયદાના ભંગને નજરઅંદાજ કરે છે. જે લોકો પાસે રાજકીય, આર્થિક કે ધાર્મિક સત્તાઓ છે તેવા લોકો સત્તાનો દુરૂપ્યોગ કરીને અન્ય માણસોના અધિકારોનું હનન કરે છે. વર્તમાન સમયમાં પ્રત્યેક માનવીએ થોડું વિચારવાની જરૂર છે કે શું વર્તમાન સમયમાં માનવી તરીકે પ્રાપ્ત થયેલા માનવ

અધિકારોને આપણે ભોગવી શકીએ છીએ? કારણકે સમાજમાં જેવી પ્રજા હોય તેવો જ તેનો શાસક હોય છે. આથી વર્તમાન સમયમાં જો આપણે મુક્તપણે આપણા અધિકારો ભોગવવા માંગતા હોઈએ તો આપણે પણ બીજાના માનવ અધિકારોને માન-સન્માન આપતા શીખવું જ પડશે અને ત્યારે જ આપણે આપણાં અધિકારોનો વધુમાં વધુ સારી રીતે ઉપભોગ કરી શકીશું અને સમાજના તમામ વ્યક્તિને તેના માનવ અધિકારોની જ્ઞાનવળી કરવામાં મદદરૂપ સાબિત થઈ શકીશું.

ખોત : પોલીસ મહાનિદેશક, માનવ અધિકાર - ગુજરાત પોલીસ, વિક્રીપીડિયા, વિવિધ અખભારી અહેવાલો.

“પરમેશ્વરી”, પ્લોટ નંબર ૧૬૫, હોસ્પિટલ રોડ,
વિજયનગર એરિયા, મુજાફાનગર, ગુજરાત ૩૯૪૩૦ ૦૦૧.
મો. ૯૮૨૮૦ ૭૭૭૮૫

દીપકની વાટમાં જ્યારે જ્યોત જલે છે ત્યારે તે જ્યોત,
કોરિયું સોનારું છે કે મારીનું તે જોવા માટે નીચી નજર નથી કરતી.

આનંદના અજવાળા

મારું નાનું એવું એક ગુંપડા જેવું ઘર હોય, પરોઢનો સમય હોય, વાતાવરણ શાંત હોય, ઘરના દરવાજાથી પાંચ મીટરના અંતરે એક દીવાલ હોય, દીવાલની બીજી બાજુ ત્રાણસો મીટર સુધી લહેરાતું ખેતર હોય,

કારતક માસનો પ્રારંભ હોય, જુવાર બાજરીના ઝૂંડા, ડળવા પવનથી માથું ધુણાવતા હોય, તે પર કાબર, તેતર, લેલા, પોપટ અને કલકલિયા આવીને બેસતા હોય;

આ પંખીઓની સંખ્યા બે ત્રાણ ડાન હોય, ને ઝૂંડાની સંખ્યા સેંકડો હજારો હોય, દરેક પંખીને, આવા સમયે એક એક ઝૂંડા પર બેસીને દાણા ચણતા જોવા એ એક આલ્બાદક લહાવો છે.

એકાદ મીટર દૂરથી શોરબકોર વિના પંખીઓને, દીવાલ પાસેથી જોવાની એક મજા છે. ત્યારે ફક્ત પાંખોનો ફફડાટ સંભળાય છે, તેનો હું આનંદ લઉં છું.

અને બરાબર તે સમયે ગૃહલક્ષ્મીનો ટહુકો સંભળાય છે : ‘અંદર આવી જાવ, ચા તૈયાર છે...’

દીવાલની આ તરફનું જગત અને દીવાલની પેલી તરફની દુનિયા વચ્ચેની બેદરેખા, ત્યારે સ્પષ્ટ થાય છે અને મારું સ્વખ્ય જ્ઞાણે બે ભાગમાં વહેંચાઈ જાય છે.

એક તરફ કણ્ઠપ્રિય ગૃહલક્ષ્મીનો ટહુકો
બીજી તરફ નયનપ્રિય દશ્ય.

જ્યેશ ટક્કર - વાલેરા
મો. ૯૮૨૮૦ ૭૭૭૮૫



વિચાર મંચ

સાહિત્ય સાથે જીવનનો સંબંધ



પ્રો. જે.પી. પટેલ

એક મિત્રે બીજા જીગરી મિત્રને મોર્નિંગ વોક વખતે સવાલ કર્યો : ‘દોસ્ત, આ જીવનને સાહિત્ય સાથે શો સંબંધ છે? મને તો લાગે છે કે આ સાહિત્ય એટલે પુસ્તકોજ ને? આવા પુસ્તકો વાંચીને શું ભલું થવાનું? પુસ્તકોમાંથી શું જિંદગી બનવાની? પેલા સંત કબીરે કહ્યું છે ને –

પોથી પછી પછ્કર જગ મુચા, પંડિત હુઅા ન કોઈ;
દાઈ અક્ષર પ્રેમકા પછે સો પંડિત હોઈ.’

‘કેમ દોસ્ત, તું કંઈ સમજતો જ નથી. અરે, સાહિત્ય અને માનવ જીવનનો સંબંધ તો આત્મા-પરમાત્માનો, જીવ અને શિવનો સંબંધ છે.’

‘શું ગાંધી મારે છે? આત્મા-પરમાત્માનો સંબંધ જીવન સાથે કેવી રીતે હોય?’

‘જો સાભળ. સાહિત્યમાં સહેતુકપૂર્વકનું માનવીના વાણી, વ્યવહાર અને વર્તનનું સચોટ વર્ણન હોય છે. સાહિત્ય કેટલા પ્રકારનું છે તે જાણે છે? બધું જ સાહિત્ય પુસ્તકોશીપી માનવ જીવનમાં દીવાદાંડી સમાન છે. ગદ્ય સાહિત્ય, પદ સાહિત્ય. આ ઉપરાંત બધા જ માનવી સાહિત્યને સથવારે સંસારની ગીતાના કારના માલિક બની જાય છે! જેમ કે સાહિત્યકાર, નૃત્યકાર, કલાકાર, શિલ્પકાર, કથાકાર, ચિત્રકાર એક યા બીજા અર્થમાં સમસ્ત માનવો જેવા કે ખેડૂત, વેપારી, એન્જિનિયર, ડોક્ટર, ધર્મગુરુ, રાજકારણી, કારીગર – બધા જ પોતપોતાના ક્ષેત્રે કલાકારો છે. પરંતુ આ કલાકારોએ સાહિત્યના માધ્યમથી જિંદગીનાં મૂલ્યો શીખ્યા છે અને મૂલ્યો વગરની જિંદગી એટલે નર્કની જિંદગી. આવી સમજણ ક્યાંથી મળે? તે તો માત્ર શાખકારો અને કેળવણીકારો જ આપે છે.’

સાહિત્ય અને જીવનનો સંબંધ ગૂઠ રહેસ્યોથી ભરપૂર છે. ગૌરવપૂર્ણ જીવન માટે શાખો અને સાહિત્યે જ્ઞાનગંગા વહેવડાવી છે. જેના ગહન અભ્યાસથી માનવજીવન સાર્થક નીવડે છે.

દાસકાકા જરા અકળાઈને બોલી ઉઠયા : સાહેબ, પૂર્ણ જીવન એટલે શું? પૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય? શાખોના અભ્યાસથી જીવનમાં શો ફરક પડે?

કાકા, ગીતા વાંચી છે? અર્જુન - કૃષ્ણનો સંવાદ સાંભળ્યો

છે? છેવટે પૂર્ણ જીવન એટલે શું? તે સમજવા નીચેના જીવન પ્રવાહો જાણવા પડશે.

આધુનિક જીવન + આધ્યાત્મિક જીવન = પૂર્ણ જીવન.

માણસના જીવનમાં આધુનિકતા ભલે આવે પરંતુ તેના જીવનમાં ૫૦ ટકા આધ્યાત્મિકતા આવે તો જિંદગી સુખમય બની જાય. પરંતુ આ બધું સમજવા માટે વેદવાસનું સાહિત્ય - શાખો વાંચવા પડે, સમજવા પડે અને આચરણમાં મૂકવા પડે.

સાહિત્યમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય. ગીતાના જ્ઞાનને સર્વશ્રેષ્ઠ જ્ઞાન ગણવામાં આવે છે કારણકે ગીતા જ્ઞાનથી માનવીજીવન શું છે? માનવ આ સૂચિ ઉપર શા માટે આવ્યો છે? માનવીએ તેના જીવનમાં શું કરવાનું છે? આ બધી વાત શ્રીકૃષ્ણે અર્જુનને પ્રશ્નોત્તરીના માધ્યમથી ગીતા જ્ઞાન આપ્યું! પ્રભુને પણ જ્ઞાની જ મ્રિય છે અને તે ગીતાના આશ્રયે રહે છે.

શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે :

“ગીતાશ્રયદેહં તિષ્ઠામિ, ગીતા મે ચોત્તમં ગૃહમ् ।
ગીતાજ્ઞાનમુપાશ્રિત્ય ત્રિજ્ઞાકોન્યાલયામ્યહમ् ॥

બોલો, આવું ગીતાનું અમૃતજ્ઞાન ‘ગીતા’ના પુસ્તકરૂપે જ્યારે માનવના હાથમાં આવ્યું, તેને રસપૂર્વક વાંચ્યું અને જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગના સમન્વયરૂપી ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી માનવ કૃતકૃતાર્થ બની ગયો.

આ બધું સાહિત્યના પ્રતાપે જ બની શકે. માનવીએ ઉત્તમ જિંદગી જીવના માટે કર્મયોગ જ કરવાનો છે અને તે પણ નિઃસ્વાર્થ ભાવે ફળની અપેક્ષા બિના જ આવી સમજણ ગીતાએ આપી પરંતુ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો કાવ્ય સાહિત્યરૂપે (૧) વેદવાસનું મહાભારત અને (૨) વાલ્મીકીકૃત રામાયણ માનવીને પ્રાપ્ત થયું. મહાભારત અને રામાયણે તો માનવ જીવનનાં મૂલ્યોને જીવનમાં તાણવાણાની માફક વણી દીધા. માનવે જિંદગી કેવી રીતે જીવવાની છે તેનું માર્ગદર્શન રામાયણના રામે અને શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણે આપ્યું છે.

“રામે માનવને કહ્યું, હું જે રીતે જીવ્યો છું તે રીતે તમો પણ પિતા સાથે, માતા સાથે, ભાઈ સાથે, પત્ની સાથે, રાજ

તરીકે પ્રજા સાથે જીવન જીવતાં શીખો.”

“મહાભારતમાં કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુધ્ઘના સમયે ગીતાના ૧૮ યોગ અધ્યાય દ્વારા અજૂનને (તમે અને હું મનુષ્યના સ્થાને) કહ્યું કે, ‘હું કહું તે પ્રમાણે તારે કરવાનું છે! ઊઠ, ઊભો થા અને હતાશા નિરાશા બંધેરી નાખ અને તારા કર્તવ્ય કર્મમાં લાગી જા!” સાહિત્યનો કેટલો જોરદાર પ્રભાવ છે.

માનવે તો જિંદગી જીવી જાણવી છે. ૨૧મી સદીમાં તો કેટલું બધું વિલિન્થ ક્ષેત્રોનું સાહિત્ય ખડકાયું છે. ટેકનોલોજીના જમાનામાં વિવિધ પ્રકારનું સાહિત્ય મેળવી માનવી કુદરતને પણ હંફાવવા લાગ્યો છે. માનવ જીવનને સુખી કેમ બનાવવું? માનવીના જીવનમાં મુખ્યત્વે ત્રણ પ્રવૃત્તિઓ અગ્રસ્થાને રહી છે:

૧. **આર્થિક પ્રવૃત્તિ :** રોજબરોજના જીવન નિર્વાહ માટેની પ્રવૃત્તિ.
૨. **સામાજિક પ્રવૃત્તિ :** સમાજનું ઋણ અદા કરવાની સેવાની પ્રવૃત્તિ.
૩. **ધાર્મિક પ્રવૃત્તિ :** શરીરરૂપી ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને ભગવાનને થેંક્યુ કહેવાની પ્રવૃત્તિ.

આર્થિક પ્રવૃત્તિમાં ઉદ્યોગ ધંધા, ખેતીવાડી, પશુપાલન, તેરી ઉદ્યોગ, ખનિજ ઉદ્યોગ, રંગરસાયણ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ અને તદ્દન નવા ઉદ્યોગ-વ્યવસાયનો તો રાફડો જ ફાટ્યો છે. આ બધી પ્રવૃત્તિઓ કરવાનું જ્ઞાન વિવિધ પ્રકારના સાહિત્ય દ્વારા પ્રાપ્ત થાય છે અને માનવી આજની ટેકનોલોજીનો અભ્યાસ કરી પોતાના જીવનમાં જરૂરી સુખ સગવડના ભૌતિક સાધનો જેવા કે ટી.વી., ફીજ, ફોન, ફર્નિચર, ફ્લેટ અને સુંદર ફિયાન્સી પણ મેળવે છે.

સામાજિક પ્રવૃત્તિ, એ સમાજના ઉત્કર્ષની વાત છે. માનવી આખરે તો સામાજિક પ્રાણી જ છે ને? સમાજના ઉત્કર્ષ માટે કુટુંબ, શાળા અને સમાજ મહત્વનો ભાગ ભજવે છે. એક સમાજશાસ્ત્રી કહે છે કે : કુટુંબમાં “મધર ઈઝ એ ટુ નર્સ એન્ડ ફાધર ઈઝ એ ટુ ટીચર.”

માતા ઉત્તમ નર્સ છે અને બાળક માટે પિતા ઉત્તમ ટીચર છે.

“શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાનગંગા જ્યાં મળે.” – આ બધું ગંગાજીમાંથી ના મળે તે તો વિભિન્ન પ્રકારના બાળ સાહિત્યમાંથી મળે, શાળાકીય સાહિત્યમાંથી મળે, સમાજ શાસ્ત્રોમાંથી મળે. સાચું એ છે કે ક્લમતી (સાહિત્યની) તાકાત તલવાર કરતાં વધુ છે.

ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’માંથી માનવીને કેટલું બધું શીખવાનું મળે? ગાંધીજીની પ્રાર્થના ‘સત્ય, અહિસા, ચોરી ન કરવી, વાણીએઈતું નવ સંગરવું, કોઈ અડે ન અભડાવવું... માનવીના ઘડતર માટે કેટલું બધું સમજાવે છે.

ધાર્મિક પ્રવૃત્તિઓનો માનવીના આધ્યાત્મિક જીવનમાં - વિકાસમાં ફાળો છે. “શરીર એક લેટમાં મળેલ મંદિર છે, તેને બગાડવાનો માનવીને અધિકાર નથી.” જીવ અને શિવનો સંબંધ, આત્મા એ જ પરમેશ્વર. ઈશ્વરનું સરનામું કયું છે? આત્મ સાક્ષાત્કાર એટલે શું? મોક્ષ એટલે શું? મંદિર એટલે શું? વિભિન્ન પ્રકારના દેવી-દેવતાઓ કોણ છે? તેમનાં વાહનોની પસંદગી જુદી જુદી શા માટે છે? પ્રાર્થના આત્માનો ખોરાક છે શા માટે? વિવેકાનંદે દરેક ધર્મગુરુને એક ગ્રન્થ પૂછ્યો હતો કે તમે ઈશ્વરને જોયા છે? માત્ર રામકૃષ્ણ પરમહંસે જ વિવેકાનંદને પ્રભુનો સાક્ષાત્કાર કરાવ્યો. તો ગુરુ એટલે શું? ગુરુ કેવા હોવા જોઈએ? દત્તાત્રે ર૧ ગુરુ કર્યા હતા. નવધા ભક્તિ એટલે શું? ભજન, કીર્તન, મંત્ર, માળા, કંઠી, મૂર્તિ એટલે શું? આટલા મોટા આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન ક્યાંથી મેળવીશું? આ બધાનો સચોટ માર્ગદર્શક તો ધાર્મિક સાહિત્ય જ હોઈ શકે ને! ઐતિહાસિક ગ્રંથો જ હોઈ શકે.

અંતમાં જો માનવીએ બધી રીતે સુખી થવું હોય તો પ્રભુને એક જ પ્રાર્થના કરવી :

“સર્વત્ર સુખિનઃ સત્તુ, સર્વ સત્તુ નિરામયા: /
સર્વ ભદ્રાણિ પશ્યત્તુ, મા કશ્ચિત દુઃખમાણુયાત ॥

૩૫ શાંતિ: શાંતિ: શાંતિ:

૧, કમલકં'જ સોસાયટી, અંડરલિય પાસે,
શાહીનબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
મો. ૯૮૮૮૦ ૭૬૬૭૭

It's our duty to keep public
property clean 



Railways spend over 1200 cr every year to clean spitting marks on trains and walls, this also takes a lot of water to clean these.



ગુલશાન

“દિલની જબાન”

હવાના દ્વાર ખખડાવતો કવિ : શ્યામ ઠાકોર
માણાકો-૧૩



ચંદ્રકાંત પટેલ ‘સરલ’



કવિ શ્યામ ઠાકોર

૪૬, વલ્લભનગર સોસાયટી,
ભૂરાવાપ,
ગોધરા - ૩૮૮ ૦૦૧.
(જિ. પંચમહાલ)
મો. ૯૪૨૭૦ ૯૦૯૯૫

હવા સાથેનો હાડ-માંસ-ચર્મ અને માયા-મમતાનો સંબંધ કોણ નથી રાખતું? માણસ કે અન્ય જીવને હવા જ જીવાડે છે. શરીરમાં હવાની આવનાવન એટલે ખાસોચ્ચવાસની કિયા. આ હવાને જીવન બદનારું તાવ છે.

હવાને હલાવનારો એક કવિ છે. એક એટલે તેમણે હવાને પટાવી, મનાવી, વહાલી કરી હવા ઉપર જેટલા કાવ્યો - ગજલ લખ્યાં છે, તેટલાં અન્ય કોઈ કવિએ નથી લખ્યા. માટે જ સાહિત્ય જગતમાં તે ‘હવાના દ્વાર ખખડાવતો કવિ’ એવી ઉપમા પામ્યાં છે.

આ કવિનું નામ છે શ્યામભાઈ એસ. રખિયાણિયા. અમદાવાદ જિલ્લાના માંડલ ગામના સૂરસંગળ રખિયાણિયાના ખોરડે માતા ગજરાબહેનની કૂખેથી ૧૯૬૬ના રોજ કવિનો જન્મ થયો. કવિના વડવાઓનું મૂળ વતન તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું ગામ ‘અમનગર.’ ત્યાંથી વડવાઓ માંડલ આવ્યા. માંડલથી પરિવાર પંચમહાલ જિલ્લાના ગોધરા ગામે વસ્યો.

શ્યામભાઈ એસ. રખિયાણિયા ‘શ્યામ ઠાકોર’ નામે ગીત, ગજલ, વાતા, લઘુકથા તથા નાટકો વગેરે ગુજરાતી ભાષામાં લખે છે. M.A., B.Ed. કરી તેમણે Ph.D. ની ડિગ્રી પણ મેળવી છે. તેઓ મૂળે સંસ્કૃત ભાષાનાં પ્રાધ્યાપક છે.

ગોધરાની શ્રી જ્ય અંબે લલિતાબહેન કાલિદાસ કોટેચા આર્ટસ એન્ડ કોમ્પ્લેઝન્સ આ કવિની સાને ૧૯૮૮માં સંસ્કૃત વિષયના વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ થઈ. ત્યાર પછી તેની કવિતા-કહેણીને પાંખો ફૂટી. સંસ્કૃત વિષયના અચ્છા પ્રાધ્યાપક તરીકે અને ગુજરાતી ભાષાના ગજલના એક સારા સર્જક તરીકે આ કવિ વિકસ્યા છે. તેમની મોટાભાગની ગજલ - કવિતાઓ હવાથી ભરી છે. અર્થાત્ હવા સાથે હાથ મિલાવતી દેખાય છે.

અત્યાર સુધીમાં તેમના ચાર પુસ્તકો પ્રગટ થયા છે. જેમાં ‘અક્ષરાંકન’ (સહ સંપાદન), ૨૦૦૫માં પ્રથમ પુસ્તક પ્રગટ થયું. ‘દ્વાર ખખડાવે હવા’ ગજલ સંગ્રહ ૨૦૧૫માં પ્રગટ થયો છે. ‘પ્રત્યાર્થ’ (અભ્યાસલેખ સંગ્રહ) ૨૦૧૭માં તથા ૨૦૨૦માં ‘ગજલ’ નામે લઘુકથા સંગ્રહ વગેરે પુસ્તકો તેમણે લખ્યાં છે.

આ કવિની ૨૫૦ જેટલી કાવ્ય કૃતિઓ, ૩૦ લઘુકથાઓ અને ઉચ્ચ અભ્યાસલેખો આજના પ્રતિષ્ઠિત ગણ્ણાતાં સામયિકો કુમાર, શબ્દસર, શબ્દસૂચિ, નવચેતન, છાલક, અખંડ આનંદ, કવિલોક, કવિતા, તાદર્થ્ય, ગજલવિશ વગેરેમાં પ્રગટ થયા છે ને થતા રહે છે. આ કવિ ગજલ- કાવ્ય - લેખો ઉપરાંત નાટકમાં પણ રસ ધરાવે છે. સંસ્કૃતનાં સંવર્ધન માટે એ.બી. ધૂવ પારિતોષિક પ્રામ થયું છે.

- મિર્જા મંડળ

મફરે જિસ મેં કી જોફને રાહત તલબી,
હરદમ સોયે કો મેં અપના શબ્દિસાં સમજા.

- મિર્જા ગાલીબ

મિર્જા ગાલીબ કહે છે કે જીવનને થકવી નાખતી યાત્રામાં

પોરો ખાવાની જરૂર થઈ ત્યારે દોડવાનું તો હું બંધ ન કરી શક્યો,
પણ મનોમન મારા જ પડછાયાને પથારી સમજને આરામ કરી
લીયો.

મિર્જા ગાલીબે પડછાયાને પથારી બનાવી દઈને વિશ્વાસ

ભલે કરી લીધો હોય, આપણા શ્યામ ઠાકોરે તો આરામને દૂર હડસેલી દીધો છે, ને શબ્દને શાશવાર કરવા પાછળ મન લગાવ્યું છે અને સમકાળીન જીવનનું પ્રામાણિક પ્રતિબિંબ જીવી લઈ માનવોપયોગી સાહિત્યના નિર્માણ માટે દોડવાનું શરૂ કર્યું છે. અને જે દોડે છે એ જ મંજિલે પ્રથમ પહોંચે છે. આ જીવન જ ચાલવાનું નામ છે. એટલે જ કવિ દોડતા રહ્યાં છે ને જે ઉભો છે તેને વઢી પણ રહ્યાં છે. જુઓ કવિનો આ શે'ર :

સાવ કોરી છે નથી, તું કેમ જીભો છે અહી?
પગ નહીં પલળે જરી, તું કેમ જીભો છે અહી?
હું ક્ષણોની રાહ જ્યારે જોઉં છું ત્યારે મને;
ખાસ પૂછે છે સદી, તું કેમ જીભો છે અહી?

શ્યામની ગજલો વાંચ્યા તેમાં પ્રગટ થતું અભિવ્યક્તિનું સૌંદર્ય, અભિવ્યક્તિની નાવિન્યતા રમણીયતા ઉભી કરવામાં કવિને સહયોગ કરતી દેખાઈ રહી છે. સરળતા, સ્વાભાવિકતા, પ્રાસાદિકતા એ ગજલની વિશેષતા છે. ગજલનું સ્વરૂપ ઉપરથી સરળ-સીધું હોય છે, પણ ભીતર પ્રવેશો તો તેની કલાકારીગરીનો કસબ કેવો કપરો છે તેની પ્રતીતિ થાય છે. માત્ર રદીફ-કાફિયા વડે શબ્દોને મફલવાથી કાંઈ ગજલ બનતી નથી. ગજલમાં રહેલ પારદર્શિતા અને સરળ વાણી એના અંતઃતત્ત્વ અને અંતઃસત્ત્વને તપાસતાં જાણી શકાય છે. કવિનો આવો એક શે'ર આ રહ્યો :

અજવાસનો ડર કેટલો બતાવ્યો અમે છતાં,
ભીતર હજ અંધાર જીભો છે ઘડેપગ!

કવિ શ્યામ ઠાકોર વાતો ચાલવાની જ કરે છે પણ કોઈ ચાલતું નથી. નથી ચાલતું એટલે ચલાતું નથી. આગળ વધાતું નથી કારણકે જે રાહભર હતાં એ બધા સાથ છોડી ચાલ્યા ગયા. જીવન પ્રવાસમાં એકલા એકલા ક્યાં સુધી ચાલી શકાય? કવિએ અહીં સાંકેતિક ભાવમાં વૃદ્ધાવસ્થાની વાત કરી છે. જુઓ :

ચાલતો જે સાથમાં રસ્તો હતો તે પણ નથી,
સાવ ઝાંખો આંખમાં નકશો હતો તે પણ નથી.

પરંપરાવાદી ગજલોને બદલે કવિએ વર્તમાન પ્રવાહો વધારે જીલ્યા છે. ગજલના કાફિયા - રદીફમાં નવી ભાત ઉપસાવવા કવિ સતત પ્રયત્નશીલ દેખાઈ રહ્યા છે. સરળ, સાઢી અને સીધી ભાષા સાદગી તેમની પ્રત્યેક ગજલને એક નવા અનિસિર ને નવી જ રહનુમાઈ તરફ દોરી જતી દેખાય છે. તેમને જે કાંઈ કહેવું છે તે મોટેભાગે ગૂઢાર્થ, સાંકેતિક, વંગાર્થરૂપે જ કહ્યું છે. ગજલની ખરી મજા આ જ છે. તેમણે કોઈપણ શે'રમાં ખુલ્ખી વાત નથી કરી કે ગજલને બોલકી નથી બનાવી. આવો જ સાંકેતિક અર્થ-ભાવ સાથેનો શે'ર જુઓ, શે'રની ઊંડાઈ જુઓ :

છે સાથમાં તું એટલે મંજિલ મળી જશે;
તારા વગર તો માર્ગમાં ભટકી જવાય છે.

અહીં સામાન્ય નજરથી જોતાં લાગે છે કે શાયરે પ્રેમિકાની વાત કરી છે. પણ એવું નથી. અહીં વાત જે સાથની કરી છે તે સાથ માશૂકાનો નહીં, પણ ભગવાનના સાથની વાત છે. જેમની સાથે ઈશ્વર હોય એમને ઈશ્વર સાચો રસ્તો બતાવે છે. જો સાથમાં ભગવાન હોય તો મુકામે પહોંચતા વાર નથી લાગતી. ઈશ્વર વગર તો માર્ગમાં ભટકી જવાય છે. કાચી માટીના ઘડા - માટલાં જેવું આ શરીર જરાક જેટલી માયાની ઠોકર લાગવાથી કૂટી જવાનું છે, એ વાત જે માણસ સમજ્યો છે તેમણે ઈશ્વરને ભોગ્યા તરીકે સાથે રાખીને મુકામ (મોક્ષ) મેળવી લીધો છે. પણ ઈશ્વર પ્રત્યે જેમની શ્રદ્ધા ડગી છે એ શું કરશે? કવિ કહે છે:

માગશે પણ કંઈ તને મળશે નહીં આ ધામમાં,
'શ્યામ' શ્રદ્ધા તવ ડગી, તું કેમ જીભો છે અહીં?

કવિની ગજલોમાં ગુંથાયેલા અસંખ્ય શે'રોમાં વ્યાપક સંવેદનાઓ અને અસ્થાલિત વહેતા ભાષા પ્રવાહનો આપણાને પરિયય મળે છે. સર્જક-પ્રતિભાને સતત કેળવીને અભિવ્યક્તિની આવડત સાથે પોતાની રીતે-ભાતે શબ્દ સાધના કરતા શ્યામ ઠાકોરની ગજલો સમતોલ - સ્વસ્થ રણકાર જન્માવે છે અને ભીતરથી જબરદસ્ત ભાવનો ઘડાકો કરે છે. જુઓ તેમનો આ શે'ર :

આગથી દાઝ્યો નથી એ સત્ય છે માનો તમે,
આજ હું દાઝી ગયો છું ફૂલના અંગારથી.

જે ચિત્ત નિદ્રા, આળસ, તૃષ્ણા અને પ્રમાદથી વેરાયેલું હોય છે, વિષયોમાં લીન હોય છે અને વિકિમ ભૂમિકાનું હોય છે તેને છેવટે પોતાનાઓથી જ તરછોડાવું પડે છે. પોતીકાના આણગમાથી દાઝવું પડે છે. કવિએ આ શે'રમાં બહુ મોટી વાત કરી છે.

માણસના સંકોચપણાની, તેમના તિરોભૂત થયેલા મન, હદ્યની ને ઉદ્દેગ, સંતુમ ને આંતરિક વ્યવહાર અને તેના કર્તૃત્વની વાત કવિએ સરળ શબ્દોમાં, પરંતુ એક મર્મવેધી કટાક્ષ સાથે કરી છે. જુઓ આ શે'ર :

ક્યાં છે સીધો સાદો માણસ, જન્માથી છે જીંધો માણસ;
સીધા તો સૌ આગળ ચાલ્યા, અટવાયો છે બસ આડો માણસ.

માણસ નામના કોયડાને હજ સુધી કોઈ પણિત, વિદ્વાન ઉકેલી શક્યા જ નથી. માણસની આ જ મોટી ખાસિયત છે. માણસ તેના સ્થાને જ રહે છે, પણ તેનું અભિમાન, તેનો મિજાજ આકાશને આંબતા હોય છે.

સત્ય ખૂબ જ વજનદાર, ખૂબ જ ભારે હોવાથી તેને ઊંચકવું પણ ભારે થઈ પડે છે. શ્રદ્ધા, વિશ્વાસનો ટેકો

મળે તો જ સત્યનો ભાર ઊંચકી શકાય. આજે પ્રતેક માણસ પોતાનો વહેવાર, પોતાનો વ્યાપાર સ્વાર્થને આગળ રાખી અને સત્યને પાછળ રાખીને કરી રહ્યો છે. વિશ્વાસ, ભરોસો હવે કયાય રહ્યો નથી. છતાં આ વિશ્વાસનું સાંગોપાંગ મરણ તો થયું જ નથી. આવી વાત ખૂબ જ સંકેતમાં, વંગરૂપે કવિ કેવી સીફુતથી કરે છે તે જુઓ :

કારમા અંધકારમાં દૂબી ગયા છે માર્ગ સૌ,
એક શેરી ઝળહળે છે રોજ તારા શહેરની!

આ શે'રમાં અર્થગાંભીર્ય અને શબ્દ ચમત્કૃતિ એમ બને છે. તેથી શે'ર વજનદાર બન્યો છે. આમાં બે જુદી જુદી કિયાઓ બતાવી ભાષા પાસેથી ધાર્યું કામ લીધું છે.

કવિ શ્યામ ઠાકોર વિદ્યાર્થી હતા ત્યારથી આરંભાયેલી અને અનેક સ્પધારોમાં વિજેતા બની પોંખાયેલી તેમની સર્જન પ્રતિભા સંસ્કૃતના પ્રાધ્યાપક બન્યા પછી અધ્યાયન, અધ્યયન સાથી પરિજ્ઞત થતી રહી છે.

જે ગજલકલામાં સંવેદના ન જીલાય તો તેનું પોત ફિક્કું લાગે છે. ઊર્મિનો ઉછાળ ન હોય તો તે ભાવક માટે ભારરૂપ બને છે. ફક્ત છંદ-રીધમ જળવાય એવી ગજલ કંઈ કામની નથી. ગજલ તો હૃદયમાં ઉછાળ મારી દિલના તાર અણગણાવી નાખે તેવી હોવી જોઈએ. કવિનો આવો જ એક શે'ર જુઓ :

આ નગરના લોક શંકાશીલ છે,
નિષ્પલક ગુલમોર પણ જોવાય ના!

કવિએ અહીં મનુષ્યના શંકાશીલ સ્વભાવનું આલેખન કર્યું છે. આપણી ગુજરાતી ભાષામાં આવો શે'ર ભાગ્યે જ વાંચવા મળે...!

આપણા સંબંધો બહારની વસ્તુઓ સાથે હંમેશાં રહ્યા છે. બહારના ભિત્રો સાથે આપણે મોજ-મસ્તી, આનંદ કરી તૃપ્તિ અનુભવીએ છીએ. પણ આપણી અંદર પણ આપણી રખેવાળી કરતો એક પરમ ભિત્ર બેઠો છે, તેને પણ સંભારવો પડે. કવિ આવી ભાવનાવાળો સરસ શે'ર લઈ આવ્યા છે. જુઓ :

બહારથી કયારેક ભીતર સાચ પણ કરવો પડે,
કોઈ છે અંદર તો એને યાદ પણ કરવો પડે.
એક ટહુકો રક્ત સાથે ભેળવી દીધા પછી,
ખૂબ છે અઘરું ફરી જો બાદ પણ કરવો પડે.

શ્યામની ગજલોમાં સમતોલપણું છે, તટસ્થતા છે અને સર્વસમાજ, સર્વલોકને સર્વોદ્યનો સંદેશ આપતું એક તત્ત્વ પણ છે. તેનું સર્જન સુખ-દુઃખના અતિરેકની સંવેદનામાંથી સર્જયું નથી. માટે જ તે કોઈ બીજા બિંદુ તરફથી અતિશયોક્તિના ભાર

નીચે દબાયું નથી. તેણે કલ્યાણભિમુખતા કેળવી છે. કવિ કોઈ જતના સીમાબંધનમાં બંધાયા નથી.

શ્યામ ઠાકોરે કાંદ્રિયા-રદ્દીફ પ્રયોજવાની જે કલા અપનાવી છે તે નોંધપાત્ર અને ધ્યાનાઈ છે. આ કારણે જ ગુજરાતમાંથી બહાર પડતાં અને કાચ્ચો ગજલને પ્રગટ કરતાં તમામ સામયિકોએ આ કવિને આવકાર્ય છે. પોતાની કાવ્યકલા સમાજમાં, ભાવકોમાં અને વિવેચકોમાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરે, સાહિત્ય જગતમાં નોંધપાત્ર બને એ જ ઉદ્દેશ આ કવિનો રહ્યો છે.

શ્યામ ઠાકોરની ‘બોલયાલ’ની ગજલ ‘છે કે નથી?’ રદ્દીફવાળી ગજલના શે'ર જુઓ :

આંખ મીંચી સાંભળો તો સંભળાતો હોય છે;
કોઈ ગેબી ગોખનો એ નાદ છે, છે કે નથી?
જળહળે ના આટલું ધર, ના કદી પણ જળહળે;
બોલ, દીવો કયાંક તો એકાદ છે, છે કે નથી?

શ્યામ ઠાકોરની આ ગજલ હું વિવિધ અર્થોમાં રૂપાંતરીત કરીને વાંચતો હતો. તેમાંના ભાવોને જુદી રીતે વ્યક્ત કેમ કરાય તે વિચારતો હતો. તેવામાં જ મને જ્યંતી જોશી ‘શબાબ’ની એક ગજલનું સુરાણ થઈ ઉઠ્યું ને હું જળહળી ઉઠ્યો. મારામાં બત્તીસ દીવા થઈ ગયા. એ ગજલ અહીં રજૂ કરું છું :

ચચ્ચાના ચોટે વિવેચક લડી મૂઆ!
શબ્દે ચડી મૂઆ, કોઈ અર્થે પડી મૂઆ!
કચરો ને પૂંજો રાતનો ઠલવાયો એટલાં,
એમાં જ કંઈક સૂર્ય સવારે સડી મૂઆ!
ઈચ્છાના પંખી ચાસ ને નિશાસના વને,
ફક્ત મૂઆ કોઈ, તો કોઈ તરફક્ત મૂઆ!
પણ એ પછી સંદાના અમર થઈ ગયા ‘શબાબ’,
હા, મોત આવ્યું ત્યારે જરા બે ધડી મૂઆ!

– જ્યંતી જોશી ‘શબાબ’ (મુજ)

જ્યાં વાણીની શક્તિ વામણી લાગે ત્યાં આજનો કવિ તેને શાણગારવા ભાષા વિશેષ, લય વિશેષ અને અલંકારથી કામ લે છે. જેથી વાણીથી ન થયેલું કામ ભાષાધ્વનિ, લયધ્વનિ અને અલંકાર ધ્વનિ વડે સધાય છે.

શ્યામ ઠાકોરમાં રહેલી આગવી પ્રતિભાનું દર્શન કરાવતી તેમની ગજલો - ગીતો અને કવિતાઓ તેમજ લેખો ભવિષ્યને ઉજણું બનાવે એવી અભ્યર્થના.

“સંસ્કૃતિ દર્શન” કાવ્યાલય,
સુતાપણ શેરી નં.-૧, વીલકંદ નગરાલાની સાઢે,
માગ દરવાજ, માણાવદ-૩૬૨ દ૩૦. (મ્ર. જૂનાગઢ)
મો. ૮૭૩૫૮ ૦૨૮૨૮



નારી ગૌરવગાથા - ૬

આરતીબેન ધોરિયા : “આધુનિક યુગની અન્નપૂર્ણા”



ડૉ. શીલા વ્યાસ

પ્રિય વાચક મિત્રો,

ભારતીય પૌરાણિક ગ્રંથોમાં નારીને શક્તિ સ્વરૂપાનું સ્થાન મળ્યું છે. જેણે આપણા સમાજમાં બહુવિધ ભૂમિકાઓ ભજવવાની હોય છે. એમાંથી મહત્વની એટલે રસોઈ રાણી - અન્નપૂર્ણા. તો ચાલો, મળીએ એક ગૌરવગાથી વ્યક્તિત્વને....

તા. ૨ નવેમ્બર, ૧૯૭૧ના રોજ રાજકોટના શિક્ષક દંપતી શ્રીમતી રસવંતીબેન અને શ્રી વિષ્ણુલભાઈ ચાવડા પરિવારનું આ પ્રથમ સંતાન એટલે આરતી ચાવડા. પોતાનાથી નાના ત્રણ બેન-ભાઈની કાળજી રાખવા સાથે ઉછર્તી તથા નાનપણથી જ માતા સાથે રસોડાના કામમાં રસ લેતી થયેલી. તેમણે ૧૯૮૮માં બી.કો.મ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. પછી ભરત-ગૃથશા અને ગૃહ સુશોભન કલાને હસ્તગત કરી. ૧૯૯૨માં જામનગરના વતની અને મુંબઈ નિવાસી શ્રી ભરતભાઈ ધોરિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. આશરે અઠાર વર્ષ મુંબઈમાં સંયુક્ત કુટુંબમાં હળીભળીને રહ્યા. એમના સંસાર ભાગમાં ‘ભક્તિ’ અને ‘તીર્થ’ નામના બે સંતાન પુણ્ય ખીલ્યા.

મહાનગરની મુંબઈની ભારે હાડમારી ભરેલી અને ઝડપી જીવનશૈલીમાં ગોઠવાયા. ઘડાયા પછી સંતાનોના વિશેષ અભ્યાસ અર્થે વર્ષ ૨૦૧૦માં વડોદરા આવીને વસ્યા. એમના પતિ ઈન્ડસ્ટ્રીયલ ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી વારંવાર મુંબઈ રહેવાનું બનતું. પરંતુ આરતીબેન બાળકો સાથે નવા સ્થળ - માહોલમાં ગોઠવાતા ગયા. બાળકો ભાષાવા જાય ત્યારે કુરસદના સમયે કંઈક પ્રવૃત્તિ કરવા એમના માનસમાં વિચાર સ્હૂર્યો. જોકે, એમને માતા પાસેથી પાકશાક્ર કલા વારસામાં મળી હોવાથી અથાણાં બનાવી સેઢી, મિત્રો કે પાઠેશીને આપતા. જેનો રસાસ્વાદ વખણાયો. એ સૌના આગછને વશવર્તી ૨૦૧૫માં ચટાકેદાર અથાણાં બનાવવા જરૂરી સાધન-સામગ્રી, વિશેષ મશીન વસાવ્યા. આર્થિક રીતે પરિવારને સહાયક બનવાનું અનુકૂળ લાગ્યું. તો વડોદરાવાસીઓનો સાથ-સહકાર પણ મળતો ગયો. એથી એમના વિસ્તારમાં ‘અથાણા આનંદી’ તરીકે પ્રસિદ્ધ થયા.

વર્ષ ૨૦૧૮માં અતિવૃદ્ધિને કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ, ને જનજીવન પ્રભાવિત થયું ત્યારે તેઓ ભૂખ્યા-દુખ્યા,



આરતીબેન ધોરિયા

જરૂરિયાતમંદ લોકોને શાક-ખીચડી બનાવી જમાડતા. સમા વિસ્તારની જુંપડપદ્ધીના ગરીબ બાળકો, વોચમેન, લાચાર - બીમારને ભોજન કરાવતા. કેટલાંક નિરાધારને માટે ફ્લેટના પાર્કિંગમાં આશરો લેવાની વ્યવસ્થા કરી આપેલી. આ રીતે ‘માનવસેવા એ જ પ્રલુસેવા’ સૂત્રને સાકાર કરતા રહ્યા.

વડોદરાની જાણીતી હોસ્પિટલ ‘ધ ક્યોર’માંથી દર્દીઓ માટે ભોજન પહોંચાડવાનો ઓર્ડર મળતાં, તેમણે સહર્ષ સ્વીકારી લીધો. નિયમિત ઘરકામ ઉપરાંતનું આ ભારણ આવી પડતાં એમને ઢીંચણ દુઃખાવાની તકલીફ ઉભી થઈ. તેમ છતાં પોતાના દર્દને અવગણીને, સવારે વહેલા ઉઠી, નિત્યકર્મથી પરવારી, રોજની ૨૦થી ૨૫ ડિશો સવાર-સાંજ તૈયાર કરી પહોંચાડે છે. દર્દીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન ખૂબ અનુકૂળ આવે છે.

કોરોના મહામારીના કપરા કાળમાં ગરીબોને અન્દાન કરીને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો. જેને સ્થાનિકોએ તાળીઓથી વધાવી લીધો. નવરાત્રિ, જન્માષ્ટમી, ગણપતિ મહોત્સવ સમયે કે પડોશીના સામાજિક-વ્યક્તિગત શુભ પ્રસંગોએ સૌને આરતીબેન તરફથી પ્રસાદ માણવા મળે તે આનંદની વાત છે.

આમ, આધુનિક યુગની નારી શક્તિની પિછાણ કરાવતા એમણે ઈન્સ્ટાગ્રામ પર ‘મોસ કિયન’ દ્વારા મજેદાર વાનગી બનાવટની પદ્ધતિઓ વિવિધ તસવીરો સાથે પ્રસ્તુત કરી છે. સેવાભાવી સ્વભાવની પત્નીની મહેશ્ચાને પૂર્ણ કરવા પતિ દર્દીઓને ટિક્ફિન પહોંચાડવા અવાર-નવાર મદદરૂપ થાય છે. તો સમય - સંજોગો મુજબ સંતાનો પણ સહકાર આપતા રહે છે. એટલે કહેવાનું મન થાય કે, નારી ધારે - ચાહે તે પોતાના મક્કમ મન અને પ્રભળ ઇચ્છાશક્તિથી નિશ્ચિત અભિયાન પાર પાડી શકે. તેનું ઉત્તમ દણ્ણાંત આરતીબેનને ગણી શકીએ.

એમને અઠળક અભિનંદન સાથે અનેક શુભેચ્છાઓ.

એમનો ટૂંકો પ્રતિભાવ : “પોતાના કાર્યની કદર કુટુંબમાં અને સમાજમાં થાય તે બાબત પરમ સંતોષ આપે છે.”

આરતીસાયનસ કોમર્સ કોર્પોરેશન,
બોરસાન, મ્ર. આર્યા. મો. ૮૨૩૮૩ ૩૨૨૭૧



ચાદગીરી

સુભિરે.... બલભીરા

(સ્મૃતિપટ પર સંભારણાં)



સંપાદક :
બલભીરસિંહ જાડેજા

(નોંધ : હુનિયામાં સારપ હજુ પણ છે અને કદાચ પુષ્ટી પર માનવતા એટલે જ ટકી રહી છે. ખરા અર્થમાં કલી શકાય તેવા ગુજરાતના નર રત્નોની કથાઓ તો અસંખ્ય છે. તે પેકી એક આપણા જાણીતા ડૉ. શરદભાઈ ઠાકર દ્વારા રજૂ થયેલ કથા – એમનો આભાર માનીને માણીએ... “થોડા આંસુ થોડો ઘાર”)

“થોડા આંસુ થોડો ઘાર”

(સત્યઘટના પર આધારિત)

ડિસેમ્બર મહિનો કેલેન્ડરના પાનાઓમાંથી નીકળીને પોરબંદરની ધરતી પર એની શીતળતાપૂર્ણ પગલીઓ પાડી ચૂક્યો હતો. ગર્જના કરતાં દરિયાના ઘૂઘવતા જળને સ્પર્શને આવતી ખારી હવા પોરબંદરવાસીઓનાં ફેફસામાં મત્સ્યગંધા બનીને ફેલાઈ રહી હતી. સમી સાંજનો સૂરજ પણ્ણે દિશામાં અદશ્ય થવાની તૈયારીમાં હતો. ત્યારે એક સોળ વર્ષનો છોકરો થાકી-પાકીને એના ઘરની તરફ ડગલાં ભરી રહ્યો હતો. સોળ વર્ષની ઉમર જાણીને કોઈપણના મનમાં એવું થાય કે એ કિશોર શાળામાંથી ભણીને થાકેલો, કંટાળેલો દફતર ઊંચીને ઘર તરફ જતો હશે, પણ એવું ન હતું. આ છોકરો તો સવારના નવ વાગ્યાથી ઊભી બજારમાં આવેલી એક દુકાનમાં ઊભા પગે નોકરી કરીને હમણા જ ધૂટ્યો હતો.

કિશોરનું નામ રેશનોઝ. પિતાનું નામ નુરુદીન. અટક આંડતિયા. તદ્દન સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખોજા ઈસ્માઈલી પરિવારનો એક શાંત, ડાખ્યો, સંસ્કારી અને સેવાભાવના ધરાવતો ફરજંદ.

રેશનોઝને નાનપણથી જ શાળાના ભણતરમાં ખાસ રસ નહોતો. એણે પિતાને કાળજાળ ગરમીભર્યા વાતાવરણમાં સળગતા ભણ્ણા પાસે બેસીને ખારી સીંગ અને દાળિયા લુંજતા સગી આંખે જોયેલા. એટલે ગણિત - વિજ્ઞાનના ચોપડા બાજુએ મૂકીને એને મન થઈ જતું હતું, ક્યાંક નાનું-મોટું કામ કરીને બે પૈસા કર્માઈને પિતાના પરસેવામાં ભાગ પડાવવાનું. ભણીના આકરા તાપમાં ઠડ પવનની એકાદ લહેરખી ફરકાવવાની તમન્ના આ સોળ વર્ષના કિશોરને શાળાને બદલે માધુરી નોવેલ્ટી સ્ટોર્સની નોકરી તરફ ભેંચી ગઈ હતી.

નોવેલ્ટી સ્ટોરના શેડે નોકરી આપતી વખતે જ પૂર્ણી લીધું

હતું, ‘કામ કેટલું કરીશ? અને પગાર કેટલો લઈશ?’

‘પગારમાં એક પૈસો પણ નહીં અને કામ તમે કહેશો એટલું.’ રેશનોઝની આંખોમાં જગતમાં જવલ્યે જ જોવા મળે તેવી અનેરી ચમક હતી.

શેઠને થયું હશે : ‘ગજબ છોકરો છે. પાગલ લાગે છે. જોઈએ તો ખરા કે કેવું કામ કરે છે!’

ચાર-પાંચ દિવસમાં જ શેઠને સમજાઈ ગયું કે આ તો ચીથરામાં વીટાયેલું રતન છે. ધૂળમાંથી જડી આવેલો હીરો છે. રેશનોઝની ઈમાનદારી, ખડેપગે કલાકો સુધી કામ કરવાની ધગશા, ગ્રાહકો – જેમાં મોટાભાગની બહેનો જ હોય, તેમની સાથે નજર ઝુકાવીને આદરપૂર્વક વાત કરવાની તમીજ, આ બધું શેઠને માફક આવી ગયું. લટકામાં બીજું એક પણ વ્યસન ન મળે. ચા પણ પરાણે પીવડાવે તો જ પીવે. એના બરોસે દુકાન સોંપીને શેઠ જમવા માટે ઘરે આંટો મારી આવે તો પણ ગલ્વામાંથી એક પાઈ પણ આડીઅવળી ન થાય. મહિનો પૂરો થાયો. શેઠ રેશનોઝને બોલાવવિને કહ્યું, ‘લે, આ તારો પગાર. પૂરા એકસોને પંચોતેર રૂપિયા છે. ગણી લે.’

રેશનોઝ સંકોચ પામી ગયો. ‘પણ મેં તો પગારમાં કંઈ ન લેવાની વાત કરી હતી. મારે તો કામ શીખવું હતું.’

‘રાખી લે, છોકરા!’ લક્ષ્મી આવતી હોય તો લઈ લેવાય, ના ન પડાય. અને આ તારા કામનો પગાર છે. જો તારી ઈમાનદારીનું મૂલ્ય આંકવા બેસું તો કુલેરનો ખજાનો પણ દૂંકો પડે. બેટા, રાખી લે આ રકમ. તારા ઘરમાં ખપ આવશે.’

રેશનોઝ રૂપિયા રાખી લીધા. તનથી થાકેલો પણ મનથી ઉત્સાહિત એવો આ સોળ વર્ષનો કિશોર જિસ્સામાં આવડી મોટી તગડી રકમ લઈને ઘર ભણી જતો હતો ત્યાં એના કાન ચમક્કા. રસ્તામાં આવતી એક દવાની દુકાન આગળ એક ગ્રાહક અને દુકાનના માલિકની વચ્ચે ચાલતી રકજક સાંભળીને એ થંભી ગયો.

એક મોટી ઉમરનો ભરવાડ ભાબો મેડિકલ સ્ટોરના માલિકને એની તળપદી વાણીમાં વિનવી રહ્યો હતો : ‘પણ આટલા બધા રૂપિયા મારે કયા જાડ માથેથી લાવવા? હું તો ગરીબ ભરવાડ છું. મારી પાંઢે વીછ રૂપિયા જ સે.’

‘તો પછી હું દવા ન આપું.’ દુકાનદારે રોકું પરખાવ્યું. ‘કેમ ન આપો? તમે તે માણણ છો કે... મારો એકનો એક જુવાન દીકરો મરવા પડ્યો સે. દાગતરે આ દવાની ચિહ્ની લખી આપી.

હું લેવા આવ્યો સું. ને તમે ના પાડો ઈ કેમ હાલે?’

‘રેશનોઝ દ્રવી ગયો. એનાથી રહેવાયું નહીં. એણે નજીક જઈને દુકાનદારને પૂછ્યું, ‘ભાઈ શું વાત છે?’ દુકાનદાર રેશનોઝને ઓળખી ગયો. ‘તું તો બાબુભાઈ સીંગવાળાનો દીકરો ને? જી ભાઈ જી, આમાં તારું કામ નથી...’

‘પણ મને કહો તો ખરા કે વાત ક્યાં અટકી છે?’ રેશનોઝ જી પર આવી ગયો.

‘આ ભાભો એના દીકરા માટે દવાઓ ખરીદવા આવ્યો છે. દવાનું બીલ થાય છે એકસો ત્રીસ રૂપિયા જેટલું. તેસા પાસે માત્ર વીસ રૂપરડી છે. હું કેવી રીતે માલ આપું એને?’ દુકાનદારનો જવાબ સાંભળીને રેશનોઝ આધાત પામી ગયો. જે ચીજ આ ગરીબ તોસાના દીકરા માટે જીવનરક્ષક દવા હતી, તે જ ચીજ આ વેપારીને મન કમાણી માટેનો માલ હતી! વાહ રે કુદરત! આ દુનિયા સાવ આવી જ છે? જે છે એને બદલાવી ન શકાય? કોણ બદલી શકે? કેવી રીતે બદલી શકે?

સોણ વરસની કુમળી વયે દિમાગમાં બીજું તો શું ઉગે? કાચી-કાચી સમજણ ઊગી અને સાવ પાકી કરુણા જન્મી. ફટ ટેતાકને છોકરાનો હાથ બિસ્સામાં ગયો. જટ દઈને બહાર આવ્યો. પૂરો પગાર દુકાનદારના હાથમાં મૂકી દીધો. ‘શેઠ, પૂરા એકસો ને પંચોતેર છે. આ દાદાની પાસે વીસ રૂપિયા છે. બાકીના ખૂટતા રૂપિયા આમાંથી લઈ લો અને એમને દવાઓ આપી દો.’

દુકાનદારની આંખો પહોળી થઈ ગઈ. એ આ છોકરાના પિતાની આર્થિક હાલત જાણતો હતો. પણ એને મમ-મમ સાથે નિસ્બત હતી, ટ્રે-ટ્રે સાથે નહીં. એણે પગારમાંથી એકસો ને દસ રૂપિયા ગણીને બાકીની રકમ રેશનોઝને પાછી આપી દીધી. રેશનોઝ એ જ મૂળ મિજાજ સાથે ઘરની દિશામાં ચાલવા માંડ્યો. ત્યાં જ પાછળથી અવાજ સંભળાયો. પેલો તોસો એને કહી રહ્યો હતો, ‘એઈ... છોકરા...! મારા બાપલા! મારા દીકરાનો જીવ બચાવનાર ભગવાન, ઘડીવાર ઊભો તો રે, ભાઈ!’

રેશનોઝ ઊભો રહ્યો. ‘હજુ વધારે રૂપિયાની જરૂર છે? તો આપું...’ એણે ખરેખર બિસ્સામાં હાથ નાખ્યો.

‘ભાભા રી પડ્યા. દીકરા, તું એવડો બધો પૈસાદાર સો? મને તારો બંગલો તો બતાવ. મારે તારા મા-બાપને જોવા સે.’

રેશનોઝ હસ્યો. તોસાને પોતાને ઘેર લઈ ગયો. તોસો ઘર જોઈને આભો બની ગયો. બે નાની ઓરડીઓ હતી. નવ જણાનો પરિવાર હતો. ધનથી ગરીબ, પણ મનથી તવંગર આ છોકરાની ઉદારતા અને માનવતા જોઈને એ ગરીબ ભરવાડની આંખો છલકાઈ ઊઠી. એના મોઢામાંથી આશીર્વાદના શબ્દો સરી પડ્યા, ‘દીકરા, ભગવાન તારું ભલું કરસે. તે આજે મારા દીકરાનો જીવ બચાવ્યો સે. ભગવાન કામનો બદલો વળી આપસે.’ સાચા અંતઃકરણમાંથી નીકળેલા આશીર્વાદ શું ઈશ્વર

આવીને આપી જતો હશે? અલ્લાહની મહેરબાની વરસી જતી હશે? હુંથી માનવીના દિલમાંથી નીકળેલી દુવા ભવિષ્યવાણી બની જતી હશે? ગમે તે કહો, પણ રેશનોઝ નામના પોરબંદરના એ કિશોરની જિંદગીએ એ દિવસથી કરવટ બદલવા માંડી.

આ ઘટના ૧૯૮૫ના નવેમ્બર મહિનામાં ઘટી હતી. એ પછીના ગણતરીના મહિનાઓ બાદ રેશનોઝના ડિસ્મત આડેનું પાંદડું ખસી ગયું. ખસ્યું તો એવું ખસ્યું કે આજ હિન સુધી પાંદું ક્યાંય જોવા મળ્યું નથી. રેશનોઝના એક મોટા ભાઈ વર્ષો પહેલાં પેટીયું રજવા માટે ઈસ્ટ આફ્રિકા ચાલ્યા ગયા હતા. ત્યાં કોઈકની દુકાનમાં નોકરી કરતા હતા. અચાનક એક દિવસ એ પોરબંદર આવી ચાલ્યા. હું શાદી માટે આવ્યો છું. મારા માટે કન્યા શોધો. ઘરમાં આનંદ છવાઈ ગયો. મોટા ભાઈ શાદી કરીને દુલહનની સાથે પાછા પરદેશ ઉડી જતા હતા ત્યારે રેશનોઝને પણ લેતા ગયા. તારામાં કામ કરવાની ધગશ છે. ચાલ, તને પણ હું નોકરી અપાવી દઉં.

નોકરીમાંથી પોતાની નાનકડી દુકાન થઈ. પછી મોટી દુકાન. પછી આસમાનમાંથી ગેબી વરસાદ વરસ્યો. નામદાર આગામાને બતાવેલી નેકીની રહ પર ચાલતો આ પરિવાર સમૃદ્ધિની સીડીના એક પછી એક પગથિયા ચંતો ગયો. એક દિવસ એક ધર્મગુરુએ રેશનોઝને સલાહ આપી, ‘તારું નામ બદલી નાખ. રેશનોઝ શબ્દનો કોઈ અર્થ નીકળતો નથી. હું સૂચવું છું તારું નામ રીજવાન રાખી લે. બરકતના બારેય મેઘ તારા માથે ખાંગા થઈને વરસી પડશે.’ આજે રીજવાન આડતિયા ઈસ્ટ આફ્રિકાના ઉદ્ઘોગ જગતમાં સૌથી મોટું માથું અને સૌથી જાણીતું નામ ગણાય છે. મોઝામ્બિક, લુઝાસી, કોંગો ઉપરાંત બધા મળીને આગિયાર દેશોમાં ફેલાયેલા એકસો પચાસ જેટલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સના તેઓ માલિક છે. આડતિયા બંધુઓ બીજા પણ અનેક બિઝનેસ ધરાવે છે.

રીજવાનભાઈ સમૃદ્ધિના શિખર ઉપર બેઠા પછી પણ જરૂરતમંદોને ભૂલ્યા નથી. આવા જ એક ગરીબના મુખેથી નીકળેલી દુવાએ તો તેમને આ શિખર સુધી પહોંચાડી દીધા છે. આ વાતને યાદ રાખીને તાજેતરમાં જ એમણે રીજવાન આડતિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. **ભારતના એકસો ગામોને આગામી પંદર વર્ષ માટે દશક લેવાનું જાહેર કર્યું છે.** દેશના પ્રધાનમંત્રી, રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા વહીવટી અધિકારીઓ સાથે મુલાકાતો કરીને ૨૦૩૦ સુધીમાં કરોડો રૂપિયાની સખાવતી યોજનાઓ ઘડી કાઢી છે.

રીજવાનભાઈ જેટલો વિનન્દ્ર ધનપતિ ગૂગલ ઉપર શોધવા જઈએ તો પણ બીજો ન જરે! સમાજને તેમનો એક જ સંદેશો છે : તમારી જે કાંઈ કમાણી હોય તેમાંથી દસ-વીસ ટકા રકમ ગરીબોને આપતા રહો. મદદ કરવા માટે લખપતિ કે કરોડપતિ હોવું ફરજિયાત નથી. જો તમે ત્રણ ઉજાર રૂપિયા જ કમાતા હો, તો એમાંથી પણ ત્રણ ગ્રાણસો રૂપિયા સારા કામમાં ખર્ચી નાખજો.

તમારે ઘર ચલાવવામાં જે ટૂટ પડતી હશે એમાં ગ્રાસોની વધારે પડશે. પણ પછી ઉપરવાળા તરફથી જે રહેમ વરસે છે તે તમે જોતા રહેશો. જો વિશ્વાસ ન પડતો હોય તો મારી તરફ એક નજર ફેંકી લેજો. પંચાસીમાં દીધેલા એકસો દસ રૂપિયા આજે ૨૦૧૫માં દોઢસો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બનીને પાછા આવ્યા છે!

દાનવીર રીત્વાન આડતિયા – આપણા ગુજરાતનું ગૌરવ!

“આવા પણ ડૉક્ટર હોય છે”

(સત્યઘટના પર આધારિત)

(નોંધ : એક ડૉક્ટરની પ્રસ્તુત કથા “આવા પણ ડૉક્ટર હોય છે” – ‘મંગલ મંદિર’ના વાચક વર્ગને જરૂર વિચારતા કરી મૂક્ષે એવો વિશ્વાસ છે.)

તર વર્ષના આ યુવાનનું નામ ડૉ. પ્રતીક સાવજ છે. ડાયમંડ સિટી સુરતમાં તેઓ ઈન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ (ઇન્ફેક્શન ડિસ્જેન્ઝિશન) તરીકે પ્રેક્ટિસ કરે છે.

ગઈકાલે એક દર્દી એના સંબંધી સાથે ડૉ. પ્રતીક સાવજ પાસે ગયા. ડૉક્ટરે શાંતિથી દર્દીની તકલીફ અને વાત સાંભળી. બધા જ રિપોર્ટ્સ જોયા અને પછી કહ્યું, ‘દર્દીને જે પ્રકારની તકલીફ છે એ જોતાં એવું લાગે છે કે આ મારા વિષય બહારનું છે. તમે એને સારા ન્યૂરોસર્જનને બતાવો. એ વધુ સારી રીતે પરિણામલક્ષી સારવાર કરી શક્ષે.’ દર્દી જેવા ડૉક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા કે તુરત જ રિસેપ્શન પર બેઠેલા કર્મચારીએ દર્દીને બોલાવ્યા અને થોડા સમય પહેલા જ ફીની લીધેલી રૂ. ૧૫૦૦/-ની રકમ પરત કરી. દર્દીની સાથે રહેલા એના પુત્રએ ફી પાછી આપવાનું કારણ પૂછ્યું તો રિસેપ્શન પરના કર્મચારીએ કહ્યું, ‘સાહેબે હમણાં સૂચના આપી કે દર્દીને આપણે કોઈ દવા નથી લખી આપી કે એની કોઈ સારવાર કરી નથી. માત્ર માર્ગદર્શન જ આપ્યું છે. એટલે એની પાસેથી કોઈ ફી લેવી યોગ્ય નથી. એની બધી જ ફી પાછી આપી ડૉ.’

મને ગઈકાલે રાત્રે જ દર્દીના સગા પાસેથી આ વાત જાણવા મળી એટલે ડૉ. પ્રતીક સાવજ વિશે વધુ જાણવાની ઉત્સુકતા થઈ. આજે સુરતના કેટલાક મિત્રો પાસેથી એમના વિશે જાણ્યું ત્યારે ખરબ પડી કે આ ડૉક્ટર નોંધી માટીનો અનોખો માણસ છે. ઉંમર નાની છે પણ સમજણ બહુ મોટી છે. એમની પાસે આવતા દર્દીઓની વાતચીત પરથી જ એ દર્દીની આર્થિક પરિસ્થિતિ અંગેનો અંદાજ લગાવી લે છે. જેમની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય એવા દર્દી પાસેથી લીધેલી તમામ ફી એ પાછી અપાવી દે છે. આટલું જ નહીં, પરંતુ પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરીને સિટી સ્કેન કે લેબોરેટરીના રિપોર્ટ્સની ફી પણ ઓછી કરાવી આપે છે. સુરતની સિવિલ હોસ્પિટલના કિટિકલ દર્દીઓ માટે પણ નિઃસ્વાર્થ સેવા આપે છે. કેટલીકવાર કોર્પોરેટ હોસ્પિટલમાં

એક્સપર્ટ ડોક્ટર તરીકે જવાનું થાય અને દર્દીની આર્થિક પરિસ્થિતિ અંગે ખબર પડે તો જેટલું બીલ ઓછું કરાવી શકાય એટલું બીલ ઓછું કરાવે. જ્યાં કોર્પોરેટ હોસ્પિટલની બીલ ઓછું કરવાની મર્યાદા આવી જાય, ત્યાં એક્સપર્ટ ડોક્ટર તરીકેનો પોતાનો ચાર્જ જતો કરીને પણ દર્દીને જેટલી રાહત આપી શકાય એટલી રાહત અપાવવાનો પ્રયાસ કરે.

કોરોનાની બીજી લહેરે જ્યારે ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું ત્યારે સુરતના ઉદ્યોગપતિ શ્રી મહેશભાઈ સવાણીએ સુરતની પર સામાજિક સંસ્થાઓને એક કરીને કોરોનાગ્રસ્ત લોકોની વિનામૂલ્યે સારવાર કરવા માટે સુરતના જુદા જુદા વિસ્તારોમાં ૧૩ કોવિડ કેર સેન્ટર શરૂ કરેલા ત્યારે ડૉ. પ્રતીક સાવજે સૌથી પહેલો ફોન કરીને રોજ સવાર-સાંજ બે-બે કલાક પોતાની સેવા આપવા માટેની તૈયારી બતાવી હતી. સુરત શહેરના એકમાત્ર ઈન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ તરીકે અફણક કમાણી કરવાની તક હતી એવા સમયે ડૉ. પ્રતીક સાવજે આ કોવિડ કેર સેન્ટરમાં વિનામૂલ્યે પોતાની સેવાઓ આપીને રૂપિયા કમાવાને બદલે લોકોના આશીર્વાદ કમાવાનો રસ્તો અપનાવ્યો હતો. સુરતવાસીઓ વતનના લોકોની સેવા કરવા સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે ડૉ. પ્રતીક સાવજ પણ ત દિવસ વતનમાં આવીને લોકોની સેવામાં લાગી ગયા હતા.

સુરતના જનનીધામમાં એચ.આઈ.વી. પોઝિટિવ દીકરીઓ રહે છે. જેમાંથી ૪૧ દીકરીઓને કોરોના થયો. બધાને ચિંતા હતી કે આ દીકરીઓ એચ.આઈ.વી. અને કોરોના – બબ્બે વાયરસ સામે કેવી રીતે લડી શકશે? ડૉ. પ્રતીક સાવજે આ દીકરીઓની સારવારની જવાબદારી સંભાળી અને તમામ દીકરીઓને નયા પૈસાનો પણ ચાર્જ લીધા વગર કોરોના મુક્ત કરી.

ડૉ. પ્રતીક સાથે ફોન પર વાત કરી ત્યારે એમણે કહ્યું કે, ‘આ બધા મારા દાદાએ આપેલા સંસ્કારો છે. મારા દાદા બાબુભાઈ સાવજ અમરેલી જિલ્લા પંચાયતના કર્મચારી હતા. એમણે પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી ગામડાંના લોકોની સેવા કરી હતી. નિવૃત્ત થયા બાદ પણ આજે ૮૮ વર્ષ એમણે લોકોની સેવા ચાલુ રાખી છે. દાદા એમના પેન્શનની રકમનો પોતાના માટે ઉપયોગ નથી કરતા પરંતુ સેવાકીય કાર્યો માટે પેન્શનની બધી જ રકમ આપી દે છે. હું જ્યારે ડૉક્ટર બન્યો ત્યારે એમણે મને કહેલું કે લોકોની મજબૂરીનો લાભ ક્યારેય ન ઉઠાવતો અને નાના માણસનું ધ્યાન રાખજે તો ભગવાન તારું ધ્યાન રાખશે. દાદાની આ શીખ પ્રમાણે ચાલું છું, તો સેવા કરતા કરતા પણ સારું કમાઈ લઈ છું. અમારે મહિનામાં એકાદ-બે વાર, ફોન પર વાત થાય ત્યારે કેટલું કમાય છે એમ પૂછવાના બદલે એમ પૂછે કે લોકોની સેવા કેવી થાય છે?

સમાજમાં માત્ર લોકોને કુંટનારા ડૉક્ટરો જ નથી પરંતુ ડૉ. પ્રતીક સાવજ જેવા સંવેદનશીલ ડૉક્ટરો પણ છે, જેમની પાસે ઉત્કૃષ્ટ મગજની સાથે ઉત્કૃષ્ટ હંદય પણ છે. ડૉક્ટર સાહેબ માત્ર તમારી અટક જ સાવજ નથી, તમે ખરેખર સાવજ છો!



જ્યોત

આશાદીપ



ડૉ. રૂપલ ભટ્ટ

માનવી અન્ય પ્રાણીથી જુદો પડે છે તેનું મુખ્ય કારણ તેણે પેટાવેલો આશાદીપ છે. માનવી સ્વખા જુએ છે. માનવી કલ્યાણાઓ કરે છે, ઈચ્છાઓ અને આકાંક્ષાઓના મસમોટા પોટલા બાંધે છે. તેની પાસે વર્તમાન છે. તેણે ભૂતકાળને ભોગવ્યો છે. તેની પાસે યોજનાઓમાં રાચવા માટે ભવિષ્યકાળ છે.

પૃથ્વી પર દરેક જીવોમાં ઈશ્વરે જેટલું મનુષ્યને આખ્યું છે તેટલું કોઈ જીવને આખ્યું નથી. એટલે જ મનુષ્યમાં અસંતોષની શાખા ફૂટેલી છે. કંદાના પડને, કોબીના પડને ઉભેઝ્યા જ કરશે, છેક સુધી. તે અંદરથી બીજ શોધે છે. બધા જ પડ ઉખડી જશે પણ બીજ ક્યાંય હાથ નહીં લાગે. માનવ જીવનનું પણ કાંઈક આવું જ છે. જે પડ છે તેજ જીવન છે. બાકી, અંદર કે બીજે ક્યાંય કશું નથી.

આશાઓ જન્મવી અને તે જન્મેલી આશાઓને જીવંત રાખવી એ દરેક મનુષ્યને મનુષ્ય હોવાપણાની અનુભૂતિ છે. **પરંતુ તે માટે તેણે કર્મ કરવાનું હોય છે.** આ દિશાની કોઈ અંતિમ ઘડી કે છેડો હોતો નથી. તેને નિર્ધારીત કરવાનો હોય છે. નહિંતર એક પછી એક ઉગતી આશાઓ માણસને જંપવા દેશે નહીં તેવું બને. કહેવાય છે, ‘આશા અમર છે.’ પણ તેનો ભાવાર્થ તેની સાથે જોડાયેલી શ્રદ્ધામાં છુપાયેલો છે. ઘણી વખત આશા અપૂર્ણ પણ રહી જતી હોય છે. આશા વર્થ પણ જતી હોય છે.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે તેમને પોતાના દેશની હાલત ખૂબ ખરાબ થયેલી જણાઈ. સમસ્ત પ્રજા અંગ્રેજોની ગુલામી તળે તોબા તોબા પોકારી રહી હતી. કાળી ગુલામીમાંથી ધૂટવાનો કોઈ માર્ગ દેખાતો નહોતો. ત્યારે ગાંધીજીના વિચારોમાં લોકોને આશાનું કિરણ દેખાયું. જેમ પાણીની ધાર પડવાથી લોખંડ પણ કપાઈ જાય છે, તેવા ગાંધીજીના એકલક્ષી નિર્ધારથી દેશ આખરે ગુલામીમાંથી આજાદ થયો. પ્રજાએ સ્વતંત્રતાની મીઠાશ માણી.

આશાદીપ પ્રજ્વલિત રહે તે માટે સતત મથતા રહેવું પડે છે. મક્કમ મન અને કાર્ય કરવાની ધગશ હોવી જરૂરી છે. એ માટે એમ કહેવાય છે કે, **લાભ નિરાશામાં એક આશા છુપાયેલી છે.**

થોમસ આલ્વા એડિસનને લોકો એક સફળ વૈજ્ઞાનિક તરીકે ઓળખે છે. પરંતુ બહુ ઓછા લોકો તેના વ્યક્તિત્વની ભિન્ન

બાજુ જાણે છે. તે સંપૂર્ણ હિન્દુસ્તાન અને આશાવાદી તેમજ ધૈર્યવાન વ્યક્તિત્વ ધરાવે છે. તે વાતને પ્રતિપાદિત કરતાં તેના જીવન સાથે વણાયેલો એક અદ્ભુત ઘટના પ્રસંગ છે.

એડિસનનો દીકરો ચાલ્સ એડિસનના ધણાખરા સંશોધનમાં મદદરૂપ થતો હતો. અચાનક પોતાની ઈન્ડસ્ટ્રીઝમાં ભ્યાનક આગ લાગી. દીકરો નાસીપાસ થઈ ગયો. આખી ઈન્ડસ્ટ્રીઝ આગમાં હોમાઈ ગઈ. બધું રાખ થઈ ગયું. મુંજાયેલો દીકરો ઈન્ડસ્ટ્રીઝમાં હાજર વૃદ્ધ પિતા એડિસનને રઘવાયો બનીને શોધતો હતો. આંખોની ચમક સાથે આસાની જવાળાઓ જોતાં જોતાં એણે એક ખૂંઝે બેઠેલા એડિસન પર દીકરાની નજર પડી. એડિસને પણ દીકરા તરફ જોયું અને કહું, ‘દીકરા, તારી મા ને શોધી કાઢ. એ પણ મારી જેમજ અહીંથી ક્યાંક મળી જશે. અને આ અવિસ્મરણીય દશ્ય જોવા તેને અહીં લઈ આવ. આવો જળહળતો પ્રજ્વલિત પ્રકાશ ધરની ટ્યુબ લાઈટો ક્યારેય પાથરી શકવાની નથી.’ આ સાંભળી અવાકુ દીકરો પિતા એડિસન સામે બે ઘડી તાકી રહ્યો. તેને લાયું, આ પ્રજ્વલિત જવાળાથી પણ અનેકગણો પ્રકાશ પોતાના પિતાના ચહેરા પર છે.

બીજા દિવસે એડિસને કહું : ‘આ વિનાશમાં પણ કશુંક મહાન તત્ત્વ ધૂપાયેલું છે.’ એ જ સ્વસ્થતા અને નિશ્ચય સાથે તેમણે આગળ જણાયું : ‘આપણી બધી જ ભૂલો નાશ પામી છે. નવાનો પ્રારંભ કરવાનો અવસર આપવા બદલ હું ભગવાનનો આભાર માનું છું.’

આશાવાદી માણસની આસપાસ હુમેશાં સકારત્મકતાના ટીમ ટીમ તારલા ચમકતા હોય છે. તે હતાશ કે નિરાશ નથી થતો. **નિષ્ફળતા કે હાર તેને વધુ એક પ્રયત્ન કરવાનો મોકો આપે છે.** ખેલદિલીથી જીવવાની રીત તેને કોઢામાં ઉતરી ગયેલી હોય છે. જે લોકો પોતાના હેતુ કે લક્ષ્યને સિદ્ધ કરવા મથતા રહે છે, તે લોકો જ આશાદીપ અંડ પ્રજ્વલિત રાખી શકે છે. ઉતાર - ચડાવ વિનાની એકસરખી - એકધારી જિંદગીની કલ્યાણ કરવી પણ વાસ્તવિકતાથી જોજનો દૂર જવું બરાબર છે.

“ઇન્ડામા”, ૧૪, હોરાની પાર્ક-ની,
૧૦ ફૂટનો રોડ, આંદ્રા-૩૮૮ ૦૦૨. • મો. ૯૮૨૮૮ ૦૨૮૮૪



જ્યોત

પિગાળો રે તમે આત્મનો અંધકાર!



ભારતીબેન ગોહિલ

આપણી સાંસ્કૃતિક પરંપરા મુજબ કોઈપણ શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવે છે. વિશિષ્ટ તહેવારો કે પ્રસંગોમાં વિવિધ પ્રકારે રોશની કરવામાં આવે છે. મંદિરોમાં દીવડાઓનો ઝગમગાટ જોવા મળે છે. ઊગતા સૂર્યનો પ્રકાશ આપણને નવી ઊર્જા આપે છે. દરેક પૂર્ણિમાને પોતાની આગવી મહત્તમા છે. આ દરેક પ્રકાશ છે અલગ અલગ, પણ એ આખરે તો સંદેશ અંધકારની જગ્યાએ પ્રકાશની સંસ્થાપનાનો આપે છે.

જો કે આ તો થઈ સ્થળ પ્રકાશની વાત. પણ આપણો તો વાત કરવી છે સૂક્ષ્મ પ્રકાશની. એક એવો પ્રકાશ, જે આપણા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. આપણને જીવવાનો ઉત્તમ માર્ગ બતાવે છે. એ માર્ગ ચાલતાં તમે તમારું જીવન ઉત્તેત કરો છો. સાથે સાથે અન્ય માટે પણ પ્રેરણારૂપ બની શકો છો. એ પ્રકાશ તમારા જીવનમાં આવતી આફતોને, મુશ્કેલીઓને સરળ બનાવી દે છે.

પ્રકાશનું સ્થળ સ્વરૂપ હોય કે સૂક્ષ્મ સ્વરૂપ, અત્યંત પ્રભાવશાળી, ઉપયોગી, સામર્થ્યવાન, અંધકારને દૂર કરનારું કે જીવન ઉત્તેત કરનારું હોય એ આપોઆપ તમારી ચેતનામાં ભળી જાય એવું બનતું નથી. એના માટે પહેલી શરત છે તમારે તમારો પોતાનો અંધકાર દૂર કરવા માટે તૈયારી બતાવવી પડે.

વિજ્ઞાને કરેલી પ્રગતિ અને આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ જો તમે અંધશક્ધા, વહેમ, ફુરિવાજો, સંકુચિતતા વગેરે છોડી ન શકતા હો તો સ્વીકારખે કે તમારું મન હજુ અંધકાર છોડવા તૈયાર નથી.

કુદરતે દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ સામાન્ય શક્તિ મૂકી છે તો કંઈ ને કંઈ વિશિષ્ટ! તમારે એ શક્તિનો, એ સામર્થ્યનો ઉપયોગ કરવો જ રહ્યો. નાની નાની વાતમાં અન્યના અભિપ્રાય પર આધાર રાખવો, પોતાના નિર્ણયો પર સંદેહ કરવા, જાતશક્તિ ઓછી આંકડી, એ પણ એક પ્રકારનો અંધકાર જ છે. તમારે તમારા આત્માને સતત કહેતા રહેવું જોઈએ, ‘તારામાં અપાર શક્તિ છે. હે શક્તિ... તું પ્રચંડ ચેતના સ્વરૂપે મારી મદદ કરો! આ રીતે આત્મવિશ્વાસ વધારો, ને જુઓ સફળતા તમારા હારે ટકોરા મારતી આવી પહોંચશો.

કવિ રમેશ પારેખ કહે છે :

તને જે ગીત આવડે તે ગા,
તું એ રીતે સ્વયંની વહારે ધા!

જે આવડે, જેવું આવડે તેવું પણ તમે તમારું પોતાનું ગીત જ્યાં સુધી નહીં ગાવ ત્યાં સુધી આત્માનો અંધકાર આપણો પીછો છોડવાનો નથી.

આપણા પૂર્વજી અત્યંત મૂલ્યવાન એવું જ્ઞાન, સાહિત્ય વારસો આપણા માટે છોડતા ગયા છે. અદ્ભુત એવા ધ્યાર્મિક - આધ્યાત્મિક ગ્રંથો, વ્યાકરણ વિષયક સંદર્ભગ્રંથો, વિવિધ જ્ઞાનકોષો આપણા પાસે ઉપલબ્ધ છે. આપણા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી શકે એવું આ જ્ઞાન માત્ર ગ્રંથાલયોની શોભા વધારનારું બની રહે તે ઈચ્છનીય નથી. આપણે એનો અભ્યાસ કરવો પડશે. એ જ્ઞાન પ્રામ્ય કરવા મથ્યામણ કરવી પડશે અને એ જ્ઞાન પ્રામ્ય બાદ એને રોજબરોજના વ્યવહારમાં ઉપયોગ કરવો પડશે. એવું કરી શકીશું તો જ આપણા આત્મના અંધકારને દૂર કરી શકીશું.

શિક્ષણ / કેળવણી માટે કહેવાય છે કે ‘તમસો મા જ્યોતિર્ગમય...’ જે શિક્ષણ પ્રામ્ય કરે છે, કેળવણી મેળવે છે, નવું નવું જ્ઞાન પ્રામ્ય કરે છે તેને માટે અંધકાર તરફથી પ્રકાશ તરફ જીવાની યાત્રા સરળ થઈ જાય છે. પણ માત્ર જ્ઞાન મેળવવું, માત્ર શિક્ષણ કે પછી માત્ર માહિતી જાણવાથી આત્મનો અંધકાર દૂર થતો નથી. એના માટે ‘ભીતરની યાત્રા’ એટલી જ અગત્યતા ધરાવે છે.

મેળવેલ શિક્ષણના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા, મેળવેલ જ્ઞાનનું ચિંતન, સારા નરસાનું વિવેકભાન, **ભદ્રાતા સમય સાચે તાલમેલ પણ** આ દિશા માટેનું સકારાત્મક પગલું ગણાય છે.

આપણા મહાપુરુષોના જીવન ચરિત્રો પર નજર કરતા સમજશે કે તેઓએ પોતાની ભીતરયાત્રા અન્યના ઉધ્યાર માટે કરીને વિકસાવી છે. કોઈએ દેશ માટે, કોઈએ સમાજના અભાવો વચ્ચે જીવી રહેલા લોકો માટે, કોઈએ બહેન-દીકરીઓ માટે, કોઈએ ધર્મ માટે તો કોઈએ બાળકો માટે દિવસરાત જોયા વગર સેવાનો માર્ગ પસંદ કરેલો.

‘જનસેવા અને જ પ્રભુસેવા’ ગણી તેઓ જરૂરિયાતમંદ

લોકોની ઉભતિ માટે પોતાનું જીવન સમર્પિત કરી ગયા છે. તેઓ પોતાના સમર્પણ થકી ગ્રંથસ્થ જ નથી થયા પણ લોકહદ્યે સદાય માટે માનભર્યું સ્થાન મેળવી શક્યા છે. તેઓએ પોતાનો આત્મઅંધકાર તો દૂર કર્યો જ, પણ અન્યોને જ્યોતિર્મય માર્ગ ચીંધવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

નવાં સ્થળો જાણવાં, પ્રકૃતિનો આનંદ માણવા અને આજકાલ સોશિયલ મીડિયામાં માહિતી શેર કરવાના હેતુથી લોકો ફરવા જતા હોય છે. જાણવા, માણવા અને ફોટો પાડવા સિવાય પણ પ્રકૃતિ આપણા આત્મનો અંધકાર દૂર કરી પ્રકાશિત માર્ગ ચીંધવાની અદભુત તાકાત ધરાવે છે એ તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે.

પાનખર પછી આવતી વસંતનું માનવ જીવનમાં આવતાં સુખ-દુઃખ કે ચડતીની પડતીની સ્થિતિ સાથે કેટલું તાદાત્મ્ય છે! આ પરિવર્તન અને પરિવર્તનનું અવલોકન આપણાને જીવનના દરેક તબક્કે સ્થૈય (સ્થિરતા) જાળવવાનું શીખવે છે. ચંદ્રની દરેક કળાઓ, ખીલતાં - મુરજાતાં પુષ્પો, સમુદ્રની ભરતી-ઓટ, પાણીના પ્રવાહો માનવજાત માટે કેટકેટલા સંદેશાઓ લઈને આવી પહોંચે છે!

જે વાયુ તમારો પ્રાણ બને છે એનું રૌદ્ર સ્વરૂપ વાવાજોડાં સ્વરૂપે વિનાશ કરે છે. જે પાણી આપણું જીવન ટકાવે છે તે પૂર સ્વરૂપે જીવન ટુંકાવી પણ શકે છે. જે અજિન આપણાં અને પકાવે છે તે જ અજિનની વિનાશકતા ભલભલાને ભસ્મીભૂત પણ કરી દે છે. આમ, કુદરત આપણને 'પ્રમાણભાન'ના કેટલા પાઈ શીખવે છે. પણ શરત માત્ર એટલી કે તમારે તમારી ભીતર રહેલા શગ (દીવાની જ્યોત)ને સતત સંકોર્ય કરવી પડશે. તો જ એ જ્યોતિ પ્રકાશિત રહેશે અને તમારો જીવનમાર્ગ પણ પ્રકાશિત કરશે.

આમ નહીં બને તો વરસે વરસે આવતી દિવાળી બાધ્ય રીતે ઉજવ્યા કરીશું પણ ભીતરનો અંધકાર નાથી નહીં શકીએ. પછી એ અંધકારમાં અટવાયા કરીશું અને પેલી રચનાની જેમ

ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો...

આપણે સૌએ આત્મો શોધવા નીકળવું પડશે!

"શિવમુ", બટારવાડી, પટેલ ટીએલ્સની પાછળ,
અમરેલી-૩૬૪ ૬૦૧. મો. ૮૪૮૮૩ ૪૧૦૪૩

રાહ જોતો પુલ

આમ તો સાંજની ક્યારેય પહેલા આમ આતુરતાપૂર્વક રાહ જોવાતી ના હતી, જેમ આજકાલ જોવાઈ રહી હતી અને કેમ નહીં, જ્યાં અંધારું થતા લોકોને ડગ માંડવા માટે પ્રકાશના સહારાની જરૂર પડતી ત્યાં હું આજ અંધકાર તળે ઘરથી એક નાનકડાં પુલ સુધીનો ખૂબ લાંબો સફર ખેડતો. મુસાફરી માત્ર મિનિટોની હતી પણ તે કરવા માટે સમગ્ર દિવસ પસાર કરવાની અસહ્ય રાહ જોવી પડતી.

જહેર જીવનમાં ક્યારેય સમય પર ના પહોંચીને 'લેઈટ લતીફ'નું જે બિરૂદ પ્રામ કર્યું હતું, એ બિરૂદને શરમાવીને દર વખતે સમયથી વહેલા પહોંચવા છતાં પણ મોડો પડતો, કેમકે એ હંમેશાં મારાથી પહેલા આવી જતા. મારે રાહ ના જોવી પડે એ એમની મારા પ્રત્યેની લાગણી હતી અને આવી અઢળક લાગણીઓના પ્રવાહમાં તુબવાનો આનંદ માત્ર નસીબદારને પ્રામ થઈ શકે. આવા અનુભવોની વ્યાખ્યા નથી હોતી.

બંનેની જે સાઈકલ ટકરાઈને થયેલી મુલાકાત એકબીજાનાં પ્રેમમાં પડવા માટે પૂરતી થઈ રહી. મુલાકાતના નિત્યકમ મુજબ આજે પણ આ પુલ અમારી વધુ એક મુલાકાતનો સાક્ષી બની રહ્યો હતો. શાદીની આપ-લે ભલે ઓછી થતી પણ આંખોની વાતોને પૂર્ણવિરામ ના હતું. વ્યાકરણની ભાષા ના સમજ શકનાર આ મન એના સ્મેતથી ચહેરા પર રચાતી સુંદરતા પર અલંકારો ઓછા પડે છે એ જ્ઞાની લેતું. જ્યાં હું એમની હાજરી માત્રથી દુનિયાનું અસ્તિત્વ ભૂલી જતો હતો ત્યાં સંધ્યાથી રાત્રિકાળ થતાં જ આકાશમાં વધતા તારાઓની સંખ્યા વહી જતા સમયની હ્યાતી આપતા.

સમયને પણ અદેખાઈ આવતી હોય તેમ એમને મળતાં જ ઝડપથી વહેવા લાગતો. વહી જતા સમયને રોકવાનું સામર્થ્ય ના હતું પણ એકબીજાના અલગ સમયને સાથે પરિવર્તિત કરવા સક્ષમ જરૂર હતા. કોઈ વાયદા-વચન કે આશ્વાસન વિના ફરી કાલે મળવાના નિર્ણયથી યાદોની સંભારણાંરૂપી ભેટ આપી છૂટા પડ્યા હતા.

અફર છે તો મંજિલ પણ હશે,
પ્રેમ છે તો પ્રસંગ પણ બનશે.

મિત્ર રાઠોક - મુજ, કરણ
મો. ૮૪૨૬૬ ૮૬૬૬૬

કસરત કરવાનો મારી પાસે સમય નથી અને છતાં મારે તંદુરસ્તી જાળવવી છે!

પેટ્રોલ પંપ આગળ ગાડીને ઉભી રાખવાની મારી તૈયારી નથી અને છતાં મારે મંજુલે પહોંચું છે!

ધર્મ મારે કરવો જ નથી અને છતાં સુખ મારે જોઈએ છે! કરુણાતા જ છે કે બીજું કાંઈ?



શક્તિ

ઉજુ નારીને સતીની વ્યાખ્યામાં બાંધી છે



અંકિતા બરવાડિયા

નારી ગૌરવ અને નારી ઉત્તેજના વાતો કરનાર આપણા પુરુષપ્રધાન સમાજે છેક પ્રાચીનકાળથી નારીને પરાધીન અવસ્થામાં જકડી રાખી છે. આજે વીસની સદીમાં પણ નારી મનથી મુક્ત થઈ શકી નથી.

નારીને સ્વતંત્રતાને નામે માત્ર ને માત્ર મૂર્ખ બનાવાઈ રહી છે. ક્રી અનામતના ઢોલ પીટચા પછીયે તેને જે જગ્યા પર પ્રસ્થાપિત કરાઈ છે, એ જગ્યાની સત્તા, હોદા, ખુરશીને ટેબલ વહીવટ તો આજે મોટાભાગના પુરુષો જ પરદા પાછળ રહીને ચલાવી રહ્યા છે. શું આમાં નારીની સ્વતંત્રતા દેખાય છે? સત્તા ગ્રહણ કર્યા પછી પણ આજની નારી પુરુષ જેટલું કહે કે કહેવડાવે અને કરાવે તેટલું જ કરે છે. તેનાથી વધારે તે નિર્ણયો લઈ શકતી નથી.

આવી પરાધીન દશામાં જીવતી નારી કન્યા કેળવણી પાસ્યા પછી પણ સ્વતંત્ર નિર્ણયો લેવા જેટલી કાબેલ કે હિંમતવાન થઈ શકી નથી. આવી દશા કંઈ આજકલની નથી, છેક પ્રાચીનકાળથી જ આ સિલસિલો અવિરત ચાલી રહ્યો છે.

આજના સમયમાં દહેજ, પ્રતિષ્ઠા, અહમ અને રીત-રિવાજોના વળગણ હેઠળ દભાવી રાખી નારીને પુરુષની સામે નમતી - ઝુકેલી રાખવામાં આવી છે. ક્રીઓ જરીકેય ચૂં-ચાં કરે તો રીત-રિવાજોને આગળ કરીને તેને ચૂપ કરી દેવાય છે, હકાલપહી પણ કરવામાં આવે છે. જો પુરુષનો અહમ વધારે ઘવાયો હોય તો તે ક્રીને બાળી મૂકી સઘળો દોષ બળનાર ક્રીને માથે ઢોળી દેવાય છે.

જ્યાં પુરુષનો અહ્મુ ઘવાય, કે પુરુષથી આગળ વધી સ્વતંત્રતા તરફ આગળ વધવા માંગતી નારીને રોકવા જ આજે તેના પર દમનકારી વલણ અપનાવાઈ રહ્યું છે. સળગી કે બળી મરવાના કેટલાક કિસ્સામાં પુરુષ પ્રધાનનું અહમભર્યુ વલણ કારણભૂત રહ્યું છે. આમાં દીકરાની વહુ પ્રથમ શિકાર બનતી હોય છે.

પ્રાયમસ ફાટે છે, ને આગ લાગે છે. આ પ્રાયમસ પુરુષ પાસે કેમ નથી ફાટતો? પુરુષ કેમ નથી બળતો?

પુરાણા સમયથી જ નારીને સતીની વ્યાખ્યામાં બાંધી દેવાઈ છે.

આજે ક્રીને સંરક્ષણ આપતા ઘણા કાચદાઓ અમલમાં છે પણ એ કાચદાઓ હેઠળ કેટલા ગુનાઓ નોંધાય છે અને કેટલા ગુનેગારોને સજ થઈ છે? નાણાં અને લાગવગાને જોરે કાચદાનું શાત્ર બુઝું કરી નિર્દોષ જહેર થતા ગુનેગારો આજે બજારમાં છૂટથી ફરી રહ્યાં છે.

વર્તમાન સમયમાં ક્રીને જોવાનો, સમજવાનો દાખિકોણ સામાજિક દાખિકોણથી જરા જુદ્ધ છે. એટલે જુદ્ધ જ અંગલથી પોતે જ પોતાની સ્વતંત્રતા, સમાનતા અને પોતાના અધિકારોની સીમારેખા બાંધીને સમાજમાં ગૌરવભર્યુ સ્થાન ક્રીએ ખૂદે જ મેળવવું પડે છે. એમાં પણ મોટાભાગની ક્રીઓ સફળતા મેળવી શકતી નથી.

અગ્રવેદકાળ સુધી નારી સન્માનનીય હતી, સ્વતંત્ર હતી. આ સમયમાં કન્યાઓ કે વહુ-દીકરી પ્રત્યે ક્યાંય ધૂણાનો ઉલ્લેખ જોવા મળતો નથી. બાળકીને ત્યારે ખૂબ જ શુકનવંતી અને શુભ માનવામાં આવતી. અપરિણીત કન્યા માટે ઋગ્વેદમાં “પિતૃપદ” પિતાને ઘરે રહેનાર, વિવાહિત થયેલી કન્યાને ઘરની ‘સ્વામિની’ કહેવાતી.

ઋગ્વેદકાળમાં પરદા પ્રથા ન હતી. એ પ્રથા તો મુગલકાળમાં જ દાખલ થઈ હતી. મુગલકાળથી જ ક્રીની હાલત રમવાના રમકડાં જેવી બની ગઈ હતી. અને આ કાળમાં જ સતીપ્રથા, કન્યા વિકય, વેશ્યાવૃત્તિ અને પરદાપ્રથા વગેરે બદીઓએ જોર પકડ્યું હતું. આ કાળમાં ક્રીઓ બાદશાહો - નવાબો માટે એક નજરાણું અને બાદશાહી દરબાર શોભાવતી મૂલ્યવાન ચીજ બનીને રહી ગઈ હતી. બસ, એ કાળથી જ ક્રીનું જીવન અંધકારમય બની ગયું હતું.

સતી પ્રથા...

મુગલકાળથી અસ્તિત્વમાં આવેલી સતીપ્રથા કાયદા વિરુદ્ધ આજે પણ ચાલી રહી છે. ક્રીને ચિત્તા પર ચઢાવી, તેને પરાણે, અનિષ્ટા હોવા છતાં બાળી મૂકવાના કિસ્સા કેટલાક રાજ્યોમાં છાસવારે બનતા રહે કે બની રહ્યા છે. આવી પરાણે સતીપ્રથાને રોકવા કાયદો બુઝો થતો દેખાય છે. ધર્મ, રીત-રિવાજો તથા અંધશર્દીના ખાપર નીચે આવી પ્રવૃત્તિ કેટલાક રાજ્યોમાં થઈ રહી છે. જો કે હવે તેમાં થોડીક જાગૃતિ આવતા તે મંદ પડી છે.

રાજસ્થાનના સિકર જિલ્લાના દેવરાલા નામના ગામમાં ૪ સપ્ટેમ્બર, ૧૯૮૭ની સવારે ૧૮ વર્ષની રૂપકુંવર નામની રાજપુત સ્ત્રી તેના પતિ માલસિંહ સાથે ચિતામાં બળી ભરી, સતી થઈ હતી. તેનો પતિ આડા ઉલટીની બીમારીથી કુદરતી રીતે મૃત્યુ પામ્યો હતો.

આ બનાવના જેરદાર પડ્ઘા ઉઠ્યા હતા પણ નવાઈની વાત એ હતી કે “સતી ધટના” પછી ૧૫મા દિવસે ચુંદી મહોત્સવ થયો. બે લાખ જેટલા લોકોની હાજરીમાં ૧૬ સપ્ટેમ્બર, ૧૯૮૭ના દિવસે રૂપકુંવરના પિતાએ સતી સ્થળે રોપેલ ત્રિશુળ પર ચુંદી ઓઢાડી આ ઉત્સવ પરિવારો સાથે ઉજવ્યો હતો. અને ન્યાયાલયનો પણ એ પરિવારે અનાદર કર્યો હતો.

“સ્ટ્રેબોસ ઇન્ડિયા” નામના એક અંગ્રેજી પુસ્તકમાં લખ્યું છે કે, સિકંદરે ભારત ઉપર ચંદ્ર કરી ત્યારે પંજાબમાં વસતી એક કોમાં સ્ત્રી ને પુરુષનાં લગ્ન થતાં ત્યારે તેની જોડે એક રિવાજ પણ હતો. તેમાં બેમાંથી કોઈ એક જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની જોડે બીજા એક જીવિતે પણ બળી ભરવું.

મુસ્લિમ શાસનમાં યુધ્યમાં પરાજિત થયેલા હિન્દુ રાજાઓની રાણીઓને મોગલો ભ્રષ્ટ બનાવતા, ને છોડી દેતા. જેથી આવી સ્ત્રીઓ પોતાનું શિયળ બચાવવા પતિની સાથે જ પ્રાણનો ત્યાગ કરતી. રાજસ્થાનમાં ‘બૈછરમથા’ હતી.

મધ્યયુગમાં સતીપ્રથા મર્યાદિત હતી. ૧૮મી અને ૧૯મી સદીમાં તે વિકરાળ બની હતી. રાજભૂશીથી જ્યારે કોઈ સ્ત્રી સતી થવા આગળ આવતી નહીં ત્યારે તેને બળજબરીથી સતી બનાવવામાં આવતી. વિધવા બનેલી સ્ત્રીને અફીણ ખવડાવી પતિની લાશ સાથે જીવતા બાંધી દઈ તેને ચિતા પર ચંદ્રાવી, બાળી મૂકતી.

સતી થવાનો ઈન્કાર કરનાર સ્ત્રીને પતિના શબ સાથે પરાણે સુવડાવી, ભારેખમ લાકડાં તેની ઉપર ખડકી દેવાતા. જેથી સ્ત્રી ભાગી શકે નહીં અને નિર્દોષ અભણ સતીને નામ શહીદ થઈ જતી.

૧૯૮૦માં વડાપ્રધાન ઈંદ્રીરા ગાંધીએ જાહેર કર્યું હતું કે હવે કોઈ સતી નહીં થાય કે તેનું ક્યાંય સતીમંદિર નહીં બંધાય. અને જો કોઈ આવાં કૃત્યો કરશે તો તેની સામે સખત પગલાં ભરવામાં આવશે. પરંતુ આજે પાટનગર દિલ્હીમાં ચાર ચાર સતી મંદિરો ઉલ્લાસ છે. ગામડે ગામડે આવાં અસંખ્ય સતી મંદિર (દેરી - ખાંની) આવ્યાં છે.

સતીપ્રથા બંધ થઈ છે પણ સ્ત્રી ઉપર થતા જુલમો બંધ નથી થયા. અગાઉના સમયમાં પતિનું મૃત્યુ થાય ત્યારે સ્ત્રીને ચિતા પર ચંદ્રાવી દેવામાં આવતી. આજે પતિની હયાતીમાં જ સ્ત્રીને વાવ-કૂવો, વિષપાન કે સણગાવી, તેને પરાણે સતી

જેવું રૂપ આપવામાં આવી રહ્યું છે. જોકે, દરેક ઘરમાં આવું બનતું નથી પરંતુ આવું બની તો રહ્યું છે, એ પણ હકીકત જ છે.

સ્ત્રીને આજે ટીંગલી બનાવી સજાવવામાં આવી રહી છે અને ફેશનના નામે સ્ત્રી ખુદ સજી રહી છે. પરંતુ અંતિમ નિર્જય તો આદિકાળથી જ પુરુષોનો જ ચાલ્યો આવે છે. સ્ત્રી આજે સ્વતંત્ર નિર્જયો લઈ શકતી નથી. એ ભલે આકાશમાં સફર કરતી હોય કે ઊંચાં આસને બેઠી હોય! અને હંમેશાં પુરુષોને તાબે જ રહેવું પડે છે. એ અબળા જ રહી છે. સબજ બનતા તેને હજી યુગો લાગશે. સ્ત્રીઓને સ્વતંત્રતા બદ્ધાવાના દાવાઓ કઈ યુગોથી ચાલ્યા આવે છે પણ નથી સ્ત્રી સ્વતંત્ર થઈ શકી, કે નથી સરકારી કાયદાઓ તેને સ્વતંત્રતા અપાવી શક્યા. આજે પણ ગામડાંઓમાં સ્ત્રીની દશા પરાધીની જ છે. ૧૮મી કે ૧૯મી સદીમાં જેવી હતી તેવી જ હાલત છે. માત્ર શહેરોમાં થોડોક સુધારો આવ્યો છે. ભલે સતી પ્રથા બંધ થઈ હોય પણ અત્યારો અટક્યા નથી, આપધાતો થમ્યા નથી. હજી પ્રાયમસ ફાટી રહ્યા છે, ને હજી સ્ત્રીઓ સતીઓ થઈ રહી છે કે તેને સતીઓ બનાવાઈ રહી છે? હજી સ્ત્રીઓને સતીની બાધ્યામાં બાંધી તેને “સતી” કહેવાય છે.

પી.પી. બરવાડીયા, શીતલ આઇસ્ક્રીમ એજન્સી,
પી. અંપોર્ટ, ટા. વંચલી, નરેકી, મ્ર. જુનાગઢ.





શક્તિ

‘મા’ – માનવજીતનું આધ્ય તીર્થ



અમૃતલાલ હિંગોરાણીયા

‘મા’ – એકાશરી શબ્દ એટલો તો વિશાળ અને ગહન છે કે તેના વિશે દુનિયામાં પુષ્ટ લખાયું છે છતાં પણ તેની વ્યાપકતાનો તાગ નથી ભય્યો. માનવીય સંબંધોમાં માત્ર ‘મા’નું પાત્ર એ કોઈ વ્યક્તિ કે શબ્દ નહીં પણ ભાવના છે, ઉર્મિ છે. તેને અનુભવી શકાય, પણ વર્ણવી ન શકાય. તેની અનુભૂતિ તેની હાજરીમાં થાય તેના કરતાં તેની ગેરહાજરીમાં વધારે થાય.

બાળક આંખો મિચીને રડતું હોય, તેને બીજો કોઈ હાથ ફેરવે તો તે છાનું નહીં રહે પણ મા જો માથે, પીઠ કે છાતી પર હાથ મૂકશે તો તેને ‘મા’ના હાથનો અહેસાસ થશે અને તે તરત જ છાનું રહી જશે. ‘મા’ના હાથમાં, સ્પર્શમાં એક અનોખો જાહું છે. ‘મા’ને તો સ્પર્શ સંહિતાના પાઠ આત્મસાત્ર છે.

કહે છે કે ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.’ પણ કવિઓ અને લેખકોએ પણ ‘મા’ની સરખામણી મીઠામાં મીઠી વસ્તુ કરતાં પણ મીઠી, ઊંચામાં ઊંચી વસ્તુ કરતાં પણ ઊંચી કે મોટામાં મોટી વસ્તુ કરતાં પણ મોટી વસ્તુ સાથે કરવા છતાં તેને ઉણાપ લાગે. તેથી સરખામણીની શોધમાં નીકળ્યા. કંઈ ન મળ્યું એટલે છેવટે ‘મા’ની સરખામણી માત્ર અને માત્ર ‘મા’ સાથે જ કરી. ‘મા’ તે ‘મા.’

બાળક ભણીગણીને મોટું થાય પછી M.B.A. (Master of Business Administration) થવા કોઈ પ્રતિષ્ઠિત કોલેજમાં જાય. ડિગ્રી લઈને જ્યારે બહાર પડે ત્યારે ખ્યાલ આવે કે બિઝનેસ મેનેજમેન્ટમાં જે કંઈ શીખ્યો છે તેની ખરી નિષ્ણાત તો ‘મા’ છે. ઘરમાં સૌથી વહેલી ઉઠે, બધાના શિરામણનું કરે, ઘરની સાફ્-સફાઈ, નાવણ-ધોવાણના કામ પતાવે, ઘરના બધા કામ આટોપે, સૌના ખાવા-પીવાની વ્યવસ્થા કરે, કોઈનું ટિક્નિક કે કોઈનું લંચ બોક્સ તૈયાર કરે, તેમાં પણ વિવિધતા જાળવે. પછી નોકરી, ધંધો, વેપાર કે મજૂરી જે કંઈ તેના ભાગનું કામ હોય તે કરવા જાય. સાંજે આવી ઘરના કામમાં જોડાઈ જાય. સૌની રસોઈ કરી સૌને પ્રેમથી જમાડે. સૌ પરવારીને ઊંઘે પછી જ પોતે ઊંઘે. ઘર, કુટુંબ, મિત્રમંડળ – એમ સૌની સાથે સંવાદિતા અને વ્યવહાર જાળવે. આ બધું સહજતાથી કરે. ક્યાંય કયવાટ નહીં, રઘવાટ નહીં, બિનજરૂરી ઉતાવળ નહીં. મગજ પર જવાબદારી ખરી, પણ કામનો ભાર નહીં. પોતાની નહીં પણ તમામની ખુશીનો ખ્યાલ રાખે. બધા જ ખુશ. M.B.A.

ના અભ્યાસકમાં આનાથી વિશેષ કશું જ નથી. ‘મા’ શ્રેષ્ઠ વહીવટદાર છે, ઉત્તમ અર્થશાસ્ત્રી છે, બાહોશ માનસશાસ્ત્રી છે, સૌ વર્ચ્યો સાંકળતી કરી છે. સૌથી ઉત્તમ તો એ છે કે આ બધી ફરજો નિભાવવામાં તે યાંત્રિક નથી પણ સંવેદનશીલ છે. ખરેખર ‘મા’ તો હરતી ફરતી – જંગમ વિધાપીઠ છે. ‘મા’નો ઘરમાં, જીવનમાં, વ્યવહારમાં શો ભાગ (Role) અને હિસ્સો (Contribution) છે તે જાણવું હોય તો ‘મા’ને અઠવાડિયું બહાર મોકલી પોતાના રોજિંદા કામ સાથે ઘરને સંભાળો. એટલે ખ્યાલ આવશે કે ‘મા’ એ વ્યક્તિ નહીં પણ સંસ્થા છે. કુટુંબ એ પરમાત્મા તરફથી માનવજીતને મળેલ આણમોલ બેટ છે જ્યાં શ્રદ્ધા, પ્રેમ અને શાંતિનો અહર્નિસ અને અવિરત પ્રવાહ વહે છે. તેના દ્વારા સમાજ અને સંસ્કારનું નિર્માણ થાય છે અને ‘મા’ એ કુટુંબ સંસ્થાની આધારશિલા છે.

મહાભારતમાં મહાપ્રતાપી ભીખ પણ જ્યારે જ્યારે વિવશ કે દ્વિધામાં હોય ત્યારે ત્યારે તે સાંત્વના અને માર્ગદર્શન માટે માતા ‘ગંગા’ પાસે જતા. તમે ગમે તેટલા મોટા હો, તમારો સામાજિક, આર્થિક, રાજનૈતિક દરજાઓ ચાહે તેટલો ઊંચો હોય તો પણ ‘મા’ તેના માટે એક પ્રેરણાતીર્થ અને સાંત્વન સ્થાન છે.

કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ પૂરો કરીને નીકળ્યા ત્યારે ગુરુને ગુરુ દક્ષિણામાં તેમનો પુત્ર પાછો આઓ. તેથી ગુરુએ પ્રસન્ન થઈને કૃષ્ણને કોઈ વરદાન માગવાનું કહ્યું. ઘણી આનાકાની પછી કૃષ્ણ ગુરુને કહ્યું કે, ‘તમે મને વરદાન માંગવા માટે ખૂબ આગ્રહ કરો છો ત્યારે આપની પાસે વરદાન માણું છું કે મને રોજ ‘મા’ના હાથનું ખાવાનું મળો.’ કનૈયાના બાલ જીવનમાં કૃષ્ણ બાળલીલા તો છે જ પણ ‘મા’ની મમતા અને માતૃત્વનો મહિમા તો ક્ષણે ક્ષણે પ્રગટ થાય છે.

માણસ પોતાના જીવનની શ્રેષ્ઠ રચનાની પાછળ પોતાનું નામ આપે તે સહજ છે પણ તેમાં ‘મા’ અપવાદ છે. ‘મા’ પોતાના શ્રેષ્ઠ સર્જન સંતાનની પાછળ પોતાનું નહીં પણ પતિનું નામ આપે છે. ‘મા’ તો ત્યાગનું પ્રતીક છે. ‘મા’ને નામનો નહીં પણ મમતાનો આગ્રહ છે.

આમ છતાં એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે આટલા ઉપકાર હોવા છતાં, સંતાનો હોવા છતાં ‘મા’ ઘણી વખત બેધર હોય. ‘મા’ વિનાનું ઘર હોય તે એક કરુણાતા છે પણ

ઘર વિનાની 'મા' હોય તે માંદા અને પતન તરફ જતાં સમાજની નિશાની છે. કયાંક 'મા'નો અનાદર પણ થાય છે. પણ જેમ ખારા ધૂધવાર મહાસાગર પર સૂરજની ગરમી પડે અને તે ખારા પાણીની વરાળમાંથી જે વાદળી બને તેનું પાણી તો અમૃત સમું મીઠું હોય, તેમ કોઈ સંતાન 'મા'ને સંતાપે અને તેની આહ ઉઠે (લગભગ તો આવું ન જ થાય) અને તે આહમાંથી જો વાદળ બંધાય તો તે વાદળના પાણીમાં કડવાશનો અંશ માત્ર ન હોય. માત્ર અને માત્ર અમી જ હોય.

ભગવાનને પોતાના સંતાનોની સંભાળ રાખવાની હોય અને તેની ઈચ્છા બધાને વેર પહોંચી રહેવાની થઈ અને પોતાના પ્રતિનિધિ તરીકે તેણે દરેક ઘરમાં 'મા' મૂકી. માણસ જ્યારે જન્મે છે ત્યારે બની શકે કે તેનો બાપ હ્યાત ન હોય, દાદા-દાઈ ન હોય, નાના-નાની ન હોય, ભાઈ-ભહેન ન હોય, પણ 'મા' તો હોય જ. 'પ્રભુના ઓ પ્રેમ તથી પૂતળી રે લોલ...' જે ઘરમાં 'મા'નો આદર થતો હોય તે ઘરમાં લાગણીના સંબંધોની સમૃદ્ધ સદા રહેતી જ રહે છે.

થોમસ નામનો એક પાંચ વર્ષનો બાળક જ્યારે શાળાએથી ઘરે આવ્યો ત્યારે શાળાના શિક્ષકે આપેલ પત્ર તેની 'મા'ના હાથમાં મૂક્યો. પત્ર વાંચી 'મા' વિચારમાં પડી ગઈ. ત્યાં થોમસે 'મા'ને પૂછ્યું, 'મા, ટીચર શું લખ્યું છે?' 'મા'એ દીકરાને બાથમાં લઈ કહ્યું, 'ટીચર લખે છે કે તમારો થોમસ અસાધારણ બુદ્ધિ પ્રતિભા ઘરાવે છે. આ શાળામાં તેને કોઈ ભણાવી શકે તેમ નથી. એટલે હવે થોમસને શાળાએ મોકલશો નહીં. તેના અભ્યાસ માટે અન્ય કોઈ સારી વ્યવસ્થા કરશો.' 'મા'એ થોમસને કહ્યું, 'થોમસ બેટા, આવતીકાલથી હવે તારે શાળાએ જવાનું નથી. હવેથી હું જ તને ભણાવીશ.' થોમસ ખુશ થઈ ગયો અને બીજા દિવસથી તે 'મા'ના હાથ નીચે ભણવા લાગી ગયો. મોટો થઈને આ થોમસ દુનિયાનો એક મહાન યેણાનિક બન્યો અને થોમસ આત્મા એડિસનના નામે વિખ્યાત બન્યો. તેણે વીજળીની શોધ કરી, દુનિયા ઉપર એક મોટો ઉપકાર કર્યો છે.

વર્ષો પછી થોમસની મા નું અવસાન થયું ત્યારે તેના સામાનમાંથી તે જ્યારે નાનો હતો ત્યારે ટીચરે આપેલો પેલો પત્ર મળ્યો. થોમસે ખોલીને તે વાંચ્યો. તેમાં લખેલું હતું કે, 'તમારો પુત્ર થોમસ એક મંદબુદ્ધિ બાળક છે. તે ભણી શકે તેમ નથી. આ શાળામાં જો આવશે તો તેને જોઈ અન્ય બાળકો પણ ખરાબ થશે. તેથી હવે પછી થોમસને શાળામાં મોકલશો નહીં.' પત્ર વાંચી થોમસ પોક મૂકી રહી પડ્યો અને 'મા'ને સંબોધીને કહ્યું, 'મા, તું આટલા વરસથી આવડો મોટો ભાર માથા પર રાખી ફરતી હતી અને મને અણસાર પણ ન આવવા દીધો? તે એકદે હાથે એક મંદબુદ્ધિ બાળકને વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક બનાવી દીધો? ખરેખર 'મા'થી મોટી પાઠશાળા દુનિયામાં બીજી

કોઈ નથી.'

'મા' ચમત્કાર સર્જ શકે, પથ્થરમાંથી મૂર્તિ ઘડી શકે. મા શું કરી શકે તેના માટે આ એક જ ઉદાહરણ બસ છે. 'મા' એ શક્તિ અને સર્જનની જ્ઞાતા અને દાતા છે.

ધણા વડીલો 'મા-બાપને ભૂલશો નહીં' કાર્યક્રમનું આયોજન કરે છે. ખરેખર આવા કાર્યક્રમનું આયોજન વડીલો દ્વારા નહીં પણ સંતાનો દ્વારા થવું જોઈએ. 'મા'નો મહિમા તેના ગચ્છા પછી તેને શ્રદ્ધાળ આપવામાં નથી પણ તેને જુવલેજુવ આદર, સન્માન આપવામાં અને તેનું આચરણ કરવામાં છે. ખરેખર 'મા', એ માનવજીતનું આધ્યતીર્થ છે.

૨૦૩, સ્વાગત ટાઈપ, માનવ મંદિર પાછળ,
દાયવ-ઇન રોડ, મેમનગર, અમદાવાદ-૩૮૦ ૦૪૨.
મો. ૮૮૨૭૪ ૧૬૧૮૮

સાચી સુખાનુભૂતિ

(અનુસંધાન : પાના નં. - ૪૦ ઉપરથી ચાલુ)

આત્માભિમુખ છે. સુખ ભૌતિકતા સાથે જોડાયેલું છે. આનંદ ભૌતિકતા મૂકવાથી મળે છે. એકમાં પ્રાપ્તિ છે, બીજામાં ત્યાગ છે. આનંદ તો ત્યાગ કરવાથી મળે છે. આપણે આ બેયની વચ્ચે આવ-જી કરીએ છીએ એટલે સમસ્યા છે. ભૌતિકવાદને અપનાવનારો સુખનો અનુભવ કરે છે. માયામાં રહેનારો અને માયા વધારનારો કહેવાતો અધ્યાત્મવાદી અવઢવમાં રહે છે. ધણા ધર્મનો આંચળો ઓઢીને, ભૌતિકતામાં રચ્યોપચ્યો રહીને, જગતને માયા મૂકવાવા દોડી જય છે. એની દોડ માયાનો વિસ્તાર કરવાની હોય છે. લોકો સુખ શોધવા એની લાખેણી કંઠી બાંધીને પાછળ પાછળ ફરે છે અને હાસ્યાસ્પદ સ્થિતિઓ સર્જાય છે!

સુખ આપણા મનની એક અવસ્થા છે. કાર્યમાં પ્રવેશીએ ત્યારે જ મળે છે. સાચા સુખની અનુભૂતિ સંતોષમાંથી મળે છે. જે છે તેનો સંતોષ હોય અને જે નથી તેની ઝંખના ન હોય તે સુખ જ છે. ઝંખનામાંથી જન્મેલા ઉત્પાતમાંથી શાંતિનો જે અહેસાસ થાય તે સુખ છે. એ પળને માણી લેવાની હોય છે. મળેલા સુખમાંથી ફરી ઝંખના ઝંખવાની જ. મનને પ્રતિકૂળતા વચ્ચે અનુકૂળતા ઊભી કરી આપવી એ મહત્વનું છે. અભાવનો અસંતોષ ન હોય એ પણ સુખ જ છે. સુખ લેવું છે કે દુઃખ લેવું છે, એ આપણા હાથની વાત છે, ઇતાં કઠિન છે કે નહીં? આવો ઝડો મનખાદેછ મળ્યો છે એટલું સમજઈ જાય તોય સુખાનુભૂતિ થઈ શકે છે. માટે 'આજનો લહાવો લિજાએ રે, કાલ કોણે દીઠી છે...'

૧૦૧, આમૂલ્ય એપાર્ટમેન્ટ, રામસેતુ શોરી,
સ્વાપર - ધુનાડા રોડ, મોરની.
મો. ૮૮૭૭૮ ૩૫૨૧૭



ચિંતન

સુખી થવું આપણા હાથમાં છે



દરજુવન રંગપરિયા

જગતમાં ભાગ્યે જ એવો મનુષ્ય હશે, જેને સુખી થવાની અપેક્ષા ન હોય. કારણકે સુખ જીવનને આનંદમય બનાવે છે, કષ્ટથી દૂર રાખે છે. સુખ માણસની અભિનિતીકા લેતું નથી. સમાજમાં પ્રતિજ્ઞા આપાવે છે, તૃપ્તિનો અહેસાસ કરાવી સ્વર્ગાર્થ સુખની અનુભૂતિ કરાવે છે. છતાં પણ દુઃખની વાત એ છે કે સુખની પાછળ દોડતો માણસ સુખી થવાને બદલે દુઃખી વધુ જોવા મળે છે. આપણે એવી શું ભૂલ કરીએ છીએ કે સુખ આપણને હાથતાણી દઈ છટકી જાય છે?

મનુષ્યને દુઃખી બનાવનાર તત્ત્વો છે : તૃષ્ણા, આસક્તિ, મોહ, લોભ, ઈર્ઝા, અસંતોષી સ્વભાવ, ભય તથા અહંકાર. આ કથાયોથી દૂર રહેવાથી જીવનમાં સુખ અને પ્રસંગતા આવે છે. મનુષ્ય દરેક કામમાં હાનિ-લોભનો વિચાર કરે છે. જેથી ધાર્યો લાભ ન થાય કે હાનિ થાય તો દુઃખી થઈ જાય છે. નભળા મનને લીધે નાના નાના દુઃખોને મોટા માની લે છે. થોડી પણ વિષમતા આવે તો ભાંગી પડે છે. તેથી દરેક પરિસ્થિતિમાં ધૈર્ય અને સમતાભાવ રાખવો અતિ આવશ્યક છે.

આપણામાં ગમા-અશાગમા, પૂર્વગ્રહ, અહંકાર, અપેક્ષા એટલા બધા હોય છે કે આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા. હું ઈર્ઝનું તેમ થાય તથા મારું કહ્યું બધા માને તેવો હઠાગ્રહ આપણને દુઃખી કરી મૂકે છે.

આપણને દરેક કાર્યનું ઈચ્છિત ફળ જોઈએ છે. કર્મ ફળની અપેક્ષાથી કરીએ છીએ. તેથી ધારેલું ફળ ન મળતાં દુઃખી થઈએ છીએ. બધી પરિસ્થિતિ આપણને અનુકૂળ જ હોવી જોઈએ તેવી અપેક્ષા રાખીએ છીએ. જે છે તેનાથી સંતુષ્ટ રહેવાને બદલે વધુને વધુ મેળવવું છે. બીજાનાં સુખથી બળવું છે, પોતાનાં સુખની અન્યના સુખ સાથે સરખામણી કરવી છે. તમે જ કહો, આમાં આપણે સુખી કેવી રીતે રહી શકીએ? બીજું કોઈ નહીં, આપણે જ આપણને નડીએ છીએ. આપણે જ આપણી કેદમાંથી મુક્ત થવું નથી. સુખને આપણાં હાથમાંથી છીનવી લેતા આવા દુર્ગુણોથી જાતને મુક્ત રાખવી અતિ જરૂરી છે.

તમારું સુખ પરાધીન એટલે કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર આધારીત હશે તો તમો ગમે ત્યારે દુઃખી થઈ શકશો. તમારું સુખ સ્વાધીન હોવું જોઈએ, નહિ તો બીજા સહેજ

ટીકા કરશે, કે તમે દુઃખી થઈ જશો. તમારી પરિસ્થિતિ સહેજેય બદલાશે તો તમો ભાંગી પડશો. તમારા સુખને અંદરથી મહેસુસ કરો. સુખ સ્વાધીન હશે તો કોઈ તમોને દુઃખી નહીં કરી શકે. ઈશ્વર કોઈને સુખી કે દુઃખી નથી કરતો. ખુદ આપણે જ આપણા સુખ-દુઃખ માટે જ્યાબદાર છીએ.

‘જે નસીબમાં હશે તેમ થશે. કર્મનો બદલો મળશે. જેવી ઈશ્વરની ઈચ્છા’ની ફિલોસોફીમાં તમે શ્રદ્ધા દ્રઢ કરશો તો જીવનમાં આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ મળશે. ગમે તેવા દુઃખમાં ટકી શકશો. ભૂલો થવા બદલ તમો તમારી જાતને કોસસો નહીં. સુખ મેળવવા ઉતાવળા નહીં થાવ. જે છે તેમાં સંતુષ્ટ રહેશો. મનની શાંતિ ટકાવી શકશો. ખરાબ તથા પાપકર્મોથી જાતને બચાવી શકશો. જેથી આવા કર્મોથી થતી ગલાનિથી બચી શકશો.

આપણે જોઈએ છીએ કે ઘણી વખત ઓદૃં ભાંગેલા, ઓછી સંપત્તિવાળા તથા ઓછા સફળ લોકો આપણાથી વધુ સુખી હોય છે કારણકે એ લોકો પોતાને સુખી માને છે, અન્યનાં સુખથી બળતા નથી, સુખની સરખામણી કરતા નથી. પોતાના દુઃખના રોદણાં રોતા નથી. જિંદગીને જેવી છે તેવી સ્વિકારે છે. દરેક કારણ સુખ, આનંદ અને પ્રેમનો અહેસાસ કરે છે. આવા લોકોને ભાવિની ચિંતા કોરી ખાતી નથી. દુઃખ આવા લોકોથી દૂર જ રહે છે. તેમનાં સુખને કોઈ છીનવી નથી શકતું. આપણે જ નક્કી કરવાનું છે કે આપણે આપણી જાતને સુખી સમજવી છે કે દુઃખી?

મોટાભાગના મનુષ્યોની સમસ્યા એ છે કે ઈચ્છાઓનો મહાસાગર તેમના મનમાં વૂધવતો હોય છે. ઈચ્છાઓ અનંત છે, ને તેને પૂર્ણ કરવાનાં સાધનો તથા આયુષ્ય સીમિત છે. તેથી અતૃપું ઈચ્છાઓ આવા મનુષ્યને પીડતી રહે છે. આવા મનુષ્ય દરેક વાતમાં લાભ અને લોભના ચશ્માથી જુએ છે. જેથી જે મધ્ય તેમાં સંતોષ માનવાને બદલે વધુ મેળવવા વલખા મારે છે. આવા લોકોનો જીવન પ્રત્યેનો દાખિકોણ સકારાત્મક હોવાને બદલે નકારાત્મક હોય છે. મહત્વાકંશાઓનો ભાર તેમને ભાંગી નાખે છે. વધુ મેળવવા દોડવા કરે છે. મળેલાની કિમત તેમને સમજાતી નથી. આવા લોકો સધણું હોવા છતાં ખરા અર્થમાં નિર્ધન છે. અસંતોષ તેમને ચેનાથી જીવવા નથી દેતો. જ્યારે જે છે તેનાથી

સંતોષ પામનાર લોકો ખરા અર્થમાં તવંગર છે. બંગલામાં રહેતા, ને વૈભવી સુખ-સગવડો માણસી લોકો કરતાં ફૂટપાથ પર રહેતાં લોકો વધુ સુખી હોઈ શકે છે. આવા લોકો સુખની નિંદ્રા માણી શકે છે જ્યારે તવંગર લોકો વૈભવી બંગલામાં ભવ્ય પલંગ પર ઊંઘની ગોળી લેવા છતાં બેચેનીથી પડખા ઘસતા રહે છે.

જીવનને જાતજાતનાં નિયમોમાં જકડી ન રાખો. ફ્લેક્સિબલ બનો. જાત સાથે નિઝૂર ન બનો. જાતને ચાહો, ખુદને શક્તિશાળી માનો, વાતવાતમાં ભયભીત ન બનો. જાત પર ભરોસો રાખો. વધુ પડતું વિચારો નહીં. નહિંતર દરેક વાતમાં તમોને ભય, દુઃખ અને જોખમ જ દેખાશે. તમારું મન જ સુખ અને દુઃખનું સર્જક છે. તેથી મનને સંયમમાં રાખો. પ્રેમાણ અને કરુણામય બનો. માનવસેવાનાં કાર્યો કરો. જેથી મનને શાંતિ મળે.

અધડાળું સ્વભાવ હોય તો છોડો. વાતવાતમાં અધડતા લોકો એકલા પડી જાય છે. લોકો તમારાથી દૂર ભાગશે. નજીકના સગા-સંબંધીઓથી સંબંધો તૂંકી જશે. આવા તૂટેલા સંબંધોની પીડા તમારા હણ્યને જીવન પર કોરી ખાશે. તેથી વાણી, વર્તન તથા વ્યવહારમાં વિવેક તથા મીઠાશ રાખો. ગમ ખાતા શીખો. પરિવારનાં લોકો સાથે સંપર્થી રહો.

ઈશ્વરે તમોને તંદુરસ્તી આપી છે. જગતમાં હેલન કેલર, સ્ટેફન હોકિન્સ જેવા ઘણા હુભર્ગી લોકો હતા અને છે જેઓ અંધે છે અને અસાધ્ય રોગથી પીડાય છે. અંધ છે, હાલી-ચાલી શકતા નથી. આવા લોકોએ પણ અસાધારણ સફળતા મેળવેલી. તેઓના હોંસલા બુલંદ હતા. સુખેથી જીવેલા તથા કયારેય પોતાના દુઃખની ફરિયાદ નહોંતી કરી. જીવન જેવું છે તેવું તેઓએ સ્વીકારેલું. જ્યારે આપણે શારીરિક તથા માનસિક રીતે તંદુરસ્ત હોવા છતાં વાતવાતમાં શા માટે દુઃખી થઈએ છીએ?

સુખી કે ખુશ હોવાનો સરળ રસ્તો એ છે કે જે છે તેને માણ્ણો. નાની નાની વાતે સુખી થતાં લોકોની દોસ્તી માણ્ણો. આવા લોકો તેઓની સકારાત્મક ઉર્જથી તમોને ભરી દેશે. જીવન પ્રત્યેનો નકારાત્મક અભિગમ છોડો. મજામાં હશો તો જ સુખી રહેશો. માણસે ખુદ સુખી રહેતાં શીખવું પડે છે. આપણા વિચારો, માન્યતા અને પૂર્વગ્રહો આપણાને સુખી કે દુઃખી કરે છે. તેથી જિંદગીને રડતાં રડતાં નહીં પણ હસતા હસતા જવો. સ્વભાવ સુધારો. ભૂતકાળની પીડાને યાદ ન કરો. ભવિષ્યની નાહકની ચિંતા છોડો. કપટી બનવાને બદલે બાળકો જેવા નિખાલસ બનો. સુખી થવા માટે સમય હજુ પણ તમારા હાથમાં છે. તો ઉઠો અને પ્રસન્નતા તથા પૂરા આત્મવિશ્વાસ સાથે આજથી જ જીવનને ભરપૂર માણવાનો દઢ નિશ્ચય કરો.

“સિદ્ધી વિનાયક”, પ્લોટ નં. ૪૫/ની,
નારાજ નગર, શેરી નં.-૧, ઘોળકિયા સ્ક્રૂલ સામે,
યુનિવર્સિટી રોડ, ગાયકાડ. • મો. ૮૮૦૪૦ ૮૮૭૨૭

LIST OF EMERGENCY HELPLINE NUMBERS ALL OVER IN INDIA

Helpline No.	DEPARTMENT
100	Police
101	Fire
102	Ambulance
103	Traffic Police
104	State Level Helpline for Health
108	Disaster Management / Medical Helpline
112	All in one Emergency Number (General Emergency Department of Telecommunications (DoT))
131	Indian Railway General Enquiry
139	Railway Enquiry
181	Domestic abuse and sexual violence - Women's Helpline
197	Directory enquiry service
198	Telephone Complaint Booking
1031	Anti Corruption Helpline
1033	Emergency Relief Centre on National Highways
1066	Anti-poison
1071	Air Accident
1072	Train Accident
1073	Road Accident / Traffic Help Line
1090	Anti terror Helpline / Alert All India
1091	Women Helpline in Distress
1092	Earthquake Help line Service
1096	Natural Disaster Control Room
1097	AIDS Helpline
1098	Child Abuse Hotline
1099	Central Accident and Trauma Services
1551	Kisan Call Center
1906	LPG Emergency helpline Number
1910	Blood Bank Information
1919	Eye Donation / Eye Bank Information service
1947	Aadhar Card UIDAI (Unique Identification Authority of India)
1950	Election Commission of India
1800 11 4000	National Consumer Helpline



ચિંતન સમજની સુસંગતતા અને વ્યક્તિગત વિચારોની અંગતતા

ચિંતન



અશોક સરિયા

સમજ સૌની સરખી નથી હોતી. જેમ ચહેરા સૌના સરખા નથી હોતા. એક જ હાથની બધી આંગળીઓ સરખી નથી હોતી, એમ એક જ પરિવારના સૌ સભ્યોની સમજ પણ સરખી ન હોય એ સ્વાભાવિક છે. દરેકની પોતપોતાની અલગ વિચારસરણી હોય છે. પોતાનો અંગત અભિપ્રાય હોય છે. માણસની મતિ અનુસાર તેનું મૂલ્યાંકન ભિન્ન હોવાનું જ. દરેક વ્યક્તિ મન અને બુદ્ધિ અનુસાર તે પોતાની અલગ છબી ધરાવે છે. ભાગ્યે જ કોઈ બે વ્યક્તિઓના વિચારો એકબીજાથી મળતા હોય અને એ પણ તમામ વિચારો મળતા હોય, એવું તો બહુ જૂજ જ જોવા મળે.

દરેક વ્યક્તિની પોતીકી સમજ તેના પોતાના માટે ખૂબ જ અગત્યતા ધરાવતી હોય છે. એ તેની સાથે સંકળાયેલી દરેક બાબતને પોતાની સમજ અનુસાર તેનું મૂલ્યાંકન કરતો હોય છે. કોઈ એક વ્યક્તિની સમજ કોઈ બીજા વ્યક્તિ માટે તે અસમજ પણ હોઈ શકે અને કોઈ અન્ય વ્યક્તિની આણસમજ કોઈ ગીજા વ્યક્તિ માટે સમજદારીભરી પણ હોઈ શકે.

સમજવાન વ્યક્તિગત વિચારોની સાર્વત્રિકતાના કારણે સમજફેર થાય છે. ઘણીવાર વ્યક્તિ પોતાની સમજ અનુસાર અન્ય વ્યક્તિઓનું મૂલ્યાંકન કરે છે. પરંતુ એ ભૂલાઈ જાય છે કે સામેની વ્યક્તિની પણ કોઈ વ્યક્તિગત સમજ હોય છે. આ બંને વ્યક્તિઓની સમજ એકબીજા માટે સુસંગત ન પણ હોય. કોઈ એકનો સુવિચાર બીજાને કુવિચાર પણ લાગે. જન સમૃદ્ધાયનો દરેક વ્યક્તિ પોતપોતાની સમજ લઈને ફરે છે ત્યારે દરેકની સમજ સરખી હોય એ અશક્ય જેવું છે. હા, લોકો એકબીજાના વિચારોને સમજી, તે અનુસાર તેને સુસંગત થવા પ્રયાસ કરી શકે છે. કોઈની સમજને ચકાસીને પોતાની સમજને વિકસાવી અને વિસ્તારી શકે છે. પરંતુ આ માટે પોતાની સમજની સ્થિતિને અન્ય માટે સુસંગત બનાવવા માટે તૈયારી દાખવવાની પણ એક આગવી સમજ કેળવવી પડે છે.

સમજફેર એ એક એવું વિષયક છે કે તેમાં સારામાં સારા સંબંધોને વેરવિભેર કરી મૂકવાની વિસ્ફોટક તાકાત છે અને સમજફેર માટે ફેરસમજ કરવાની સમજણ કેળવવા કોઈ વિચારસુદ્ધાં પણ નથી કરતું અને ક્ષણભરમાં લાખનો સંબંધ ખાકનો બનીને રહી જાય છે.

જ્યારે પણ કોઈ સમજફેર જેવી ઘટના ઘટે ત્યારે દરેક વ્યક્તિને એવી સમજણ કેળવવી જોઈએ કે આપણી જેટલી સમજણ છે એવી જ સામેની વ્યક્તિની પણ અંગત કોઈ સમજણ હશે. આપણો એની સમજણ અને આપણી સમજણ — બંનેને એકબીજાની સાથે સાંકળીને તેમાંથી સારી બાબતને બહાર લાવી, તે અનુસાર વર્તવું જોઈએ. આપણો આપણી પોતાની સમજણને સર્વસિધ્ય માનીને ચાલીએ તો સામેની વ્યક્તિ પણ એવું જ કરશે અને એનો કોઈ અંત નહીં આવે. આમાં યોગ્ય તો એ જ રહે કે દરેક વ્યક્તિ પોતાની સમજને એકબીજા સમકારાખીને તેમાંથી સર્વમાન્ય સમજનો સ્વીકાર કરવો. જ્યારે પણ સમજફેરથી કોઈ અયોગ્ય ઘટના બને ત્યારે એ વાતનું ધ્યાન રાખવું કે એ તેની પોતાની અંગત સમજ છે અને એની સમજણની સાથે આપણો સમજણપૂર્વકનું વર્તન કરીએ, નહીં કે દલીલો કરીને એની સમજણને નકારીને આપણી સમજણને જ પ્રાધાન્ય આપવા માટે આગ્રહ કરીએ. આવી સ્થિતિમાં સામેની વ્યક્તિની સમજણનો સ્વીકાર જ મહત્વનો છે. એટલે એમ નહીં કે આપણી સમજણ ખોટી છે પરંતુ બંનેની સમજણમાં સુસંગતતા નથી.

આવા વણઉકેલ્યા કોયડાઓમાં કોઈની સમજણ સાચી ને કોઈની સમજણ ખોટી એવું નહીં પરંતુ બંનેની પોતપોતાની સમજણ હોય છે. જે બંનેની સમજણ અલગ અલગ દટ્ટિકોણ અને પોતાના વ્યક્તિગત વિચારો ધરાવતી હોય છે. આમ તો તમામની સમજણ વ્યક્તિગત રીતે પોતાના માટે સાચી જ હોવાની, પરંતુ કોઈ અન્ય સાથે સાપેક્ષમાં તેમાં થોડો ધણો ઉતાર ચાવ હોઈ શકે છે. એનો મતલબ એ ન કરવો જોઈએ કે કોઈક સમજુ છે અને કોઈક આણસમજુ. પરંતુ એનો એક માત્ર અર્થ એ જ થાય કે બંનેના વિચારોમાં સુસંગતતા નથી. બસ, આનાથી વિશેષ કંઈ નહીં. આવા વખતે એ ડાહાપણભર્યું રહે છે કે બંને એકબીજાની સમજણ એકબીજા સાથે જોઈને બંનેની સમજમાંથી સુસંગતતાને ખોળી કાઢી, તેનો યોગ્ય ઉપાય કરવો.

મંપદક - "ગ્રામસ્ત્ર"
ફિલ્મેન ઓગ્રોઓન્ઝિનિયસ,
પાલ નં. સી-૧૩૧-૨૬૮/એ, ફેર-૨,
આજુ શ્રી.આઇ.ડી.સી. મેન્ન રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૩.
મો. ૯૮૦૪૮ ૯૦૪૭૯



ચિંતન

જીવનની પાસબુક



ભરત અંજારિયા

આપણે બેંકમાં ખાતું ધરાવતા હોઈએ છીએ ત્યારે બેંક આપણને ખાતાની પાસબુક આપે છે. આ પાસબુકમાં આપણા વહીવટ - જમા-ઉધાર તથા જમા રાશિની વિગતો હોય છે. જીવનની પાસબુકનું પણ કંઈક આવું જ છે. આપણા જીવનમાં પણ આપણે આપણા દોષ, રોષ, ગુસ્સો, લોભ કે મોહને બાદ કરવા જોઈએ અને આપણા સંસ્કાર, શીલ, ઉદારતા, સાદગી, વાત્સલ્ય તથા મનોનિગ્રહનો ઉમેરો કરવો જોઈએ. તો જ્યારે જીવન નિઃશેષ કે નામશેષ થાય ત્યારે શેષમાં કીર્તિ, ઘ્યાતિ, માન-સન્માન રહે.

આ પાસબુક જેવું જ જીવનની કિતાબનું પણ છે. જીવનના લેખા-જોખા તથા સત્સંગરૂપી બચત તથા માનરૂપી શેષ આપણને કામ આવે છે. સંસ્કારોની બચત હશે તો જીવનમાં પ્રેમનો ગુણાકાર અને કરુણાનો સરવાળો થતો રહેશે તે સત્ય છે.

બેંકના એ.ટી.એમ.માં ચોવીસ કલાકમાંથી ગમે ત્યારે પાસબુકમાં એન્ટ્રી પાડવા જઈ શકાય છે. જીવનના ચોવીસ કલાકનો જો આપણે હિસાબ માંડીએ તો કેટલાક કલાક નામ સ્મરણ, જપ કે પૂજામાં અને સત્સંગમાં વિતાવીએ છીએ? ઉદ્પદિવસમાંથી ગમે ત્યારે વડો રે ગોવાળિયો આવી જવાનો છે. માટે અત્યારથી જ આપણે આપણી મૂડી વધારવાના પ્રયાસો કરીશું તો મુક્તિનું બ્યાજ જરૂર મળશે. ઈશ્વર ભક્તિની મૂડી વધારીશું તો જીવન ઘન્ય થએ શકશે. ભક્તિની શક્તિ જ મુક્તિના દ્વાર ખોલી શકે છે.

બેંકની પાસબુક ખોવાઈ જાય, ફાટી જાય કે ચોરાઈ જાય તો બેંકમાં અરજી કર્યથી નવી કે કુલ્લિકેટ મળી શકે છે. પરંતુ જો જીવનની પાસબુક ખોવાઈ જાય તો બધું વ્યર્થ છે. જીવનની પાસબુક માત્ર નામ સ્મરણમાં જ ખોવાવી જોઈએ કે નામ સ્મરણમાં રત રહેવું જોઈએ. જીવન નિઃશેષ થાય પછી જ નવજીવન મળે છે. જીવનમાં કેટલું કમાણા તેનો સરવાળો માંડીએ તો ખબર પડે કે આપણે નફામાં છીએ કે નુકસાનમાં?

બેંકની પાસબુકમાં નામ, સરનામું, ખાતા નંબર આપેલા હોય છે. આપણે આપણા જીવનમાં નામ રોશન થાય તે માટે શું કરીએ છીએ? આપણું સરનામું આપણા જીવન સુધી જ રહે છે. બેંક પાસબુકમાં હિસાબની વિગતો જોવા મળે છે પરંતુ આપણા જીવનનો હિસાબ શું કહે છે તે વિચારતા નથી. અત્યાર સુધી શું કર્યું? કેવું કર્યું? કોના માટે કર્યું? તે

જાણવાની પણ ખાસ જરૂર છે તેવું નથી લાગતું? જીવનના વ્યવહારો તથા વહીવટ સંતોષકારક હશે તો ઉપરવાળાના ઓડિટિયાં કોઈ કોમેન્ટ નહીં આવે.

બેંક પાસબુકમાં જો કોઈ ભૂલ દેખાય તો તરત બેંકનું ધ્યાન દોરીએ છીએ. પણ આપણી જીવનરૂપી પાસબુકમાં આપણને જ આપણા દોષ કે ભૂલ દેખાતા નથી હોતા અને તે સુધારવાના પ્રયાસો પણ આપણે કરતા નથી. આપણી ભૂલ માટે અન્યને દોષિત ઢરાવીએ છીએ. જીવનની ભૂલો સુધારવામાં આપણને જ ફાયદો છે. ઉપર રહેલા ચિત્રગુમના ચોપડામાં આપણા જીવનના હિસાબો અંકિત થયા હશે, જે ચિત્રગુમને આપણા સ્વર્ગ-નર્કનો નિર્ણય લેવામાં મદદરૂપ થશે. આપણા સદગુણ, શીલ, સદ્વૃત્તિ, સત્સંગ, સ્વભાવ, સદ્વાંયન થકી જ આપણા જીવનને ઊર્ધ્વગતિ મળે છે. જીવનના ચોપડા ચોખ્ખા હશે તો સદ્ગતિનો માર્ગ મોકલો થશે. આવો, આપણે આપણા અમૂલ્ય જીવનનું પાકું સરવૈયું બનાવીએ જેથી જીવન સફળ થઈ જાય.

'આસોપાતવ', ઇન્કમ્ટેક્સ સોસાયટી,
શૈયા રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૭. • મો. ૯૮૨૬૪ ૧૩૮૫૪



શું તમે જાણો છો ? જનરેશન ગેપ શું છે?

પિતા 20 મિનિટ ચાલીને

20 રૂપિયા બચાવવા માંગો અને

દીકરો 20 રૂપિયા ખર્ચને

20 મિનિટ બચાવવા માંગો છે...!!

આશ્ર્યજનક છે, પરંતુ બંને સાચા છે !



સંસાર

માનસ, I am Sorry



એમ. ડી. સોલંકી

શહેરની જાણીતી ફર્મમાં ફરજ બજાવતા કુંદનભાઈની મોટી દીકરી કવિતાએ ગયા વરસે જ ગ્રેજ્યુઅશન પૂરું કર્યું હતું. નાનો દીકરો કૃષાલ બાર સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

કવિતાના ગ્રેજ્યુઅશન થયા પછી ઘર-કુટુંબ અને સમાજમાં એના સગપણ અંગેની વાત ચર્ચાવા લાગી હતી. કુંદનભાઈ અને એમના પત્ની કલ્પનાબહેને પણ એમના સગા-સંબંધીઓના કાનમાં કવિતા માટે યોગ્ય મુરતિયાની તપાસ કરતા રહેવાની વાત કહી રાખી હતી.

સારું ભાજાતર અને સુંદર દેખાવવાળી કવિતા માટે સમાજમાંથી કેટલાય માંગા આવતા હતા. ચારેક વખત તો છોકરા-છોકરીની મુલાકાતો પણ ગોઠવાયેલી. આમ છતાં ક્યાંય સગપણની વાત નક્કી નહોતી થઈ.

કુંદનભાઈના બનેવી હસમુખલાલ આરોગ્ય ખાતામાં નોકરી કરતા હતા. તેમના કાને એક વાત આવ્યા પછી એમણે એ બાબતની પોતાની રીતે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે છોકરાના પણાનું નામ મનહરભાઈ છે. એમના દીકરા માનસને ચારેક મહિના પહેલાં જિલ્લા મથકે મેડિકલ ઓફિસર તરીકેની સરકારી નોકરી મળી છે. સ્વભાવે શાંત, સરળ અને નિખાલસ સ્વભાવના મનહરભાઈનું માનસ એકમાત્ર સંતાન છે. એમનું કુટુંબ આર્થિક રીતે સધ્ય છે અને શહેરની સોસાયટીમાં એમનું પોતાનું બે માળનું પાકું મકાન છે.

આટલી માહિતી મેળવ્યા પછી હસમુખલાલે એમના સાણા કુંદનભાઈ અને કલ્પનાબહેનને વાત કરી તો બંને પતિ-પત્ની રાજી રાજી થઈ ગયા. જ્યાં પૂછવા જેવું હતું ત્યાં પૂછપરછ કર્યા બાદ કવિતા-માનસની વાત ચલાવવામાં આવી. બંને પક્ષોએ પોતપોતાની રીતે સામાન્ય જાણકારી મેળવી લીધા પછી કવિતાના ધેર માનસ તથા તેના મમ્મી-પણા અને સંબંધીઓ સાથે મુલાકાત ગોઠવાઈ. પરસ્પર એકબીજાનો પરિચય મેળવ્યા પછી કવિતા-માનસ એમની રીતે અલગ મળ્યા. એકમેકનો અભ્યાસ, રસ-રૂચિ, પસંદ-નાપસંદ વગેરે બાબતોની ચર્ચા-વિચારણા બાદ નાજુક - નમણી કવિતા અને સ્માર્ટ માનસે એકબીજાને પસંદ કર્યા. વડીલોએ કવિતા-માનસના સગપણ માટે સંમતિ દર્શાવી.

નક્કી કરેલી તારીખે માનસના સગા-સંબંધીઓ કુંદનભાઈના

ધેર આવ્યા. કન્યા પક્ષના મહેમાનો અને સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં આનંદબેર કવિતા-માનસનું સગપણ કરવામાં આવ્યું. બંને પક્ષના વડીલો તરફથી ચર્ચા વિચારણા કરીને દિવાળી પછી લગ્ન ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું.

બંને ભાવિ પતિ-પત્ની માનસ અને કવિતા એકબજાની પસંદગી અને સગપણથી ખૂબ જ ખુશ હતા. બે ચુવાન હૈયાઓ માટે સગપણ પછીનો આ સમયગાળો રોમાંચિત અને ગુલાની શમણાઓની મોસમનો હતો. કવિતા અને માનસ મોબાઈલમાંથી ફોન કરીને એકબીજાને જીવંત સંપર્કમાં રહીને હૈયાની વાતને હોઠ પર લાવીને ભાવિ જીવનની રંગીન ચોપાટ ગોઠવતા હતા. એટલું જ નહીં, વહેલી તકે દિવાળી આવી જાય એવી મનોમન મીઠી કલ્પનાય કરી લેતા હતા.

ભાવિ જીવનની કેડીએ ડગ માંડવાની ઉત્સુકતામાં એક દિવસ કવિતાએ ફોન પર માનસને કહ્યું, ‘માનસ, આપણા લગ્ન થાય પછી આપણે એક તણખલું ભેગું કરીને આપણો પોતાનો માળો બાંધીશું. એ માળામાં ફક્ત ને ફક્ત આપણે બંને જ રહીશું. બસ એક તમે અને બીજી હું! બીજા કોઈ નહીં. આપણે આપણી રીતે અલગ રહીને સ્વતંત્ર રીતે પ્રસંગ દાંપત્યજીવન જીવીશું. જેનો આનંદ કંઈક અલગ પ્રકારનો જ હશે. કવિતાની આવી વાતો ક્યારેક માનસ માટે મુંજુવાળાભરી બની રહેતી. એ મનોમન વિચારતો – ‘લગ્ન પછી કવિતા અમારા બંનેની જ એકલાં રહેવાની વાત કરે છે એ સમજાતું નથી. તો પછી મારા મમ્મી-પણાનું શું? એમણે જન્મથી માંડીને આજ સુધી મારો ઉછેર કર્યો, મને સારું શિક્ષણ અપાવ્યું. જેના થકી મને સારી સરકારી નોકરી મળી. આ બધું શું કવિતા સાથેના લગ્ન પછી મારે ભૂલી જવાનું? પુત્ર તરીકે મારી પણ મારા મમ્મી-પણા પ્રત્યે કોઈ ફરજ તો હોય ને? એમને પણ એમની પુત્રવધુ માટે એમના દિલમાં કંઈક આશા - અરમાનો તો હોય જ ને? ના, ના, કવિતા ભવે ગમે તે કહે, પણ એમ કંઈ એની વાત માનીને મારાથી મમ્મી-પણાને મૂકીને અલગ તો રહેવાય જ નહીં. એ બંને તો અમારી સાથે જ રહેશે.’

માનસ આવી બાબતે કવિતાને સમજાવવાનો પ્રયત્ન કરતો ત્યારે કવિતા કહેતી - ‘જુઓ માનસ, હવે તો સમય ઘણો બદલાઈ ગયો છે. આજે આપણે સૌ એકવીસમી સદીમાં જીવીએ

છીએ. એટલે હવે એવું ફરજિયાત નથી કે લગ્ન થયા પછી આપણે તમારા મમ્મી-પપ્પા સાથે જ રહેવું પડે! આવા જૂનવાણી વિચારોને આપણે છોડી દેવા જોઈએ. આપણે બંને અમનાથી એકલા અલગ રહીએ તો પછી આપણે પણ આપણી રીતે સ્વતંત્ર જીવન જીવી શકીએ. અને હા, એમને કોઈ દિવસ આર્થિક મુશ્કેલી પડશે તો આપણે એમને થાય એટલી મદદ કરીશું અને કદાચ તમને તમારા મમ્મી-પપ્પાને મળવાની ઈચ્છા થાય તો વળી એકાદ આંટો તેમને ત્યાં મારી આવીશું! પછી તો તમને સંતોષ થશે ને?’

કવિતાની આવી બાલીશ માનસિકતાથી માનસ મનોમન મુઝાતો હતો. કવિતા લગ્ન થયા પહેલાં જ આવું વિચારે છે તો એની સાથે લગ્ન થઈ ગયા પછી કેવી પરિસ્થિતિનું નિમિષ થશે?

આ સમય દરમિયાન રાજ્યમાં કોરોનાની મહામારી શરૂ થઈ ગઈ હતી. મેડિકલ ઓફિસર તરીકે માનસની કામગીરી અને જવાબદારી ખૂબ જ વધી ગઈ હતી. સમગ્ર મેડિકલ સ્ટાફને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ખેડેપગે હાજર રહેવું પડતું હતું. આવા સમયે કવિતાનો ફોન આવતો ત્યારે મેડિકલ કામગીરીમાં અત્યંત વ્યસ્ત હોવાને કારણે માનસ ફોન રિસીવ કરી શકતો નહોતો. ફરજ દરમિયાન ક્યારેક થોડી મિનિટોની નવરાશ મળી જતી ત્યારે માનસ, કવિતાને ફોન કરી લેતો. આવા સમયે પણ કવિતા ફરિયાદના સૂરમાં કહેતી, ‘માનસ, તમે મારો ફોન કેમ ઉપાડતા નથી? ઘણીવાર તો તમારો ફોન સતત વ્યસ્ત આવે છે, તો ક્યારેક એ સ્વિચ ઓફ હોય છે.’

જવાબમાં માનસ કહેતો : ‘કવિતા, અત્યારે સમગ્ર રાજ્યમાં ફેલાયેલી કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં અમારું આખુંય આરોગ્ય ખાતું દિવસ-રાત જોયા વગર, નોકરીના નિયત સમયગાળાને બાજુ પર મૂકીને જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં લાગી ગયું છે. નાના કર્મચારીથી માંડીને છેક સચિવ કક્ષાના અધિકારીશ્રીઓ કોરોનાને મહાત કરવાના મિશનમાં લાગી ગયા છે. આવી પરિસ્થિતિમાં બનવાજોગ છે કે મારાથી તારો ફોન રિસીવ નહીં થઈ શક્યો હોય. અમારે તો ગમે ત્યારે કોરોના સંબંધી ફોન આવે ત્યારે બીજું બધુંય ભૂલીને ફરજ પર હાજર થઈ જવું પડે છે. મારા સહિત મારા સ્ટાફને જમવાનું તો ઠીક, ચા-નાસ્તો કરવાનો સમય પણ ઘણીવાર મળતો નથી. કવિતા, તું અત્યારની વિષમ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરજો.’

માનસની આવી અને આટલી સમજાવટ પછી પણ કોણ જાણે કેમ કવિતાની એક યા બીજા પ્રકારની ફરિયાદ ચાલુ જ રહી.

રાજ્યમાં કોરોનાની મહામારી હવે અંતિમ પરાકાણાએ પહોંચી ગઈ હતી. સમગ્ર સરકારી તંત્ર અને સૈચિંદ્ર સેવાભાવી સંસ્થાઓ રાજ્યમાંથી કોરોનાને નેસ્તનાબૂદ કરવાના ભગીરથ કાર્યમાં જોતરાઈ ગયા હતા. હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા,

ઓફિસજનની બોટલ, જરૂરી દવા - ઈજેક્શનોની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સ અને કોરોનાને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિઓના અંતિમ સંસ્કારની કઠિન કામગીરીના કારણે સૌના મન ઉચાટભર્યા બની ગયા હતા. માનસને પોતાના મમ્મી-પપ્પાને ફોન કરવાનો કે અમના આવેલા ફોન રિસીવ કરવાનો સમય જ નહોતો મળતો. ઘણીવાર તો એને બે-ગ્રાણ દિવસ હોસ્પિટલમાં જ રોકાઈ જવું પડતું હતું. કવિતા આવી બધી વિકટ પરિસ્થિતિથી અજાણ હોય અથવા તો એની ગંભીરતાની એને સમજ ના હોય, એમ એ તો મોબાઇલથી જ્યારે ને ત્યારે માનસને ફોન કર્યા કરતી. આવા સંજોગોમાં એકવાર કવિતાનો ફોન માનસને બદલે આરોગ્ય ખાતાના કોઈ મહિલા કર્મચારીએ રિસીવ કરતા કહેલું, ‘મેડમ, અમારા માનસ સર અત્યારે આરોગ્યમંત્રીશ્રી સાથે કોરોના અંગેની એક અગત્યની મીટિંગમાં સામેલ હોવાથી તમે થોડા સમય પછી ફોન કરજો.’ આવું બે-ગ્રાણ વખત બન્યું એટલે કવિતાનો અહીં મહત્વ જ નહીં ને? માનસને મેં કરેલો ફોન એમની ઓફિસની કોઈ મહિલા કર્મચારી રિસીવ કરે એ કેવું? એના મનમાં માનસ પ્રત્યે શંકા જન્મી અને વહેમના વાદળો છવાયા! કદાચ માનસ અને ફોન રિસીવ કરનારી પેલી મહિલા કર્મચારી વચ્ચે કોઈ છૂપા સંબંધ તો નહીં હોય ને? આવા ટૂંક વિચારોએ કવિતાના મનને ડહોળી નાખ્યું. ગુસ્સાના આવેગમાં વિવેકભાન ભૂલીને કવિતાએ એના હૈયામાં ચાલતાં ધમસાણાની વાત હોઠ પર લાવીને માનસના ચારિત્ર્ય પર ખોટું દોષારોપણ કરી દીધું!

ફોન દ્વારા કવિતાએ કરેલા મનઘંઠ આશેપો અને એના અવ્યવહારું વર્તનથી માનસની માનસિક સ્થિતિ થોડી અપસેટ થઈ ગઈ. એકબાજુ કોરોનાની અવિરત કપરી કામગીરી અને બીજી બાજુ કવિતાના આવા અવળા આશેપો! આવી વિકટ પરિસ્થિતિમાં હવે શું કરવું? એવી દ્વિધામાં માનસ અટવાઈ પડ્યો. ખૂબ વિચાર કર્યા પછી મનમાં ચાલતી ગડમથલની વાત એણે એના મમ્મી-પપ્પાને કહી. કવિતા સાથેના સગપણથી માંડીને આજ સુધીની એની વર્તણૂકની વાત સાંભળીને મનહરભાઈ અને માલતીબેન પણ ગંભીર બની ગયા. હજુ તો કવિતા સાથે માનસનું સગપણ જ થયું છે તોય કવિતા આવી બેહૂદી હરકતો કરે છે તો લગ્ન થઈ ગયા પછી એની વર્તણૂક કેવી હશે? બે-ગ્રાણ દિવસ આ બાબતે વિચાર્યા પછી મનહરભાઈએ કવિતાના ફોઈ-કુઝાને એમના ઘેર બોલાવ્યા. કવિતાની આજ સુધીની અવ્યવહારું હરકતો વિશે વાત કરતા કહ્યું : ‘આવી ગંભીર પરિસ્થિતિમાં તો અમારે કવિતા-માનસના સગપણ બાબતે ફેર વિચારણા કરવી જ પડે!’

કવિતાના ફોઈ-કુઝા પણ આવી વાત સાંભળીને ડ્વાઈ ગયા. કવિતાથી આવી છોકરમત થાય જ નહીં. એમણે તાબડતોબ

રૂબરૂ આવીને કુંદનભાઈ તથા કલ્પનાબહેનને કવિતાએ કરેલ હરકતોથી વાકેફ કર્યા. એ બંને પણ હસમુખલાલની વાત સાંભળી અવાજ બની ગયા. એમણે કવિતાને સામે બેસાડીને ધીરજપૂર્વક પૂછપરછ કરી તો એમને પણ કવિતાનું માનસ પ્રત્યેનું વલણ અવ્યવહારુ અને વિવેક વગરનું લાગ્યું. આ વખતે હાજર રહેલા એના કુઝા હસમુખલાલે કહ્યું, “કવિતા, આપણા અનુભવી વડીલ કહી ગયા છે કે, ‘સોનાની કટારી ભેટમાં રખાય, અને કાંઈ પેટમાં ના મરાય.’ બસ, એવી જ રીતે આજે ઘર ઘરની અનિવાર્ય જરૂરિયાત બની ગયેલા મોબાઇલનો ઉપયોગ હંમેશાં સમજુ વિચારીને વિવેકપૂર્ણ રીતે જ કરવો જેદયો. સમજ્યા વગર જ એનો આડેઠ ઉપયોગ કરવાથી સામેની વ્યક્તિનું દિલ દુભાય છે અને સંબંધમાં પાર વગરની ગુંચો પેદા થાય છે. મોબાઇલનો યોગ્ય ઉપયોગ થાય તો એ વરદાનરૂપ છે. એનો વિવેક વગરનો ઉપયોગ અભિશાપ બની જાય છે.”

સમાજમાં પોતાની દીકરી માટે સરકારી નોકરી કરતો છોકરો, સારું ઘર અને આવા વ્યવહારુ માણસો દીવો લઈને શોધવા જઈશું તો પણ નહીં મળે એવું વિચારીને કુંદનભાઈએ કોઈપણ ઉપાયે કવિતાનું માનસ સાથેનું સગપણ તૂટું બચાવવા એમના બનેવી હસમુખલાલને વિનંતી કરી.

બીજા દિવસે કવિતાના મમ્મી-પપ્પા અને ફોઈ-હુએ માનસના ઘેર ગયા. સામાન્ય વાતચીત કર્યા પછી માનસના પપ્પાએ કવિતાની અધિકૃત હરકતોની વાત કરતા કહ્યું, ‘હજુ તો કવિતાનું માનસ સાથે સગપણ જ થયું છે. લગ્ન કરવાનું તો બાકી છે. ત્યારે કવિતાનું આવું બેહુદુ વર્તન ચલાવી ના લેવાય. જેથી ભવિષ્યમાં બીજા કોઈ પ્રશ્નો ઊભા ના થાય.’

કવિતાના મમ્મી-પપ્પાએ પોતાની દીકરીએ કરેલી ખોટી વર્તણૂક – ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું, ‘કવિતાએ અત્યાર સુધી માનસ સાથે જે કાંઈ હરકતો કરી, એ એની ગેરસમજ હતી. માનસ પ્રત્યેની વધારે પડતી લાગણીના આવેશમાં સમજણિકર થવાના કારણે જ આવું બન્યું હશે. હવે પછી આવું ક્યારેય નહીં બને. આમ તો કવિતા લાગણીશીલ અને ઘરરખ્યુ છે. તમે ઉદાર બનીને એને માફ કરીને આ સગપણનો સંબંધ ચાલુ રાખશો તો ભવિષ્યમાં એ ઉત્તમ પત્ની અને વ્યવહારુ ગૃહિણી સાબિત થશો. કવિતા-માનસના વણસવા આવેલા સગપણના સંબંધ બાબતે આપણે સૌ શાંત ચિંતે વિચારીશું તો આ ગુંચવાયેલી બાબતનો જરૂર સારો ઉકેલ મળી રહેશે.’

કવિતાના પપ્પા કુંદનભાઈએ કરેલી આવી વાત માનસના મમ્મી-પપ્પાને વ્યવહારુ લાગ્યી. એમણે ઉદાર બનીને કવિતાની તમામ હરકતોને ભૂલી જઈને કવિતા-માનસના સગપણને ચાલુ રાખવા સંમતિ આપી. સૌઅં સાથે મળીને ગળ્યા મોં કર્યા. બધાના મનમાં રાજ્યો થયો. અને એ જ સમયે કવિતા-માનસના લગ્નની

તારીખ નક્કી કરવામાં આવી.

વળતે દિવસે રવિવાર હતો. કોરોનાની મહામારી હવે કાબૂમાં આવીજતાં ચા-નાસ્તો કર્યા પછી માનસ હળવા મુડમાં હતો. ત્યાં કવિતાનો ફોન આવ્યો. માનસે ફોન રિસીવ કર્યો. સામે કવિતા ગળગણ સાંદે કહેતી હતી, ‘માનસ, તમે સૌ મને માફ કરશો. સગપણથી માંડીને આજ સુધી આપણી વચ્ચે જે કંઈ બન્યું એમાં ભૂલ તો મારી પોતાની જ હતી. સાંપ્રત સમયમાં પરિસ્થિતિની પૂરેપૂરી ગંભીરતા અને તમારી ફરજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાને નજર અંદાજ કરી, તમારી ભાવનાઓને સમજ્યા વગર જ લાગણીના આવેશમાં આવીને મેં તમારી સામે મનઘડત વ્યવહાર – આશેપો કર્યા હતા. જેના કારણે તમારા સૌના દિલ દુભાયા હતા. એટલું જ નહીં, આપણા બંનેનું સગપણ લગભગ તૂટી જવાની ઘડી સુધી આવી ગયું હતું. પરંતુ આવા વિપરીત સંજોગોમાંય તમે અને મારા થનાર સાસુ-સસરાએ ઉદાર મન રાખીને મને તમારા ઘરમાં પુત્રવધૂ તરીકે સ્વીકારી છે એ તમારા સૌના મનની મોટાઈ છે. હું તમને સૌને ખાતરી આપું છું કે હવે પછી ભવિષ્યમાં ક્યારેય પણ મારા તરફથી કોઈ અજુગતી હરકત કરવામાં નહીં જ આવે. આપણા પરિવારમાં હું દૂધમાં સાકરની જેમ ભળી જઈશ. મમ્મી-પપ્પા અને આપણે સૌ એક જ છતમાં સાથે રહીશું. માનસ, I am Sorry.’

૩/૨૮, રાન્ડપ્રાન્ટ સોસાયટી, પુ. કલિક્ન્ડ,
દા. ઘોટકા, નિ. અમદાવાદ.
મો. ૯૦૯૯૯ ૪૧૨૪૦





અનુભૂતિ

સાચી સુખાનુભૂતિ



ડૉ. ભાવેશ જેતપરિયા

માણસ જે કંઈ ઉધામા કરે છે તેની તપાસ કરવામાં આવે તો આપણાને જાણવા મળશે કે તેની તમામ પ્રવૃત્તિ પાછળ સુખની ખોજ હોય છે. સુખ મેળવવા માટે સાધનો તરફ વળવાનું થાય છે. ભૌતિક સાધનોમાં સતત બદલાવ આવ્યા કરે છે. સ્કુટર, ફન્ટી, સ્કોડા, બી.એમ.ડબલ્યુ., મર્સિડીઝ અને રોલ્સ રોયસ – એ ઈચ્છા પૂર્ણ થાય એટલે એક નહીં અવિક વાહનની અપેક્ષા જાગે. એ પૂર્ણ કરવા ફરી દોડધામ. એવું જ ગામડાંમાંથી શહેરમાં અને મહાનગરના પોંશ એરિયામાં જવાની દોટનું છે. એવું જ જમીન સંપાદનમાં અને ઘરવખરીની વસ્તુઓની દોટમાં છે. એક પછી એક ચડિયાતી લોતિક સુવિધાઓ વધારવામાં આચયખ ખર્ચાઈ જાય છે. સુખદાયી સુવિધાઓથી પલવાન થવું તે પુરુષાર્થ મૂકવાની વાત નથી પણ જે મેળવીએ છીએ તેના અહેસાસ સંદર્ભે વિચારવાનું છે. જીવનની ઘટમાળમાં સુખ ઓછું અને દુઃખ વધારે છે. જીવન તેજ-છાયાનું પૂતળું છે. સુખ આપણી પ્રકૃતિ, પ્રવૃત્તિ અને પરિસ્થિતિ પર અવલંબે છે. સુખ સ્થાયી નથી. સુખ વર્તમાનની માણવાલાયક પળ છે. ભૂતકાળ કે ભવિષ્યકાળમાં સરી જતો માણસ વર્તમાનની પલપલ ગુમાવનારો કાયમ દુઃખ જ મળવે છે.

ભૌતિકતાના બદલાવ સાથે સંબંધોમાં બદલાવ આવ્યા કરે છે. ‘આપણા’ કહીએ એની ખોજ સતત ચાલુ જ રહે છે. એની સાથે સાથે સમયની ગતિ પણ ચાલતી રહે છે. સમય સાથે તાલમેલ કરવામાં શરીર, મન, બુદ્ધિ અને વિવેક અથડાય છે. ‘આપણા’ની ખોજ કરવામાં આપણા કહી શકાય એવા મળતા નથી. પહેલું સુખ તંદુરસ્તી છે. પડખા ઘસ્યા વિના નિરાંતે આવતી ઊંઘ એ મોટું સુખ છે. આખી જિંદગી હેરાન થાય અને છેલ્લે શરીર કામ ન આવે પછી ગાડી હોય પણ ડોક્ટર વોકિંગની સલાહ આપે. બગ્નીસ જાતનાં ભોજનની શક્યતા હોય પણ મોળી ભાજ અને રોટલો ખાય તો જ જીવી શકે એવા ઘણા દાખલા છે. ઘણાં ફાર્મ હાઉસમાં એના નોકરો જ જલસા કરે છે. સુખની ખોજ કરવામાં સારું સુખ મળતું નથી. અરે, અશાંતિના ઓથારના ભરડામાં ભરડાઈ જાય એ લટકામાં!

મેં એક વાર્તા વાંચેલી. એમાં કથા એવી આવે છે કે ગામડાંમાં સંપથી રહેતા સંયુક્ત પરિવારમાં એક છોકરો હોંશિયાર

અને ભાણ્યો. બીજો ઠોઠ, તે ન ભણી શક્યો. ભણેલાની પત્ની ભણેલી અને નોકરી કરે. ભણેલાના બે સંતાનો ઇંગ્લિશ સ્કૂલમાં ભાણ્યા. અભણના ચાર સંતાનોએ ગામની સ્કૂલમાં અભ્યાસ કર્યો. ભણેલો સગવડ વધારવા શેર બજરના સાઈડ બિઝનેસ તરફ વળ્યો. ગાડી અને મોટો બંગલો ખરીદ્યો. એના મોટા છોકરાને દસમા ધોરણમાં ટકા ઓછા આવ્યા. એને સાયન્સમાં કે કોમર્સમાં મોકલવો એ બાબતે પત્તિ-પત્ની વચ્ચે તનાવ વધતા પત્નીની જીદ્ધથી સાયન્સ રાખ્યું. છોકરો માંડ પાસ થયો. ફરી ડેનેશન દઈને મેડિકલમાં મોકલવા બાબતે તનાવ શરૂ થયો. એની અસર નાની છોકરીનાં પરિણામ પર થઈ. રોજનો કંકાસ સહન ન થતાં બેય છોકરા લઈને પત્નીએ ગાડી અને બંગલો સંભાળી લીધો. આ ભાઈ એકલો ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. ઘર તરફ નજર કરે છે પણ અંતર વધી ગયું છે. ફરી લગ્ન કરવાના હવાતિયા મારે છે. અભણ પાસે ગાડી બંગલો ન હોવાનું દુઃખ છે. બાળકોને ભણાવીને શહેરમાં આવવાની હોંશ છે. એ મેળવવા માટે હવાયિતા મારે છે.

જે છે એને ભોગવી લેવાને બદલે લાયકાતથી ઓછું છે તે મેળવવા પાછળ દોટ લગાવવી અથવા નથી તેનું દુઃખ અનુભવવું યોગ્ય નથી જ. સાચી સમજણ વિના યોગ્ય નિર્ણય ન થાય અને બધું મેળવેલું હોવા છિતાં અંતે દુઃખ મળે છે. સુખમાંથી દુઃખમાં અને દુઃખમાંથી સુખમાં પલતાતી સ્થિતિની વચ્ચે ખરી અનુભૂતિનો અહેસાસ થાય છે. અપેક્ષા અને સતત દોડધામમાં બીજું એવું ઘણું પસાર થઈ જતું હોય છે, જે મૂલ્યવાન હોય છે. એના પર આપણું વ્યાન જતું નથી. ખરેખર તો સુખ શોધતો માણસ કસ્તુરી મૃગ જેવો છે. એની પાસે જે છે એને બહાર શોધે છે.

નર્મદ કહે છે કે, ‘જેને જેમાં માન્યું તેમાં તેને સુખ.’ સાંસારીના સુખની વાત એવી છે. સાંસારિક સુખ ક્ષમિક અને અત્ય હોય છે. મીરાંબાઈ કહે છે, ‘સાંસારીનું સુખ એ તો જાંજવાના જળ જેવું.’ એમ પણ કહેવાયું કે, આનંદ સંત ફીર કર છે અને ફિકરની ફાકી કરે તે સંત. ‘સુખ’ અને ‘આનંદ’ બેય શબ્દો તપાસવા પડે. સુખ શરીર અનુભવે છે અને આનંદ (અનુસંધાન : જુહો પાના નં. - ૩૨ ઉપર)



વ્યક્તિ / સંસ્થા વિશેષ

માણસે જોખમો ઉઠાવતાં ન ડરવું જોઈએ

લોકપ્રિય લેખક એચ.એન. ગોલીબાર
(ભોલાભાઈ ગોલીબાર)ની રોમાંચક જીવન સફર



આશુ પટેલ

વિઘ્યાત સામાજિક 'ચંદન'ના તંત્રી-માલિક એચ.એન. ગોલીબાર એટલે કે હાજ મોહમ્મદ યુનુસ ગોલીબાર એટલે કે ભોલાભાઈ ગોલીબારની પ્રેરક અને રસપ્રદ જીવનસફર જ્ઞાણવા જેવી છે. ભોલાભાઈ લોકપ્રિય લેખક તો છે જ, પણ એક એવા માણસ છે, જે દરેક ઉમરની વ્યક્તિઓ સાથ સહજ રીતે મોકાળા મને હસ્તીને તેમની સાથે વાતો કરી શકે. તેમની વાતોમાં ક્યારેય ઊંખ ન જોવા મળે. ભોલાભાઈ સર્વમિત્ર છે, અજાતશરૂ છે. આવી વ્યક્તિઓ આજના સમયમાં ભાગ્યે જ જોવા મળતી હોય છે. ભોલાભાઈ વિશે આખું પુસ્તક લખી શકાય એમ છે, પણ આ લેખ થકી વાચકો સામે તેમની જીવનસફર ટૂંકમાં મૂકું છું.

ભોલાભાઈ જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે તેમને તેમના પિતા નૂર મોહમ્મદ ગોલીબારે 'ચકમ'ના પ્રેસમાં દૈનિક મજૂર તરીકે કામ પર રાખ્યા હતા. ભોલાભાઈ એ વખતે પ્રેસની સાડા ચાર હજાર ફૂટથી વધુ જગ્યા રોજ સાવરણીથી વાળતા. પ્રેસમાં ઘણી જગ્યાએ પાણી પીવાના ગોળા હતા, એ બધા ગોળા અને જ્લાસ માંજવાનું અને બીજા નાના-મોટાં કામ તેમને કરવા પડતા હતા. અને આખો દિવસ પ્રેસમાં કામ કર્યા પછી ભોલાભાઈ પ્રેસના એકાઉન્ટન્ટ પાસે જતા અને એકાઉન્ટન્ટ તેમને ચાર આના મજૂરી ચુક્કવતો હતો (ભોલાભાઈએ એક વખત કહું હતું કે આખો દિવસ મજૂરી કરીને મને ચાર આના મળતા હતા. પરંતુ મારા બા રોજ મને બિસ્સાખર્ય માટે પાંચ રૂપિયા આપતા હતા!) નૂર મોહમ્મદ ગોલીબારે નાના દીકરા ભોલાભાઈને બાઈન્ડિંગ, સ્ટેમ્પિંગ મશીન, કટિંગ, પાર્સલ પેકિંગ, બુકિંગ, કંપોઝ કરવાનું – એ બધા કામો શીખવી દીધાં હતાં. અને તેમને 'પ્રમોશન' મળ્યા પછી તેમનો પગાર આઈ આના થયો હતો. અને એ પછી તેમના પિતાએ તેમને તંત્રી વિભાગમાં પણ તાલીમ આપી હતી. એ વખતે ગેલીના પૂરુષ રીડિંગથી શરૂ કરીને



શ્રી ભોલાભાઈ ગોલીબાર

શ્રી ભોલાભાઈ ગોલીબારને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અફલક વિવિધ અંવોર્ડ્સ એનાયત થયા છે અને સામાજિક ક્ષેત્રની અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત થનાર જાગ્રત્તમાન વ્યક્તિ છે.

'ચકમ'નાં પાનાનાં પૂરુષ રીડિંગ, અનુવાદ અને નવલકથાનાં પ્રકરણો લખવા સુધીની જવાબદારી તેમને સૌંપાતી હતી.

ભોલાભાઈ ટીનેજર હતા ત્યારે ૧૯૬૬માં તેમનાં પિતા નૂર મોહમ્મદ ગોલીબારનું મૃત્યુ થયું હતું. એ પછી ભોલાભાઈના મોટાભાઈ છોટે ગોલીબારે 'ચકમ'નું સુકાન સંભાળી લીધું હતું. પરંતુ તેઓ પણ ૩૧ વર્ષની નાની ઉમરે મૃત્યુ પામ્યા.

૧૯૭૦ સુધીના એ પાંચ વર્ષ દરમિયાન ચકમ પરિવારની મહત્વની દસ વ્યક્તિઓ મૃત્યુ પામી અને 'ચકમ'ની સાથે આખા ગોલીબાર કુટુંબની જવાબદારી માત્ર ૧૮ વર્ષથી ભોલાભાઈ ઉપર આવી પડી હતી. ભોલાભાઈ એ વખતે કોલેજમાં અભ્યાસ કરતા હતા.

૧૯૭૧માં ભોલાભાઈએ 'ચકમ'નું સુકાન સંભાળ્યું. એ પછી તેમણે ૧૯૭૩માં એક અકલ્ય નિષ્ણય લીધો. તેમણે જાહેર કર્યું કે આજ પછી ચકમ સામયિકમાં એકપણ જાહેરખબર પ્રકાશિત નહીં થાય.

ભોલાભાઈએ એ વિશે વાત કરતાં એકવાર કહ્યું હતું કે મારી પાસે એ નિષ્ણય લેવા પાછળ ઘણાં મજબૂત કારણો હતા. મને લાગતું હતું કે મોટી મોટી કંપનીઓ લોકોને ગેરમાર્ગ દોરનારી છેતરામણી જાહેરખબરો આપીને ગ્રાહકોને છેતરે છે. એવી જાહેરાતો છાપીને પ્રકાશન સંસ્થાઓ પણ એ પાપમાં ભાગીદાર બને છે. તેમનો બીજો મુદ્રો એવો હતો કે, 'માત્ર પૈસા મળે, કમાણી થાય એ માટે જે જાહેરાતો જોઈને લોકો છળી ઉઠે એવી નિભત્સ જાહેરાતો પણ પૈસા માટે છાપવી પડતી હોય છે. એટલે મેં જાહેરાતો લેવાનું બંધ કરવાનું નક્કી કર્યું.' વળી, ભોલાભાઈને પત્રકારત્વના એક શિક્ષકે કહ્યું હતું કે જાહેરખબર વિના કોઈ પણ છાપાં કે સામયિકો ચાલી જ ન શકે. એટલે ભોલાભાઈએ એ પડકાર પણ ઝીલી લેવાનું નક્કી કર્યું હતું.

ભોલાભાઈએ જાહેરખબરો લેવાનું બંધ કર્યું એ પછી ઘણા લોકોએ ભોલાભાઈ અને 'ચક્રમ'ના નામનું હંડા પાણીએ સ્નાન કરી નાખ્યું હતું. તેમને એમ હતું કે હવે ભોલાભાઈ અને 'ચક્રમ' બંને ખતમ થઈ જશે. પરંતુ માત્ર ૨૧ વર્ષની ઉમરે એ આકરો અને અકલ્પનીય નિર્ણય લઈને ભોલાભાઈએ 'ચક્રમ'ની ગાડી ફરી પાટે ચડાવી દીધી. એ વખતે 'ચક્રમ' આમ પણ આર્થિક તકલીફો ભોગવી રહ્યું હતું.

ભોલાભાઈએ બીજું જોખમ 'ચક્રમ'નું નામ બદલવાનું ઉઠાવ્યું હતું. પિતા નૂર મહભૂમદ ગોલીબારના મૃત્યુ પછી ભોલાભાઈએ 'ચક્રમ'નું સુકાન તો સરસ રીતે સંભાળી લીધું હતું પરંતુ તેમને લાગતું હતું કે મારામાં પિતાજીએ રમૂજવૃત્તિ નથી. નૂર મહભૂમદ ગોલીબાર હયાત હતા ત્યાં સુધી 'ચક્રમ'ના દરેક પાનાં પર હાસ્યરસ માણવા મળતો હતો. 'ચક્રમ'ના નામ સાથે હાસ્યરસ જોડાઈ ગયો હતો. ભોલાભાઈ રમૂજના મુદ્દે પિતાના પેગડામાં પગ નાખી શકે એમ નહોતા. એમણે પોતાની એ મર્યાદા સ્વીકારી લીધી અને તેમણે 'ચક્રમ'માં મનોરંજનની સાથે માહિતી પીરસવાનું પણ શરૂ કરી દીધું હતું.

ભોલાભાઈએ 'ચક્રમ'માં મનોરંજનની સાથે માહિતી પીરસવાનું શરૂ કર્યું એટલે 'ચક્રમ'ના જૂના વાચકો થોડા અકળાયા હતા. એની સામે જો કે નવા વાચકોને ચક્રમનું નવું કલેવર ગમવા માંડ્યું હતું. એટલે ભોલાભાઈએ 'ચક્રમ'નું નામ બદલીને 'ચંદન' કરવાનો નિર્ણય લીધો. એ નિર્ણય એકદમ જોખમી હતો. પરંતુ ભોલાભાઈને જોખમો લેવાની આદત હતી. તેમને મિત્રો અને પરિચિતોએ સમજાવ્યા કે અન્ય કંપનીઓને બ્રાન્ડનું નામ બદલવાના નિર્ણયની બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે. પણ ભોલાભાઈ પોતાના નિર્ણય પર મક્કમ હતા. તેમણે 'ચક્રમ'ના કવર પર નાના વાઈપમાં 'ચક્રમ'ની સાથે 'ચંદન' છાપવાનું શરૂ કર્યું. તેઓ ધીમે ધીમે 'ચંદન'ના ફોન્ટ મોટા કરતા ગયા અને 'ચક્રમ'નું નામ નાનું કરતા ગયા. એ રીતે તેમણે 'ચંદન' નામ મોટું કરી દીધું અને 'ચક્રમ' નામ નાનું કરી દીધું. એ રીતે તેમણે વાચકોને 'ચંદન' નામની આદત પાડી દીધી.

'ચંદન'ની સૌથી મોટી તાકાત એમાં પ્રકાશિત થતી

નવલકથાઓ છે, જે ગોલીબાર પરિવારના સભ્યો જ લખતા આવ્યા છે. ભોલાભાઈ 'ચંદન'માં નવી નવલકથા શરૂ કરે ત્યારે તેમને પોતાને પણ ખબર નથી હોતી કે આ નવલકથા કેટલા હમા સુધી ચાલશે! 'ચંદન'માં નવલકથાના થોડા પ્રકરણો પ્રકાશિત થાય અને ન્યુઝપેપર એજન્ટ્સ તરફથી વધારાની કોપીનો ઓર્ડર ન મળે તો ભોલાભાઈ સમજી જાય કે વાચકોને આ પ્લોટ બહુ પસંદ નથી પડ્યો એટલે તેઓ એ નવલકથાને જરૂરી થોડા પ્રકરણોમાં આટોપી લે અને નવી નવલકથા શરૂ કરી દે! એ નવી નવલકથા વાચકોને ગમી જાય તો 'ચંદન'નું સરક્યુલેશન ઊંચકાય તો પછી એ નવલકથાના પ્રકરણોની સંઘ્યા પણ ખાસ્સી વધી જાય. એટલે ભોલાભાઈની કોઈ નવલકથા નાની હોય, તો કોઈ મોટી હોય.

ભોલાભાઈ સવા બસ્સો નોવેલ્સ લખી ચૂક્યા છે. જી હા, તમે બરાબર જ વાંચ્યું છે. તેમણે ૨૨૫ નોવેલ લખી છે. એમાંથી અડ્યોઅડ્ય નોવેલ હોરર થિલર છે એટલે કે ભૂતપ્રેતની નવલકથાઓ છે. ઘણા લોકો જિંદગીમાં આટલી નોવેલ્સ વાંચી પણ નથી શકતા. મોટાભાગના લોકો જીવનમાં આટલા કુલ પુસ્તકો પણ વાંચતા નથી હોતા એટલે આટલી નોવેલ્સ કોઈ વ્યક્તિ વાંચે એ પણ મોટી વાત છે. પણ ભોલાભાઈએ આટલી નોવેલ્સ લખી છે (અને મને એ વાતનો આનંદ પણ છે અને ગૌરવ પણ છે કે ભોલાભાઈએ તેમની બસ્સોની નવલકથા 'ફરેબ' મને અર્પણ કરી હતી. તેમણે એ નોવેલની કોપી મને કુરિયરથી મોકલી અને મેં પ્રથમ પાનું ખોલીને જોયું ત્યારે એ નોવેલ મને અર્પણ થયેલી જોઈને અને નીચે તેમની એ જ ચિરપરિચિત સ્ટાઇલમાં સાઈન જોઈને રોમાંચ થઈ આવ્યો હતો.) ભૂતપ્રેતની કથાઓ લખવામાં તેમની અદ્ભુત પકડ છે. હું ભોલાભાઈની જેમ ભૂતપ્રેતમાં માનતો નથી, ચમત્કારોમાં માનતો નથી. આવા માણસો આજના સમયમાં આ દુનિયામાં મળે એ ચમત્કાર જેવી જ વાત છે. **ભોલાભાઈ માટે કહી શકાય કે આ માણસ જ પોતે ચમત્કાર સમાન છે!** ભોલાભાઈએ ખૂલ જોખમો ઉઠાવ્યા છે અને જોખમો થકી ચમત્કારિક પરિણામો પણ મેળવ્યા છે. તેમના જીવન પરથી એ પ્રેરણા લેવા જેવી છે કે માણસે જોખમો ઉઠાવતા ન કરવું જોઈએ.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના બેંક ખાતામાં રકમ જમા કરાવવા અંગે...

એકાઉન્ટ નામ : શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

Account Name : Shri Kutchi Jain Seva Samaj - Ahmedabad

બેંકનું નામ : કેનેરા બેંક - પાલડી બ્રાંચ, અમદાવાદ

Bank Name : Canara Bank, Paldi Branch, Ahmedabad.

A/C No. : 70072010016032 • IFSC : CNRB0017007

જ્યારે પણ રકમ મોકલાવવામાં આવે ત્યારે તેની આણ મેનેજરને વોટ્સએપ નંબર : ૮૮૨૪૦ ૮૭૬૫૪ ૫૨ કરવી જરૂરી છે.



સંયમ

વૃદ્ધત્વ એટલે સંયમની મોસમ



વિષિન પંડ્યા

શૈશવ, એ નિર્દોષતા અને નિખાલસતાની અવસ્થા છે. યૌવન એ મોજમસ્તીની અવસ્થા છે પરંતુ વૃદ્ધત્વ એ નિર્દોષતા, નિખાલસતા, મોજ-મસ્તીની સાથે સાથે સંયમની પણ અવસ્થા છે. વૃદ્ધત્વ એટલે જ સંયમની મોસમ.

સંયમ એ સંસ્કૃત શાદી છે, જેની સંધિ થાય સમુદ્ધારણ એટલે સારી રીતે, યમ એટલે કાબૂ. આમ આપણી ઈન્દ્રિયો પર સારી રીતે કાબૂ રાખીએ તેનું નામ સંયમ. પછી તે વાચા હોય કે જીવા, તન હોય કે મન, વિચાર હોય કે આચાર.

જાતું પ્રમાણે જેમ પ્રકૃતિનાં તત્ત્વોમાં પરિવર્તન આવે છે, તેમ જીવનની અવસ્થા બદલાય ત્યારે તેમાં પણ પરિવર્તન આવે છે. તેથી વૃદ્ધત્વમાં આવતા વિવિધ પરિવર્તનથી લગ્નિરે ડરવાની કે ડગવાની જરૂર નથી.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે જીવન જીવવાનો ઉત્તમ સંદેશ પાઠવતાં સાચું જ કહ્યું છે કે, ‘યુક્તાહાર વિહારશ્ચ!’ જીવનમાં પ્રમાણસર આહાર અને પ્રમાણસર વિહાર સુખી જીવન જીવવાની માસ્ટર કી છે. આ માસ્ટર કી અપનાવીએ તો મુસીબતોના મજબૂત તાણા પણ ખૂલ્લી જ જાય ને!

આમ, ભગવાન શ્રીકૃષ્ણ પણ જીવનમાં સંયમ કેળવવા સ્પષ્ટ જરૂર કરું છે. **વૃદ્ધત્વમાં વાણી પર ખાસ સંયમ રાખવો જોઈએ.** વાણમારી સલાહ કોઈને પણ આપવી ન જોઈએ. સંસ્કૃતમાં સાચું જ કહ્યું છે કે, ‘સત્યં બ્રુયાત् પ્રિયં બ્રુયાત्’ સત્ય બોલવું જોઈએ, સાથે પ્રિય પણ બોલવું જોઈએ. સત્ય પણ અહિતકારી વાણી કઢી ન બોલવી જોઈએ.

ગુજરાતીમાં સાચું જ કહ્યું છે કે –

‘પડે ચડે જીબ વડે જ માનવી,
ઉચ્ચાર જે તું સાંભળીને વાણી.’

આમ, માણસની ચડતી-પડતીનો આધાર જીબ પર જ છે ને. દુર્યોધન મહેલમાં લપસી પડતાં દ્રૌપદી બોલ્યા કે, ‘અંધળાનો પુત્ર અંધળો.’ દ્રૌપદીની આવી દાતરડા જેવી જીબનો સીધો જ વાઢ કરે એવી વાણી સાંભળી દુર્યોધન હાડોહાડ સણગી ઊઠ્યો અને પાંડવો અને કૌરવો વચ્ચેનું જે વેર હતું તે વધુ દઢમૂલ બન્યું.

એટલું જ નહીં, દુર્યોધને ફેલાવેલી કપટ જાળમાં નિર્દોષ એવા પાંડવો ફસાયા અને તેમને ૧૨ વર્ષનો વનવાસ અને ૧૩મું વર્ષ ગુમવાસ સહિત જીવનમાં પારાવાર સંકટોનો સામનો કરવો પડ્યો! તેથી જ વૃદ્ધોએ પણ પરિવારને પ્રેમના તાતંથે બાંધી રાખવા વાણી પર સંયમ અવશ્ય રાખવો જોઈએ.

વાણીની સાથે સાથે વૃદ્ધોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આહાર-વિહાર કરવો જોઈએ. જીબને અનુકૂળ આવે તેવું નહીં, પણ પોતાના પેટને અનુકૂળ હોય તેવો આહાર કરવો જોઈએ. બૂકે ડીનર હોય ત્યારે પુનઃ લાઈનમાં ન જવું પડે તે માટે દૂધીના હલવાનું એક ચક્કાનું મૂકાવવાને બદલે વધુ ચક્કાનું મૂકાવીએ અને પછી છાંડીએ, તે શું યોગ્ય છે? જીબને ચટકા તો બહુ થાય, પણ નીરોગી રહેવા માટે ભોજનમાં સંયમ રાખવો ખૂબ જરૂરી છે.

વૃદ્ધાવસ્થામાં તો ભોજન કરતાં ભજન વધારવાની વધુ જરૂર છે. ભજન વધશે, તો આપોઆપ મન પર સંયમ આવશે અને મન પર સંયમ આવશે તો ખોટા અભરખા પર નિયંત્રણ આવશે જ આવશે.

વૃદ્ધાવસ્થામાં શરીર નિરોગી રહે તે માટે યોગ્ય વિહાર કરવો જોઈએ. ‘યોગ ભગાડે રોગ.’ પણ આપણા શરીરને અનુકૂળ હોય તેટલાં જ આસન કરવા જોઈએ. ૨મણભાઈ દરરોજ ૪ કિ.મી. ચાલે છે, તો હું પણ ચાલું – એવી દેખાદેખી ન ચાલે કારણકે ૨મણભાઈનું શરીર અને આપણું શરીર જુદું છે. તેથી આપણા શરીરને અનુકૂળ હોય તે પ્રમાણે જ કસરત કરવી જોઈએ.


ટૂંકમાં, વૃદ્ધત્વમાં અતિશયતાનો ત્યાગ કરવો જોઈએ. પછી બોલવાની અતિશયતા હોય કે આહારની, વિચારોની અતિશયતા હોય કે વિહારની... ભસ, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. આ સંયમની મોસમમાં સૌ વૃદ્ધો યેનકેન પ્રકારેશ સંયમ કેળવી પોતાની ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થા બનાવી પ્રભુનો રાજ્યો મેળવે એ જ અંતરની આરાધના!

“નિર્મિત સ્થિત”, ૧૧, શિવશક્તિ સોસાયટી,
મંગળપુરા રોડ, ગાંધીનગર પાસે, આંધ્રા.
મો. ૮૪૨૬૪ ૬૭૭૬૦



આયોજન

આદર્શ વિશ્વ વ્યવસ્થા



યોગેશ નટવરલાલ ભક્ત

“નથી બહારનું કોઈ, બધા જ ઘરનાં છે;
તું તારી દણિની સીમા જરા વધારી જો.”

આદર્શ વિશ્વ વ્યવસ્થા એટલે “વસુધૈવ કુટુંબક્રમ”ની ભાવના કેળવવી અને તેને ચરિતાર્થ કરવી. આદર્શ વિશ્વ વ્યવસ્થા એટલે સમગ્ર વિશ્વનું સંચાલન એવું નમૂનારૂપ અને સર્વોત્તમ રીતે થાય કે જેથી સાચા અર્થમાં રામ રાજ્યની કલ્યાણ સાકાર થાય!

કોઈ પણ સમાજ કે રાખ્યની વ્યવસ્થા કેટલી આદર્શ છે, તે જ્ઞાનવા માટે તે સમાજ કે રાખ્યમાં સ્વચ્છતાનું, સાક્ષરતા, ભ્રષ્ટાચાર, ગરીબી, ખીનો દરજા, શિક્ષણ, ધાર્મિક માન્યતા, બાળ ઉછેર, વસનનું પ્રમાણ, કાયદો અને વ્યવસ્થા, અર્થતંત્ર અને આંતરરાખ્યી નીતિઓનું ધોરણ કેવું છે? તે ઉપરથી તે રાખ્યનાં વિકાસના માપદંડો નક્કી થતાં હોય છે. આદર્શ વિશ્વ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે સમાજનાં પ્રત્યેક વ્યક્તિથી માંડીને સમગ્ર સમાજ ખરા અર્થમાં પ્રયત્નશીલ બને અને સમાજને સીધી જ સ્પર્શતી દરેક વ્યવસ્થાઓમાં અસરકારક અમલીકરણ થાય, તો ચોક્કસ આદર્શ વિશ્વ વ્યવસ્થા સ્થાપિત થઈ શકે.

આ સાથે અહીં સમાજને સીધી જ સ્પર્શતી સાત વ્યવસ્થાઓ ઉપર પ્રકાશ પાડી આદર્શ વિશ્વ વ્યવસ્થાનો સંકલ્પ સાર્થક કરવા પ્રયત્ન કરેલ છે.

૧. સામાજિક વ્યવસ્થા :

વ્યક્તિ, એ સમાજનું પાયાનું મહત્વનું અંગ છે. તેથી જ વ્યક્તિગત સુધારાથી જ સમાજ સુધાર થઈ શકે છે. આદર્શ વિશ્વ વ્યવસ્થા ચરિતાર્થ કરવા માટેની સૌથી પહેલી અને મોટી જવાબદારી, એ વ્યક્તિગત જવાબદારી છે. દરેક વ્યક્તિ સભ્ય બને, જગૃત બને, સ્વયં અને સમાજનાં વિકાસ અને ભલા માટે પ્રયત્નશીલ બને તે ખૂબ જ ઈચ્છનીય અને જરૂરી છે. માણસ ક્ષિતિજ વ્યાપી બને ત્યારે જ સરહદો, દીવાલો અને સંકુચિત ધારણાઓ ખરી પેદે છે. આ દુનિયાને વધારે સારી, સુંદર, સંપર્ક, શાંતિપૂર્ણ બનાવવી હોય તો વ્યક્તિત્વની શ્રેષ્ઠતા અને તેનાં દ્વારા સામૂહિક ચાલિયને ઉંચું ઉદાવવું અનિવાર્ય છે. દરેક પોતાની ફરજો, જવાબદારીઓ પ્રત્યે સભાન હોય તો આદર્શ પરિવાર, સમાજ અને વિશ્વની રચના કરી શકે.

૨. ધાર્મિક વ્યવસ્થા

ધર્મ સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય છે. તેથી જ ધર્મની જનમાનસ ઉપર ઊરી અને તીવ્ર પકડ હોય છે. વર્તમાન સમયમાં સંપ્રદાયના જાળા-ઝાંખરા એવા ગીય ઊગે છે કે અની પાછળ ઈશ્વર ઢંકાઈ જાય છે. ખરેખર ધર્મનો હેતુ સર્વધર્મ સમભાવના કેળવવા, લોકકલ્યાણનાં કાર્યો કરવા સમાજને સાચી રાહ બતાવવા અંગેનો જ છે.

“હદ્યમાં જે માનવનો ગમ સાચવે છે,
અસલમાં એ જ સાચો ધરમ સાચવે છે.”

માણસ પોતાના માંદ્યલાને વફાદાર રહે એ જ સાચી આસ્તિકતા છે. ટૂંકમાં, ધર્મનો ઉપયોગ સમાજનાં કલ્યાણનાં માર્ગ જ થવો જોઈએ અને એ જ ધર્મનો સાચો સાર છે.

૩. શૈક્ષણિક વ્યવસ્થા

શિક્ષણ, એ વર્તમાન સમયનું સૌથી અગત્યનું અને અનિવાર્ય અંગ છે. *“Knowledge is the currency of 21st Century.”* શિક્ષણના માદ્યમથી જ સમાજ અજ્ઞાનના અંદ્ધકારમાંથી બહાર નીકળી જ્ઞાનનો પ્રકાશ ફેલાવી શકે છે. વર્તમાન સમયમાં શિક્ષણ અનું છે કે જ્યાં મગજ ખીલે છે ને હૃદય કરમાઈ જાય છે. તેથી જ શિક્ષણ વ્યવસ્થા ભારમુક્ત, સહજ, સરળ, વ્યવસાયલક્ષી, જ્ઞાન અને સદ્ગુણો પ્રસ્થાપિત કરતી, વૈજ્ઞાનિક અભિગમયુક્ત હોવી ખૂબ જ જરૂરી છે.

૪. આર્થિક વ્યવસ્થા

અર્થવ્યવસ્થા, એ રાખ્યના સંચાલનની કરોડરાજુ છે. તેથી જ અર્થવ્યવસ્થા હુમેશાં માનવકેન્દ્રી, પર્યાવરણલક્ષી, આયોજનયુક્ત અને જીવનનું અભિવાદન કરનારી તથા ખરા અર્થમાં હોવી ખૂબ જ આવશ્યક છે. અર્થતંત્રનાં વિકાસનાં મુખ્ય ચાર પરિબળો છે : (૧) મૂડી (પૂજી), (૨) શ્રમ, (૩) વિજ્ઞાન અને ટેકનોલોજી તથા (૪) આયોજન. આ ચારેય પરિબળોનો રાખ્ય જે રીતે ઉપયોગ કરે છે તેના આધારે તેમની પ્રગતિ અને

(અનુષ્ઠાનિક : જુહો પાના નં. - ૫૦ ઉપર)



આરોગ્ય
મને વારંવાર માથાનો દુખાવો (માઇગ્રેન)
થાય છે : ભાગ-૪
માનસિક સ્ટ્રેસ અને માઇગ્રેન



ડૉ. મહિલાલ ગઢા
(મનોચિકિત્સક)



ડૉ. દીપિતા શાણ (ગઢા)
(મનોચિકિત્સક તથા
બાળ મનોચિકિત્સક)

આગળના લેખ (ભાગ-૩)માં આપણે જાણ્યું કે માનસિક સ્ટ્રેસને લીધે (૧) માઈગ્રેનના હુમલાઓ વધી જાય છે (Frequency is increased), (૨) માથાનો દુખાવો વધારે તીવ્ર થાય છે (more severe headache), (૩) દુખાવાના રાહત માટે સારવારમાં અવરોધક બને છે, દવાઓની અસર ઓછી થાય છે. દવાઓનું પ્રમાણ વધારવું પડે છે.

આ લેખ ભાગ-૪ માં કેસ સ્ટડી વિશે જાણકારી મેળવીએ. જેથી ઉપરોક્ત વિધાનોની સાર્થકતા સમજશે.

કેસ સ્ટડી-૧

૪૫ વર્ષના નિભિલને (નામ બદલ્યું છે) માથાનો દુખાવો થતો હતો. માથાનો દુખાવો એક કે બે દિવસ રહેતો હતો. સાથે ઉબકા આવતા હતા. ઘણી વખત ઉલટી થતી હતી. આંખોમાં અંધારા આવતા. ઘણી વખત પ્રકાશના ઝબકારા (Flashes of Light) આંખોમાં થતા. દવા લઈને નિભિલ રૂમમાં અંધારું કરી પડા લગાડી સૂઈ જતો. એ દિવસે જમતો પણ નહીં. બીજા દિવસે બધું નોર્મલ થઈ જતું. બીજા દિવસે રૂટીન કામકાજ કરતો, જાણે કાંઈ જ થયું ન હોય.

વૈદ્યકીય તપાસ બધી જ નોર્મલ આવી હતી. માઈગ્રેન - આધાશીશીના રોગનું નિદાન થયેલ. નિભિલ જ્યારે માઈગ્રેનનો હુમલો આવે ત્યારે દવાઓ લેતો. એકાદ દિવસમાં સારું થઈ જતું. ત્યારબાદ કાંઈ તકલીફ ન રહેતી.

માઈગ્રેનના બે હુમલાઓની વચ્ચે કોઈ તકલીફ ન હતી. નિભિલ વચ્ચેના સમયમાં કોઈ દવા ન લેતો.

વર્ષમાં બે થી ત્રણ વખત આ પ્રકારના હુમલાઓ આવતા. નિભિલ તથા કુટુંબીજનોએ આ હુમલાઓને સ્વીકારી લીધા હતા તથા એ સમયે દવાઓ લઈ રાહત મળતી હતી.

છેલ્લા એકાદ વર્ષથી માઈગ્રેનના હુમલાઓ વધી ગયા હતા. મહિનામાં બે-એક હુમલાઓ આવતા હતા. નિભિલ તથા કુટુંબીજનોને ખૂબ જ ચિંતા થતી હતી. આ હુમલાઓનું - (૧) પ્રમાણ (Frequency) વધી ગયું હતું, (૨) દુખાવો વધારે તીવ્ર (Severity) રહેતો હતો, (૩) દવાઓનું પ્રમાણ પહેલા કરતાં વધી ગયું હતું. (૪) દુખાવો વધારે સમય રહેતો હતો. બે થી ત્રણ દિવસ રહેતો હતો (Duration).

૧. ધંધાકીય પાર્ટનરનું અચાનક મરણ :

નિભિલના ધંધાકીય પાર્ટનરનું અચાનક હાર્ટ એટેકથી મરણ થયું. પાર્ટનર જોડે નિભિલના ભાઈ જેવા સંબંધો હતા. સંવેદનશીલ નિભિલના મનને ઊડો આધાત લાગ્યો હતો. કાઉન્સેલિંગના સેશનમાં આ વિશે વાત કરતાં નિભિલ રી પદ્ધો હતો. પાર્ટનરના મરણના આધાતમાંથી નિભિલ હજી બાદાર આવ્યો ન હતો.

૨. ધંધાનું સ્ટ્રેસ :

પાર્ટનરના અચાનક મૃત્યુથી ધંધાની સંપૂર્ણ જવાબદારી નિભિલ પર આવી પડી હતી. અત્યાર સુધી અડધાથી વધારે જવાબદારી પાર્ટનર સંભાળતો હતો. જ્યારે પણ કામ વધી જતું અને ટાર્ગેટ ડેલાઇન નજીક આવતો ત્યારે નિભિલનું સ્ટ્રેસ લેવલ વધી જતું અને માઈગ્રેનનો હુમલો આવી જતો.

૩. ફ્લેટના કબજામાં મોડું :

નિભિલે રહેવા માટે ફ્લેટનું અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં બુકિંગ કર્યું હતું. પોતાનું જૂનું ઘર વેચીને પૈસાની ગોડવણ કરી હતી. હાલ ભાડાના ઘરમાં રહેતો હતો. આ ફ્લેટનો કબજો મળતો ન હતો. મોહું થતું હતું. આપેલા સમયથી એક વર્ષ વધારે નીકળી ગયો હતો. કબજો ક્યારે મળશે એ નિશ્ચિત ન હતું. આથી નિભિલ સ્ટ્રેસમાં રહેતો હતો.

ઉપરોક્ત કારણોને લીધે સંવેદનશીલ નિભિલનું માનસિક સ્ટ્રેસ ખૂબ જ વધી ગયું હતું. જેની અસર શરીર પર થતી હતી અને માઈગ્રેનના હુમલાઓ વધી ગયા હતા. દુખાવો વધારે તીવ્ર થયો હતો.

● સારવાર :

સ્ટ્રેસ પ્રતિરોધક દવાઓ (Anti Stress Medication) શરૂ કરી. બે અઠવાડિયામાં દવાઓની પોઝિટિવ અસર જણાવા લાગી. સાથે કાઉન્સેલિંગ પણ શરૂ કર્યું. સંવેદનશીલ વલણ બદલાવવા માટે કોન્જિનિટિવ બિહેવિયર થેરાપી પણ શરૂ કરી. જીવનશૈલીમાં બદલાવ લાવવા કાઉન્સેલિંગ કર્યું.

આ બધાની અસરથી નોંધપાત્ર સુધારો થયો. માઈગ્રેનનો દુઃખાવો ઓછો થયો. માઈગ્રેનના હુમલાઓ ઓછા થયા.

માઈગ્રેનની દવા પૂર્વવત ફક્ત એટેક વખતે જ આપી. છેલ્લા છ મહિનામાં માઈગ્રેનનો દુઃખાવો એક પણ વખત નથી થયો.

કેસ સ્ટડી-૨

૩૮ વર્ષની મંજુલાને માઈગ્રેનની બીમારી હતી. થોડા સમયથી માઈગ્રેનનો દુઃખાવો વધી ગયો હતો. પહેલાં બે માઈગ્રેનના એટેકની વચ્ચે બીજા કોઈ લક્ષણો ન હતા.

જ્યારથી માઈગ્રેનનો દુઃખાવો વધી ગયો છે ત્યારથી રાત્રે ઊંઘ બરોબર આવતી ન હતી. હૃદયના ધબકારા વધી જતા હતા. ભૂખ ઓછી થઈ ગઈ હતી. નબળાઈ લાગતી હતી, બેચેની રહેતી હતી. કામમાં મન લાગતું ન હતું. સ્વભાવ ચીંદ્રિયો થઈ ગયો હતો. મનમાં નકારાત્મક વિચારો આવતા હતા. ભવિષ્યની ચિંતા રહેતી હતી. કોઈક વખત રડવું આવી જતું હતું.

વૈદ્યકીય તપાસ બધી નોર્મલ હતી. ફિલ્ઝિશિયનનો અભિપ્રાય લઈ સારવાર શરૂ કરી. રાહત ન મળી. ગાયનેકોલોજિસ્ટની મેનોપોઝ માટે સારવાર કરી. રાહત ન મળી. ફિલ્ઝિશિયને મનોચિકિત્સકનો અભિપ્રાય લેવાની સલાહ આપી.

ઉંડાણમાં જતા તથા માથાના દુઃખાવાની વૈજ્ઞાનિક નોંધ પરથી નીચેની માહિતી મળી.

માઈગ્રેનના બે હુમલાઓની વચ્ચેના સમયમાં મંજુલાને જે લક્ષણો હતા એ બધા ડિપ્રેશનની બીમારીના હતા. શારીરિક તથા માનસિક લક્ષણો હતા. માનસિક સ્ટ્રેસના બનાવો નીચે પ્રમાણે હતા.

૧. દીકરી સાસરેથી પાછી આવી હતી

પરણેલી દીકરી સાસરેથી જઘડો કરીને પાછી આવી હતી. સાસુ જોડે વિચારોનો મતભેદ રહેતો હતો. પતિ જોડે સારું બનતું હતું. મંજુલાએ તથા કુટુંબીજનોએ ખૂબ સમજાવું પણ સાસરે જવા દીકરી તૈયાર ન હતી.

૨. દીકરાના લગનનો પ્રશ્ન

દીકરાની ઉંમર વધતી હતી. દીકરો લગન કરવા રાજી થતો ન હતો. દીકરા માટે માંગા આવતા હતા પરંતુ દીકરો ના

જ પાડતો હતો. મંજુલાને બધાને જવાબ આપવા પડતા હતા. જેથી માનસિક સ્ટ્રેસ વધતું હતું.

૩. મમ્મીની તબિયત

મંજુલાની મમ્મીની તબિયત નરમગરમ રહેતી હતી. ડાયાબિટીસનું પ્રમાણ વધી ગયું હતું. બે વખત હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવી પડી હતી. મંજુલાને મમ્મી જોડે ખૂબ જ સારું બનતું હતું. મમ્મીની તબિયતને લીધે સ્ટ્રેસ વધી ગયું હતું.

● સારવાર :

ડિપ્રેશન પ્રતિરોધક દવાઓ, માઈગ્રેનની દવાઓ સાથે શરૂ કરી. બે અઠવાડિયામાં ડિપ્રેશનના લક્ષણોમાં રાહત મળી. ભૂખ લાગવા માંડી. રાત્રે ઊંઘ નોર્મલ થઈ. માઈગ્રેનના દુઃખાવામાં રાહત મળી.

કાઉન્સેલિંગ શરૂ કર્યું. હકીકતનો મનથી સ્વીકાર કરવા કાઉન્સેલિંગ કર્યું. વ્યક્તિ પોતાનું કર્મ કરે ત્યારબાદ જે પરિણામ આવે એ મનથી સ્વીકારવું જોઈએ એ સિદ્ધાંત અપનાવવા સમજાવ્યું.

● મનોવૈજ્ઞાનિક સમજણ :

માનસિક સ્ટ્રેસની અસર શરીર પર થાય છે. સ્ટ્રેસને લીધે થતા હોરમોનલ તથા ન્યુરોટ્રાન્સમિટર્સને લીધે નકારાત્મક અસર થાય છે. જેને લીધે માઈગ્રેનની બીમારીથી પીડાતા દર્દીમાં (૧) દુઃખાવાની તીવ્રતા વધી જાય છે, (૨) દુઃખાવાના હુમલાઓ વધી જાય છે, (૩) માઈગ્રેનની દવાની અસર ઓછી થાય છે.

સારવારમાં માઈગ્રેનની દવાઓ જોડે સ્ટ્રેસની શરીર પરની અસર ઓછી કરવા સારવાર કરવી અગત્યની છે.

મનોચિકિત્સાથી મન અંદરથી શાંત થાય છે. માનસિક દમ્યુનિટીમાં વધારો થાય છે, મનોભળ વધે છે, આત્મવિશ્વાસ વધે છે. પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિનો વધારો થાય છે. સ્ટ્રેસને લીધે થતાં નકારાત્મક હોરમોનલ તથા ન્યુરોટ્રાન્સમિટર્સમાં ફેરફારો પાછા નોર્મલ થાય છે. માઈગ્રેનમાં આથી રાહત મળે છે.

● સારાંશ :

માઈગ્રેનના કિસ્સામાં મનોચિકિત્સકનો અભિપ્રાય લઈ જરૂરત પ્રમાણે મનોચિકિત્સા કરવાથી દર્દીને રાહત મળે છે. દર્દી ગુણવત્તાભર્યું જીવન જીવી શકે છે. ■

આપણી પાસે જ સમય છે
અમાં જ પળે પળે તકના ધબકારા થયા કરે છે
અને અનો ઉપયોગ કરતા જ રહેવું જોઈએ.



વાતો

મન ! તોહે કાહે વિદ્ય સમજાઉં !



દેશ ઘોળકિયા

વીણાના મૃત્યુના સમાચાર છાપામાં વાંચી હું તો આધાત પામી. વીણા મારી પ્રિય બહેનપણી! અમે સાથે જ મોટા થયા હતા. લગ્ન પછી ધૂટા પડ્યા હતા. છતાં વારંવાર મળતા હતા. વીણાના પતિ રશ્મિભાઈ એક સરળ માણસ હતા. બંને સાથે જ એક કોલેજમાં નોકરી કરતા હતા. વીણા તેમનાથી થોડી મોટી હોવાથી વહેલી નિવૃત્ત થઈ હતી. રશ્મિભાઈ પાછળથી નિવૃત્ત થયા હતા. પણ પછી પણ બંને આનંદથી રહેતા હતા. રશ્મિભાઈ વિવિધ પ્રવૃત્તિઓ કરતા હતા અને વીણા ઘર સંભાળતી હતી. તેના બે દીકરા અલગ, પણ પાસે જ રહેતા હતા. વીણાએ જ તેમને એ વ્યવસ્થા કરી આપી હતી. નિવૃત્તિ પછી પણ દસકો પસાર થઈ ગયો હતો. **પણ પછી વીણાને ડિમેન્સિયા - ભૂલકણાવૃત્તિ શરૂ થયો હતો** અને તે વારંવાર તેનો ભોગ બનતી હતી. ક્યારેક તેને પાર્કિન્સનના પણ હુમલા આવતા હતા. પરિણામે તે બીમાર રહેતી હતી. છતાં બંને આનંદથી રહેતા હતા. રશ્મિભાઈ તેની બરાબર સંભાળ લેતા હતા. હું ક્યારેક તેની પાસે જતી. વાતો કરતા. પણ હવે તેની વાતો કરવાની અને રસ લેવાની વૃત્તિ ઓછી થઈ ગઈ હતી. તે શરીરે ઘસાતી જતી હતી.

છેવટે કાલે તે ગઈ.

હું તરત તૈયાર થઈ અને બસમાં બેસી તેના ઘેર ગઈ. થોડા લોકો બેઠા હતા. બધા વીણાની પ્રશંસા કરતા હતા. હું થોડીવાર તો ચૂપ રહી. પછી રશ્મિભાઈ સાથે વાતો કરવા લાગી. રશ્મિભાઈ ઢીલા થઈ ગયા હતા. તે આખું જીવન વીણા પર જ આધારિત રહ્યા હતા. બધી જ બાબતો વિશે વીણા જ નિર્ણય લેતી. રશ્મિભાઈને પણ બાળકની જેમ સાચવતી હતી. એટલે તે તો તેના જવાથી અનાથ જેવું અનુભવતા હતા. મેં તેમને આશ્ચર્યાસન આપ્યું કે દીકરાઓ અને વહુઓ સારી હતી, વાંધો નહીં આવે.

‘મુદ્રો એ નથી. એ બધા તો સારા જ છે. બરાબર ધ્યાન રાખશે એની મને ખાતરી છે. મૂળ વાત એ છે કે મને જ વીણા વગર નહીં ગમે. હવે મારા જીવનમાંથી રસ ઉડી જશે.’ રશ્મિભાઈની આંખમાં આંસુ આવી ગયા.

હું રશ્મિભાઈની વાત બરાબર સમજતી હતી. તે તદ્દન સાચું

બોલતા હતા. તેમનું સમગ્ર જીવન વીણાની આસપાસ હૂમતું રહ્યું હતું. સ્વસ્થ હતી તો તેની સાથે પ્રેમમાં સમય પસાર થતો હતો અને માંદી પડી પછી તેની સેવામાં રશ્મિભાઈનો સમય પસાર થતો હતો. હવે બંને ગયા. એટલે રશ્મિભાઈના જીવનનો હેતુ જ ચાલ્યો ગયો હતો.

કંઈક બોલવું જોઈએ એટલે હું બોલી. ‘રશ્મિભાઈ, આ તો અનિવાર્ય છે. એમાં કશું ન થઈ શકે. સમય જ દવા છે. ધીમે ધીમે ટેવાઈ જશો.’

‘પણ માયાબેન, વીણા માત્ર મારી પત્ની ન હતી, તે મારી મા પણ હતી. આખું જીવન તેણે મને સાચવ્યો હતો. મેં મા અને પત્ની બંને ગુમાવ્યા છે.’

આ વાત પણ સાચી હતી.

પછી થોડી વાતો થઈ. વિવિધ વાતોથી તેમને હળવા કરવાનો પ્રયાસ કર્યો. છેવટે હું ઊભી થઈ અને બોલી, ‘હું પ્રયાસ કરીશ કે સમયાંતરે તમને મળવા આવું, પણ તમને પણ ઈચ્છા થાય તો મારી પાસે આવજો. સ્થળ બદલાશે તો હળવા રહેવાશે.’

તેણે મસ્તક નમાયું. મેં વિદાય લીધી.

હું બસ સ્ટેશને ગઈ અને મારા ગામની બસમાં બેઠી. બસ ચાલવા લાગી. હું વિચારે ચઢી ગઈ.

આમ જુઓ તો વીણા ખૂબ જ સુખી હતી. રશ્મિભાઈ જેવા પ્રેમાળ પતિ મળ્યા હતા. પૈસેટકે પણ સુખી હતા. સંતાનો પણ સારા હતા. છેલ્લે સુધી બંનેએ ભરપૂર પ્રેમ કર્યો. ઈચ્છા આવે તેવું તેમનું જીવન હતું.

પણ હકીકિતે વીણા સુખી હતી?

હકીકત હું જાણતી હતી. વીણા સુખ વચ્ચે પણ અસ્વસ્થ હતી. અધૂરાશ અનુભવતી હતી.

મને તેની બધી વાતો સાંભરી આવી.

બસ ઝડપથી ઢોડતી હતી. સુંદર ઠંડો પવન વાતો હતો. સાંજનો સૂરજ ફળતો હતો. વાતાવરણમાં બસના ઘરઘરાટ સિવાય શાંતિ હતી. બસમાં પણ બહુ લોકો ન હતા અને જે હતા તે બધા શાંતિથી બેઠા બેઠા જોલા ખાતા હતા.

મારું મન ભૂતકાળમાં ચાલ્યું ગયું.

વીણાનાં લગ્ન થયાં પછી થોડા સમય પછી તે મને મળી હતી. હજ તો પૂછવા જરૂર તે પહેલાં તો તે મને વળગી પડી હતી. મને નવાઈ લાગી.

‘કાં વીણા, એવું તે શું થયું કે તું મને વળગી પડી? ભૂલથી મને રશમભાઈ નથી માની લીધીને?’ મેં હસતા હસતાં કહ્યું.

તેણે તો મારા ગાલ પર બે ચાર ચુંબન ચોડી દીધા. હું સમજ ગઈ કે પોતાના ગૃહસ્થ જીવનનો આનંદ પ્રગટ કરે છે. હું ચૂપ રહી.

તે માંડ મારાથી છૂટી પડી.

‘હવે બોલ, અમારા રશમભાઈ કેવા છે? મજા કરાવે છે?’ મેં પૂછ્યું.

‘અરે વીણા, તારા રશમભાઈ તો દેવ છે, દેવ. કલ્યાના કરી હતી તેવા જ ઉત્તમ માણસ છે. હું તો માની નથી શકતી. અહાહા, શું આનંદ આવે છે તેમની સાથે!’ તેણે મારો હાથ દાખ્યો.

‘શું મજા કરાવે છે? આટલા દિવસમાં સારા સમાચાર તો નથી ને?’ મેં મજાક કરતાં કહ્યું.

‘જાને માયાડી, તને આ જ સૂજે છે.’

‘અત્યારે તો આ જ મજા હોય. બીજી કંઈ મજા હોય?’

‘એ તો છે જ, હોય જ, મસ્ત મજા કરાવે છે તે પણ. તું સાચી છો. પણ હું તેની વાત નથી કરતી.’

‘તો?’

‘અરે માયા, તે એટલા પ્રેમાળ છે કે વાત ન કર. મને રાણીની જેમ રાખે છે. આટલું સુખ તો મેં મારા પીયરમાં પણ નથી ભોગવ્યું, જેટલું આ છ માસમાં ભોગવ્યું છે.’

‘તો તો ભગવાનની તારા પર કૂપા કહેવાય.’

‘કૂપા? અરે, કૂપાનો તો ધોધમાર વરસાદ જ કહે. દેવ છે દેવ, રશ્મે તો.’

અને પછી રશ્મ કેવું ધ્યાન રાખે છે તેની વાતો કરી. સાંભળી ખરેખર ઈર્ઝા થાય. રશ્મ તેને હથેળી પર રાખતા હતા. મને તો સાંભળીને ખૂબ આનંદ થયો બહેનપણી સુખી હોય તેનાથી વધારે શું જોઈએ?

થોડો સમય પસાર થઈ ગયો. એક બાળક પણ આવી ગયું.

હું ઘણા સમય પછી તેને મળવા ગઈ. આ વખતે પણ તે મસ્તીમાં જ હતી. તેણે બાળક દેખાડ્યું. મેં રમાડ્યું.

મેં મશકરી કરી, ‘વીણા, રશમભાઈનું દેવત્વ તો અખંડ છે ને? મજા કરાવે છે ને?’

‘હા, હા, પૂરી મજા.’ તે બોલી. પણ આ વખતે તેના

બોલવામાં પૂરી મસ્તી ન હતી.

‘તારા અવાજમાં આગળ જેવી મસ્તી નથી, વીણા. કંઈ તકલીફ તો નથી ને?’

‘ના, ના, કંઈ જ તકલીફ નથી.’

‘પણ તારો અવાજ ઢીલો છે.’

‘એ તો એમ જ.’ તે બોલી.

‘અલી, મને બનાવે છે? આપણે બંને એકબીજાને નખશીખ બરાબર ઓળખીએ છીએ. સાચું બોલ.’ મેં તેની સામે ધ્યાનથી જોતાં પૂછ્યું.

વીણાનો અવાજ ઢીલો થઈ ગયો.

‘કોઈ શારીરિક તકલીફ? કે માનસિક? તે રખે તેવા તો નથી દેખાતા’ મેં અનુમાનો ધાર્યા.

‘ના, ના, એવું કશું નથી.’

‘તો? પ્રેમ ઓછો થઈ ગયો?’

તે હસી. ‘તે તો શક્ય જ નથી. દિવસો દિવસ ઉલટો વધે છે.’

‘તો પછી શું છે? મને નવાઈ લાગે છે.’

‘કહીશ તો માનીશ નહીં.’

‘પણ કહે તો ખરી.’

વીણા બોલી, ‘માયા, રશ્મ ખૂબ પ્રેમાળ છે. તેની સામે કોઈ ફરિયાદ નથી. અત્યારે તેના વિરુદ્ધ બોલિશ તો પણ હું નરકમાં પડીશ. છતાં એક મુદ્દો તો છે.’

મને આશર્ય થયું. મુદ્દા વિનાનો મુદ્દો! મને પણ જિજાસા થઈ.

‘બોલ.’ મેં ટૂંકો જવાબ આપ્યો.

‘માયા, રશ્મ એક અનાય બાળક તરીકે ઉછર્યા હતા. માતા જન્મ આપી મરી ગઈ હતી. પિતા પણ જલ્દી ચાલ્યા ગયા હતા. તે તેના ફષ પાસે ઉછર્યા હતા. ફર્દાએ સરસ રીતે મોટા કર્યા હતા અને ભણાવ્યા પણ હતા. હુવા પણ સરળ હતા. એટલે કોઈ પણ તકલીફ વિના મોટા થયા હતા. પણ...’

‘પણ?’ મારી જિજાસા તીવ્ર થઈ. ‘ક્યાંય લપસી પડ્યા હતા?’

તે હસી. ‘ક્યાંય શું, મારી પાસે પણ પૂરા નથી લપસતા. બહુ – કદાચ વધારે પડતા – ભલા છે.

‘તો પછી?’

‘માયા, રશ્મ બાળપણથી જ માતાના પ્રેમ માટે જુરતા હતા. તેને હંમેશ થતું કે તેમને માતાનો પ્રેમ નથી મળ્યો. કંઈ

ગમે તેટલો સ્નેહ કરતાં, પણ તેમને સંતોષ ન થતો. તે અધૂરાશ જ અનુભવતા. તે હંમેશા માતાનો પ્રેમ શોધતા હતા.'

'તે તો સહજ છે.' મેં જવાબ આપ્યો.

'પણ તે મારા માટે સમસ્યા બની ગઈ.' વીણા બોલી.

'કેમ?' મને આશ્ર્ય થયું આ સાંભળીને.

"રશ્મિ મારી પાસેથી માતાનો પ્રેમ ઈચ્છતા હતા. તેમણે મને પત્ની તરીકે સ્વીકારી હતી. તેનો પણ પ્રેમ કરતા હતા, પણ તે સતત મારી પાસેથી ઈચ્છતા હતા કે હું તેને માનો પ્રેમ પણ આપું. તે મને પત્નીના બદલે મા તરીકે વધારે જોતા હતા. મને કહેતા પણ ખરા કે, 'વીણા, મને માતાનો પ્રેમ જોઈએ છે, તું આપ.' હું તેમને સ્નેહ કરતી, પણ મારો પ્રેમ તો હકીકતે પત્નીનો જ હતો. તે પતિ તરીકે પ્રેમ કરતાં કરતાં મને ક્યારેક એવી રીતે વળગી પડતા અને પુત્રની જેમ વહાલ કરવા મંડી પડતા. ત્યારે તે મારા શરીર સાથે એવો સ્પર્શ કરતા કે જીણે માને સ્પર્શ કરતા હોય. ત્યારે છાતી પર એવી રીતે હાથ ફેરવતા કે જીણે નાનું બાળક હાથ ફેરવતું હોય. તેમાં પ્રેમ કે વાસના કરતાં બાળકની નિર્દ્દીષ્ટતા વધારે વ્યક્ત થતી. હવે હું તો ત્યારે મસ્તીમાં હોઉં. તેના પ્રેમની તીવ્રતા માગું. તે પણ પોતાની વાસના વ્યક્ત કરે તેમ ઈચ્છું. પણ તે તો ખોવાઈ જતા અને હળવેથી હાથ ફેરવી મારા ખોળામાં સૂઈ જતા અને બાળકની જેમ વર્તવાનું શરૂ કરી દેતા. મારો બધો નશો ઉત્તરી જતો અને હું નિરાશ થઈ જતી. હું તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરતી, તો તે શરમાઈ જતા અને ખરી જતા. 'અત્યારે તું મારી મા છો, મને રમાડ, મને વહાલ કર' એમ કહેતા. હવે તે ક્ષણે હું તો સંપૂર્ણ પત્ની અને સ્ત્રી હોઉં. મારું શરીર તેને તીવ્રતાથી ઈચ્છતું હોય. તેના પતિ તરીકેના પ્રેમ માટે તરફડતી હોઉં. અને તે મને મા તરીકે જુઓ. તેવો જ સ્નેહ માંગો. હું તેને ઠપકો આપું અને કહું કે તે સવારે આપીશ. અત્યારે તે મને પત્ની તરીકે જ પ્રેમ કરે. તો શરમાઈ જતા અને પતિ બનવાનો પ્રયાસ કરતા. પણ થોડી જ ક્ષણોમાં ફરી બાળક બની જતા અને ફરી માંગણી કરવા લાગતા. હું ખૂબ ગુસ્સે થતી, પણ થોડીવાર મા નું નાટક કરતી. તે મને જોરથી વળગી પડતા અને બાળકની જેમ પ્રેમ કરવા લાગી જતા. તેમને એટલો સંતોષ થતો કે હળવા થઈ જતા અને મારા ખોળામાં જ સૂઈ જતા."

'હું હતાશ થઈ જોઈ રહેતી.' વીણાની આંખમાં આંસુ હતા.

'પણ તો આ બાળક?'

'એમ તો તે સહજ હોય ત્યારે પ્રેમ કરતા. મારી પણ માંગતા. પણ વારંવાર પેલી અધૂરાશ તેના મનનો કબજો કરી લેતી અને મને માનો રોલ ભજવવાનું કહેતા. ત્યારે મારી ઈચ્છાને અવગણતા.'

'તો, તો, તારો પ્રેમ ઓછો થઈ જતો હશે!'

'એ જ તો તકલીફ છે. તે ભયંકર પ્રેમાળ છે. મારી એટલી તો સંભાળ રાખે છે કે હું ગુંગળાઈ જાઉ છું. ઘરમાં હોય ત્યારે બસ, પ્રેમ જ કર્યા કરે. મારી છોકરાની જેમ સંભાળ રાખે છે. કહું તેના કરતાં પણ વધારે ઈચ્છાઓ પૂરી કરે છે. બસ, આ હુમલા તેને હેરાન કરે છે. તેમને ઠપકો આપું તો કહે કે — વીણા, જીવનની શરૂઆતનાં પચ્ચીસ વર્ષ મા વિના રહ્યો છું. માના પ્રેમ વિના તરફડયો છું. તને જોઉં છું અને મા યાદ આવી જાય છે. અધૂરાશ તીવ્ર બને છે. તું મને એ સ્નેહ પણ આપે છે, પણ મને લાગે છે કે મારી અધૂરાશ ક્યારેય સંતોષ નહીં પામે. લાગે છે કે આ અધૂરાશ એક ટેવ બની ગઈ છે. જન્સમાં ઘૂસી ગઈ છે. તારી પાસે આવું અને પહેલાં તું મને મા તરીકે જ દેખાય છે. પત્ની તરીકે જોવાની મારે મહેનત કરવી પડે છે. એવું નથી કે હું તારા શરીરથી આકર્ષિતો નથી. હું પણ માણસ છું. મને તારું શરીર ખૂબ ગમે છે, તેનો ઉપભોગ પણ ગમે છે. પણ વચ્ચે વચ્ચે આ હુમલા આવી જાય છે અને હું બદલાઈ જાઉ છું. વીણા, તારી મારી માગું છું.... મારે શું કહેવું? પણ માયા, તેના કારણે હું પત્ની તરીકેનું સુખ સો ટકા ભોગવી નથી શકતી. મારાં બે બાળક છે — આ અને રશ્મિ.'

હું વિચારમાં પડી જતી. આ તો વિચિત્ર મુદ્રો છે. કોઈ સાથે ચર્ચા પણ ન શકાય તેવો.

પછી તો બીજું પણ બાળક થયું. મને શાંતિ થઈ.

પછી મળતી ત્યારે પણ વીણા આ ફરિયાદ તો કરતી જ. કહેતી, 'હવે તો રશ્મિના હુમલા વધી ગયા છે. પ્રેમ કરતા કરતા છાતીને વળગી પડે છે અને બાળકની જેમ વર્તવાનું શરૂ કરી દે છે. ક્યારેક આ બાળક ધાવતું હોય તો તેને ખ્સેડીને પોતે...!' તે મોં નીચું કરી ગઈ.

હું સમજી ગઈ કે રશ્મિ 'મધર કોમ્પ્લેક્સ'થી હેરાન થતા હતા. માતાના પ્રેમનો અભાવ તેમના ચિત્તમાં એવો તો ઘૂસી ગયો હતો કે તે બધામાં મા નાં જ દર્શન કરતા હતા. અલબાત્, એટલે તે સ્ત્રીઓ બાબતમાં ખૂબ સ્વસ્થ રહ્યા. મારી સામે પણ આદરથી જોતા. હું આવતી ત્યારે પણ ઓછા ઓછા થઈ જતા. મારી સાથે આદરપૂર્વક વાતો કરતા. ખૂબ માન આપતા. હું પણ ગુંગળાઈ જતી. તેમનું આ વર્તન ન સમજતી. માનતી કે તેમનું અતિ સ્નેહાળપણું આમ કરાવે છે. પણ વીણાની વાતો સાંભળ્યા પછી આ વર્તની સમજ પડી. મને તો વાંધો ન આવે, પણ વીણા પણ અતૃપુરુષ રહેવા લાગી હતી.

અને છેલ્લા દિવસ સુધી રહ્યી. નિવૃત્ત થયા પછી તો તે કહેતા, 'વીણા, હવે આપણે મોટા થઈ ગયા છીને. હવે પતિ પત્નીનો રોલ બસ. હવે તું મારી પૂર્ણ માતા.'

વીણા જવાબ આપતી, ‘પણ રશ્મિ, હું મોટી નથી થઈ. મને તમારો પ્રેમ, તમારો આવેગ જોઈએ છે.’

રશ્મિ હસતા. ‘વીણા, વાસનાનો તો અંત જ નથી. તું પણ મને તારા પિતા તરીકે જો. વાસના શાંત થઈ જશે.’

વીણા ગુસ્સે થતી. ‘મને પિતાનો અભાવ નથી નડયો. હું શા માટે જોઉં? તો તો તમને પરણી જ ન હોત. મને તો રશ્મિ ધ હસબન્દ જોઈએ છીએ.

પણ રશ્મિ શાંત થઈ ગયા હતા. પ્રેમ પહેલી કષેત્રે કરતા હતા તેટલો જ કરતા હતા. પણ પુરુષ તરીકે શાંત થઈ ગયા હતા. તે વીણાને મા તરીકે જ જોતા હતા. પુત્ર જેવો સ્નેહ આપતા હતા.

વીણા છેલ્લી કષ્ણ સુધી અતૃપુ રહી. કદાચ અતૃપુ જ મરી ગઈ. કદાચ એટલે જ તે હતાશામાં આ ડિમેન્સિયાનો ભોગ બની ગઈ. દબાવેલ ગુસ્સો જ પાર્કિન્સનમાં પલટાઈ ગયો. ભલે બહાર વ્યક્ત ન કરતી, પણ અંદરને અંદર એક સ્વી તરીકે ગુંગળાતી

રહી. છેલ્લે જો હું મળી હોત તો કદાચ તે વ્યક્ત પણ કરત. પણ હું પણ વ્યસ્તતાને કારણે મળી શકતી ન હતી.

મનોવિજ્ઞાનના પ્રાથ્યાપક જ પોતાની જ પત્નીનું મનોવિજ્ઞાન ન સમજી શક્યા. સમજ્યા હશે તો પાલન ન કરી શક્યા – પોતાના વળગણના કારણે.

એક ઉત્તમ પ્રેમી વ્યક્તિ હોવા છતાં ઉત્તમ બની ન શક્યા. વીણાનો મધુર સ્વર પૂરો પ્રગટ ન જ થઈ શક્યો. તેના તાર ઢીલા જ રહ્યા.

માનવનું મન ખરેખર અદ્ભુત છે. ક્યારે કેમ વર્તશે તેની ખબર નથી પડતી. આના કરતાં તે કૂર હોત અને મારત, પણ એક પતિ તરીકે ઉત્તમ પ્રેમ કરત તો વીણાને ગમત!

જવાબ નથી.

અચાનક બસ ઊભી રહી. હું ઉત્તરી ગઈ. સામે સૂરજ ઠણતો હતો. તેનું તેજ જાંખું થતું હતું. અંધકાર વધતો હતો. મારા મનમાં પણ ગુંચવણો હતી. હું પણ અસ્પેષ મનથી ચાલવા લાગી.

આદર્શ વિશ્વ વ્યવસ્થા

(અનુસંધાન : પાના નં. – ૪૪ ઉપરથી ચાલુ)

વિકાસ થાય છે. આ ચારેય પરિબળો ઉપર આવડત અને કુનેહથી અમલ કરી રાખ્ય ખૂબ જ આગળ વધી શકે છે.

૫. ન્યાયીક વ્યવસ્થા

ન્યાય સાથે હંમેશાં પ્રજાનું મોરલ જોડાયેલું હોય છે. તેથી જ ન્યાયીક વ્યવસ્થા હંમેશાં કડક, ચુસ્ત, પારદર્શી, ઝડપી અને સત્યની ભાવનાને ઉજાગર કરતી રહે તેવી હોવી જોઈએ. વિલિયમ સેક્સપિયર કહે છે કે, ‘અપરાધ હોય ત્યાં પ્રયંડ કુહાડીને પડવા જ દો.’ ન્યાયીક વ્યવસ્થા હંમેશાં સમાજને સંતોષ મળી રહે તેવી સુદૃઢ હોવી જોઈએ.

૬. રાજકીય (વહીવટીતંત્ર) વ્યવસ્થા :

રાજકીય વ્યવસ્થા સંભાળનું વહીવટીતંત્ર હંમેશાં વિકાસ માટે કટીબદ્ધ, પ્રજાહિત માટે સમર્પિત, પારદર્શક, ભ્રાણાચાર મુક્ત, કર્તવ્યનિષ્ઠ, સહકારમય ભાવના સભર અને ફરજી પ્રત્યે સભાન હોવું જોઈએ. તંત્ર સમાજને લગતા પ્રશ્નો જેવા કે શાંતિ, સલામતી, સમૃદ્ધિ, વિકાસ, મોંઘવારી, રોગો, મંદી, ગ્લોબલ વોર્મિંગ, આતંકવાદ વગેરે તમામ બાબતો પ્રત્યે જગ્યાત અને કાર્યાન્વિત હોવું ખૂબ જરૂરી છે. વહીવટી તંત્રમાં Work is Worship ની ભાવના જરૂરી છે.

૭. વિદેશ નીતિ (આંતરરાષ્ટ્રીય વ્યવહારો)

દરેક રાષ્ટ્રની અન્ય રાષ્ટ્રો પ્રત્યેની વિદેશ નીતિ હંમેશાં મૈત્રીપૂર્ણ, સહકારમય, સૌહાર્દ્યમય, ઉભાસભર હોવી જોઈએ. દરેક રાષ્ટ્ર પરસ્પર દરેક ક્ષેત્રમાં સહકાર અને સમજણાની ભાવનાથી વ્યવહાર, વ્યાપાર અને વિનિમય કરે, ઉદારમતવાદી વિદેશ નીતિ અપનાવે, એકબીજાનાં વિકાસ અને મુશ્કેલીઓનાં, પ્રશ્નોના નિવારણમાં સક્રિય ભૂમિકા નિભાવે તો સમાજ અને વિશ્વ એક પરિવાર બની શકે. વૈશ્વિક સમસ્યાઓનો સાથે મળીને હલ શોધી શકે.

ધર્મો, તત્ત્વ વિચારો, પદ્ધતિઓ, ચોજનાઓ, નકશાઓ અને કાર્ય રેખાઓ એ બધું જ નિખાણ છે, જ્યાં સુધી અમલીકરણની ઊર્જા અમેં રેડાતી નથી. તેથી જ સમાજને પ્રત્યેક વ્યક્તિ પોતાની પાસે જે જે શ્રેષ્ઠતા છે તે સમાજને અર્પણ કરે, તો સર્વશ્રેષ્ઠ છે. અને આવી રીતે સાકાર થઈ શકે આદર્શ વિશ્વ વ્યવસ્થાની હિન્દ્ય અને ભવ્ય કલ્પના અને રચાય આદર્શ સમાજ અને આદર્શ વિશ્વ.

“મહાદેવ”, પાઠ નં.-૧૬,
શિવલીલા રેસિડેન્સી, પાઠક સ્કૂલ સામે,
છનુમાનપુરા રોડ, અમરેલી - ૩૬૫ ૬૦૧.
મો. ૯૮૨૪૦ ૯૩૪૬૪

આપણા પ્રેમની શક્તિ બીજાને માટે જેમ જેમ વપરાતી રહે છે
તેમ તેમ આપણામાં નવી શક્તિ અને નવો પ્રેમ પ્રગટ થતો રહે છે.



નોલેજ બેંક

ગુજરાતી સાહિત્ય નોલેજ બેંક - (૭)

(વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી)



રમેશ પટેલ

- ‘ઘર ઘર મેં પંછી બોલતા’ – નિબંધ સંગ્રહના લેખક કોણા? (ડૉ. ગુણવંત શાહ)
- ‘એકબીજાને ગમતા રહીએ’ – ગ્રંથના લેખિકા કોણ છે? (કાજલ ઓજા વૈધ)
- ‘જેર તો પીધા છે જાણી જાણી’ – નવલકથાના લેખક કોણા? (મનુભાઈ પંચોલી ‘દર્શક’)
- ‘પ્રિયજન’ નવલકથાના લેખક કોણા? (વિનેશ અંતાણી)
- ‘સૌંદર્યની નદી નર્મદા’ના લેખક કોણ છે? (અમૃતલાલ વેગડ)
- ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના હાલના તંત્રી કોણ છે? (કુમારપાળ દેસાઈ)
- ગુજરાત વરનાક્યુલર સોસાયટી તરફથી ગુજરાતી ભાષામાં પહેલું સામયિક ક્રયું પ્રગટ થયું હતું? (બુદ્ધિપ્રકાશ)
- રણજિતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર મહિલા કોણા? (હિરાબેન પાઠક)
- ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના સ્ક્રી પાત્રો ક્યા છે? (ગુણસુંદરી - કુસુમ સુંદરી)

સામાન્ય જ્ઞાન

- હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? (ચાંગદેવ)
- ‘મહાગુજરાત આંદોલન’ની આગેવાની કોણે લીધી હતી? (ઠંડુલાલ યાણિક)
- નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? (કુવરબાઈ)
- ગુજરાતનું સૌથી જૂનું ખુલ્લિયમ ક્રયું છે? (કંદ્ય ખુલ્લિયમ)
- ક્યા વંશના શાસનકાળ દરમિયાન ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર સૌથી વધુ હતો? (સોલંકી વંશ)
- ભારતનું બંધારણ ઘડવામાં ક્યા ગુજરાતી મહાનુભાવે મહત્વની ભૂમિકા ભજવી હતી? (કનેયાલાલ મુનશી)
- નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? (તળાજ)
- ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? (ઇ.સ. ૧૯૨૩માં, પાટણ)
- ક્યા ગુજરાતી મહિલા સ્વાતંત્ર્ય સેનાની એમ.એસ.

- યુનિવર્સિટી, વડોદરાના કુલપતિ હતા? (ડૉ. હંસાબહેન મહેતા)
- ગાંધી વિચારધારા મુજબ ક્રયું વિશ્વવિદ્યાલય કાર્યરત છે? (ગુજરાત વિદ્યાપીઠ)
- ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ‘ફિલ્ડ માર્શલ’ કોણ હતા? (જનરલ માર્શિલશા)
- વેધશાળાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? (ઇ.સ. ૧૯૪૭, અમદાવાદ)
- રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? (પાંડુરંગ વિહુલા વળામે)
- ગાંધીજીએ ક્યા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શાખ રાખવાની છૂટ આપી હતી? (પૂર્ણિમાબહેન પકવાસા)
- ‘આજવા દેમ’ કોણે બંધાવ્યો હતો? (મહારાજ સયાજરાવ ગાયકવાડ)
- કઈ નદી વડોદરા શહેરમાંથી પસાર થાય છે? (વિશ્વામિત્રી)
- મીરાં કઈ સાલમાં ગુજરાતની દારકા નગરીમાં આવીને વસ્યા હતા? (ઇ.સ. ૧૫૩૭)
- ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? (ગાંધીનગર)
- ગુજરાતમાં ડાયનોસોરના હંડાં ક્યાંથી મળી આવ્યાં છે? (રૈયોલી)
- ગુજરાતમાં સૌપ્રથમ ‘નેચર એજયુકેશન સેન્ટર’ ક્યાં આવેલું છે? (હિંગળગઢ)
- ભક્ત કવિયત્રી ગંગાસતીનું વતન ક્રયું હતું? (સમદ્વિયાળા, જિ. ભાવનગર)
- સરકારી કેળવણીનો બિલ્ડિંગ કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? (ગુજરાત વિદ્યાપીઠ)
- કંદ્યમાં ક્રયું આધુનિક ખાનગી બંદર આવેલું છે? (મુંડ્રા)
- ગુજરાતમાં કુલ કેટલા ગામડાં છે? (૧૮૯૮૨)
- ઇ.સ. ૧૮૪૪માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? (ભોળાભાઈ સારાભાઈ)
- દક્ષિણ ગુજરાતનું હવા ખાવાનું સ્થળ ક્રયું છે? (સાપુતારા)

‘પાંજવ’, ૩૦, આનંદ વાટિકા સોસાયટી, સરદાર પુર પાસે,
ગાડાજા રોડ, સુરત-૩૬૪ ૦૦૮ • મો. ૯૮૨૪૯ ૦૦૨૪૪



કારકિર્દી

સિવિલ સર્વિસ કેડર પોલિસી



હિરેન પટેલ

કેડર પોલિસિનો ઉદ્દેશ્ય બ્યુરોકેસીને વધુ ઈન્કલુઝિવ અને ડાયવર્સિફાઇય કરવાનો છે. કોઈપણ રાજ્યમાં જે બ્યુરોકેસી નીતિઓના ઘડતરનું કાર્ય કરે છે તેમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિષ્ઠિત મળે. એવી અમલદારશાહી બને કે દેશના સમાજનું દર્પણ હોય. જેથી દરેક જુથો/હિતો - સમુદ્દ્રાયના પ્રશ્નોને ધ્યાનમાં લઈને નીતિઓ કે યોજનાઓ બને. કોઈપણ રાજ્યના અમલદારશાહી તંત્રમાં રાજ્યના સ્થાનિક અધિકારીઓ (ધર્તીપુરો) તો હોય જ પણ દેશના વિવિધ પ્રદેશોમાંથી આવેલા અધિકારીઓનું પણ સારુ એવું પ્રમાણ હોય. દરેક રાજ્યમાં જેટલા અભિલ ભારતીય સેવકોની જરૂરિયાત હોય તેમાંના ૧/૩ હોમ સ્ટેટમાંથી પસંદ કરવાના હોય છે અને ૨/૩ આઉટ સાઇડરની પસંદગી કરવાની હોય છે. એમ દરેક રાજ્યમાં શક્ય એટલું સમાવેશી (ઈન્કલુઝિવ) બ્યુરોકેસીનું માળખું રચવામાં આવે.

આ નીતિ અંતર્ગત કેડરની ફાળવણી રિઝલ્ટ બાદ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનિલ એન્ડ ટ્રેનિંગ (ડી.ઓ.પી.ડી.) દ્વારા કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા હોમ કેડરની ફાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ ક્યારેક એક્સચેન્જ સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવે છે. ગ્રીજ ક્રમે આઉટ સાઇડર વેકન્સીની સીટો પર એલોકેશન થાય છે અને ચોથા ક્રમે જે ઉમેદવારોએ કોઈ પ્રેફરન્સ નથી આવ્યા કે સિલોક્ટિવ પ્રેફરન્સ આપેલ છે તેમનું એલોકેશન કરવામાં આવે છે.

ઈન્સાઇડર વેકન્સીનું એલોકેશન દરેક રાજ્યોની કુલ વેકન્સીમાંથી ૩% ઈન્સાઇડર વેકન્સી રોસ્ટર પદ્ધતિથી ફાળવાય છે. ઈન્સાઇડર વેકન્સીમાંથી આરક્ષણની બેઠકો અને જનરલ બેઠકો નિર્ધારિત કરવા માટે પાછું ૨૦૦ પોઈન્ટનું અલાયદુરોસ્ટર રચવામાં આવેલ છે. સિવિલ સર્વિસ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા બાદ દરેક રાજ્ય કેડરની જે બેઠકો હોમ કેડર માટે છે તેની સૌપ્રથમ ફાળવણી પાસઆઉટ કેન્દ્રિક્ષા પૈકી રેન્ક-વાઈસ કરવામાં આવે છે.

ત્યારબાદ જે રાજ્યો માઈન સાઇડર વેકન્સીની બેઠકોની સામે પાસઆઉટ કેન્દ્રિક્ષા ઓછા હોય તે રાજ્યમાં એક્સચેન્જ પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે ગુજરાતમાં કોઈ વર્ષે ૧૫ આઈ.પી.એસ.ની જરૂર છે, જેમાંથી ૫ હોમ સ્ટેટ

(ઈન્સાઇડર) વેકન્સી છે, પણ રિઝલ્ટમાં ગુજરાતના માત્ર ૨ જ ઉમેદવારો પાસ થયા છે. તો હોમ સ્ટેટની ત્રણ સીટો ખાલી રહે છે. આ સીટો માટે સૌપ્રથમ એ જોવામાં આવે છે કે, સીટો જે કેટેગરીમાંથી હોય તે સિવાયની કેટેગરીના કોઈ ઉમેદવાર હોમ કેડરમાંથી પાસ થયા છે? તો સીટોને જનરલ, એસ.સી., એસ.ટી. કે ઓ.બી.સી.ના નિયમાનુસાર તબદિલ કરવામાં આવે છે. ત્યારબાદ પણ જે હોમ સ્ટેટની બેઠકો ન ભરાતી હોય તો તેવી બેઠકોને આઉટસાઇડર વેકન્સીમાં કન્વર્ટ કરવામાં આવે છે.

ત્યારબાદ આઉટસાઇડર વેકન્સી પર કેન્દ્રિક્ષાની પસંદગી કરવામાં આવે છે. કેન્દ્રિક્ષા જે જોનને પ્રથમ પસંદગી આપે છે, તેમાંના પ્રથમ પસંદગીના રાજ્યને હોમ-કેડર માનવામાં આવે છે. જેમકે, ગુજરાતમાંથી પાસ થયેલ ઉમેદવાર જોન-૩ પણ્ણીમ ભારતનો હોઈ તેને પ્રથમ પસંદગી આપે તે સ્વાભાવિક છે. તેમાંના ૪ રાજ્યો પૈકી ગુજરાત તેનું પ્રથમ પસંદગીનું રાજ્ય હોય તો તેને હોમ કેડર ગણાય. જે પણ આઉટરને હોમ કેડર મળતી નથી તેમને એ જોનના બીજા રાજ્યની પસંદગી મળતી નથી પણ તેનો દ્વિતીય પસંદગીનો જોન ચેક થાય છે. માનો કે તે ઉત્તર ભારત છે, જેમાંની ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાજ્યસ્થાન નજીક હોવાથી જે સીટ ઉપલબ્ધ હોય તો તેને આપવામાં આવે છે. તેમાં ન મળે તો તીજી પસંદગીનો જોન માનો કે દક્ષિણ ભારત છે તેમાં ફર્સ્ટ પ્રાયોરિટી કણ્ણાટક છે. જે સીટ ઉપલબ્ધ હોય તો આપવામાં આવે છે. આમ, દરેક જોનમાં કેન્દ્રિક્ષાની પ્રથમ પસંદગીના રાજ્યોમાં સીટો ચેક કર્યા બાદ જો કોઈ બેઠક ઉપલબ્ધ ન હોય તો દ્વિતીય પસંદગી દરેક જોનમાં ચેક કરવામાં આવે છે. ત્યારબાદ તૃતીય પસંદગી પ્રત્યેક જોનમાં ચેક કરવામાં આવે છે. જ્યાં સીટ ઉપલબ્ધ હોય ત્યાં ફાળવી દઈ આ પ્રોસેસ પૂર્ણ થાય છે અને આગળના ઉમેદવાર માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આમ, આઉટ સાઇડર વેકન્સી એલોકેટ થાય છે.

સૌથી છેલ્લે જે પાસઆઉટ્સ કોઈ પ્રેફરન્સ આપેલ જ નથી તેમના માટે જે રાજ્યોની વેકન્સી ઉપરની પ્રક્રિયા બાદ બચી હોય તેને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવામાં આવે છે અને રેન્ક અને કેટેગરીના આધારે ઉમેદવારોને ફાળવવામાં આવે છે. આથી વધુ માહિતી માટે યુ.પી.એસ.સી.ની સાઈટ પર કેડક એલોકેશન પોલિસી ૨૦૧૭નો પી.ડી.એફ. ડોક્યુમેન્ટ વાંચો. ■

શાસમાં ભળવા મળો (મંગલ)

પ્રેમનાં બે બોલ સાંભળવા મળો,
આ ધબકતાં શાસમાં ભળવા મળો.
બસ અઢી અક્ષર ઉજાણે જિંદગી,
ના પરોઢી સ્વખને છળવા મળો.
બે હદ્ય ધબકે પછી બસ તાલમાં,
લાગણી, સંવેદના કળવા મળો.
કલરવે ધર ગુંજશે આઠો પ્રહર,
કો' ઝરણ શું રોજ ખળખળવા મળો.
જિંદગીમાં ના જરા મનભેદ હો,
પીડ સંગાથે બધી દળવા મળો.

દર્શા પંક્તા - ભાવનગર • મો. ૯૮૨૮૮ ૦૧૬૨૭

હું ક્યાંક આસપાસ છું

જો તું કરે શોધવાનો પ્રયત્ન
તો
હું તારે હાથવેંત છું
હું ક્યાંક આસપાસ છું,

જો તું કરે હદ્યથી સ્મરણ
તો
હું તારી નજરમાં કેદ છું
હું ક્યાંક આસપાસ છું

જો તું કરે શબ્દોથી મારું રેખાંકન
તો
હું તારી કલામનો અવાજ છું
હું ક્યાંક આસપાસ છું.

જો તું લે હોઈથી મારું નામ
તો
હું તારા હદ્યનો ધબકાર છું
હું ક્યાંક આસપાસ છું

જો તું બનાવે મને તારી હાથની રેખા
તો
હું તારી ડિસ્મતનો તારણહાર છું
હું ક્યાંક આસપાસ છું.

જો તું કરે વર્તમાનમાં મારું નિરૂપણ
તો
હું તારા ભવિષ્યનું ભવ્ય સ્વખ છું
હું ક્યાંક આસપાસ છું....

મિત્રી રાઠોડ - ભુજ, કચ્છ
મો. ૯૮૨૬૬ ૦૫૬૬૬૬

મારા શહેરની સાંજ

મંગલ /
કાચ્ચા
સૂર્ય

જ્યોતિમધ્ય પ્રકાશપુંજ ફેલાવતી
વિહંગના કલરવનું ગુજરન કરતી
જડપભેર આવતી
વાયુવેગે જતી
પતંગિયાની જેમ ઉડયન ભરી
પુષ્પોનો પમરાટ છોડી જતી
જતાં જતાં શ્વામની મોરલી વગાડતી જતી
હમીરસરના નીરમાં ઉદ્ય પામી,
ક્ષિતિજોના શમિયાખામાં સંતાકુકરી રમતી
દેવમંદિરની ઝાવર સાથે સૂર-તાલ મિલાવતી
દેવાશિષ સમા મીઠડા પ્રસાદ સમી લાગતી
હેત છલકાવતી
ઓ મારા શહેરની સાંજ
તું મને “અનેરી” લાગતી.

દીક્ષિતા નવીન વોરા - ભુજ
મો. ૯૮૨૭૭ ૧૮૮૬૬

વિસ્તરી ગાયો

પવન પણ વિસ્તરી ગયો,
સુગંધી આંતરી ગયો.

પવન, પંખે વધૂટતો,
પવન ખુદ ફરફરી ગયો.

નજર એકીટસે ફરી,
અરે શું? ચાતરી ગયો.

પરાકાશા હતી સમજ,
પથારી પાથરી ગયો.

પ્રણય પ્રણાવ બની જતાં,
અભિલ જગ પર તરી ગયો.

કિનારે કાફલો સરે,
નિરામય નીતરી ગયો.

સહજભાવે છબી અસલ,
મને ખુદ ચીતરી ગયો.

અડી જાતો સમય ખબર -
પડી ત્યાં નીસરી ગયો.

વરસતો જાય, ક્યાં પછી -
અચાનક ઉતરી ગયો.

ભૂપેન્દ્ર શેઠ “નીલમ” - ભાવનગર
મો. ૯૫૧૦૧ ૨૮૪૧૮

વડલાને વૃદ્ધાવસ્થા આવી

ગામના પાદરે ઉભેલા એક વડલાને
વૃદ્ધ અવસ્થા આવી ને...
પછી વડલાના ખોળે ઉછરનારા પંખીઓ
તારે મુંજવણમાં મૂકાયા...

શું કરવું, હવે કોના ખોળે રહેશું ને
કોના પર આશરો લઈ ભરશું આપણા પેટ
પંખીઓની નાતમાં હવે એવી ચર્ચાઓ મંડાણી.

વડલાની વડવાઈઓ નીચે હિંયકા લેતી
ગામની દીકરીઓ સાસરેથી આવી ત્યાં તો
વડલાને વૃદ્ધ અવસ્થા આવી ને...
દીકરીઓ વડવાઈઓને યાદ કરીને તે દી
ભારે મુંજવણમાં મૂકાણી...

ગામના પાદરનો વડલો હતો એ વટેમાર્ગુનો સાચો વિસામો
તે હતો શૂરવીર પાળિયાઓનો કાયમી સથવારો.

જ્યાસુખ કુછટિયા “નિવેદી” - રાણાવાવ (ક્રિ. પોરંદર)
મો. ૯૮૨૯૭ ૬૮૧૪૫

સંબંધો

આમ તો આ કુદરત કઠણ નથી હોતી,
પણ એની કરામત સરળ નથી હોતી.
જેની સાથે વહેંચી હોય મનની ઉદાસી,
ખુશી વહેંચવા નસીબ એક પળ નથી હોતી.
મેળવવા ચાહો કશું ને ન મળો તો માનવું કે,
ચાહેત કિસ્મત કરતા પ્રબળ નથી હોતી.
વિતાવવા માગો જે આયખું તમારી સાથે,
એની પાસે બે-ચાર પણી કુરસદ નથી હોતી.
ખરેખર સંબંધો કંઈ વહેવાર નથી “જાનકી”,
છતાં અપેક્ષિત કોઈ વળતર નથી હોતી.

જ્યાસુખ તથા “જાનકી” - મોરણી

સૌ સંપીને તહેવારો ઉજવીએ

દીવા પ્રગટાવીને અંધારી રાતોને અજવાણી છે,
કોઈએ ઈચ્છાઓને આખેઆખી જાણો બાળી છે.
કોઈએ ઘરને રંગોળીથી દીપાલું છો ને આજે,
ભીતર ભીતર સણગે હોળીને ચહેરા પર દિવાળી છે.
જીવન આખું સૂરજ માફક સળગ્યા કરતું સૌનું સાથી,
ઢંડક ટિલમાં રાખીને આફત સધળી સૌંદર્યે પાળી છે.
કાળી રાતો વીતી જાશે ને અજવાણું પણ પથરાશે,
ખોટો ડર ખોટી વાતો જેણે જીવનમાંથી ટાળી છે.
ચાલોને સૌ સંપીને આ તહેવારો ઉજવીએ આજે,
સુખ પામીશું સૌ સાથે ઈચ્છાઓ એવી પંપાળી છે.

જ્યાસુખ કુંડારિયા - રાજકોટ

મંગલ /
કાચ્ય
સૂચિ

પણ

જોઈ લેવા દે બધો વ્યવહાર પણ
તેલ જો ને તેલની એ ધાર પણ
ખોઈ બેઠાં જે બધુંયે ભાવવશ
ચાલ થઈએ એમના આધાર પણ
જિંદગી જીવી જવાતી મોજથી
દુઃખ ને સુખનો કરું સ્વીકાર પણ
એ જ તારા પ્રેમની ખૂબી ગણું
દઈ આપે ને કરે ઉપચાર પણ
એમ શક્તા સો ટચની હોય તો
આખરે પેરાવશે પ્રભુ હાર પણ
આપવું, ના થાકવું, ના માંગવું
વારતાનો આટલો છે સાર પણ

અત્ય નિવેદી - મહુવા (ક્રિ. ભાવનગર)
મો. ૯૯૭૮૮ ૦૬૨૬૦

હાઈકુ

આવી દિવાળી	અમાસ રાત
મોંઘવારી કારણો—	દીવાના પ્રકાશમાં,
રંકની હોળી!	દોરે : રંગોળી.

અમાસ રાત	દીવા કરીને
ધનધોર અંધારું —	અમાસ રાત કરે —
ઉડે : આગિયા!	છે : અજવાણું.

દીપાવલીમાં	લોક પ્રવાસે
ઘર ઘર દીવાઓ —	હિલ સ્ટેશને ભીડ—
ટમટમતાં!	દીપોત્સવીમાં!

અમાસ રાત	દર્શન કરી
આભ કરે દીવાઓ —	છષ્પનભોગ; રંક
દીપોત્સવીમાં.	બાળ છે ભૂખ્યા!

જૂનું વરસ	નૂતન વર્ષે
પસાર થયું; બેહું —	ખરીદ ‘સબરસ’ —
નૂતન વર્ષ!	જુઓ : સત્તારી!

કનકતારા	
સળગાવે ભૂલકાં —	રમેશ પટેલ — સુરત
જુઓ : તારલા!	મો. ૯૯૨૫૧ ૦૦૨૬૫

SOME GOLDEN THOUGHTS....

Presentation : Dinesh R. Mehta

*Every new day
is another chance
to change your life.*

*When you learn to accept
instead of expect,
you have fewer disappointments.*

*May you have all the joy
your heart can hold,
all the smile
a day can bring all the blessings
a life can unfold, may you get
the world's best in everything.*

*Past is a "Waste paper"
Present is a "News paper"
Future is a "Question paper"
So read and write carefully...
Otherwise
life will be a "Tissue paper."*

*I don't need my life
to be perfect.
I just want to be happy,
with a few close friends
who love me just the way I am.*

*In the end,
people will judge you anyway,
So don't live your life
impressing others.
Live your life impressing yourself.*

*Thought for life time :
"If you are not satisfied
with what are you getting
Check what you are giving."
"Give better to get best."*

*Being deeply loved by someone
gives you strength,
While loving someone deeply
gives you Courage.*

- Luo Tzu

*Whenever a problem arrives
do three things –
Face it, Fight it & Finish it.*

*Life is all about moving on,
accepting changes and looking
forward to what makes you
stronger and more complete...*

*If you want to feel rich,
Just count all of the things
you have that money can not buy.*

*You can't win in life
if you're losing in your mind!*

આંજે કાર

દીપોત્સવી અંક : આંખ કે તિલમેં આસમાં!

‘મંગલ મંદિર’ ‘સાહિત્ય સરગમ’ દીપોત્સવ વિશેષાંકનું અવલોકન યથાવાંછિત અતે પ્રસ્તુત છે.

આપના પ્રેરક નેતૃત્વમાં તૈયાર થયેલો આ અંક આપની દાખિસંપત્ત જહેમતની છી પોકારી સંગ્રહણીય બનવા ઉપરાંત અન્ય સમાજ માટે પણ ઉદાહરણીય અને સીમાચિહ્ન સમો બની ગયો છે. યથાપતિ, યથાશક્તિ મેં એને માણીને મૂલવવાનો વિનામ્ર પ્રયત્ન કર્યો છે.

‘મંગલ મંદિર’નો ‘સાહિત્ય સરગમ’ દીપોત્સવ વિશેષાંક નજર સમક્ષ છે.

સામાન્ય રીતે તહેવારો અને ઉત્સવના સપરમા દિવસે લોકો દિવસનો પ્રારંભ મંદિરે જઈ પ્રભુને માથું નમાવીને કરતા હોય છે. પરંતુ દરેક વખતે આ વાત સાચી નથી. જેનું સુંદર ઉદાહરણ આપનું ‘મંગલ મંદિર’ છે! દિવાળી અને શાશ્વત તહેવારોની વધાઈ આપવા અથવા તો એમ કહો કે સુશ્રી વાચક નારાયણની શોધમાં મંદિર સ્વયં પ્રબુધ્ય વાચકોના દ્વારે જાય છે! આ મંદિરના મુખ્યપૂર્ણથી જ એક સરસ કવિતાનો પ્રારંભ થાય છે. અહીં તોરણની જે સાજસજજ છે, તે રાખ્યી તિરંગાની શાન જેવા કેસરી, સફેદ, લીલા રંગથી સુશોભિત છે તો પુર્ણાખૂતિ ફરીને કેસરી રંગથી કરવામાં આવી છે. જે સૂચવે છે કે કેસરી રંગ બળનું પ્રતીક છે. સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ આપણી કૃષિપ્રધાન સંસ્કૃતિનો રંગ છે. સમગ્ર દેશની અસ્મિતાને જાળવવા માટે પ્રત્યેક નાગરિકે તન, મન અને ધનથી રાખ્યાને સમર્પિત થઈ ‘કેસરીયા’ કરવા સદૈવ તૈયાર રહેવું જોઈએ. અને એવી પળને જ દિવાળી માની આવકારવી જોઈએ! તેથી આ તોરણમાં કેસરી રંગનું પ્રાધાન્ય છે.

દીપોત્સવના પ્રતીકરૂપે સરસ મજાના બે દીપકો મૂકવામાં આવ્યા છે અને એની ઉપર રાખ્યુંધરજની જાંયવાળું નભ વિસ્તરે છે. નાનકડો દીપક જીવનું, તો મોટો દીપક પરમાત્માનું પ્રતીક બની રહે છે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે દીવો બળે છે. પરંતુ દીવો કદ્દી નથી બળતો! જે બળે છે એ તો દીવેટ અને દીવેલ છે! એવી રીતે જ્યાં જ્યાં અજવાળું છે ત્યાં ત્યાં કોઈએ જાતને બાળી છે, એનું એ પ્રતીક છે. વળી આ બેઉ દીપકો, એ વાતનું સૂચન કરે છે કે જીતને બાળ્યા વિના ન તો લક્ષ્મીજીને પામી શકાય છે, કે ન તો ગણેશજીને!

સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અધિષ્ઠાત્રી મહાશક્તિ જ્યારે પદ્માવતી રૂપે પ્રકટે છે ત્યારે સોનાના સિક્કા

તો એના આસન, કમળના મૂળ, પાસે પડેલા હોય છે. તે મહાદેવીનું સ્મરણ થતાં જ આપણાથી કહેવાઈ જવાય છે...

“જું પદ્માવતી, પદ્માનેત્ર, પદ્માસન,
લક્ષ્મીદાયિની, વાંધાપુરણી
ભૂતપ્રેત નિગ્રહણી, હુર્જન-મોહિતી
રિદ્ધિ સિદ્ધિ જ્યં જ્યં
જ્યં કુરુ કુરુ સ્વાહા!”

“શરીરના અષ્ટ ચકોમાં બિરાજતા હે માતા પદ્માવતી! પદ્મ જેવા નેત્રોવાળા અને પદ્માસનવાળા મહાદેવી આપ લક્ષ્મી આપનારા છો, અમારી કામનાઓ પૂરી કરનારા છો, દુર્જનોની મતિને મોહિત કરનારા છો. ભૂતપ્રેત જેવી નકારાત્મક ઉજને નિયંત્રિત કરનારા છો. આપને વિનય છે કે આપ અમને રિદ્ધિ આપો, સિદ્ધિ આપો અને સર્વત્ર વિજયનું વરદાન આપો!

કોઈ પણ માતાનું ચિત્ર ભારતીય સંસ્કૃતિમાં પુત્ર વિના અધૂરું હોય છે. આદિશક્તિના પરમ સંતાન અને બધા જ વિઘ્નોના નાશક એવા ગણપતિ ગજાનન મહારાજની સ્થાપના એટલે રિદ્ધિ-સિદ્ધિની સાથે લાભ-શુભની અને વિવેકની પણ સ્થાપના છે. અથર્વવિર્ષા સૂક્ત કહે છે કે, હે દેવ! આપ અમારા સૌના મૂલાધાર ચકોમાં બિરાજે છો અને આપનું આબ્દિન કરીને અમારા સત્કાર્યો નિર્વિઘ્ને પૂરા કરીએ. આપની ઉપસ્થિતિથી અમારું ઘર મંગલ મંદિર બની રહે એવી અભ્યર્થના.

આવી સુંદર સંકલ્પના સાથે શરૂ થયેલો અંક પોતાની સમુજ્જ્વલ પરંપરાની ચશ કલગીમાં એક નવું પીછું ઉમેરતો બની રહ્યો છે. પરસ્પર ઋણ સ્વીકાર એ આપણા સંસ્કૃતિની સુવર્ણમયી ધરોહર છે. તંગીમંડળ દ્વારા સર્જકો અને વાચકોના ઉલ્લેખ સાથે સહુનો આભાર માનતા તંત્રી મંડળની ગરિમા હદ્યને સ્પર્શે છે. તંત્રી લેખમાં દિનેશચંદ્રજાએ આંતરદીપના અજવાળાં પ્રગટાવીને પરિવાર, સમાજ અને રાખ્યની પ્રગતિ માટે મજબૂત સંકલ્પ અને કાર્ય શક્તિનો અનુરોધ કર્યો છે અને સૌ માટે શાશ્વત સુખ અને શાંતિની કામના કરી છે.

વિશ્વનું ચાલકબળ જો કોઈ હોય, તો એ છે સારા વિચારો. એવું કહેવાયું છે કે આ સંસારરૂપી જેરી જાડના બે ફળો અમૃત તુલ્ય છે. એક છે સુવિચારો અને બીજું ફળ સજજનોની સંગતિ. આ અંક દ્વારા આ બંને ફળોની છૂટથી લહાણી કરવામાં આવી છે. એક એક વિચાર એવો છે કે જેની ઉપર અનેકાનેક સમરકંદ બુખારા ઓવારી શકાય એમ છે! ફક્ત એકનો ઉલ્લેખ કરીને આગળ વધીએ....

“એકવાર તમારી પાસે જે નથી એની ચિંતા છોડશો તો

જે તમારી પાસે છે તેનો આનંદ મેળવી શકશો!”

વિચારોની આ અમૃત સરિતા ડૉ. પૂજા કોટક, વિધિન પંડ્યા, ભાલેનનુશોખર જાની, બજુલા ઘાસવાળા, ડૉ. શ્રદ્ધા ત્રિવેદી, હરિદાસ કે. ટક્કર અને વિદ્વાન સાક્ષર ચંદ્રકાંત પટેલ ‘સરલ’જીના લેખોમાં વહેતી રહે છે.

અંકનો, ગાગરમાં સાગર સમેટઠો વિભાગ છે ‘કાવ્ય સૃષ્ટિ.’ શબ્દોની વેધકતાને છંદનો ઘાટ આપી આગળ વધારતી, ખરેખર સુંદર અને ચિરંછુવ રચનાઓ આપણાને આ વિભાગમાં સાંપડી છે. એકાદ બે ઉદાહરણ લઈ આગળ વધીએ.

બ્હાર તો ઉજાસ છે, પણ ભીતરે અફળક અંધકું,
સત્ય ધૂપાઈ ગયું ને દંભનું વાણ દિવાળી.

(ડૉ. નનુભાઈ પ્ર. પંડ્યા)

શબ્દ અજવાયું કરે, રણકાર અજવાયું કરે,
ભીતરી ભંડારનો ચમકાર અજવાયું કરે.

(ડૉ. નિર્દંજન રાજ્યયુક્ત)

મહાકવિ દંડિનું ખૂબ સારું કહે છે કે જો શબ્દરૂપી દીવો ન હોત તો આ આપું જગત અંધકારમય બની જાત. હિંદીના પ્રસિદ્ધ કવિ મૈથિલીશરણ ગુમજી પણ કહે છે...

“અંધેરા હૈ વહાં,
જહાં આહિત્ય નહીં હૈ;
મુર્દા હૈ વહાં,
જહાં સાહિત્ય નહીં હૈ.”

‘મંગલ મંદિર’ની આ સૂરીલી સરગમ કવિતાના સંપુર્ણથી આગળ વધી કર્યાની ધરા ઉપર મીટ માટે છે.

ખૂબ, હુંખ અને લુખ (લૂ)ની વેદનામયી ભૂમિને એક અભિશાપ છે અને તે એ છે કે એની પાસે સંસાધનોના અખૂટ ભંડાર ભર્યા હોવા છતાં કોઈ એના વિકાસ માટે વાયદા અને વાતો સિવાય કશું ન કરતો હોય એવી સ્થિતિમાં એને હુંખી રહેવું પડે છે.

ડૉ. યાસીન દલાલનો અભ્યાસપૂર્ણ લેખ ‘કર્યાના નાના રણમાં મોહું સરોવર બને?’ જો સારી રીતે અમલમાં મૂકાય તો કર્યાની કાયાપલટ કરવા માટે સમર્થ છે.

કર્યા, એ આપણા ગુજરાત રાજ્યનો લગભગ ચોથા ભાગનો વિસ્તાર છે. તેના વિકાસ માટે વિશેષ માવજત અને સંવેદનશીલતાની જરૂર છે. એ વાત આ વિદ્વાન લેખકના તેમજ ત્યાર પછીના લેખ (કર્યાને નવપલ્વિત કરતું ધોળાવીરા ક્ષેત્ર : પ્રા. સૂર્યકાંત ભર્હ) દ્વારા સમયસર નહીં સમજાય તો ધણું મોહું થઈ જશે કારણકે આદાન-પ્રદાન અને કરવા જેવા કામ

જે સમયસર કરવામાં ન આવે તો સમય તેનો રસ પી જાય છે.

એક સરસ મજાની પૌરાણિક આધ્યાત્મિક દ્વારા એવું કહેવાયું છે કે લક્ષ્મીજીએ ગાયોને વિનંતી કરી કે મને તમારામાં સ્થાન આપો. અને ખૂબ આજ્ઞા પછી ગાયોએ લક્ષ્મીજીને કહ્યું : “હે યશદાયિની! અમારે તમારું સન્માન જરૂર કરવું જોઈએ. ભલે, તમે અમારા છાણ અને મૂત્રમાં નિવાસ કરો. અમારી એ બેઉ ચીજો ખૂબ જ પવિત્ર છે.”

લક્ષ્મીજીએ ત્યાં રહેવાનું પસંદ કર્યું અને પ્રસંગતાપૂર્વક એમાં વાસ કર્યો. આજે એ ગોબરમાંથી કલાત્મક ચીજોના નિર્માણની વાત લઈ ડૉ. પૂર્વી ગોસ્વામી ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને આગળ વધારે છે. તેઓ એક કચ્છી દીકરીની વાતનો હવાલો આપીને જે કહે છે તેના પર સૌચે ધ્યાન દેવાની જરૂર છે.

“આજના યુવાનોને ગોબરમાં હાથ નાખવું પસંદ નથી. પરંતુ આ જ ગોબરના વિશિષ્ટ ગુણો સાથે, ‘ગોલ્ડ’ ખરીદી શકાય એટલી કમાણીની શક્યતા ઉભી થઈ ગઈ છે. મહત્વની વાત તો એ છે કે કોરોના વાયરસ પણ કર્મની કઠણાઈ વધારી શક્યો નથી. બલ્કે ‘ગોબર કાફિટ’ દ્વારા મહિલાઓને ઘર બેઠા કમાણી કરવા સક્ષમ બનાવી દીધી છે.”

કૃષિ અને માલધારી સંસ્કૃતિ આધ્યારિત કર્યા માટે એના અર્થતંત્રને સજીવન કરવા માટે અને દરેક હાથને કામ મળી શકે તે માટે આનાથી ઉત્તમ સૂચન કર્યું હોઈ શકે? ફક્ત દિવાળીના જ નહીં અંતરઘટમાં પણ ઉજાસ પાથરી દે એવા આ લેખ બદલ લેખિકા તેમજ ‘મંગલ મંદિર’ના દેણિસંપત્ત તંત્રી મંડળને સલામ કરવાનું મન થાય છે.

કર્યા, ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કચ્છી પ્રજાને એક સૂત્રે જો કોઈ બાંધતું હોય તો તે છે કચ્છી ભાષા. અત્યંત સંવેદનશીલ આ ભાવને વધારી લઈને જ આપણા વડાપ્રધાને જ્યારે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે વખતે, કચ્છી સાહિત્ય એકેડેમિની બેટ ધરી છે. આપણીએ કચ્છી ભાષાનું મહત્વ અને હીર પારખીને જ શ્રી નારાયણ જેશી ‘કારાયલ’ને તે દિશામાં તેમની કામગીરી માટે ‘પદ્મશ્રી’થી નવાજ્યા છે. તો એ દિશામાં કચ્છી ભાષાને ભારતના બંધારણમાં વૈકલ્પિક ભાષા તરીકે સમાવેશ કરવાનો હેતુ પ્રકટ કરતો લેખ એવા જ એક સવાયા કચ્છી શ્રી મહેન્દ્ર સાકરયંદ દોશીજુ દ્વારા લખાઈને આ અંકમાં સવેણા સ્થાન પામ્યો છે. એમના તર્ક અકાટ્ય છે. તો વળી ભાષાને બંધારણમાં સ્થાન મળે એ સમયની તાતી જરૂરિયાત પણ છે. એ વાત સાથે સહુઅં સંમત થવું જોઈએ.

માણસ મનુનો દીકરો છે. એટલે માનવ છે એટલું પૂરું નથી. એ મનન વડે જીવે છે એટલે જ માણસ છે. આ વાતને

ધ્યાનમાં લઈ ચિંતનાત્મક લેખોમાં મનને વશ કરવા તેમજ સુખને સાચી રીતે સમજવાની વાત કમશા: ડૉ. ભાવેશ જેતપરિયા તેમજ ડૉ. કાલિન્ડી પારેખ દ્વારા થઈ છે.

“સાત સમંદર મસી કરું,
લેખિની સબ વનરાઈ;
પૃથ્વી સોં કાગં કરું,
શુદ્ધયુન લિખા ન જાય.”

આ વાતને ચરિતાર્થ કરતો લેખ ‘સત કેરી વાણીના પદોમાં ગુરુ મહિમા’ એક અભ્યાસપૂર્ણ લેખ છે.

ગૌતમ વકાણીનો લેખ ‘મંજુસરના સંતો’ વાંચતા એવું પ્રતીત થયા વિના નથી રહેતું કે...

“સરવર, તુવર, સંતજન
ચોથા બરસત મેહ;
પરમારથ કે કારણે,
ચારોં ને ધરિયા દેહ!”

‘વન વિહારીજી’ દ્વારા આલેખાયેલી ઈતિહાસ કથા શાંતરસને વરેલા સાધુઓ દ્વારા પ્રદેશની રક્ષા માટે અને ઋજુ ઉતારવા માટે કરેલા જંગની વાત વીરરસે મઢી આબેહૂબ આલેખાઈ છે.

“કાશદ્ધા કર બરસજા
જૂઝા વેળ આનંદ,
ઉપાસક શિવશક્તિકા
સો ચારણ કવિયન્દ.”

પરાત્પર શિવ નિત્ય સત્ય સ્વરૂપે બિરાજે છે અને ચારણો તે શિવના ગણો છે. એટલે સત્યની રક્ષા માટે, ન્યાયને માટે આત્મ બલિદાન આપવાની ઉજ્જવળ પરંપરાના તેઓ વાહક છે. આ વિષય ઉપર જે અભ્યાસલેખ ડૉ. બલરામ ચાવડા દ્વારા લખાયો છે, તે તેમની નિષ્ઠાપૂર્વકની જહેમતની સાક્ષી પૂરે છે. આવા લેખ આપણા પ્રદેશની માટીની મહેક જેવા અને અંકનો મહિમા વધારનારા છે. એનો જેટલો મહિમા કરીએ તેટલો ઓછો છે.

શ્રીમતી મંગળાબહેન ચાવડાના કચ્છી ભરતકામનું મહિમાગાન હોય કે પછી લોક સાહિત્યને સથવારે વરઘોડાની પરંપરા અને ગીતોની વાત હોય કે પછી લગ્ન પ્રસંગો અને કૌટુંબિક પ્રસંગોમાં હાસ્ય નિરૂપણની વાત હોય — એવા લેખોએ આપણી ભૂમિના લોક સાહિત્યને હાથવગું કરી આપ્યું છે. ‘અભણ બોલે ને ભાણેલા સાંભળો’ એવી વ્યાખ્યા સાથે વખાણાયેલું લોકસાહિત્ય કાગળના પાના ઉપર આવી આવીને કેટલું આવે? છતાં, જેમ ટીપામાં સમુદ્ર સમાયો છે તેમ અહીં પણ એના નાનકડા તિખારા મહાનલની યાદ આપી ગયા છે. તે લેખકોને હાર્દિક વધાઈ.

આદરણીય સારસ્વત શ્રી ચંદ્રકાંત પટેલ ‘સરલ’જી જ્યારે ‘દિલની જબાન’ ખોલે છે ત્યારે નિત નવા માઈલ સ્ટોન ઉભા થાય છે! આ વખતે તેમણે રમેશ પારેખને મૂલવવા અને મલાવવાનો સુભગ-મંગલ પ્રયત્ન કર્યો છે. અંગુઠાના નખમાં બ્રહ્માંડ દેખાડવું અધરું જરૂર છે પરંતુ અશક્ય નથી એ વાત તેમણે સાબિત કરી આપી છે (ભુજ ખાતે આકાશવાણીમાં કામ કરતાં સ્વાભાવિક રીતે આકાશવાણી રાજકોટને લીધે સૌરાષ્ટ્રના સાહિત્યકારો સાથે પણ અમારો ધરોબો હોય એ સ્વાભાવિક છે). શ્રી અમૃત ‘ધાયલ’ અને શ્રી રમેશ પારેખ બેઉને આકાશવાણી ભુજના સ્ટૂડિયોમાં રેકોર્ડ કર્યા તેમજ અમારા સંચાલનમાં એમની કવિ ઉપસ્થિતિ સાથેની સંગોળ્ણનું અમૂલ્ય સંભારણું આ લેખ દ્વારા અમારા માનસપટે જીવંત થયું છે!)

“મને સૌભાગ્ય કે તારે નગર
જાવા મળ્યા શબ્દા;
ચરણ લઈ દોડવા બેસું
તો વરસોના વરસ લાગે.”

(રમેશ પારેખ)

રમેશજીની વાત આમ સહજ રીતે અને છતાં અસરકારક રીતે થઈ છે તેનું કારણ ‘સરલ’જીનો તેમની સાથેનો અનુબંધ છે, તે વરતાય છે.

દરેક લેખ વિશે કશુંક કહેવું છે પણ —

“તંગ દામન, વકન કમ, ગુલ બેહિસાબ,
ઇન્તોખાબ, અય દસ્તે-ગુલચી! ઇન્તોખાબ.”

(અણાત)

અર્થાત્ જે રીતે જોળી નાની હોય અને સમય ઓછો હોય વળી સામે જ્યારે બેસુમાર ફૂલો પથરાયેલા હોય ત્યારે શું લઉં અને શું મૂર્ખ તે પણોજા કશમકશ એ વાતની સાબિતી આપે છે કે તંત્રીમંડળ કેટલો મોટો ખજનો આ પાનાઓમાં ભરી શકે છે??!

ભાષા, સંવેદના અને શિક્ષણની પ્રા. સંદ્યા ભહુની વાત હોય, ડૉ. એમ.પી. કાકડિયાનો બંગલેખ હોય, ગોરધન ભેસાણિયાની નવલિકા ‘જગંબા’ હોય, ડૉ. અમૃત કાજુયાનો લેખ ‘વંદાને ભગાડવાના હાથવગા ઉપાયો’ કે ‘હોસ્ટેલ લાઈફ’ (ગોપાલકુમાર જે. ધકાણ) હોય — આ બધુંચ એવું લાગે છે જીએ એક નાની છાબડીમાં અનેક તારલાઓ ભર્યા હોય. અહીં ગ્લોબલ વોર્મિંગની વાત પણ છે, પ્રવાસ નિબંધ પણ છે. સ્મરણ પટે તરવરતા સંભારણાં લઈ આવતો વિભાગ પણ છે તો આધ્યાત્મિક ઘટનાને શબ્દ દેહ આપનારા ‘પાનબાઈના પદો’ પણ છે. આમ અનેક રીતે અનેક રસોમાં આ અંક વિલસે (ગરદકે) છે.

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નવી પેઢીને તૈયાર કરતો લેખ હોય કે પછી રંગભૂમિ પર ભજવી શકાય તેવું સરસ એકાંકી નાટક હોય — આ બધું જ્યાં જ્યાંથી સમેટું છું ત્યાં ત્યાંથી છૂટું જાય છે. સાંબેલાધારે વરસતા મેહને કોઈ ખોભામાં કઈ રીતે જીલી શકે??!

પત્રકાર શ્રી જીજોશ પટેલ દ્વારા લખાયેલા ‘રસ નિર્જર’ની વાત સાથે આ નાનકડો પ્રયાસ સમાપન કરવા મથું છું.

કવિક્રી ભૂપેન્દ્ર શેઠ હોય કે પછી કાલિદાસ કે ભવભૂતિ હોય, જ્યારે જ્યારે પ્રેમરસની વાત થતી હોય છે ત્યારે ત્યારે એ સનાતન સત્ય ઉભું હોય છે કે —

“પ્રેમને ઊપર સાથે કોઈ લેવા દેવા નથી,
પ્રેમ તો ગમે તે ઊપરે ‘નીલમ’ જાગે પછી.”

અને તેથી જ તો કોઈ શાયરે સાચું જ કહું છે કે...

“યે આશિક મર નહીં સકતે
યે જિંદા હી દફનાયે જતે હે,
કબ્ર ખોદકે દેખો તો,
ઇતજાર મેં પાયે જતે હે.”

પ્રેમની આવી નિરંતર ચાગ્રામાં એક સરસ મજાનો પ્રણાય ત્રિકોણ પણ હોય છે અને એ છે સર્જક, સંપાદક અને વાચક! આ પ્રણાય ત્રિકોણ નિરંતર બની રહે અને એની વચ્ચે મધ્યબિંદુમાં જ્ઞાનની અધિકારી ભુક્તિમુક્તિદાયિની માતા સર્વ મંગલા સરસ્વતી બિરાજે એવી કામના.

સહુને અભિનંદન સાથે સાદર નમન.

આવું ભગીરથ કાર્ય સુપેરે પાર પાડી વાચકો, અભ્યાસુઓને પણ સંગ્રહક્ષિય અંક આપવા બદલ તંત્રી મંજળને પુનઃ પુનઃ વધાઈ.

જ્યાંતી જોખી ‘શબાબ’ - મુજ, કચ્છ
કોન : (૦૨૮૩૨) ૨૩૦૪૪૪, મો. ૯૪૨૭૭ ૧૬૨૮૮

(શ્રી જ્યાંતી જોખી ‘શબાબ’ની એક વિશિષ્ટતા છે કે, તેઓશ્રી જ્યારે પણ કોઈ પુસ્તક કે સામયિકીનું અવલોકન — સમીક્ષા કરે છે ત્યારે આરંભથી અંત સુધી સંપૂર્ણ રીતે કરતા હોય છે. કોઈ એક વિભાગ નહીં પરંતુ દરેક વિભાગના દરેક લેખ / કૃતિની બારીકાઈથી સમીક્ષા તેઓશ્રી વિસ્તારપૂર્વક કરતા હોય છે. તેમની આ કામગીરી ખરેખર કાબિલેદાદ છે, બિરદાવવા યોગ્ય છે. ‘મંગલ મંદિર’ના દીપોત્સવી વિશેષાંકનો ‘પ્રતિભાવ’ ખૂબ વિગતવાર, વિશિષ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરીને સાબિત કર્યું છે કે, તેમની નજર - દિમાગથી એક પણ બાબત છૂટતી નથી. એકદમ સૂક્ષ્મ મુદ્દાને પણ તેઓ આસાનપૂર્વક આવરી લેતા હોય છે. ખૂબ ખૂબ આભાર!

- મંગી મંડળ)



‘મંગલ મંદિર’ની માતબર વાંચન સામગ્રી
વાચકો માટે રસ્તાળ સમાન

‘મંગલ મંદિર’નો દીપોત્સવી અંક મળ્યો. ‘માતબર વાંચન સામગ્રી’ વાચકો માટે રસ્તાળ સમાન છે. ખૂબ ગાય્યું. મુખપૂછ દિવાળીને ઉજાગર કરે છે. ચંદ્રકાંતભાઈ કાવ્યની ઓળખ સાથે પ્રસ્તુત કરે છે. રસ તરબોળ કરે છે.

એક વિનંતી : આપણા પુરાણો, ગ્રંથો, વેદોમાં — જે રસ સમાન, ધ્રુવતારક સમાન પાયો છે, જેનો પ્રભાવ છે એવા પૌરાણિક પાત્રોને ‘મંગલ મંદિર’માં સ્વીકારાય / એક કોલમ ચાલુ થાય તો સૌને ગમશે. ‘ખોવાયેલાને ખોળી કાટવા’ જેવા પાત્રો છે. યોગ્ય કરશો.

‘મંગલ મંદિર’ વધુ ઉત્કૃષ્ટ બને એવી શુભ કામના.

ખૂપતરાય એમ. ટાકર ‘ઉપાસક’ - દ્રાગધા
મો. ૯૮૨૪૫ ૬૬૨૮૮

(નોંધ : પ્રતિભાવના પ્રેષક એક પ્રતિષ્ઠિત લેખક છે. તેમના તર પુસ્તકો પ્રગત થયા છે અને ‘કુમાર આધ્યાત્મિક પુરસ્કાર’ વિજેતા છે. તે ઉપરાંત ગુજરાતના જાણીતા અભિબારોમાં નિયમિત રીતે પ્રકાશિત કોલમના લેખકશ્રી છે.)



‘મંગલ મંદિર’માં સમાવિષ્ટ પ્રત્યેક કૃતિની પસંદગીનું ધોરણ ઉત્તમ છે. પ્રૂફ રીડિંગ પણ દ્યાનાકર્ષક છે.

‘મંગલ મંદિર’નો માસ ઓગસ્ટ-૨૦૨૧નો અંક મળ્યો. અંકને સહજ નિરખી લેવા વિચાર્યુ, પણ એમ ન કરી શક્યો. અંક એટલો રસાળ અને વેવિદ્યસભર હોવાથી એક જ બેઠકે આખો અંક માણ્યો. ‘મંગલ મંદિર’ના તંત્રી, સહતંત્રી અને સંપાદક — આ માટે ખરા યશના હક્કદાર છે.

મેં ઘણા જ્ઞાતિપત્રો - જ્ઞાતિ અંકો જોયા છે. એમાં મુખ્યત્વે જે જ્ઞાતિને અનુલક્ષીને જ છપાતું હોય છે. જ્યારે ‘મંગલ મંદિર’ એમાં અપવાદરૂપ છે. ‘મંગલ મંદિર’ કચ્છની ગરિમાને સતત ઉજાગર પણ કરતું રહ્યું છે. ‘મંગલ મંદિર’ના અંકમાં તંત્રીલેખથી શરૂ કરીને સંસ્થા સમાચાર સુધીના વિધવિધ એકવીસ જેટલા, મનભાવન વિભાગો આવરી લેવાયા છે. આ અંકમાં સમાવિષ્ટ પ્રત્યેક કૃતિની પસંદગીનું ધોરણ પણ ઉત્તમ છે. પ્રૂફ રીડિંગ પણ દ્યાનાકર્ષક છે. તો અંકની સાઈઝ અને તેમાં વપરાયેલ કાગળ પણ ઉત્તમતાની સાખ પૂરે છે.

સાહિત્યને આવરી લેતું કોઈપણ સામયિક ચલાવું એટલે ઓસરીમાં ધોડાં દોડાવવા જેવું કામ છે. ત્યારે ‘મંગલ મંદિર’ સામયિક આપ છેલ્લા છેંતાલીસ-છેંતાલીસ વર્ષથી,

સાતત્યપૂર્ણ રીતે ચલાવો છે – એ વાત જ કાબિલેદાદ છે. ‘મંગલ મંદિર’ અંકનું સમગ્ર અવલોકન કરતાં તમારા તથા તમારી સમગ્ર ટીમના ઉત્સાહ, ધીરજ, અંત અને ચીવટાનાં દર્શન થાય છે. આ માટે તમને પુનઃ પુનઃ અભિનંદન પાઠવું છું.

અભ્ય નિવેદી – મહુવા (ભાવનગર)
મો. ૯૯૭૮૮ ૦૬૨૬૦



‘મંગલ મંદિર’ – પ્રત્યેક લેખો અને સામગ્રીમાં ઊંડાણ, જે તેની વિશેષતા

‘મંગલ મંદિર’નો દળદાર દીપોત્સવી અંક હાથમાં આવ્યો. તેની સજાવટ અને મુદ્રાંધ્યાનાકર્ષક, સહતંત્રીના સમયાનુરૂપ વિદ્ધિત લેખથી ઉધાડ થતો અંક. અંદર પ્રવેશ કરવા મજબૂર કરે તેવા લેખોની હારમાણા. ન કોઈ છીછરાપણું, પ્રત્યેક લેખોમાં ઊંડાણ. આ તો ‘મંગલ મંદિર’ની વિશેષતા. વિદ્ધાન લેખકો અને વિશાળ મર્મજ્ઞ વાચકવર્ગ તેની સમૃદ્ધિમાં વધારો કરે છે. કેટલીક નિયમિત શ્રેણી જેવી કે પૌરાણિક પાત્રો, વૈદિક કથા, જૈન પુરાણ કથા, હાસ્ય-વંગ, જૈન આચાર્ય - મહાસ્થાધ્યી પારિચય વગેરેમાંથી અંકની ગરિમા વધારે તેવા કોઈ એકાદ-બે નો સાયમિકમાં સમાવેશ કરાય તો વાચકોની રસ-રૂચિમાં વધારો થાય. ‘મંગલ મંદિર’ સાથે નાતો બંધાયાનું આ એક સૂચન માત્ર. બાકી, સમાવિષ્ટ અને નિરંતર જળવાયેલું લેખોનું વૈવિધ્ય વાચક માટે પર્યાપ્ત રસથાળ તો પીરસે છે જ.

ડૉ. અમ.પી. કાકડિયા - ભાવનગર
મો. ૯૯૨૪૦ ૩૦૨૦૩

(નોંધ : આપશ્રીના સૂચન ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક છે. તે સંબંધી જરૂરી વ્યવસ્થા થશે તો, તેવા વિભાગોને સામયિકમાં ચોક્કસપણે સ્થાન આપશું.)



હૃદયની તિજોરીમાંથી પ્રતિભાવ

(પ્ર = વિશેષ, તિ = અસરકારક, બા = તેજ, વ = વાંચન)

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનો ‘મંગલ મંદિર’ સાહિત્ય સરગમ દીપોત્સવી વિશેષાંક લાભ પાંચમના દિવસે અમને ધરે મળતાં – અંક આપવા આવનારને રૂ. ૫૧/- બોણીના આપી, ભવામણ કરી કે દર માસે અંક આવી જ રીતે જલ્દીથી પહોંચાડશોજુ. સાલ મુખારક.

ધરે ઉપસ્થિત સૌઅને નવા વર્ષમાં સૌથી પ્રથમ મળેલું આ કૃપા પ્રસાદી પૂ. લક્ષ્મીજી અને પૂ. ગણેશજીની તસવીરો સાથેના આ અંકને વધાવ્યો.

અંકના ‘રેપર’નું અનાવરણ કરી, મારા પૂ. પિતાશ્રી

(નિવૃત્ત શિક્ષક છે)એ બપોરના જમ્યા પછીની ‘વામકુક્ષી’ને ભૂલીને અંક ખોલીને પ્રથમ જ ‘વતનના રતન’ કવિ રમેશ પારેખ અંગેનો ચંદ્રકાંત પટેલ ‘સરલ’નો દિલની જબાન લેખ વાંચી નાચવા લાગ્યા. કારણકે કવિ રમેશ પારેખના ‘જ અક્ષરનું નામ’ ગ્રંથની શોભાયાત્રામાં તેઓશ્રી શાળાની કન્યાઓની ટુકડી લઈને મતિરાળા ગામદેથી ભાગ લેવા આવેલ, તે પ્રસંગ યાદ આવી ગયો ને રાજી રાજી થઈ ગયા. પૂ. મોરારિબાપુએ કવિ રમેશ પારેખને તેઓને કાંઈક ભાળી ગયેલો કવિ કહેલ...

આજ વગડાવો વગડાવો રૂડી શરણાયું ને ઢોલ...

યોગેશ ભક્ત - અમરેલી
મો. ૯૯૨૪૦ ૧૩૪૬૪



‘મંગલ મંદિર’ એટલે દીપ પર્વનો રસથાળ

ધેર ધેર દીવા પ્રગટે, પર્વોના રાજાનું આગમન થાય, અવસરના ભણકારા વાગે અને સોનાની સવાર ઉગે અને દિવાળીનો પર્વ હેઠાના બારાંશો ટકોરા મારે. તેનું આગમન એટલે પ્રકાશ અને રંગોનો સુમેળ. ઉમ્ભગ અને ઉત્સાહથી સભર નવા વરસનો પહેલો દિવસ એટલે અભિકૃતનો વૈભવ. આવો ધેભવ એટલે ‘મંગલ મંદિર’ના બે પૃષ્ઠો વર્ચ્યે ગુજરાતના નામાંકિત સાહિત્યકારોના વિચારોની સરવાણી.

સૌ પ્રથમ તો કાબ્ય સૂચિ પર નજર જાય તે સ્વાભાવિક છે. બધા જ કાબ્યોમાં દીવાળીની શગને સંકોરી છે. અંધકારમાં પ્રકાશને ઉજાગર કરેલ છે. આ વાંચતા જ હેઠાની ખાટ જુલાઝુલ થાય છે.

આપણા કચ્છ જિલ્લામાં આવેલ ધોળાવીરાને વર્દ્ધ હેરિટેજમાં સ્થાન મળેલ છે તે અંગેનો પ્રા. સૂર્યકાંત ભહેનો લેખ વાંચવો રહ્યો.

ઉપરાંત કચ્છી ભોલીને, ભારતના બંધારણના આર્ટિકલ ઉપર મુજબનો લાભ મળે તે અંગેનો લેખ પણ કચ્છના સાહિત્યકારોએ વાંચી તેનું ચિંતન કરવું જરૂરી છે.

ડૉ. જિઝોશ રાદડિયાએ ‘સંત કેરી વાણી’ના સંદર્ભે જે લેખ લખ્યો છે તેમાં ભજનોનો મહિમા દર્શાવિલ છે. ઉપરાંત ગુરુનો મહિમા પણ પ્રસ્તુત કરેલ છે. આ આધ્યાત્મિક લેખનું મનન કરવું જરૂરી છે.

ચંદ્રકાંત પટેલ ‘સરલ’ની કાયપી કોલમ ‘દિલની જબાન’માં આ વખતે આપણી ભાષાના વિઘ્નાત કવિ રમેશ પારેખની પ્રતિભા વર્ણિત કરેલ છે તે દરેક વાચકને આકર્ષે તેવી છે.

આ ઉપરાંત જૂના વરઘોડા અને તેની પરંપરાના ગીતો પ્રસ્તુત થયેલા છે. ડૉ. જે.કે. ઉમરેઠિયાએ મોટાભાગના વૃદ્ધોને ઘરીભર જૂની યાદોની સરિતામાં નવડાવી દીધા હોય તેથું પ્રતીત થાય છે.

જિફોશ પટેલનો લેખ આજની નવી પેઢીએ તો વાંચવો જ પડશે. તેમાં ભૂપેંડ્ર પટેલ ‘નીલમ’ કવિશ્રી / ગજલકારશ્રીની પ્રેમ રસ વિશેની કાવ્ય/ગજલ પંક્તિઓ ખુશખુશાલ કરી નાખે તેવી છે.

નોકરીની શોધમાં હોય તેવા ઉત્સાહી યુવકોએ હીરેન દવેનો લેખ તો વાંચવો જ રહ્યો.

આ અંકમાં લઘુ કથાઓનો રસથાળ પણ વાંચવા જેવો છે અને પાના નં. ૧૧૬/૧૧૭ પરના ભાવભીના કાવ્યો પણ માણવા જેવા છે.

આમ તો આ અંકમાં દીવડાની હારની જેમ વાતાઓ, લેખ અને કાવ્યોની હારમાળા છે. તેમાંથી મેં શક્ય તેટલું આચ્યમન કરેલ છે અને દીવામાંથી દીવો પ્રગટાવવાનું કામ સુજ્ઞ વાચક કરશે તેમ માનું છું.

આ અંક હાથમાં આવતા જ રિદ્ધિ સિદ્ધિના સ્વામી અને મહિલક્ષ્મીના દર્શન કરાવવા બદલ તંત્રી મંડળનો આભાર. તંત્રી મંડળ અને તેમની ટીમને નૂતન વધ્દીભિનંદન પાઠવું છું.

જ્યેશ ટ્રિક્સ - કડોદરા
મો. ૯૮૨૪૮ ૫૯૫૮૫



પૌરાણિક પાત્રો વિશે લેખમાળાનું સૂચન

‘મંગલ મંદિર’ નિયમિત અને સમયસર મળે છે. આવે એટલે એક જ બેઠકે વાંચી જઈ છું.

આગવી ઓળખ ધરાવતા અલગ અલગ વિભાગોમાં તેને અનુરૂપ સાહિત્ય, જે તે માસના ખાસ ઉત્સવ માટે તેને લગતું સાહિત્ય, તેમજ કોઈ એક વિષયને લઈને લખાતા લેખો તેમજ કાવ્યો, ઉપરાંત શ્રદ્ધા, પર્યાટન, જીવનસાથી, વાર્તા, વિકાસ, સાંપ્રદાત્રી, નોલેજ બંક, કારકિર્દી, યુથ કલબ, માહિતી, વૈવિધ્ય, ગેમ્સ ગેલેરી, નિયમિત વિભાગો દ્વારા તમામ ઉભરના અને તમામ રૂચિના લોકોનો રસ જાળવવા પ્રયત્નશીલ. સાથોસાથ યશ કલગીની શોભારૂપ ચંદ્રકાંત પટેલ ‘સરલ’નો વિભાગ દિલની જાણથી શોભતું ‘મંગલ મંદિર’ ખૂબ જ આવકાર્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

એક નાનકદું સૂચન છે. શક્ય હોય અને અનુકૂળ હોય તો પૌરાણિક પાત્રો વિશે લેખમાળા શરૂ કરી શકાય તો બહુ જ લોકોપ્યોગી અને આજની ભાવિ તેમજ યુવા પેઢી માટે એક અનિવાર્ય આવશ્યકતા પૂરી કરી શકશે. યોગ્ય લાગે તો વિચારજો.

ડૉ. નાનકભાઈ પ્ર. પંક્ત્યા - ભાવનગર
મો. ૯૮૨૪૮ ૫૮૦૫૩

(નોંધ : ઉપરોગી સૂચન અંગે ખૂબ ખૂબ આભાર. તે સંબંધી ચર્ચા નોંધ અન્ય પ્રતિભાવ સાથે આપી છે.)



ભાતીગળ અંકો પ્રગટ કરવા એ ‘મંગલ મંદિર’ની આગવી વિશિષ્ટતા રહી છે

ભાતીગળ અંકો પ્રગટ કરવા એ ‘મંગલ મંદિર’ની આગવી વિશિષ્ટતા રહી છે. આકર્ષક રંગ અને મોહક ચિત્રથી શોભતો ગુજરાતની અસ્મિતા – રાસ-ગરબા અંક પણ સોને મેં સુદાગા સમાન બન્યો છે. વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પીરસવું ‘મંગલ મંદિર’નું આગવું લક્ષણ છે. જે એના ભાવકો - વાંચકોને વાંચવા માટે સતત પ્રેરે છે. આબાલવૃધ્ય સર્વ એમાંથી રસસ્વાદ મેળવી શકે છે. નોખી નોખી વાનગીઓનો અનોખો રસથાળ એટલે ‘મંગલ મંદિર’ એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

વાંચકો નવા અંકની પ્રતીક્ષા કરે એ જ સામયિકની સફળતાની પારાશીશી છે.

આટલો સુંદર અને વાંચન સભર અંક તૈયાર કરવા બદલ આપનો તથા સહભાગી સર્વેને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સામયિક ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે એવી હુાંદું.

ખાસ વિનન્દ્ર સૂચન : મોટાભાગના લોકો અને વાંચકો પૌરાણિક પાત્રોના માત્ર નામ જ જાણે છે. તેમના જીવન પરિચયથી અજાણ છે. એટલે વિવિધ વિભાગો સાથે આપણા પૌરાણિક પાત્રોનો પરિચય આપતો નવો વિભાગ ઉમેરાય તો અંકને ચાર ચાંદ લાગી જશે. અનુકૂળતા પ્રમાણે અમલ કરવા વિનંતી છે.

આનિદ્રા ભજ - લિંગતનગર

(નોંધ : “આપણા પૌરાણિક પાત્રો” અંગે ખૂબ સરસ સૂચન છે. તે કોલમ સંબંધી ચર્ચા વ્યવસ્થા થતાં, સામયિકમાં તે વિભાગને યોગ્ય સમયે ચોક્કસ સ્થાન આપશું.)



દીપોત્સવી અંક પર કંકુ છાંટણા...

હું હંમેશાં હર દીપોત્સવી અંક પર કંકુ છાંટણાં કરી વધાવું છું, ઓવારણા લઉં છું કેમકે ત્યાં સરસ્વતી લક્ષ્મીનો સમન્વય થાય છે. સમજાય તો ઘણું. મને તેમ કરતું ગમે છે.

જેમ શ્રી કેલાસ - માનસરોવરનું નીર નિર્મલ હોય છે તેમ તંત્રીશ્રી - સંપાદકશ્રીની નીર-કીર નિર્મણ દણ્ણ સાથે Positive Thinking – Mind સાથે Positive Ora (ઓરા) થકી ‘મંગલ મંદિર’નો દીપોત્સવી અંક આકર્ષક, નયનરમ્ય, દળદાર બન્યો છે. વધુ ઉમેરાય તો પઠનીય, અભ્યાસનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ ગૌરવ પ્રાપ્ત કરે છે.

દીપાવલી અંક વાંચતા જ મન પ્રહુલિત તથા ચહેરો હસતો બિલબિલાટ શો ભાવ અનુભવે છે.

દરેક વિભાગ - સ્તંભ Master Piece! હર લેખક - કવિની સંવેદના - સ્પંડનો સતત સ્પર્શ કરતા રહે છે. સૌને મારો પ્રેમભર્યો આવકાર.

સંપાદકશ્રી હિનેશભાઈ મહેતાનો વિશેષ આભાર. આપનું સંપાદન જાદુભર્યો અને મસ્ત-મસ્ત હોય છે. દરેક અંક વાંચવાની મજા આવે છે. સંપાદકીય - ટીમવર્ક - ચીવટભર્યો Marvellous - અભિનંદન, શુભેચ્છા.

તો કરો પ્રશ્નાં મધુર 'મંગલ મંદિર'ની
કાયમી કદર થાય 'મંગલ મંદિર'ની.

મૂળેનું શેઠ 'નીતમ' - જમનગર
મો. ૮૫૧૦૧ ૨૮૪૧૮



'મંગલ મંદિર' દીપોત્સવ સાહિત્ય સરગમ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના મુખ્યપત્ર 'મંગલ મંદિર' દિવાળી વિશેષાંકના ૧૩૦ પૃષ્ઠો પર ૮૦ જેટલી રચનાઓથી સમૃદ્ધ 'દીપોત્સવ મંગળા ગુજરાત' હૃદયંગમ રહ્યું. આ અંકમાં ગુજરાતના ૨૬ સ્થળોએથી ૭૨ જેટલી રચનાઓ પ્રેષિત છે. એના કલમકારોમાં, અધ્યાપન ક્ષેત્રે કાર્યરત ૨૧ Ph.D. થયેલા છે. આમાં સાત મહિલા પ્રાદ્યાપકો પણ છે. મોટાભાગની રચનાઓ રાજકોટ, અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, આણંદ, મોરબી, ધોણકા, તલોંદ તેમજ અન્ય સ્થળોએથી આવેલી છે. ૭ કચ્છથી (ભુજ-૪, અંજાર-૨, માંડાલી-૧) આવેલી છે. આ હકીકત 'મંગલ મંદિર'ની સાહિત્યિક સામયિક તરીકેની ગુજરાતમાં સાર્વભિક પ્રતિષ્ઠાની સૂચક છે.

હું કચ્છનો વતની હોતાં આ અંકમાં મારા માટે, બલકે સમસ્ત કચ્છીઓ માટે ગૌરવપ્રદ બે વિશેષ બાબત પણ નોંધપાત્ર છે. શ્રી કચ્છી સમાજ - અમદાવાદ અને શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના સંયુક્ત ઉપક્રમે, તા. ૧૭-૧૦-૨૦૨૧ના રોજ, કચ્છના વિકાસ કાર્યો અંગે ચિંતન શિબિરનું આયોજન થયું તેમજ જ્લોબલ વિકાસ ટ્રસ્ટ અને કૃષિ વિકાસ ઈનોવેશન ટેવલપમેન્ટ એસો. (કિડા)ના સમર્પિત સેવાભાવી મહાનુભાવો અને ઉપરોક્ત સંસ્થાઓની પ્રવૃત્તિઓનો વિસ્તૃત માહિતીસભર અને પ્રેરક પરિચય થયો. અન્ય રસપ્રદ બાબત આ અંકના અંતિમ પૃષ્ઠ પર છે. કચ્છ, કચ્છીયત અને કચ્છી ભાષાનો મહિમા ઉજાગર કરતી, શહોની કરકસર અને એકાકારી શાલ્દોની પ્રભાવી અસર બાખુબી દર્શાવતી, શ્રીમતી ફાલ્ગુની હીરેન શાહની કચ્છી કવિતા છે. તાજેતરમાં અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં આયોજિત 'કાવ્ય યજ્ઞ' કાર્યક્રમમાં ફાલ્ગુનીબેને, અન્ય ભાષાના કાવ્યો સાથે આ કચ્છી કાવ્ય પણ પ્રસ્તુત કર્યું હતું. તંત્રી

મંડળને મારો અનુરોધ છે કે, આ બાબતની નોંધ, ડૉ. કંતિ ગોર, મુખ્ય તંત્રી 'ચીંગાર', કચ્છી સાહિત્ય અકાદમીનું મુખ્યપત્ર, ને મોકલે.

સરસ સાહિત્ય સરગમ દીપોત્સવ વિશેષાંક આપવા બદલ તંત્રી મંડળને ભાવસભર અભિનંદન.

હંસરાજ કંસારા - દિલ્લી
('શાતિસેતુ'ના મુખ્યતંત્રી તથા 'કચ્છશ્રુતિ'ના પૂર્વ મુખ્યતંત્રી)
મો. ૮૫૪૮૩ ૨૬૩૬૬



'મંગલ મંદિર' : દિવાળીના અવસરે મીઠાઈનો થાળ મળ્યો

'મંગલ મંદિર' દીપોત્સવી અંક પ્રામ થયો. અઢળક અભિનંદન સહ અદકેરો આભાર.

'મંગલ મંદિર' હાથમાં લઇ વાંચતો ગયો એટલે જાણે મંદિરની પ્રસાદી આરોગવાની અનુભૂતિ થાય. દિવાળી ટાણે મનગમતી મીઠાઈનો થાળ મળ્યો હોય એવું લાગ્યું.

જરેખર સાંપ્રત સમયમાં મેગેજિનો કટોકટીભર્યો સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એવા સમયમાં 'મંગલ મંદિર'ની લેખન - વાંચન સામગ્રીનું વૈવિધ્ય, સુધાર છાપકામ, છાપકામના કાગળોની ગુણવત્તા અને ૪૫ વર્ષ જેટલા દીર્ઘકાળથી નિયમિતપણે પ્રગટ થતા રહેવું એ સામૂહિક સંયેતના અને નિષાપૂર્ણ પ્રયત્નો વિના શક્ય જાણાતું નથી. એ બધું જ એક પ્રવાહમાં ભણે ત્યારે જ 'મંગલ મંદિર'નું નિર્માણ શક્ય બને.

પુન: 'મંગલ મંદિર' સહ આપ સૌને અને શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદને સાભાર અભિનંદન.

પ્રભુદત ભક્ત - ભર્યા



રસપ્રદ વાંચન સામગ્રી : 'મંગલ મંદિર' દિવાળી વિશેષાંક

'મંગલ મંદિર'નો વાચકવર્ગ વિશાળ અને પ્રભુદ્ધ છે. કચ્છી - ગુજરાતી સાહિત્યના શિરમોર સર્જકોની કલમે સાહિત્યની જ્યોત અહીં પ્રગટ થતી જોવા મળે છે.

દિવાળી વિશેષાંક હારા મેગેજિનમાં રસપ્રદ વાંચન સામગ્રી પીરસી છે જેમાં ટીમ મેબર્સની મહેનત જોઈ શકાય છે. આ વિશેષાંક લેમિસાલ બન્યો છે. આ દીપોત્સવી અંકમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને પણ મળ્યું એનો રાજ્યો છે. તંત્રી, સહાયી, પરામર્શકો સર્વશ્રીની મહેનત, અનુભવ અને ચીવટને સલામ છે. ખૂબ ખૂબ આભાર.

ડૉ. પૂર્વી ગોટ્યામી - ભુજ
મો. ૮૮૨૪૯ ૨૦૪૮

પુસ્તક પરિચય

અવલોકન : હંસરાજ કંસારા - ડિલ્વી

“રણ, જણ જણનું”

લેખક : ડૉ. ધીરેન્દ્ર મહેતા - ભુજ, કચ્છ

આ સારગર્ભિત શિર્ષક ધરાવતા ગ્રંથના અંતિમ પૃષ્ઠો પર એક કાવ્ય છે, રણમાં ઉત્સવ. આ કાવ્યનો ધ્વનિ છે, ‘જણ જણનું રણ જુદું’, એમ કહી, આ ગ્રંથના લેખક, કચ્છના ભૂમિ-વિશેષ ‘જણ’ની આગવી રણજણ પ્રસ્તુત કરે છે. આ ગ્રંથના પ્રકાશકીયમાં ડૉ. કુમારપાણ દેસાઈ જણાવે છે કે, “ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર શ્રી ધીરેન્દ્ર મહેતાના કચ્છની અસ્મિતા, સાહિત્ય અને ભાષાને લગતા લેખોનો આ સંગ્રહ છે.” એનું પ્રકાશન રસિકલાલ પરીખ સ્મૃતિ ગ્રંથમાં અંતર્ગત, ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા થયું છે. આ ગ્રંથમાં લેખકના સમયાંતરે પ્રસંગોપાત પ્રસ્તુત, નિબંધોનું સંકલન છે.

પ્રારંભે, પ્રદેશ-વિશેષ પરિવેશમાં સંઘર્ષરત કચ્છી માડુ અને એની કચ્છીયત દર્શાવતા ડૉ. જયંત ખગીની વાર્તા ‘ધાડ’ અને ‘ખરા બપોર’ તેમજ લેખકની પોતાની નવલકથા ‘છાવણી’ના એક એક પ્રસંગ વર્ણની લેખક કહે છે કે, “પ્રતિકુળ પરિસ્થિતિ વચ્ચે પણ અડગ વતન-પ્રેમ અને વિપરીત સંયોગોમાં પણ સ્વત્વ જાળવી રાખવાનું બળ ધરાવતો માણસ દિલોજાનથી કચ્છી છે. ... એનો, એની ભૂમિ પ્રત્યેનો પ્રેમ, ‘કચ્છીયત’નું મુખ્ય લક્ષ્ણ છે, જે પડકારણ પરિસ્થિતિ હોય ત્યારે આપમેને ભીતરથી જાગી ઉઠે છે. કચ્છીયતની આ વ્યાખ્યાને અનુરૂપ એક ઉદાહરણ અત્રે ઉલ્લેખનીય છે. ૧૯૬૦માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ સરદાર સરોવર ડેમ નિર્માણ પ્રતિરોધક તત્વોને પડકારવા આહવાન કર્યું. એના પ્રતિસાદમાં કચ્છી શ્રેષ્ઠી શ્રી દામજુભાઈ ઓકરવાલાના નેતૃત્વ હેઠળ મુંબદમાં વસતા કચ્છીઓ તેમજ ગુજરાતના અન્ય ક્ષેત્રોના વતનીઓએ, ત્મી જૂન, ૧૯૬૦ના રોજ એક પ્રચંડ મહારેલીનું પ્રદર્શન કર્યું. આ અભૂતપૂર્વ રેલીના વિસ્તૃત અહેવાલો ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી અખભારોમાં પ્રકાશિત થયા. પરિણામે સરદાર સરોવર ડેમ નિર્માણ કાર્યને સાવન્ધિક સમર્થન મળ્યું. પડકારજનક પરિસ્થિતિમાં ‘કચ્છી માડુ’ની કચ્છીયત અને એના ખમીરનાં પારખાં થયાં.

એક અન્ય લેખમાં ‘ભારત પછ્યમ અચ્છો દેશ...’ વર્ષ ૧૯૮૦માં ગુરુ પંચમીને રોજ ‘ભારતીય સંસ્કૃતિ દર્શન’ સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે કવિ કુલગુરુ ઉમાશંકર જોશીએ ઉપરોક્ત

પંક્તિ કંડારી હતી, તે જણાવી ધીરેન્દ્રભાઈ, આ સંસ્થાના સ્થાપક શ્રી રામસિંહજી રાઠોડના પરિચય સાથે, ‘કચ્છ સંગ્રહાલય’ની રસપ્રદ માહિતી આપે છે.

કચ્છના પ્રદેશ-વિશેષ સાહિત્યનો ‘કેલિડોસ્કોપ’ પ્રસ્તુત કરતાં લેખક કહે છે કે, ‘વિષમ અને વિકટ ભૌગોલિક સ્થિતિને લીધે, વિશ્વથી વિખૂટા પડેલા આ પ્રદેશના માનવીની વિચ્છેદ દશાએ, અને આ ભૂમિની છાતીસરસો ચાંપી રાખ્યો. એના ભૂમિરાગે અને ‘કચ્છી’ તરીકેની ઓળખ અને ‘કચ્છીયત’ની સંજ્ઞા આપી. સમગ્ર કચ્છી સાહિત્યનો મુખ્ય નિરૂપણ-વિષય વતન-પ્રેમ રહ્યો છે.’ વધુમાં લેખક કહે છે કે, “આ પ્રદેશ ત્રિભાષી છે. કચ્છી, ગુજરાતી અને સિંહી. આ ત્રણો ભાષાઓનો પારસ્પરિક પ્રભાવ અને તેનો સાહિત્ય સર્જનમાં વિનિયોગ થતો રહ્યો છે. પ્રદેશ-વિશેષ પ્રતિકલ્યન, અલંકાર જેવા અભિવ્યક્તિને અર્થપૂર્ણ બનાવતા કલાતત્ત્વો પણ સંપડાવે છે. એનું નિર્દર્શન પણ આ પ્રદેશની સાહિત્ય ફૂતિઓમાં જોવા મળશે. આ પ્રદેશ સાહિત્યની દઢ રેખાઓમાં કયાંક વિશ્વ સાહિત્યની ઝાંય પણ જોનારને દેખાશે.”

કચ્છમાં સાહિત્ય સર્જન પ્રવૃત્તિને સમયાંતરે પ્રભાવિત કરનારા પરિબળોને અનુલક્ષીને કચ્છના પ્રદેશ-વિશેષ સાહિત્ય પ્રવાહોનું લેખકે ઈતિહાસલક્ષી અવલોકન કર્યું છે. કચ્છના વિપુલ અને વૈવિધ્ય સભર (કંઠસ્થ) લોક સાહિત્યનું ગુજરાતી લિપિમાં લેખન ૧૮૫૬થી શરૂ થયું, જેનો પ્રારંભ, અને એકંદું કરવાનો પ્રયાસ જીવરામ અજરામર ગોરે કર્યો. તત્પશ્ચાત કારાણી સહિત જે જે સારસ્વતોએ અને સમૃધ્ય કરવાના પ્રયાસો કર્યો તેની લેખકે વિગતવાર નોંધ લીધી છે. કચ્છની કાવ્ય પરંપરા, સંત પરંપરા સાથે જોડાયેલી છે. એનો પ્રારંભ સંત મેકણાની વૈરાગ્ય અને તત્ત્વબોધસભર સાખીઓ, પદો અને ભજનોથી થયો. કચ્છી કાવ્ય સાહિત્યના વિકાસનું બીજું પ્રભાવક પરિબળ ઈ.સ. ૧૯૪૮માં સ્થાપાયેલી પ્રજભાષા પાઠશાળા અને એની પ્રબોધેલી પરંપરાનો લેખક સંક્ષિમ પરિચય આપે છે.

‘ભાષા મોરચે બે લડાઈ’ લેખકે, આ લેખમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એમના યોગદાન બદલ એનાયત થયેલા, રણજિતરામ સુવર્ણ ચંદ્રકનો મહિમા કથ્યો છે. તત્ત્વમયે એમણે આપેલા પ્રવચનમાં કદ્યું કે કચ્છમાં કચ્છી અને ગુજરાતી બે ભાષાનું ચલાણ છે. એને લીધે, એમના બૃહદ્દ ભાષા પ્રદેશમાં ભાષાનું એક વિલક્ષણ સ્વરૂપ ‘કચ્છી ગુજરાતી’ ઉભું થયું છે, જેનો એમણે એમના સાહિત્ય સર્જનમાં વિનિયોગ કર્યો છે.

કચ્છી લોક સાહિત્યથી લઈને વીસમી સદી સુધીના પૂર્વાઈ સુધીનો કચ્છી ગુજરાતી સાહિત્યના કમિક વિકાસની ઈતિહાસમૂલક વિગતોની વિસ્તૃત ચર્ચા પછી લેખકે દુલેરાય કારાણી, તેમના સમકાલીનો અને અનુકાલીનો એ સમૃધ્ય કરેલાં

કચ્છી, ‘કચ્છી ગુજરાતી’ સાહિત્ય અને તેના સર્જકોનો વિસ્તૃત પરિચય આપ્યો છે. તેઓશ્રી લખે છે કે, ‘કારાણીની કાવ્ય પ્રવૃત્તિના સમયના દીર્ઘપટનો પથરાટ, કચ્છી કવિતામાં સ્વરૂપ અને શૈલીનું વૈવિધ્ય અને નાવિન્ય સાથે આવેલું છે. આમ છતાં એમાં બહુધા કચ્છી કવિતાની પ્રચલિત લઢણ પરખાઈ આવ્યા વગર રહેતી નથી.’

કચ્છીમાં ‘ગદ્ય લેખન’ની ચર્ચા કરતાં લેખક કહે છે કે, પ્રતાપરાય શિવેદીના મત મુજબ, કચ્છમાં ગદ્ય લેખનનો આરંભ કારાણી અને એના સમકાળીનોની નાટ્ય લેખન પ્રવૃત્તિથી થયો. કચ્છના ગુજરાતી ભાષા ગદ્યલેખનમાં બહુલેશ પછી જ્યંત ખત્રી તેમજ એમના સમકાળીનો અને અનુકાળીનોની વિસ્તૃત ચર્ચા કરી છે. અતે લેખકે ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે એમના પોતાના યોગદાનની પણ થથોચિત નોંધ લીધી છે. ઈ.સ. ૧૮૭૦થી કચ્છીઓએ જેઠેલા પત્રકારત્વની સામાયિકો પૂરતી સંક્ષિપ્ત નોંધ લીધી છે.

આ પુસ્તકના બે અન્ય અભ્યાસ નિબંધ (૧) સાગર કથા

કચ્છ દર્શન

(અનુસંધાન : પાના નં. - ૬૫ ઉપરથી ચાલુ)

ઈનોવેશન ક્ષેત્રમાં બે FCBA એવોડ રિઝર્વ બેંકના પૂર્વ ડી.જી.એમ. દ્વારા વેરાવળની ઉપરોક્ત બેંકને એનાયત થયેલ છે. જે જ્ઞાતિ માટે ખરેખર ગૌરવપૂર્ણ બાબત છે.

ગિરીશ નારાણજીભાઈ શાહ

E-mail : shah555girish@gmail.com

ભુજના પ્રબોધ મુનવરને ‘કોરોના યોજ્ઞા’ સંમાનપત્ર અર્પણ કરાયું

કોરોના વાયરસ (કોવિડ ૧૯)ની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાખ્યાં હતે પોતાનું યોગદાન આપનાર ‘માનવ જ્યોત’ સંસ્થાનાં પ્રબોધ મુનવરને રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદૂ હસ્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોના યોજ્ઞા સંમાનપત્ર તાજેતરમાં અર્પણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજ્યપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી મુનવરે કોરોના કાળ દરમિયાન ‘ભૂખ્યાને ભોજન’ પ્રવૃત્તિ દ્વારા ભુજ વિસ્તારનાં ૨૧ ગામોમાં રસોડા શરૂ કરાવી અછી લાખ લોકોને જમાડ્યા હતા. જેની રાજ્યકક્ષાએ નોંધ લેવાઈ હતી. ■

અને કચ્છ; તેમજ (૨) ‘કચ્છમાં ભવાઈનું સ્વરૂપ’ વિશેષ ઉલ્લેખનીય છે. તહુપરાંત ‘કચ્છના નારી સર્જકો’ પુસ્તકની સમીક્ષા કરતાં નિબંધમાં ધીરેન્દ્ર મહેતાના અધ્યયન અને અધ્યાપન અનુભવ તેમજ વિવેચન કૌશલનો વિશેષ પરિચય થાય છે. આ લેખમાં એમના અવલોકન સાથે ટીપ્પણીઓ શિક્ષાપ્રદ છે.

સમગ્ર દાણિએ જોતાં, આ ગ્રંથમાં કચ્છી માટુ, એની ‘કચ્છીયત’ તેમજ એના ગુજરાતી તેમજ કચ્છી ભાષા સાહિત્ય સર્જનનું અભ્યાસપૂર્ણ વિહંગાવલોકન છે.

અંતમાં, આ ગ્રંથની એક અન્ય વિશેષતા એના મુખપૂર્ણનું આકલ્યન છે. આ મુખપૂર્ણમાં પ્રથમ અને અંતિમ પૂછે, એક તરફ કચ્છી માટુનું વેરાન રણ છે, જે પ્રત્યેક કચ્છી માટે પોતીકું છે અને અંતિમ પૂછે એ રણની વિશાળ એકલતાની સુંદરતાનો લોપ કરતા –, એ રણમાં ઉગેલા આધુનિક ભૂંગાઓ છે. લેખક ગ્રારંભે જ સ્પષ્ટ કરે છે કે એ રણ કચ્છીઓનું નથી જ નથી. આ દાણિકોણ લેખકનો કચ્છ અને કચ્છના પરિવેશ પ્રત્યેનો લગાવ વ્યક્ત કરે છે.

અવલોકનકર્તા : મો. ૮૫૪૮૩ ૭૬૩૬૬

છગીની નાવડી

(અનુસંધાન : પાના નં. - ૬૬ ઉપરથી ચાલુ)

આગળ વધતી જાય. બંને બચ્યા ગીત ગાતા જાય.

છગીની તો નાવડી બનાવી, વરસાદે તો મજા કરાવી; છગીએ જીલ્યો બંનેનો ભાર, રસ્તામાં આવ્યું ચકીનું ઘર.

ચકીનું બચ્યું કૂદકો મારીને નીચે ઉતરી ગયું. નાવડીને એક ઘક્કો માર્યો. નાવડી ચાલવા લાગી.

મરધીનું બચ્યું હવે એકલું નાવડીમાં પાંખો ફેલાવતું જાય ને છબદ્ધ કરતું જાય. ત્યાં સામે ઘર દેખાયું. મા ઘરની બહાર રાહ જોતી જ ઉભી હતી.

મા ને જોઈને મરધીનું બચ્યું નાવડીમાંથી કૂદી પડ્યું. નાવડી એના પર ઊંધી પડી. મા દોડીને આવી. છગી ઊંધી કરી, બચ્યાને જલ્દી જલ્દી ઘરમાં લઈ ગઈ.

ઘરમાં જતાં બચ્યાને આવી છીંક, એ જોઈને માને લાગી બીક બચ્યું બહાર ફરી આવ્યું, નવી બીમારી ઘરમાં લાવ્યું.

બચ્યું બોલ્યું : ‘ઓ વહાલી મા... આ બીમારીની છીંક નથી. આ તો છગીનો સણિયો નાકમાં ભરાઈ ગયો હતો એની છીંક આવી.’

બચ્યાની વાત સાંભળી મા ને થઈ હાશ. બન્યું નથી કરી ખાસ....

૩૮૮, મંગલેશ્વર, પો.નો. નં.-૧૨,
આંધ્રપ્રદેશ, કર્ણા. • મો. ૯૩૯૯૫ ૫૮૭૮૮

કચ્છ દર્શન

શ્રી અને વિશ્વાસથી સંયમના માર્ગે પ્રયાણ ભુજ મધ્યે વંદનકુમાર અને અજેશભાઈનો દીક્ષા મહોત્સવ ઉજવાશે

વિશ્વ વાલેશ્વર વીર વિભુની વાટે વિચરવા માટે થનગનતા મુમુક્ષુ વંદનકુમાર સુનિલભાઈ કારાજી (નારાશપુર) તથા મુમુક્ષુ અજેશભાઈ પ્રબોધ મુનવર (કોઠારા) નવેમ્બર માસમાં ભુજ મધ્યે દીક્ષા અંગીકાર કરશે.

અચલગઢાધિપતિ શાસન સમ્પ્રાટ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મ.સા., જિન શાસન શિરોમણી, અચલગઢાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશિષથી તેમજ અચલગઢાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. પાસેથી દીક્ષાનો મુહૂર્ત મેળવી ભુજ પધારેલા બંને મુમુક્ષુઓનું શ્રી અચલગઢ જૈન સંધ - ભુજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.

દીક્ષા પ્રસંગે ભુજ અચલગઢ જૈન સંધ દ્વારા ચતુર્દશાન્તિક પ્રભુભક્તિમય પ્રસંગ પ્રયાસ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. બંને મુમુક્ષુઓને ભુજ મધ્યે પ.પૂ.આ.ભ. શ્રી કવીન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા. પ્રવજ્યા પ્રદાન કરશે. પૂ. મુનિરાજ શ્રી રાજરત્નસાગરજી મ.સા., આદિ શ્રમણ - શ્રમણીવૃદ્ધ મહોત્સવે નિશા આપશે.

ભુજ નજીક જૈનોના વર્ધમાનનગર મધ્યે સાધુ-સાધીજની પાવનકારી નિશામાં અજેશભાઈની દીક્ષા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વર્ધમાન નગરે વરસીદાન વરધોડામાં સ્થાનિક, જ્ઞાતિ તથા વિવિધ સંસ્થાઓના હોદેદારો અને અગ્રણીઓ તેમજ સમાજ પરિવારજનો બહોળી માત્રામાં જોડાયા હતા. શ્રી વર્ધમાન નગર જૈન સંધ દ્વારા મુમુક્ષુ અજેશભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું. તે રીતે, મુમુક્ષુ અજેશભાઈનો વરસીદાનનો વરધોડો કોઠારા - સાંધવમાં પણ વાજતે ગાજતે નીકળ્યો હતો. આ પ્રસંગે શ્રી ક.દ.ઓ. જૈન જ્ઞાતિ મહાજનશ્રી - કોઠારા તથા માતુશ્રી કસ્તુરભાઈ હીરાચંદ મુનવર પરિવાર દ્વારા કોઠારા ગામે ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન થયું હતું. સાંધવ ગામે દરેક શ્રી સંધો દ્વારા દીક્ષાર્થીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

કચ્છ - ભુજથી પશ્ચિમ બંગાળનો યુવાન ૩ વર્ષ પછી ઘરે પહોંચ્યો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાનાં સીમાલીયા ગામનો ૩૮ વર્ષથી યુવાન સંજ્યદાસ છેલ્લા ૩ વર્ષથી ગુમ હતો.

પરિવારજનો તેને સતત શોધી રહ્યા હતા.

ભુજના માર્ગે ઉપર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ - ભુજના પ્રબોધ મુનવર તથા તેમના સાથીની નજરે ચડતાં તેને 'માનવ જ્યોત' સંસ્થા - ભુજ સંચાલિત સેવાશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો હતો. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના મનોચિકિત્સકની સારવારથી તે ઝડપભેર સ્વસ્થ બન્યો હતો.

સંસ્થાનાં સામાજિક કાર્યકર બાબુલાલ જેપાલે કાઉન્સેલિંગ કરી તેની પાસેથી મળેલ માહિતીનાં આધારે પશ્ચિમ બંગાળની પોલીસનો સંપર્ક કરી તેના ગામ અને પરિવાર શોધી કાઢ્યા. પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ એકદમ નબળી હોતાં માનવ જ્યોત સંસ્થાએ પરિવારજનોને પશ્ચિમ બંગાળથી કચ્છ આવવા-જવાનાં ટિકિટ ભાડાની રકમ આપી હતી.

પરિવારજનોના જણાવ્યા મુજબ સંજ્યદાસનાં લગ્ન થઈ ગયા છે. તેને એક દીકરી છે. પિતાનાં અવસાનથી આધાત અનુભવતા સંજ્યદાસ માનસિક સમતુલન ખોઈ બેઠો હતો અને ટ્રેન કે કોઈ વાહનમાં બેસી ગયો હતો. સતત તૃ વર્ષ સુધી તે રખડતો ભટકતો રહ્યો હતો. તેના ભાઈ તથા કાકા તેને તેડવા ભુજ આવીને સંજ્યદાસને લેટી પડતાં તેમની આંખો અશ્વુત્તીની બની હતી. આખરે છૂટો પડેલો પરિવાર ફરીવાર એક બન્યો હતો. માનવતાનાં આ કાર્યમાં માનવ જ્યોતની ટીમ સહભાગી બની હતી.

વેરાવળ સ્થિત નવીનભાઈ હીરજુભાઈ શાહ (૬૬)નું સામાજિક સેવાકીય કોર્પો પ્રદાન...

નવીનભાઈ હીરજુભાઈ શાહ (૬૬) ગામ લાલા, હાલે વેરાવળ (ગીર સોમનાથ) શહેરને પોતાનું કમ્ક્ષેત્ર બનાવી અનેક સેવાકીય કાર્યો કરે છે. તેઓ અત્રેના શ્રી સંધના લગભગ તર વર્ષથી પ્રમુખ છે. કોલેજ તથા બીજી અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે. અત્રેની ૫૦ વર્ષ કરતાં વધારે જૂની પાંજરાપોળની કાયાપલટ કરી ગૌવંશ માટે સગવડતાસભર બનાવેલ છે. તેઓ અત્રેના શાંતિનાથ જિનાલય તથા શાંતિનાથજી યાત્રિક ભવનના મુખ્ય ટ્રસ્ટી છે.

વિશેષમાં તેઓશ્રી અત્રેની અગ્રણી બેંક 'ધી વેરાવળ મર્કેન્ટાઇલ કો.ઓ. બેંક લિમિટેડ'ના ધણા વર્ષોથી ચેરમેન છે. તેઓની આગેવાની હેઠળ બેંકની અકલ્યનિય પ્રગતિ થયેલ છે. દેશના બેન્કિંગ ક્ષેત્રના પ્રથમ હોણના જ્યાતનામ મેગેજિન 'બેન્કિંગ ફન્ટિયર' દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧માં સમગ્ર દેશની આશરે ૧૫૦૦ જેટલી નાગરિક સહકારી બેંકોએ કરેલ કામગીરીનું મૂલ્યાંકન કરી બેસ્ટ કો-ઓપરેટિવ બેંક તેમજ બેસ્ટ એચ.આર.

(અનુસંધાન : જુહો પાના નં. - ૬૪ ઉપર)



બાળ વિભાગ

છત્રીની નાવડી



દ્વારી અમૃતિયા

મરધીનું બચ્ચું ચાલ્યું દાણાં ચણવા...

એ જોઈ મરધીબેન કહે, ‘છત્રી તો લઈ જ સાથે.’

‘ના રે ના. વરસાદ આવશે તો વરસાદમાં નાહીશ, દાણા ચણીશ, મજા કરીશ. પછી આવીશ.’ મરધી સામું જોતાં બચ્ચું કહી રહ્યું.

મા કહે, ‘ના હો. વરસાદમાં પલળે તો તાવ આવે! રંગબેરંગી પીંછાવાળી છત્રી લઈ જા.’

બચ્ચું તો ના પાડતું રહ્યું ને માએ હાથમાં છત્રી પકડાવી દીધી. છત્રી મોટી હતી તો બચ્ચાને ચાલતા ફાવતું ન હતું. તો બચ્ચું તો છત્રીને લાકડીની જેમ ઉપયોગ કરી ચાલવા લાગ્યું.

બચ્ચું તો આજુભાજુ, ઉપર-નીચે જોતું જાય, ને ગાતું જાય:

“બચ્ચું ચાલ્યું ફરવા, લીલા દાણા ચણવાં,
લીલા દાણાં ચણતું જાશે, મોજ-મજા કરતું જાશે.”

જતા જતા રસ્તામાં ચકલીનું બચ્ચું મળ્યું. તે પણ દાણા ચણવા જતું હતું. એટલે મરધીના બચ્ચાએ પૂછ્યું : ‘મારી સાથે તને ફાવશે?’

ચકલીનું બચ્ચું તુરંત કહી ઊંઘ્યું : ‘હા, હા, કેમ નહીં! એક કરતા બે ભલા!’

આગળ જતાં મકાઈનું ખેતર આવ્યું. ખેતરમાં તો મકાઈનાં પીળા પચ દાણા હતા. મરધીનું બચ્ચું અને ચકલીનું બચ્ચું મકાઈના દાણા જોતા હતા ત્યાં જ ખેતરના માલિકને આવતા જોયા.

મરધીના બચ્ચાએ માલિક પાસે જઈને કહ્યું :

“માલિક દાદા, તમે સરસ મકાઈ છે વાવી
અની સોડમ અહીં લાવી અમને તાણી.
અમને મૂઢી મકાઈ લેવા દો ને,
મોજ-મજા કરવા દો ને...”

માલિક કહે, ‘ઓહો બચ્ચાઓ, તમે એક શું કામ, બે-ચાર મુઢી લઈ જાઓ ને.’

બચ્ચા તો ખુશ. ચકીનું બચ્ચું કહે : ‘દાદા, તમારી મુઢી ભરીને જ આપો ને.’

માલિકદાદા તો એક સૂપહું ભરીને મકાઈ લાવ્યા. પછી કહે : ‘લો બચ્ચાઓ, હવે કરો મોજ અહીં.’

‘દાદા, અમે તો અમારા મિત્ર વાંદરાભાઈના ઘરે વડલાના જાડ પર ચડીને મોજ કરીશું.’ મરધીનું બચ્ચું ઉત્સાહથી બોલી ઉઠ્યું.

માલિકદાદા કહે, ‘સારું ત્યારે... એમ કરજો. હું મારા કામે જાઉં છું.’ કહેતાં માલિક દાદા તો ગયા.

આટલા બધા મકાઈ દાણા કેવી રીતે લઈ જવા? બંને બચ્ચા વિચારે ચઢ્યા. ચકીના બચ્ચાના મનમાં એકાએક વિચાર જબક્યો. તે બોલી ઉઠ્યું : ‘તારી આ છત્રી જ ખોલી દે ને. પછી એને ઊંધી કરી એનો વાટકો બનાવી દે. એમાં દાણા ભરી લઈશું.’

મરધીના બચ્ચાએ એમ જ કર્યું. બંને બચ્ચા ચાલતા જાય ને ગાતા જાય.

“છત્રીનો તો વાટકો બનાવ્યો, પછી એમાં દાણા ભરાવ્યા;
દાણા લાગે છે પીળા, ખાશું થઈને ભેળા”

ગાતા ગાતા વડલા નીચે પહોંચ્યા. વાંદરાભાઈ વડની વડવાઈ બાંધી હીંચકા ખાતા હતા. મિત્રોને જોઈને એ નીચે આવ્યા.

મરધીનું બચ્ચું કહે : ‘વાંદરાભાઈ, ચાલો, આજે તો સરસ મજાની ઉજાણી કરીએ.’ અને ત્રણેય મિત્રો સરસ મજાની ડાળ શોધીને બેઠા.

મકાઈના દાણા ખાતા જાય, અલક મલકની વાતો કરતા જાય. વાતો કરતા પડી સાંજ. વીજળીના ચમકારા થયા સાત.

બંને બચ્ચા ઘરે જવા નીકળ્યા. વાંદરાભાઈ કહે : ‘છત્રી તો ખોલો.’

ચકીનું બચ્ચું કહે : ‘પહેલાં વરસાદમાં થોડું નાહી લઈએ?’

‘હા, હા. વરસાદમાં નહાવાની કોને મજા ન આવે?’ કહેતાં મરધીનું બચ્ચું ફેરફૂદરી ફરવા લાગ્યું.

ધીમે ધીમે વરસાદ વધવા લાગ્યો. વરસાદમાં પલળવાથી પાંખોનું વજન વધી ગયું. હવે ઉડવામાં તકલીફ થવા લાગી.

મરધીનું બચ્ચું કહે : ‘ઓ વહાલા દોસ્ત, જે હિંમત કદી ના હારે, જીવનમાં સધળી બાળ મારે.’

ચકીના બચ્ચાએ છત્રી ખોલી અને તેની નાવડી બનાવી દીધી. બંને બચ્ચા નાવડીમાં સવાર થઈ ગયા. નાવડી તો પાણીમાં

(અનુસંધાન : જુગો પાના નં. - ૬૪ ઉપર)



ગોમસ ગેલેરી

રાજકી આયેગી બારાત - ગેમ



ભાવના એ. અવેરી

લગ્નની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. અત્યારના ટ્રેન પ્રમાણે દરેક અવસરે લોકોને કંઈક નવું કરવાની હચ્છા હોય છે. તેના માટે સ્પેશિયલ એરેન્જમેન્ટ કરવાની હોય છે. તો ચાલો, હલ્દી-મહેંદીના ફંક્ષનમાં રમીએ “શાદી - બિંગો ગેમ”.

આપેલ ચિત્રની પ્રિન્ટ કરાવી, ૨મનાર બધાને પેન સાથે આપો. તેમાંના ખાલી બોક્સમાં ૧ થી ૮૦ અંકમાંથી મનગમતાં અંક લખીને તૈયાર કરીને...

હોસ્ટ : હાઉસીનું બૉર્ડ અને ટોકન નંબર લઈને આ ગેમ રમાડશે.

આ સાથે નિયમ પણ આપેલ છે. તે પ્રમાણે જેના નંબર કટ થાય તેને પોતાના નંબર વેરિફિએ કરાવીને વિનર થશે. ગેમમાં જીતનારે લગ્ન ગીતની કરી ગાવાની રહેશે. જેથી આપેલ સૌ છેલ્લે સુધી રમતની મજા માણી શકશે.


વિજેતા બધાને ગિફ્ટ આપીને નવાજો. આ રીતે તમારા પ્રસંગને ચાર ચાંદ લગાવો....

- | | | | |
|----------------------|--|---------------------------------|--------------------------|
| ગેમના નિયમો : | ★ સાત ફેરે - ક્રિકેટ ૭ | ★ જોરુકા ગુલામ - પેર નંબર | ★ ગોળ ધાણાં - પહેલી લાઈન |
| | ★ રિંગ સેરેમની - બીજી લાઈન | ★ મહેંદી રસમ - ત્રીજી લાઈન | |
| | ★ સંગીત સંધ્યા - ત્રણ લાઈનનાં એક-એક નંબર | | |
| | ★ લગ્ન બંધનમાં - ત્રણેય લાઈનનાં બે-બે નંબર | | |
| | ★ વિદાય - કુલ હાઉસી-૧ | ★ શસુર ગૃહે પગલાં - કુલ હાઉસી-૨ | ★ હનીમુન - કુલ હાઉસી-૩ |

ઘડિયાળમાં ગોઈવાયેલા બને કાંઠા જેવા આપણો છીએ. હું નાનો છું અને તમે મોટા છો એવો પ્રશ્ન કરવો નકામો છે. એક જ મધ્યબિંદુ સાથે સંકળાઈને આપણો ફરી રહ્યા છીએ. જુદા જુદા છતાં પણ એક મધ્યબિંદુ છોડીને જો આપણો જુદા પડી જઈશું તો તમે, તમે નહીં રહો, અને હું, હું નહીં રહું. આજે તો લોકો આપણી સામે જુઓ છે પણ જુદા પડી ગયા તો ‘આ ઘડિયાળ તદ્દન નકામું છે’ એમ કહીને આવતીકાલે જરૂર ગટરમાં ફેરી દેશે.

બોલો શું કરવું છે?

રાજકી આયેગી બારાત - બિંગો ગેમ



માહિતી

કુવારાનું વિજ્ઞાન

કુવારા, એ બગીચાની શોભા છે. જાતજાતના આકારના અને કરામતોવાળા કુવારામાંથી પાણીની છોળો ઉંચે સુધી જઈ નીચે પછીય એ દશ્ય સુંદર હોય છે. કેટલાક બગીચા અને પાર્ક તો તેના કુવારા માટે પ્રસિદ્ધ થયા છે.

બગીચામાં કુવારા એ માગ આકર્ષણ માટે નથી પણ તેનો મુખ્ય હેતુ હવા શુલ્ક કરવાનો છે. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ પ્રદૂષણ સમાન છે. આ બંને વાયુઓ પાણીમાં ઓગળી જાય છે. સતત ઉડતા કુવારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ ઓછો કરવામાં મદદરૂપ થાય છે. આ કરણથી જ બગીચાની હવા તાજગી ભરેલી હોય છે અને વાતાવરણ ખુશનુમા હોય છે. ઘણા શહેરોમાં પ્રદૂષણ ઓદૃષ્ટ કરવા રસ્તા પર પાણી છાંટવાની પરંપરા છે.

પૃથ્વી પરના મહાસાગરો

પૃથ્વીની સપાઠી પર ૭૧ ટકા વિસ્તારમાં સમુદ્રોનું ખારું પાણી છે. પૃથ્વી પર પાંચ મહાસાગર છે. આ મહાસાગરો એકબિજા સાથે જોડાયેલા છે પરંતુ ખંડ પ્રમાણે તેના નામ અપાયા છે. મહાસાગરોની સરેરાશ ઊંડાઈ ૧૨,૨૦૦ ફૂટ છે.

- સૌથી મોટો પેસિફિક મહાસાગર પૃથ્વીની સપાઠીનો જીજો ભાગ રોકે છે. એશિયા અને ઓસ્ટ્રેલિયાને દક્ષિણ અમેરિકાથી જુદ્દો પાડતો આ સાગર પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખાય છે. પેસિફિક સમુદ્રમાં મેરિયાના ટ્રેન્સ સૌથી ઊંઠું સ્થળ છે.
- વિશ્વનો બીજા નંબરનો એટલાન્ટિક મહાસાગર ગરમ પાણીના પ્રવાહો માટે જાહીતો છે. તેના તળિયે ૩૫,૦૦૦ કિ.મી. લાંબી પર્વતમાળા આવેલી છે.
- શ્રીજો મોટો હિંદ્સાગર પણ ગરમ પાણીના પ્રવાહોવાળો છે.
- આર્કટિક મહાસાગર તરીકે ઉત્તર ધૂવી આસપાસનો બરફનો દરિયો. સૌથી છીછરો આ સાગર બરફથી છવાયેલો રહે છે.
- દક્ષિણમાં આવેલો સધન મહાસાગર પણ બરફથી છવાયેલો રહે છે.

વિશ્વની પ્રથમ યુનિવર્સિટી : નાલંદા

પ્રાચીનકાળમાં ભારત વિદ્યાનું કેન્દ્ર હતું. વિશ્વની પ્રથમ અંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી પણ ભારતમાં હતી. પાંચમી સદીમાં મૌર્ય વંશના શાસન દરમિયાન સ્થાપવામાં આવેલી નાલંદા વિદ્યાપીઠમાં તે સમયે ૨૦૦૦ શિક્ષકો લગભગ ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને જાત જાતની વિદ્યાઓ શીખવતા. ૧૨મી સદી સુધી

ચાલુ રહેલી આ વિદ્યાપીઠમાં શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ચીન અને કોરિયાના વિદ્યાર્થીઓ આવતા. નાલંદા વિદ્યાપીઠમાં બૌદ્ધ ધર્મના મહાયાન, હિન્દુયાન તેમજ વૈદિક ગ્રંથોનો અભ્યાસ થતો. તે ઉપરાંત અધ્યાત્મ, જ્યોતિષ, તર્કશાસ્ત્ર, શબ્દવિદ્યા કે વ્યાકરણ, ગણિત અને ચિકિત્સા એટલે કે રોકટરી વિદ્યા શીખવતી. આજે બિહારમાં નાલંદા વિદ્યાપીઠના ખંડરો જોવા મળે છે. તે સમયે બૌદ્ધ ધર્મ વધુ ફેલાયેલું હતું. નાલંદા વિદ્યાપીઠમાં નવ માળની લાઇબ્રેરી અને બૌદ્ધ સાહુઓને રહેવાની સગવડતા હતી. પાંચમીથી બારમી સદી સુધીના સમયગાળામાં થઈ ગયેલા તમામ રાજાઓએ નાલંદા વિદ્યાપીઠના વિકાસમાં ફાળો આપ્યો હતો. ચીનનાં વિદ્યાત પ્રવાસી હુસાંગ અને ફી-દાન નાલંદાના પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ હતા.

આજે બિહારમાં આવેલા નાલંદાના અવશેષોમાં નવ મઠો અને અનેક બૌદ્ધ મંદિરો જોવા મળે છે. ખોદકામ દરમિયાન આ સ્થળે ધાણાં પગથિયાવાળાં બાંધકામ મળી આવ્યા હતા. નાલંદાના મુખ્ય સ્તુપમાં બુદ્ધની વિશાળ મૂર્તિ છે. નાલંદાનો અર્થ ‘શાન આપનાર’ એવો થાય છે.

ઘોડા વિશે...

- માણસ પ્રાચીનકાળથી ઘોડાની સવારી કરવા ઉપયોગ કરે છે. વાહનો નહોતા ત્યારે ઘોડા ખૂબ જ ઉપયોગી થતા.
- ઘોડાની ઊંચાઈનું માપ હાથમાં મપાય છે. ઘોડો કેટલા હાથ ઊંચો છે તેમ બોલાય છે.
- ઘોડો પાંચ વર્ષનો થાય ત્યારે બધા જ દાંત ઊગે છે અને ઉંમર વધવાની સાથે દાંતની લંબાઈ વધે છે. જાણકાર લોકો ઘોડાના દાંતની લંબાઈ જોઈને તેની ઉંમર જાણી શકે છે.
- ઘોડાના કપાળ પર સફેદ નિશાની હોય છે.
- ઘોડો કાન, નસકોરાં અને આંખો વડે ગુસ્સો કે ખુશી બક્કત કરી શકે છે.
- ઘોડાના પગની ખરી આપણા નખની જેમ વધા કરે છે.
- ઘોડાને ગ્રીક ભાષામાં ‘ઈક્સિસ’ કહેતાં. જેનો અર્થ થાય છે ‘જડપી.’
- ઘોડાના બચ્ચાં મોટાભાગે રાત્રે જ જન્મે છે.
- ઘોડાનાં બચ્ચાને વછેરું કહે છે. તે જન્મયા પછી એકાદ કલાકમાં ઊભું થઈ શકે છે.
- ઘોડો પોતાના માલિકના મૂડને ઓળખે છે. માલિક નિરાશ હોય તો તે પણ નિરાશ થઈ જાય છે.
- ઘોડાને લાંબા પગ, મોટા ફેફસાં અને મોટું હૃદય હોવાથી તે જડપી દોડી શકે છે. વધુ વજન ખેંચી શકે છે અને લાંબી છલાંગ મારી શકે છે.
- ઘોડા મોટા દ્વારા શાસ લઈ શકતા નથી એટલે કદી હાંફુતા નથી.

૧		૨				૩		૪		૫	૬
					૬						
૮	૯			૧૦							
૧૧		૧૨			૧૩			૧૪			
૧૫				૧૬		૧૭		૧૮			
	૧૯		૨૦			૨૧	૨૨				
૨૩		૨૪			૨૫				૨૬	૨૭	
૨૮	૨૯			૩૦		૩૧					૩૨
૩૩		૩૪		૩૫							
૩૬					૩૭		૩૮		૩૯		
		૪૦				૪૧		૪૨			
૪૩					૪૪		૪૫				

શબ્દ રમત ભરનારનું નામ : _____

સરનામું : _____

ફોન/મો. _____

આપણીના જવાબો તા. ૩૧-૧૨-૨૦૨૧ સુધીમાં શ્રી કર્ણી જૈન ભવન - પાલકીના સરનામે મોકલાવવા વિનંતિ.

આડી ચાવીઓ

૧. તારામતીનો પતિ સત્યવાદી (૫)
૩. ગુજરાતનો ચર્ચાસ્પદ એન્કાઉન્ટર કેસ (૬)
૭. સૂર, તાલ (૨)
૮. સોગંદ (૨)
૧૦. રક્ષક, ચોકી કરનાર (૪)
૧૧. આશા, હુકમ (૪)
૧૩. મારી જાત (૧)
૧૫. વળુર શબ્દ આડોઅવળો થઈ ગયેલ છે (૩)
૧૮. પૂર્વ ભારતમાં વકરેલો વાદ (૪)
૧૯. સંવાદ, ચર્ચા (૪)
૨૧. રૂપુ, ચાંદી (૩)
૨૪. શેરીનો તાજો પીઓ (૨)
૨૫. હૈયું, ટિલોજન (૩)
૨૬. શરીર, અવયવ, ભાગ, કર્ષણ (૨)

૨૮. ફરિયાદ (૨)
૩૧. ધામધૂમથી (૫)
૩૩. ઘર, રહેઠાણ (૩)
૩૪. ભય, બીક (૨)
૩૬. વિમાનને ઉડવા માટે આના પર દોડવું પડે (અંગ્રેજમાં) (૩)
૩૭. ઉજ્જડ (૩)
૩૮. પારકું, બીજાનું (૨)
૪૦. પ્રભાત (૩)
૪૧. ખાસ, ટૃપા (૩)
૪૩. હજામ અને દરજનું એક ઓજાર (૩)
૪૪. ધરતી (૨)
૪૫. નુકસાનકારક, યુક્તિબાજ, મૃત્યુ નિપઞ્ચાય એવું (૪)

ગુણી ચાવીઓ

૧. સાથે મુસાફરી કરનાર (૫)
૨. દીવાની વાટ (૨)
૩. એક જંતુ (૩)
૪. રાત્રી (૩)
૫. ન્યાય કરનાર (અંગ્રેજ) (૨)
૬. અસ્થિર, ચલાયમાન (૬)
૭. મધ્યસ્થી (૩)
૮. ઊંડા પાણીમાં દૂબકી લગાડનારા (૪)
૧૦. વિકેટની વચ્ચે બેટ્સમેન દોડે તે (૨)
૧૨. મા-બાપ (૪)
૧૪. બેંક દારા ચૂકવણીનું એક માધ્યમ (૨)
૧૬. પાટુ પગથી મારવું તે (૨)
૧૭. આરોગ્ય માટે આ સીંગ ઉપયોગી છે (૪)
૧૮. ઝુકેલું, નિરાશા (૨)
૨૦. મદદ માટે પાલેલી ભૂમ (૨)
૨૨. માલમતા, ધરેણાં (જોડણી છૂટ) (૬)
૨૩. ચોખાની એક જાત (૪)
૨૬. અજિન, તષાખો (૩)
૨૭. એક માપ (૨)
૨૮. મુખ, મો, ચહેરો (૩)
૩૦. બેડચા વિનાનું ખુલ્લું (૪)
૩૨. એક પક્ષી (૩)
૩૪. ફરીથી શરૂ કરીને (૪)
૩૮. દોજખ, વિદ્યા (૩)
૪૨. શિક્ષા, દંડ, નસિયત (૨)

ગરીબી

ગરીબી જેણે વેઠી હોય, તેને સમજાય છે કે બે છેડા કેમ ભેગા થાય!

ખાવામાં થોરી બાંધણોડ કરવી પડે.
ક્રપા રહુ કરાવેલા પહેરવા પડે.
બીમારીમાં સરકારી હોસ્પિટલના પકડા ખાવા પડે.
સેકન્ડ હેન્ડ ચોપડાથી ભણતર પુરું કરવું પડે.
ઉચ્ચ અભ્યાસ માટે કોઈની મદદ લેવી પડે.
ગરીબીની સીઝનમાં પણ કંદરતી હવાથી સંતોષ માનવો પડે.
કોઈ પ્રસંગ આવે ત્યારે ખર્ચમાં ફેરફાર કરવો પડે.
ફેરફાર કે બસની હાલાકી સહન કરવી પડે.
ડગલે ને પગલે કષ્ટો સહન કરવા પડે.
ડગલે ને પગલે મનને વળવું પડે.
પણ ગરીબીમાં મોટો થયેલો માણસ, જિંદગીમાં ક્યારેય હારતો નથી અને ગરીબીમાંથી ઉપર આવેલો માણસ સુખમાં ક્યારેય છલકાતો નથી.

ટૂકી વાર્તા : “કંપની”

નદી ડિનારે ૫૦૦૦ ચોરસ વારના મોટા ખોટમાં અજયનો આલીશાન બંગલો હતો. શહેરના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી. અજય એની પત્ની રીતા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વિલામાં રહેતો હતો.

એક દિવસ ડાઈનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું, ‘બેટા, મને ઘરડા ઘરમાં મૂકી આવને!’

અજય એને રીતા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યુ કે અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું?

અજયે કહ્યું, ‘કેમ પપ્પા, અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ કે કોઈએ તમને કંઈ કહ્યું?’

હસમુખરાયે હસતા હસતા કહ્યું, ‘ના બેટા ના. તું, વહુ અને સુકેન જેટલી સારસંભાળ મારી કોણ રાખી શકે? પણ હું અહિયા એકલો આખો દિવસ કંટાળી જાઉ છું અને ઘરડાઘરમાં મારા ગ્રાણ જૂના મિત્રો છે. તો મારો ટાઈમ પાસ થઈ જશે.’

અજયે તરત જ કહ્યું, ‘પપ્પા, સમાજ અમારા માટે શું વિચારશે? ૫-૬ મહિના જવા દો. હું કંઈ વ્યવસ્થા કરી આપીશ.’

હસમુખરાય પણ માની ગયા.

વાત વિસરાઈ ગઈ.

અજયે ‘વિલા’ની બાજુમાં જ એક ‘નાનું આઉટ હાઉસ’ બનાવવાનું શરૂ કર્યું અને જોતજોતામાં એક સુંદર મજાનું ‘આઉટ હાઉસ’ તૈયાર થઈ ગયું.

હસમુખરાયે પૂછ્યું, ‘બેટા, આ શું કામ બનાવ્યું? આપણું

આટલું મોટું ઘર છે ને!!’

અજયે કહ્યું, ‘મહેમાનો માટે છે, ને આવતા રવિવારે તમારા હાથે એનું ઉદ્ઘાટન કરવાનું છે.’

રવિવાર આવી ગયો. ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી.

હસમુખરાયે તાળીઓના ગડગડાટ સાથે રીબીન કાપી.

અજયે કહ્યું, ‘પપ્પા, દરવાજો તમે જ ખોલો.’

હસમુખરાયે બારણું ખોલ્યું.

સામે ખુરશી પર તેમના ગ્રાણ મિત્રો બેઠા હતા. હસમુખરાય ખુશીથી ઝુમી ઉઠ્યા અને ત્રણો મિત્રોને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેટી પડ્યા. અજયે કહ્યું, ‘પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે. એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઈ આવ્યો. આજથી આ ઘર તમારું જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે. અને હા, મેં એક કેર ટેકર શંભુકાકાને પણ રાખ્યા છે, જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે.’

ચારે વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્વુઓ વહી ગયા.

અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી ખડખડાટ હાસ્યના અવાજો આવવા લાગ્યા.

અજય મનોમન બોલી ઉઠ્યો, ‘મિત્રોની કંપની સ્ટીરોઇડ જેવી હોય છે!!’

‘મિત્રતા’થી ઉત્તમ કોઈ ટોનીક નથી. હસતા રહો અને હસાવતા રહો.

૧ NanoNine® શરૂ રમત-૧૭૬નો ઉકેલ

ક	મા	વ	ત	ર			હ્રી			મા	યા
લિ		ખા	ર		ક	ટિ		ધા	ર		મ
ત		એ		લ		ઉ	મ	જ	કો		
			ર	હે	મ	મા		વું		સા	
ખુ	દા	ષ		દે		આ	શં	કા		જ	ર
	વા	વ	ર		સા		ક		સ	મા	સ
અ	િન			કા	ર	ભા	ર		મ	ત	
ગ	વ્યો	મ		પ	ગ		શા	ષું		ત	
મ	સ્તી		એ	સ્તી			ના		ખૂ	બી	
નિ		ટા		સા	થી	દા	ર			ય	
ગ	મ		મ	દ	દ		ન		આ	ફ	ત
મ	સી	ંા		ન	ગી	ન		ાં	ગ	બી	

વ્યક્તિત્વને વિકસાવો

When we loose our individualism

We become boring.

When we can no longer see

a vision of the future, We are dead.

— Dr. Barnes Wallis

શહેરમાં કે ગામડામાં તમને બીબાંઢાળ માનવો ઘણા મળે છે. તેમની સાથે બે મિનિટ વાત કરશો ત્યાં કંટાળી જશો. પણ કેટલાક માનવો બીબાંઢાળ હોતા નથી. અનોખા હોય છે. તેમનામાં વ્યક્તિત્વ હોય છે. આવું નિરાણું વ્યક્તિત્વ ધરાવતા માનવ આપણને મીઠા લાગે છે. તેમની વાત સાંભળવી ગમે છે. તે જગતને ઘારા લાગે છે. જો જગતને ઘારા બનવું હોય તો વ્યક્તિત્વ વિકસાવો, નહિંતર કંટાળાજનક બની જશો. જ્યારે આપણે આપણું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવીએ છીએ ત્યારે આપણે લાંબી દિશીથી જોઈ શકીએ છીએ. ભાવની અંખી કરી શકીએ છીએ. નિરાણાપણું ન હોય તે ભરેલા જેવા છે.

— કાર્નિલ ભર
સૌભાગ્ય : “પ્રશ્નાની પુસ્તકી”

આવકના ૨-૫ ટકા દાન સામાજિક વિકાસ - કલ્યાણ માટે અપાય તે પૂર્તું નથી. દાન ધર્મદાની દસ્તિએ નહીં પણ સામાજિક જવાબદારી સમજને અપાવું જોઈએ અને જનસમૃદ્ધયના વિકાસમાં ભાગીદાર બનવું જોઈએ.

જિંદગીમાં ઉતાવળ કરીને આગળ નીકળી જનરા માણસોને આપણે ઓળખીએ છીએ અને તેઓને મળ્યા પણ છીએ. ઘણાં લોકોને જિંદગીમાં ઘણું બધું પામવાની ઉતાવળ હોય છે. એમને લાગે છે કે જો એ સહેજ પણ મોંડું કરશે તો એ જ્યાં દીર્ઘે ત્યાં નહીં પહોંચી શકે. મહત્વાકંશા, એ કેટલાક લોકોના ડી.એન.એ.માં હોય છે, જીતનું અથવા આગળ નીકળી જવું એ એમની પ્રકૃતિનો ભાગ હોય છે. એમને માટે ધાર્યું નિશાન પાર પાડવું, સફળ થવું કે પોતે મનમાં જે કામ કરવાનું નક્કી કર્યું હોય એ કરવું જે, એ જ્ઞાન પોતાની જીતને આપેલી ચેલેન્જ હોય છે. આ બાબતો સારી છે, જેમાં માણસ પોતે જ પોતાનો હરીફ બને. એનાથી ઉત્તમ શું હોઈ શકે? એકો ગઈકાલે કરેલા બધા જ કાર્યોથી આગળ આજે કશુંક વધુ સારું કે શ્રેષ્ઠ કરવું છે. એ વિચાર એની અંદર પ્રોત્સાહન અને પ્રેરણા ઉમેરતો રહે છે.

ઉકેલ :
ક્રમાંક - ૧૧૩૪

A	4 7 6 3 2 1 8 9 5 8 1 3 5 9 6 2 7 4 2 9 5 7 8 4 6 1 3 6 2 1 8 7 3 5 4 9 9 8 7 6 4 5 3 2 1 5 3 4 2 1 9 7 8 6 7 5 9 1 3 8 4 6 2 3 4 8 9 6 2 1 5 7 1 6 2 4 5 7 9 3 8
B	4 2 6 9 8 3 1 5 7 7 3 1 5 2 6 9 4 8 5 9 8 7 4 1 6 2 3 3 7 4 1 9 8 2 6 5 2 8 9 3 6 5 7 1 4 1 6 5 4 7 2 3 8 9 9 1 2 8 3 4 5 7 6 6 4 7 2 5 9 8 3 1 8 5 3 6 1 7 4 9 2
C	6 4 2 9 1 8 3 5 7 3 7 1 5 4 2 9 6 8 5 8 9 6 7 3 1 4 2 9 3 5 1 2 7 4 8 6 2 1 8 4 6 9 5 7 3 7 6 4 3 8 5 2 9 1 8 9 7 2 3 4 6 1 5 4 2 6 7 5 1 8 3 9 1 5 3 8 9 6 7 2 4
D	5 7 2 6 3 1 9 8 4 6 3 1 8 9 4 5 2 7 9 4 8 2 5 7 3 1 6 3 9 7 1 6 8 2 4 5 2 1 6 5 4 9 7 3 8 4 8 5 7 2 3 1 6 9 8 5 4 9 1 2 6 7 3 1 6 3 4 7 5 8 9 2 7 2 9 3 8 6 4 5 1

NanoNine® Sudoku

રજનીકાંત પાટેખ (૧૯૯૦ કૃપ્રેરી)

સુડોકુ ક્રમાંક-૧૧ ઉપયોગી રજૂ કરવામાં આવેલ છે. તેના ચારે ભાગ ભરીને 'મંગલ મંદિર' કાર્યાલય પર તા. ૩૧-૧૨-૨૦૨૧ સુધીમાં મોકલી આપવા વિનંતી.

સુહેલું ભરનારનું નામ : _____
સરનામું : _____
ફોન/મોબાઇલ : _____

A

ક્રમાંક - ૧૧૩૪

B

C

D

Nano 9®
kitchenware

in new avatar



NanoNine®
INNOVATIVE KITCHENWARE
Bana De Life Aasaan!

Mfg By: Shree Balaji Metal Industries, Vasai.

E: care@nanonine.in | W: www.nanonine.in

AHMEDABAD: Authorised Distributors: Devam Enterprises : M. 96385 21024, 97245 00513

MUMBAI: Authorised Distributors: Vasant Marketing: (+91) 98206 72501 / KK Associates: (+91) 93234 04736

ખીલજી મ, ભલા...!!!



• સંકલન : ગુલાબયંદ ધારશી રાંભિયા •

બચુડો

અધા : પુતર બચુડા?

બચુડો : કો અધા કુરો કમ આય?

અધા : પાંજે ફ્લેટ કે નીચે જુકો બચુભાઈ રેંતા ને અનીજો અગરબતીજો હોલ્સેલ વેપાર આય, પણ અનીજે ફ્લેટકે બાર હક્કો પહેલવાન જેડો માહુ અચે ને રાડારાડ કરેતો ને ધમકી દેતો... સે જરા તપાસ ત કર, મામલો કુરો આય?

બચુડો : (તપાસ કરે ને ચે) બચુભાઈ અગરબતીજો વેપાર વધારેલા જાહેરાત જા બોર્ડ ભનાયા આય. અનમે લખેજો વો “પહેલવાન છાપ અગરબતી” પણ જાહેરાતમે લખાજે વો આય “અગરબતી છાપ પહેલવાન.” એટલે પહેલવાન ખારો ઓ આય અને જું તીં રાહુ પાડેતો...

શિક્ષક : કેમ પર્વ સ્કૂલમાં મોડો કેમ આવ્યો?

પર્વ : સાહેબ, સ્કૂલ આવવાના રસ્તામાં આવેલા એક બોર્ડને લિધે.

શિક્ષક : એવું તે કેવું બોર્ડ મૂકવામાં આવ્યું છે, અને એના પર શું લખ્યું છે?

પર્વ : આગળ સ્કૂલ છે... ધીમે ચાલો! એ સૂચનાનું પાલન કરવામાં મને મોહું થયું.

☺ ☺ ☺ ☺ ☺

શિક્ષક : એવી કઠ વસ્તુ છે જેનાથી સૂક્ષ્વવા માટેનો વપરાશ થાય છે પણ તે ભીની થઈ જય છે?

મનુ : સાહેબ, ટુવાલ.

☺ ☺ ☺ ☺ ☺

પતિ : (પત્નીને) હું તારા માટે દુનિયાના અંતિમ છેડા સુધી જઈ શકું છું.

પત્ની : આભાર... પણ મને વચન આપવું પડશે કે તમે આખી જિંદગી ત્યાં જ રહેશો!

☺ ☺ ☺ ☺ ☺

પત્ની : (પતિને) તમે આજે ઓફિસમાંથી મોડા કેમ આવ્યા?

પતિ : સાચું કહું તો... પટાવાળો મને જગાડવાનું જ ભૂલી ગયો

હતો!

☺ ☺ ☺ ☺ ☺

ગ્રાહક : (વેઈટરને) તને કેવી રીતે ખબર પડી કે હું આ હોટલમાં પહેલીવાર આવ્યો છું?

વેઈટર : કારણકે જે એક વખત અહીંનું ભોજન જમીને જાય છે, તે ફરી બીજીવાર આવતો જ નથી!

☺ ☺ ☺ ☺ ☺

મહેશ : કેમ દિનેશ, મોબાઇલ કંપનીમાં જ્યાં તું ઈન્ટરવ્યૂ આપવા ગયો હતો, ત્યાં શું થયું?

દિનેશ : પહેલા સવાલનો જવાબ સાંભળીને જ મને ભગાડી દેવામાં આવ્યો.

મહેશ : એવો તે કેવો પ્રશ્ન પૂછ્યો હતો અને તે શું જવાબ આયો?

દિનેશ : સવાલ હતો — સૌથી જાણીતું નેટવર્ક કર્યું છે? અને મેં જવાબ આયો — કાર્ડન નેટવર્ક.

☺ ☺ ☺ ☺ ☺

ભાડુઆત : મકાન માલિક સાહેબ, તમે આ કેવું મકાન આપ્યું છે? અહીં તો દરેક વખતે ઉદરો જ દોડ્યા કરતા હોય છે.

મકાન માલિક : તો શું આટલા ઓછા ભાડામાં તું ઘોડાની રેસ જોવા માંગે છો?

☺ ☺ ☺ ☺ ☺

સુમિત : સૌથી નુકસાનકારક વાનગી કઈ હોઈ શકે?

અંકિત : વેઝિંગ કેક!

☺ ☺ ☺ ☺ ☺

પત્ની : મેં એ બિભારીને ચાર રોટલી આપી છે. વળી પાણી તમે શું આપવા ચાલ્યા?

પતિ : એ તો હું એને રોટલીના પાચન માટે બે ગોળી આપવા જઈ શકું છું.

☺ ☺ ☺ ☺ ☺

ગાંડાલાલ : લગ્ન પહેલાની અને લગ્ન પછીની જિંદગી વચ્ચે શું ફર્ક છે?

અધ્યાલાલ : લગ્ન પહેલા માણસ ખુશીથી ખર્ચ કરે છે અને લગ્ન પછી મજબૂરીથી ખર્ચ કરે છે.

☺ ☺ ☺ ☺ ☺

ભીખાલાલ : બેટા, મારી ઉંમર એકસો દસ વર્ષની થઈ. તેમ છતાં મારે એક પણ દુશ્મન નથી.

કચરાલાલ : વાહ, કમાલ કહેવાય...

ભીખાલાલ : એમાં કમાલની વાત ક્યાં આવી? કારણ એ છે કે મારા બધા જ દુશ્મનો મૃત્યુ પામ્યા છે!

c/૨૬, ગંગામણિ ક્રેટ્સ, વરંણનગર સોસાયટી, ગોપાલચોક,
મહિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮. ફોન : ૨૪૪૬૮૭૫૦

જે પળે પળે મનમાં મૃત્યુનો ડર રાખીને જીવે છે
તે કદી સાહસ કરી શકતો નથી.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ : ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ યોજનાર કાર્યક્રમો

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા તા. ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ
નીચે મુજબ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે (સંઝોગોવસાત ફેરફારને આધીન)

- ❖ સવારના ૦૮.૦૦ કલાકે : શ્રી કચ્છી જૈન ભવન - પાલડી ખાતે ધ્વજવંદન
- ❖ સવારના ૧૦.૦૦ કલાકે : અતિથિ વિશેષશીઓ, ટ્રસ્ટ મંડળ, કારોબારી સમિતિનાં સભ્યો તેમજ સમાજ પરિવારજનો સાથે ગીતા મંદિર ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન
- ❖ સવારનાં ૧૧.૦૦ કલાકે : ઉદ્ઘાટન કાર્યક્રમનો સમારંભ - ટાગોર હોલ, પાલડી ખાતે
- ❖ સવારનાં ૧૨.૦૦ કલાકે : કાર્યક્રમની સમાપ્તિ ખાદ સુરૂચિ બોજન લીધા બાદ છૂટા પડીશું.

વિગતવાર કાર્યક્રમ
જાન્યુઆરી-૨૦૨૨ના
'મંગલ મંદિર'ના અંકમાં
પ્રસારીત કરવામાં આવશે.

માનદ મંત્રીશ્રી, શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

સાભાર સ્વીકાર

રૂ. ૬,૦૦,૦૦૦/- (રૂપિયા નવ લાખ પૂરા)

શ્રી ગુણપ્રભાશ્રીજી સ્વાધ્યાય ટ્રસ્ટ તરફથી
પંથપ કેસરી વિજય વલ્લભસ્થુરિથરજી સમૃદ્ધાયના ગચ્છાધિપતિ
પ.પુ. આચાર્ય શ્રી ધર્મધૂરંધર સ્થુરિથરજી મ.સા.ના આણાનુવર્તિની
પ.પુ. સાધીરતાશ્રી કીર્તિપ્રભાશ્રીજી મ.સા.ના સ્મરણાર્થે
પ.પુ. સાધીજી શ્રી સિમતકૃપા સમ્યક-નંદી રત્નાશ્રીજીની પ્રેરણાર્થી
શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ ઇસ્તકના
મેટિકલ સેન્ટરના પેથોલોજ વિભાગ માટે
અનુદાન પ્રાપ્ત થયું છે.



ડૉનેશનનો ચેક સ્વીકારતા સંસ્થાના ખાતાનથી શ્રી ચંદ્રકાંત દામજી શાહ (કે.ડી. શાહ)

★

રૂ. ૫૧,૦૦૦/- : વૈયાવચ્ચ ખાતા માટે

નવાગામ જૈન મિત્ર મંડળ - પાલનપુર
દ. રમેશભાઈ શાહ અને વિનોદભાઈ શાહ તરફથી
અનુદાન મળ્યું છે.

દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર સાથે અનુમોદના.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

યુવા વિકાસ સમિતિ

યુવા વિકાસ સમિતિ દ્વારા આયોજિત
ગુડબાય ૨૦૨૧ - વેલકમ ૨૦૨૨

મિત્રો, કોરોનાની ગંભીર મહામારીના કારણે ગત વર્ષ હતાશા,
નિરાશા, તણાવમાં વિત્યું હતું... પરંતુ છેલ્લા થોડા મહિનાઓથી
પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે. તો હતાશા બંખેરીને... આવનાર
વર્ષનું ઉલ્લાસભેર સ્વાગત કરવા, નવીન ઉર્જા સાથે સહ પરિવાર નવા
વર્ષનું સ્વાગત કરવા યુવા વિકાસ સમિતિ દ્વારા ઉંમી ડિસેમ્બરના રોજ
DJ Nightનું આયોજન કરવામાં આવ્યું છે.

સમય : સાંજે ૭ થી રાતે ૯ : જમણવાર

DJ Night : રાતે ૮.૦૦ થી ૧૧.૩૦

થીમ : ઇન્ડિયન કલ્યાર (ભારતીય સંસ્કૃતિ)
(તમે કોઈપણ રાજ્યને રિપ્રેઝન્ટ કરી શકો છો.)

સ્થળ : શ્રી કચ્છી જૈન ભવન, પાલડી (બેંકેટ હોલ)

ચાર્જ : રૂ. ૧૫૦/- પ્રતિ વ્યક્તિ.
(રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત છે.)
રજિસ્ટ્રેશન શ્રી કચ્છી જૈન ભવન - પાલડી પર થશે.

રજિસ્ટ્રેશન તારીખ : તા. ૧૦ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૧

(હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલા તે
પહેલાના ધોરણે ૨૦૦ લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે.)

વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો :

ધનરાજ દેઠિયા : ૮૮૮૦૦ ૪૮૮૩૪

કૃપાલી રાંભિયા : ૬૦૮૧૯ ૧૭૮૧૪

પ્રોગ્રામના દિવસે આવનારના નામ અને સંખ્યાની નોંધણી અચૂક કરાવો.

તો મિત્રો, રાહ કોની જુઓ છો... નવા વર્ષના સ્વાગત કરવા માટે...
પ્રોગ્રામમાં ભાગ લેવાની અને ડી.જી.નો આનંદ માણવાની તક ગુમાવણો નહીં...

કંવીનર - યુવા વિકાસ સમિતિ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

યુવા વિકાસ સમિતિ : Get Together With Fun Games



યુવા વિકાસ સમિતિ દ્વારા તા. ૨૪-૧૦-૨૦૨૧ના રોજ Get Together With Fun Games નું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનામાં પસાર થયેલા બે કઠિન વર્ષ બાદ સમાજના લોકોએ આ પ્રોગ્રામને ઉલ્લાસભેર વધાવી લીધો હતો.

યુવા વિકાસ સમિતિના નવ નિયુક્ત કન્વીનર ચૈતન્ય રાંભિયા તથા કમિટીના સભ્યો કૃપાલી રાંભિયા, દણ્ણ મહેતા, નેહા શાહ, ધનરાજ દેઢિયા, નીલય ગડા, ચાર્મિ દેઢિયા, પીયુષ સાવલા અને વંદના ગડા દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં પથારેલા સર્વે મહેમાનોનું સ્વાગત કર્યું બાદ, અવનવી Quiz, Tongue Twister, Couple Games દ્વારા લોકોનું મનોરંજન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામના સંચાલનનો દોર દણ્ણ મહેતા અને વૃષ્ટિ મહેતા દ્વારા સંભાળવામાં આવ્યો હતો. ત્યારબાદ ભોજનનો આનંદ માણી ફરીથી લોકો રમતોની મજા મેળવવા એકઠા થયા. જેમાં ધનરાજભાઈ દેઢિયા અને કૃપાલી રાંભિયા દ્વારા નાના ભૂલકા તથા વડીલોને સંગીત ખુરશી રમાડી હતી. ત્યારબાદ આઈસ્ક્રીમની મજા માણસી માણસી લોકોએ હાઉસી ગેમ રમી હતી. જેમાં વિજેતા થનારા લોકોને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.

આમ, હસતાં રમતાં આનંદપૂર્વક અભાલ-વૃદ્ધ સર્વે સભ્યોએ આ પ્રોગ્રામ માણ્યો હતો.



શ્રી કૃષ્ણ જૈન સેવા સમાજ - અમદાવાદ

સમાજનું સહ્યપદ મેળવવા માટે તેમજ તેનાથી મળતા લાભોની વિગત

• સહ્યપદ •

શ્રી કૃષ્ણ જૈન સેવા સમાજ - અમદાવાદની કોઈપણ સેવાનો લાભ લેવા સૌપ્રથમ સમાજના સત્ય બનવું જરૂરી છે. સહ્ય બનવા માટે નીચે જાણાવાયેલ કેટેગરી મુજબ સહ્યપદ મેળવી શકાય છે.

- (૧) સ્વજન સહ્ય : રૂ. ૧,૦૦૦/- (રૂપિયા એક હજાર)
અમદાવાદ - ગાંધીનગરથી અન્યત્ર રહેવા જાય તો સહ્યપદ રદ થાય છે.
 - (૨) માનદ્દ સહ્ય : રૂ. ૧૦,૦૦૦/- (રૂપિયા દસ હજાર)
અમદાવાદ - ગાંધીનગરથી અન્યત્ર રહેવા જાય તો પણ સહ્યપદ ચાલુ રહે છે.
 - (૩) પેટ્રન સહ્ય : રૂ. ૧,૦૦,૦૦૦/- (રૂપિયા એક લાખ)
 - (૪) મુરબ્બી સહ્ય : રૂ. ૭,૦૦,૦૦૦/- (રૂપિયા સાત લાખ)
- ◆ કોઈપણ કૃષ્ણ જૈન વ્યક્તિ કે જેની ઉંમર ૧૮ વર્ષથી ઉપર હોય તે વ્યક્તિ ઉપર મુરબ્બીની કેટેગરી પ્રમાણે સહ્યપદ મેળવી સહ્ય બની શકે છે.
- ◆ ટ્રસ્ટ બોર્ડમાં સ્વજન સહ્યની ગ્રાં (૩), માનદ્દ સહ્યની નવ (૮) અને પેટ્રન / મુરબ્બી સહ્યની નવ (૮) જગ્યા છે.
- ◆ કારોબારી માટે કોઈપણ કેટેગરીનું સહ્યપદ હોવું જરૂરી છે.

• સમાજમાં મળતા લાભો •

મેડિકલ સેન્ટર :

- ★ મેડિકલ સેન્ટરની કોઈ પણ પ્રકારની સેવામાં જે પણ ચાર્જ થાય તેમાં સહ્યોને ૭૫ ટકા રાહત આપવામાં આવે છે.
(ઉદાહરણ : સોનોગ્રાફી જનરલ ચાર્જ રૂ. ૪૦૦/- થાય ત્યારે સમાજના સહ્યો માટે રૂ. ૧૦૦/- લેવાય છે.)
- ★ વર્ષ દરમયાન એક વખત સમાજના દરેક સત્ય કે જેમની ઉંમર ૩૦ વર્ષથી ઉપર હોય તેઓને ઉંમર પ્રમાણે બોડી ચેક-અપની સ્ક્રીનિંગ નિઃશુલ્ક લાભ મળે છે.
- ★ ૬૦ વર્ષથી ઉપરની ઉંમરવાળા સહ્યોને દાંતની સારવાર માટે વાર્ષિક રૂ. ૫,૦૦૦/- સુધીનો એક્સ્ટ્રા લાભ પણ આપવામાં આવે છે.
- ★ સિટી સ્કેન / એમ.આર.આઈ. સેન્ટર સાથે પણ ટાઈ-અપ કરેલ હોવાથી જરૂરિયાત હોય તેવા સહ્યોને સિટી સ્કેન / એમ.આર.આઈ.માં પણ ડિસ્કાઉન્ટ મળે છે.
- ★ સહ્યોના કુટુંબમાં જન્મેલ નાના બાળકોને જરૂરી રસીઓ નિઃશુલ્ક અપાય છે.

બાળ સમૃદ્ધિ યોજના :

- ★ સમાજના નોંધાયેલ સહ્યોને ત્યાં જન્મતા બાળક માટે રૂ. ૧૫,૦૦૦/- (પંદર હજાર પૂરા) સમાજ તરફથી એચ.ડી.એફ.સી. યુનિટમાં બાળકના વાલીના નામે ડિપોઝિટ કરવામાં આવે છે. બાળકની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યારે તે રકમ બાળકને મળે છે.

સાધર્મિક સહાય યોજના :

- ★ સમાજના નબળા કુટુંબોને દર મહિને કરિયાણું - અનાજ વગેરે ચીજવસ્તુઓ કુટુંબના સભ્યોની સંખ્યા પ્રમાણે અમુક મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

મેડિકલ સહાય :

- ★ જરૂરિયાતમંદ કુટુંબના સભ્યો કે જેમણે કોનિક દવા, બી.પી., ડાયાબિટીસ જેવી દવાઓ કાયમ લેવી પડતી હોય, તેઓને સહાય આપવામાં આવે છે.

શૈક્ષણિક સહાય :

- ★ જરૂરિયાતમંદ કુટુંબના બાળકો માટે સમાજ તરફથી સ્કૂલ - કોલેજની ફી, ટ્યુશન ફી અને પુસ્તકો માટે સહાય / લોન આપવામાં આવે છે.

સાંસ્કૃતિક હોલ (એ.સી.) :

- ★ સમાજના સભ્યોના પોતાના ગ્રસંગો માટે : (૧) અધ્યા દિવસ માટે : રૂ. ૫,૦૦૦/-
(૨) આખા દિવસ માટે : રૂ. ૧૦,૦૦૦/-
- ★ સમાજના સભ્યો માટે સાંસ્કૃતિક હોલ, બેસણા / પ્રાર્થના સભા માટે ફી માં આપવામાં આવે છે. ઈલેક્ટ્રિક, સ્ટેજ અથવા અન્ય વસ્તુઓ જોઈતી હોય તો એનો અલગથી ચાર્જ લેવામાં આવે છે.

બેઝમેન્ટ એ.સી. હોલ :

- ★ નાના પ્રોગ્રામો માટે સમાજના સભ્યો માટે ત્રણ કલાકના રૂ. ૫૦૦/- અને આખા દિવસ માટે રૂ. ૧,૦૦૦/- ભાડું લેવામાં આવે છે. જ્યારે ખુરશી, ટેબલ, શેરટરણ વગેરેનો ચાર્જ લેવામાં આવતો નથી. હોલમાં ૧૫૦ વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે. સૂકો નાસ્તો આપી શકાય છે. બેઝમેન્ટ (નીચેનો) હોલ બેસણા / પ્રાર્થના માટે ફી આપવામાં આવે છે.

સામાજિક સુરક્ષા :

- ★ દ્વારા વર્ષથી ઉપરની વ્યક્તિનો વીમો વીમા કંપની દ્વારા મળતો ન હોવાથી સમાજ તરફથી તેવી વ્યક્તિઓને હોસ્પિટલમાં ઓપરેશન / ટ્રીટમેન્ટ પાછળ થયેલ ખર્ચ પેટે અમુક લિમિટ સુધીની સહાય આપવામાં આવે છે. ઉપરાંત સમાજની ૭૦ વર્ષથી નીચેની વ્યક્તિઓની રૂ. ૫,૦૦,૦૦૦/- સુધીનો પર્સનલ એક્સિસેન્ટ પોલિસિ પણ લેવામાં આવે છે. દ્વારા વર્ષથી નીચેની ઉમર હોય તેવા સભ્યોએ પોતાની રીતે વીમો લેવો જરૂરી છે અને આ વીમા માટે સમાજ તરફથી કોઈ સહાય આપવામાં આવતી નથી. જ્યારે સમાજના સભ્ય વ્યક્તિ કે જેઓએ વીમો લીધેલ હોય અને તેઓ પોતાની આર્થિક સ્થિતિને લીધે પ્રિમિયમ ભરી શકવા સક્ષમ ન હોય તેવી જરૂરિયાતમંદ વ્યક્તિને પ્રિમિયમ ભરવા સમાજ તરફથી એપ્રિલ-૨૦૨૦થી સહાય આપવામાં આવી રહી છે.

સિનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપર) :

- ★ સમાજના ૬૦ વર્ષથી ઉપરની ઉમરની વ્યક્તિઓ માટે વર્ષ દરમિયાન બે / ત્રણ કાર્યક્રમો, યાત્રા, પિકનિક અને પ્રવાસોનું આયોજન કરવામાં આવે છે. જેમાં નબળા કુટુંબોના વડીલોને રાહત દરે લઈ જવાય છે. તેમજ વર્ષ દરમિયાન સ્થાનિકે બે થી ત્રણ સંગીત - મનોરંજનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

સ્વામિવાત્સલ્ય • ૧૫મી ઓગસ્ટ : ૨૬મી જાન્યુઆરીના દિવસે વિવિધ કાર્યક્રમો

- ★ સમાજ દર વર્ષે સ્વામિવાત્સલ્ય અને વાર્ષિક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજે છે. આ કાર્યક્રમમાં સમાજના દરેક સભ્યો તેમજ નિયાણી બહેનોને પણ આમંત્રણ આપવામાં આવે છે. ઉપરાંત સમાજ પરિવારજનનોની ઉપસ્થિતિમાં દર વર્ષે ૧૫મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) અને ૨૬મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ)ના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમનું પણ આયોજન થાય છે.

કેરિટ સોસાયટી :

- ★ સમાજની કેરિટ સોસાયટીના સભ્ય બન્યા પછી કેરિટ સોસાયટીના નિયમો મુજબ સભ્યને પોતાનો ધંધો શરૂ કરવા માટે લોનની સગવડ આપવામાં આવે છે.

ઉચ્ચ શિક્ષણ સમિતિ :

- ★ આ સમિતિ દ્વારા સમાજના ધોરણ ૧૦ થી ૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતો દ્વારા કરિયર ગાઈડન્સ, કાઉન્સેલિંગ અને વર્કશૉપ બહુ જ રાહતના દરે વર્ષ દરમિયાન યોજવામાં આવે છે. આ કાઉન્સેલિંગ કે વર્કશૉપ એક્ટિવિટીમાં વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવવામાં આવે છે.

ચોપડા-નોટબુકો :

- ★ સમાજના ભાગના વિદ્યાર્થીઓને શક્ય હોય તો દર વર્ષે ચોપડા-નોટબુકો પ્રેટ ટકા રાહત દરે આપવામાં આવે છે.

પુરસ્કાર / ઇનામ વિતરણ :

- ★ સમાજના કે.જ. થી લઈ પી.જ. સુધીના વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરેલ હોય તેઓને દર વર્ષે પુરસ્કાર કે મોમેન્ટો આપી સંમાનિત કરવામાં આવે છે.

લાઇબ્રેરીની સુવિધા :

- ★ સંસ્થાના સભ્યો કે જેઓ વાંચવાનો શોખ ધરાવે છે તેઓ વાંચનનો લાભ લે તે હેતુથી સાર્વજનિક લાઇબ્રેરી શરૂ કરવામાં આવેલ છે. રિફિનેબલ ફી ભરી સભ્ય બની શકાય છે.

માસિક મુખ્યપત્ર :

- ★ સમાજના કુટુંબોને સમાજની દરેક પ્રવૃત્તિઓની માહિતી મળી રહે તે હેતુથી દર મહિને સમાજ દ્વારા માસિક મુખ્યપત્ર “મંગલ મંદિર” પ્રકાશિત કરવામાં આવે છે. આ મુખ્યપત્રમાં સમાજ દ્વારા યોજાતા કાર્યક્રમો, પ્રવાસો, સેમિનાર વગેરેની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. ઉપરાંત ધાર્મિક સમાચાર, માહિતીસભર લેખો, અન્ય સંસ્થાઓના સમાચાર વગેરે પ્રકાશિત કરવામાં આવે છે. આ મુખ્યપત્રનું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦/- છે અને આજવન લવાજમ ફક્ત રૂ. ૧૫૦૦/- જ રાખવામાં આવેલ છે. સમાજના સભ્યો પોતાના પરિવારના કોઈપણ પ્રકારના સમાચાર અથવા નોંધ લેખિતમાં આપીને સામયિકના સમાજ દર્પણ વિભાગમાં આપી શકે છે.

નવનીત આવાસ યોજના :

- ★ સમાજના નભળા વર્ગના કુટુંબો માટેની આવાસ યોજના છે. આ આવાસમાં ૪૦ ફ્લેટ છે. જરૂરિયાતમંદ કુટુંબોએ આ યોજનાનો લાભ લીધેલ છે. જ્યારે ફ્લેટ ખાલી પડે ત્યારે જરૂરિયાતમંદ કુટુંબને આવાસ યોજનાના નીતિ-નિયમોને ધ્યાનમાં રાખીને, ખાલી પડેલ ફ્લેટ ફાળવી આપવામાં આવે છે.

યુવા વિકાસ સમિતિ :

- ★ આ સમિતિ દ્વારા આયોજિત થતી કાર્યક્રમોમાં સમાજના પરિવારજનોના યુવક-યુવતીઓ ભાગ લઈ શકે છે.

મેરેજ બ્યુરો સમિતિ :

- ★ સમાજના પરિવારજનોના લગ્નોત્સુક યુવાવર્ગ માટે આ સમિતિ કાર્યરત છે. સમાજના સભ્યો તેમાં રજિસ્ટ્રેશન કરાવીને પોતાની પસંદગી બાબત યોગ્ય કરી શકે છે. વધુમાં, જૈન શાતિના લગ્નોત્સુક કોઈપણ યુવાવર્ગ આ સમિતિમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

મહિલા ઉત્કર્ષ સમિતિ :

★ આ સમિતિ દ્વારા વર્ષ દરમિયાન મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. સમાજના પરિવારજનોની મહિલાઓ તેમાં સામેલ થઈ શકે છે.

વિવિધ સમિતિઓ :

★ સમાજ તથા સમાજ હેઠળની વિવિધ સમિતિઓ દ્વારા યોજાતા કોઈપણ કાર્યક્રમ અથવા તેમની પ્રવૃત્તિઓનો સમાજના સભ્યો નિયમોને આધીન લાભ લઈ શકે છે.

સમિતિમાં સભ્યોનું યોગદાન :

★ સમાજના સભ્યો, સમાજની કોઈપણ સમિતિમાં સભ્યપદે રહીને તેના નિયમોનુસાર પોતાનું યોગદાન પ્રદાન કરી શકે છે.

સાંસ્કૃતિક હોલ (એ.સી.)

અન્યો માટે : પ્રાર્થના / બેસણા શર્દાંજલિ માટે	શર્દાંજલિ માટે : રૂ. ૧૦,૦૦૦/- + (ઇલેક્ટ્રિક ચાર્જ યુનિટ દીઠ રૂ. ૧૫/- લેખે + સફાઈ ચાર્જ રૂ. ૫૦૦/)
અન્યો માટે લગ્ન પ્રસંગ, સગાઈ વગેરે કાર્યક્રમ માટે :	(૧) અડ્યા દિવસ માટે : રૂ. ૧૫,૦૦૦/- + (ઇલેક્ટ્રિક ચાર્જ યુનિટ દીઠ રૂ. ૧૫/- લેખે + સફાઈ ચાર્જ રૂ. ૫૦૦/) (૨) આખા દિવસ માટે : રૂ. ૨૫,૦૦૦/- + (ઇલેક્ટ્રિક ચાર્જ યુનિટ દીઠ રૂ. ૧૫/- લેખે + સફાઈ ચાર્જ રૂ. ૫૦૦/)

બેઝમેન્ટ એ.સી. હોલ

- ★ અન્ય ઘટક સમાજો અને અન્યો માટે અડ્યા દિવસ માટે રૂ. ૧,૦૦૦/- ભાડું + ઇલેક્ટ્રિક ચાર્જ યુનિટ દીઠ રૂ. ૧૫/- લેખે + સફાઈ ચાર્જ રૂ. ૨૫૦/-
- ★ આખા દિવસ માટે : રૂ. ૨,૦૦૦/- ભાડું + ઇલેક્ટ્રિક ચાર્જ યુનિટ દીઠ રૂ. ૧૫/- લેખે + સફાઈ ચાર્જ રૂ. ૨૫૦/- લેવામાં આવે છે.

ડાયાલિસિસ સેન્ટર

શ્રી કચ્છી વિશ્રામ ગૃહ - શાહીબાગ તથા નવનીત મેડિકલ સેન્ટર - બોપલ ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. ત્યાં ડાયાલિસિસ કરાવનાર દર્દીઓને નજીવા દરે ડાયાલિસિસ કરી આપવામાં આવે છે. ‘મા અમૃતમ્ય યોજના’ અને ‘આયુર્યુમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ના લાભો પડ્યા આપવામાં આવે છે.

ડિસ્પેન્સરી

શ્રી કચ્છી વિશ્રામ ગૃહ - શાહીબાગ ખાતે જનરલ પ્રેક્ટિસનરની ડિસ્પેન્સરી પણ શરૂ કરવામાં આવેલ છે. જેના અંતર્ગત આવનાર દર્દીને રૂ. ૩૦/-ના નજીવા દરે તપાસીને દવાઓ આપવામાં આવે છે.

અશ્વાશોન્મ યોજના

શ્રી કચ્છી વિશ્રામ ગૃહ - શાહીબાગ ખાતે “જલારામ અશ્વાશોન્મ યોજના” હેઠળ બી.પી.એલ. કાર્ડ ધારક દર્દીઓને અને તેમની સાથે આવનાર એક વ્યક્તિને સવાર-સાંજનું જમવાનું નિઃશુલ્ક આપવામાં આવે છે.



શ્રી ચેતનભાઈ શાહ (ડાબી તરફ)નું ભૂમાન કરતા
સમાજના ઉપપ્રમુખ શ્રી હીરેન શાહ



શ્રીમતી કોકિલાભેન ભોગીલાલ કોરડિયાનું ભૂમાન કરતા
સમાજના માનદ મંત્રી શ્રી રજનીકાંત પાટેખ



શ્રીમતી શિલ્પી શાહ (જમણી તરફ)નું ભૂમાન કરતા
શ્રીમતી પૃષ્ઠાબેન ગટેચા



શ્રી આશિષ ધીરુભાઈ શાહ (ડાબી તરફ)નું ભૂમાન કરતા
ડૉ. હિટેન્દ્રભાઈ શાહ



એચ. એન. સંકલ ગુપ્તના શ્રી ધીરેન વોરા અને શ્રી ઉદ્યન વોરા (બંને ડાબી તરફ)નું
ભૂમાન કરતા શ્રી રાજુભાઈ ગાલા અને શ્રી હીરેન શાહ



ફાઈકોર્ટના જ્ઞ શ્રી સતીષભાઈ વોરા (ડાબી તરફ)નું ભૂમાન કરતા
શ્રી હસુમખભાઈ ગટેચા



ભોજન ગ્રહણ કરતાં મહાનુભાવો



સમારંભમાં પદ્ધારેલા મહાનુભાવો

આ પુસ્તકોનાં
પ્રાપ્તિસ્થાન

ગુજરાત ગંધરવન કાર્યાલય



ગુજરાત સાહિત્યભવન


સ્તરનાળનાકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ-380001,
ફોન : 079-22149660, 09227055777
ઈ-મેલ : goorjar@yahoo.com

ગુજરાત સાહિત્ય પ્રકાશન

102, લેન્ડમાર્ક બિલ્ડિંગ,
ઘાટએન્નિયમ સિટીસેન્ટર પાસે,
સીમા હોલ સ્થામે,
પ્રાહ્લાદનગર, અમદાવાદ-380 015
ફોન : 079-26934340, 98252 68759
ઈ-મેલ :
gurjarprakashan@gmail.com
વેબસાઈટ :
www.gspbooksmall.com

કચ્છી સજ્જકોનું સાહિત્ય કચ્છનો મહિમા ગાતું સાહિત્ય

ધીરેન્દ્ર મહેતાની	હરેશ ધોળકિયાનાં પુસ્તકો	દુલેશ્ય કારાણીનાં પુસ્તકો
નવલકથાઓ	અંગદનો પગ (નવલકથા)	કચ્છની રસધાર
આપજો લોકો	115	મિઠે મેરાં જી મોતીઝા
અદૃશ્ય	80	કચ્છી પિરોલી
ખોવાઈ ગયેલી વસ્તુ	100	કચ્છડો બારે માસ
ભંડારી ભવન	175	(તથા અનોઝી નવલકથાઓ)
વલય	100	હંસરાજ સાંખલાની
શાવણી (પુરસ્કૃત)	150	નવલકથાઓ
શિલ્પ	200	મનબંધણા
તમે માનશો ?	150	છોરાંવણોઈ
પ્રત્યંચાનો કુપ	125	દર્શના ધોળકિયાનાં
કોઈ જબકે, કોઈ જબકાવે	120	પુસ્તકો
મહેતાજી, તમે એવા શું ?	400	પરિયય પર્વ
નંદશંકરથી ઉમાશંકર	250	મહાભારત ચચ્ચિત્રવિમર્શા
દશ્ક અને બીજા વિશે	180	શાસમાં વાગે શંખ (આધ્યાત્મિક) 225
કથા, તું બહુ રૂપિણી	240	નારીની કથા, પુરુષની લેખિની 200
નવલિકાઓ		ગુજરાતના સાહિત્યસર્જકોનું
ગંઠાઈ ગયેલું લોકી	140	પ્રાથમિક શિક્ષણ
હું એને જોઉં એ પહેલાં	100	280
કચ્છી ગયેલું લોકી		
કચ્છનું સંસ્કૃતિકાનન		
ધીશોધાર સંભરન		
કચ્છી બોલી		



If undelivered please return to :

શ્રી કચ્છી ઐન સેવા સમાજ - અમદાવાદ

શ્રી કચ્છી ઐન ભવન,

૪૩-૪૪, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી,
નવચેતન હાઈસ્કૂલની સામે, પાલાડી - એવિસાંબિજ,
અમદાવાદ-૩૮૦ ૦૦૬.

ફોન : (૦૭૯) ૨૬૫૭ ૮૮૯૨, ૨૬૫૮ ૧૫૦૧

To,